

શ્રી ગંથમારી

દાદાશેલ, ભાવલાંદ,  
સુરત ૩૮૧૦૨૬  
ફોન : ૦૨૯૬-૨૪૨૨૩૩૨૬

૩૦૦૨૪૫

3626

સાહુખાંધી શિખિર માટુંગા [ મુંખદ ]ના  
ઉપકરે થોળાપેલી વ્યાપ્યાનમાળા

# ધર્માનુભૂધી વિશ્વરૂપ

ભાગ : ૬

સામુદ્દ્રાધિક અહિંસા-પ્રયોગો।



મુખ્ય પ્રવચનકાર :

મુનિશ્રી સંતભાલલ



સંપાદક :

ગુરૂભાઈંદ્ર જૈન



: પ્રકાશક :

લક્ષ્મીયંદ્ર ઝવેરચંદ્ર સંધ્વી

મંત્રી

મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર  
ડીકાર્થની વાડી - અમદાવાદ - ૧

## અસ્તિત્વ કે વિનાશ ?

[ સંપ્રાક્ષીય ]

જગતનાં જીવનનો ડાડો અભ્યાસ કરતાં; તેમજ તેનો ઈતિહાસ તપાસતાં; જીવનની એ વૃત્તિઓ રૂપેણ સામે આવે છે. એક છે જીવનના અસ્તિત્વને ટકાવી રાખવાની વૃત્તિ; અને બીજી પોતાના અસ્તિત્વ માટે અન્યનો વિનાશ કરવો। યુગયુગથી આ પ્રશ્ન માનવ સામે જીલો છે અને તેનું પૃથક્કરેણ કરતાં એક વરસુ રૂપેણ છે કે માનવસમાજ અને જગત-જીવે; જીવનના અસ્તિત્વને ટકાવી રાખવાનાજ બધા પ્રયત્નો કરે છે.

નાની કીડી નેટલી ચીવઠથી ઢાડા મૂકે છે; સેવે છે; લય આવતાં ઉપાડીને ભાગે છે. તેના માટે જરૂરી જોરાક ભેગો કરે છે. એટલી જ ચીવઠથી માનવ-માતા પણ બાળકને જન્મ આપે છે; ઉછેરે છે. મોટો કરે છે અને આશા રાખે છે કે પોતાની ઉત્તરાવસ્થામાં એ બાળક તેનો આધાર બને. ત્યારે બીજુ તરફ એંબું જોવામાં આવે છે કે પોતાના સ્વાર્થ માટે વ્યક્તિ વધુ બળવાન થઈને ડેવળ પોતાના અસ્તિત્વ માટે અનેક બીજાઓનો વિનાશ કરે છે. આ વિનાશને અટકાવવાની પ્રક્રિયા માનવસમાજમાં આદિકાળથી ચાલુ છે; વિચારકો તેને પોતપોતાના કાળમાં વધારે ને વધારે શુદ્ધ ઇપ આપે છે અને તે વિનાશને થતો રોકવા પ્રયત્ન કરે છે. જ્યાં એક તરફ સંગઠિત માનવસમાજ અન્યના જીવનનો વિનાશ કરવા ગતિમાન થાય છે; ત્યાં આવા વિચારકો, સંતો ઋષિઓ નખણા વર્ગના લોકોને તૈયાર કરે છે અને એ વિનાશને સામૂહિક તંત્ય-ત્યાગ દ્વારા રોકવા મથે છે. એ વિનાશની રીતો હિસા છે અને અસ્તિત્વને ટકાવી રાખવા માટેની જે ભાવના અને પ્રક્રિયા છે તે અહિસા છે. ધીમે-ધીમે માનવ સદીઓથી સંગઠિત ઇપે જીવતાં શીખી ગયો છે. એટલે આજે તેને અસ્તિત્વને ટકાવી રાખવા માટે સામુદ્દરિયક ઇપે જ વિચારનાં અને કાંખું કરવાનું છે! એમાંથી એક નવી વાત આ વીસમી સદીમાં માનવસમાજ આગળ આવી છે; તે છે: “ સહ-અસ્તિત્વ.” આ વિચાર પ્રમાણે હવે વિનાશને અવકાશ રહેતો નથી. ગમે તેટલાં સંધર્ષના ભાખનો વસાવવાં છતાં, અવિશ્વાસની નજરે જોવા જરૂરી લોડા: એમ ખોને

છે હે જીવન વિનાશ માટે નથી; અરિતત્વ માટે છે; એક ધરમાં જેમ ભિન્નભિન્ન વય, વિચાર અને જતિની વ્યક્તિઓ રહી જીક્તી હોય તો આખા વિશ્વમાં દૃશો અને સમાજે પણ રહી શકે છે.

અને આ ભૂમિકાએ કુગતને પહેંચાડવાનું શ્રેય સામુદ્દર્યિક અહિસાના પ્રયોગકારો અને પ્રયોગોને ક્રમે જાય છે. આ પ્રયોગો ધણી સાવધાનીપૂર્વક બના જોઈ એ અને તેમાં પણ કેટલીક કાળજ રાખવી જોઈ એ. પ્રયોગકારની કેટલી યોગ્યતા હોવી જોઈ એ; તે ચકાસીને જ કામ થતું જોઈ એ. નહીંતર એકના બદલે ખીજ અનથો ફેલાઈ જવાનો ડર રહે છે.

આ આખાયે વસ્તુ (Matter) વિષયને “સામુદ્દર્યિક અહિસા—પ્રયોગો” શીર્ષક શ્લીલિર પવચનમાં, પ્રભર વિચારક પૂ. મુનિશ્રી સંતખાલજાએ બહુ જ ડિડાણુથી અલગ—અલગ પવચનો વડે આવરી લીધું છે.

એમાં એમણે કેટલીક વસ્તુઓ શાખત સિદ્ધાંતો ઇપે રજૂ કરી છે. પ્રયોગકારની યોગ્યતા અંગે તેમણે એક સિદ્ધાંત આપ્યો છે:- અહિસક હિસ્ક તરવો, કોમી તરવો કે પ્રાંતીય તરવો સાથે સાહંગાંડ ન બાંધવી જોઈ એ. એનું કારણ એ છે કે અહિસા પોતાનામાં વિશાળ છે—તેને જ્યારે સંકુચિત ઇપ આપી દેવામાં આવે તો ત્યાં ખોટું થાય છે. સામ્યવાદ, કોમવાદ કે પ્રાંતવાદ આવા સંકુચિત ઇપો છે.

ચીન સાથે ભારતે ગાંઠ બાંધી. પરિણ્યામ એનું ને આવ્યું તે આને સૂર્યપણ છે—કારણ કે સહ—અરિતત્વ માટે એ રાષ્ટ્રોની જીવન પ્રણાલિકા અલગ હોઈ શકે; પણ તેનો મૂળ આધાર અલગ ન હોવો જોઈ એ. સામ્યવાદ હિસા વડે પણ પ્રચારમાં માને છે, ત્યારે ભારત અહિસક—તઠરથ બળ અને અ—સંધર્ષમાં માને છે. એટલે બને વચ્ચેનો મેળ પણ સુમેળ ન બની શકે અને તેનાં એ પરિણ્યામો આવવાં જોઈ એ તે આપણી આગળ રૂપણ છે. ધર આંગણે પણ કેંચેસન્નોએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેમજ આંધ્ર-તામિલનાડુમાં જ્યાં પ્રાત કે લાલા સાથે જોડાણ ડર્યું લાં તેમને અંતે હિસક માર્ગ ધસડાવું પણું—કો એના મૌન—સાહી થતું પણું. કોમવાદનો આસરો લેવા જતાં કેરલમાં અને

હમણું યુ. પી. માં તેના પ્રત્યાધાનો પણ્યા. એટલે પ્રયોગકાર કેવળ અહિસક અને વ્યવર્ચિથત બણો સાથે જ સુમેળ બેસાડી શકે.

ખીજુ વાત અહિસક પ્રયોગકાર માટે મહત્વની એ હોવી જોઈ એ કે તે રૂપણ હોવો જોઈએ. આર્થિક બાધતોમાં અતિ રૂપણ. ગાંધીજી બાદ આ અંગે ધ્યાન ન રખાયું. પરિણામે આજે નાણુંકીય જોટાળાનો આક્ષેપ ધણું મંત્રીએ સામે આવીને જિલ્લો છે.

એવી જ રીતે અહિસક પ્રયોગકાર પૂંજુવાદ સાથે પણ સાઠમાંડ નથી બાધતો. કારણ કે પૂંજુવાદ પણ અન્યના શોષણ-વિનાશને આધારે ફૂલે છે. શોષણ, દમન, અન્યાય આ બધાં તત્ત્વોનો અહિસા સાથે મેળ બેસતો નથી.

આ જ વાતને વિશ્વને નજર સામે રાખીને વિચારવાની છે. વિશ્વના દેશો “સહ-અસ્તિત્વ”ને માનતા થઈ ગયા છે અને એજ યુગયુગના અહિસક પ્રયોગેનું પરિણામ છે. હવે જોવાનું એ છે “સહ-અસ્તિત્વ”ના સિક્ષાંતને પેતપોતાની રીતે મનાવવા માટે જે કઢાગહ છે અને વિનાશ-કારી તૈયારીએ છે તે દૂર થશે કે નહો? જો પેતાની પ્રણાલિકાને જગતના સુખ માટે શ્રેષ્ઠ સાભિત કરવી હોય તો અંતે વિનાશ અને હિસાને તિળાંજલિ આપવી જ પડશે. શ્રેષ્ઠતા માટે અસ્તિત્વનું ખરું મૂલ્યાંકન ત્યારે જ થશે!

એ બાધતમાં જગત ખરું જ આશાપૂર્વક અહિસાના સામુદ્દરિક પ્રયોગો તરફ મીંટ માંડી રહ્યું છે. કારણ કે વિનાશ કોઈને પસંદ નથી; વિનાશમાં કોઈ શાંતિની કલ્પના કરે એ નરી મૂર્ખતા છે; એનું મુખ્ય કારણ એ છે કે જગતનો કભ જ જીવનને ટકાવવા - અસ્તિત્વ માટે જ ચાલુ છે.

આ અંગે ધણું ધણું આ પ્રવચનોમાં પુ. મુનિશ્રી સંતખાલલાએ રજૂ કર્યું છે. જેનું હંમેશ માટેનું મૂલ્યાંકન ધણું જિયું છે, એમ દરેક ચિંતકને વાંચ્યા પણી લાભ્યા વગર રહેશો નહીં.

બૈન વિદ્યાર્થીગૃહ,  
મદ્રાસ  
૧૦-૬-૬૩ } }

ગુલાખચંડ બૈન

## બે બોલ

મુનિશ્રી સંતખાલજને તમો સૌ જાણો છો. તેઓ એક ફાન્ટિકારી બેન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મળ રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહોનિષ્ઠ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપર્દેશ્યથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંચાઈ ગયું છે; ઉગલે ને પગલે અથાનિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુસંતોચે સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તો જ બની જીકે જે સાધુસાધ્વીઓ પ્રાણુ, પ્રતિષ્ઠા અને પરિશ્રણનો મોહ છોડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વર્ધમનો અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ આમજનતાનો અને આમ-જનતાનો સંપર્ક આવી જશે.

આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂછું નહીં બને. જે ધર્મભ૟ સમાજરચના જીબી કરતી હશે તો માનવજીવનમાં જીબા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોનો સર્વાંગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થાદારા જનતા વાટે કરવો પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે; અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ધરના ધર્મની ચોકી ખીઓ કરતી એટલે કુદુંગ સ્નેહસભર અને પરિત્ર રહેતું. સમાજની ચોકી આલથો કરતા, તેઓ કથાંય વ્યસના, અપ્રમાણિકતા કે જેરનીતિઓ પેસી ન જાણ ને માટે સતત ક્રિયાશીલ રહેતા; નેથી દેશ નીતિસભર રહેનો. અને સનો આખા દેશમાં પરિઅમણું કરી સંસ્કૃતની ચોકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ બનો, આલથોને આધીન રહીને ચાલતું. આ જ્યાના કારણે સમાજ શાન્તિથી જીવતો. અને અધ્યાત્મલક્ષ્મી રહી જાકતો; કોઈ જાળીન દુષ્ટ કૃત્ય કરનાર નીકળતો. તો રાજ્ય તેને યોગ્ય નસ્તિત કરતું.

આજે સ્થિતિ જાહ્યાઈ ગઈ છે. પૂર્વ પરિભૂત એક થવા લાગ્યાં છે. વિજાને દોટ મૂકી છે. એટલે મહારાજની એ જ પુરાણી સંસ્કૃતને નજરમાં રાખી, યુગાનુરૂપ નવી દ્વારે સમાજ વ્યવસ્થા ચોઢવવા પ્રયત્ન કરે છે.

હવે વિશ્વરાજ્યોમાં લોકશાહી વ્યવસ્થા છેણ ઘનતી જાય છે ત્યારે જનતાને ધડવાનું જ સુખ્ય કામ અગત્યતું ઘન્યું છે. એટલે એમનાં નીતિનાં ખાયા પર સંગઠનો જોઈએ. એ સંગઠનો સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે; તેનું સંચાલન આજના આદ્ધારો કે જે રચનાત્મક કાર્યકરો કરેલાય છે તેમની ભનેલી સંસ્થાના હાથમાં મૂક્યું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માગંદશ્શેક પ્રેરણું મળતી રહે તે માટે સાધુસંતોષે ધ્યાન રાખવું જોઈએ. હુનિયાબરનાં રાજ્યોનાં અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોષે ધ્યાન આપવું જોઈએ.

આ સાધુસંતો સર્વાંગી પ્રક્રણે સમજે, અને તે માટે સાથે એસી વિચાર વિનિમય કરી શકે તે માટે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુખ્યમાં માફુંગા ( ચુંજરવાડી ) મુકામે સાધુ-સાધ્યી અને સાધક-સાધિકાચોનો એક શિબિર યોજવામાં આવેલો. તે સતત ચાર માસ ચાલ્યો, તેમાં જે પ્રવચનો ચર્ચા વ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકળન ચાય તો ખીજ સાધુ સાધ્યી, સેવકો અને પ્રજને તેમાંથી ઉપયોગી માગંદશ્શન મળે તેવી ધણ્યાં ભાઈધણેનોને લાગણી થઈ આવી. આસ કરીને પૂ. નેમિયંડલ મહારાજની એવી તીવ્ય છચ્છા હતી. પરંતુ આઠથા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ધણ્ય અધિરૂપ કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણ્યાં પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કોઈકને નિભિત બનાવી પ્રેરણું આપે છે.

માફુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીગંડ બોાંદુવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતપ્પાલજ ઉપર અપાર અદ્ધા છે. મહારાજશ્રી ને ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરના કાગેમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રીના આ શિબિરપ્રવચનો પુસ્તકર્પે છપાય અને સાધુસંતોને અપાય તો તેનો લાભ તેમના જ્ઞાનવિકાસમાં તો ચાય જ

પણ તેઓ છકાયનાં પિયર ( સમાજનાં માબાધ ) છે નેથી સમાજને માર્ગદર્શન આપવામાં ધ્યાન ઉપરોગી થઈ શકે.”

તેમના આ શુલ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ હતું કરી શકાયું છે. આ પ્રવયનેનું મુખ્ય તત્ત્વ જગતી અધિગ અધિગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકદ્વારે છપાય; તો વાંચનારને ચુંગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દરેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે.

આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાખુમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિમનો જગતીને થાય એ જરૂરી હતું. એ મારે પણ શ્રી. ભણ્ણિભાઈ લોખાંડવાળાએ મદાસના જૈન વિદ્યાર્થીનું ગૃહપતિ શ્રી ગુલાબચંદ કેનતું નામ સંચયાં. તેમને ઇન્હે મળતો એવાંયા અને વાતચીત કરી અને તેમણે સહખ્યે આ કામગીરી સ્વીકારી.

અંતમાં અમે પુ. મુનિશ્રી સંતાપાલજી તેમજ મુનિશ્રી નેમિયંડજીએ આવું સર્વાંગ સુદર અનુભવપૂર્ખ સાહિત્ય જનતાને આપ્યું; તે બદ્ધ તેમનો આભાર માનીએ છીએ. તે જ રીતે સામનમાં શીર્ષ સોચાયટીમાં રહેતા વોરા ભણ્ણિભાઈ લક્ષ્મીચંદ કંઈ મુદ્દાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરનો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા ખીજાએ પાસેથી સહકાર અપાવેલ છે તે બદ્ધ તેઓઓનો આભાર માનીએ છીએ. તેમની મદદ વમર અમે આ સાહિત્ય પ્રકાર્થિત કરી શકત કે કેમ? તે સવાલ હોય. અને મદાસનાણા શ્રી. મુલાબચંદ જૈન કે જેમણે અનેક જ્ઞાનદારીએ હોવા છતાં આ કામને ધર્મદ્વારાં માની સમયસર સંપાદન કર્યું છે તેમનો પણ આભાર માનીએ છીએ. પુ. શ્રી. દાદીસ્વામી, શ્રી. માટલિયા, વિશ્વવાત્સલ્ય પાયોગિકસંસ્થ વમેરેએ પણ પ્રેરણું આપ્યો છે, તેથી તેમનો અને ગ્રાત, અગ્રાત સૌચે જે સહકાર આપ્યો છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ.

સાહુસંગેનો, સાધીઓ, સેવકો અને જનતા આ પુસ્તકોનો અભ્યાસ કરી સ્વપ્ર કલ્યાણનો રૂપી માર્ગ અભિતાર કરતો એવી અમને આપા હો. તા. ૨૪-૪-૬૨                    સાહુસાહી ચિનિર બ્રહ્મસાપક સાગિત્ત; મુંદ્ધુ.

## પ્રાર્દ્ધ કથન

જૈન આગમોના સારદૃપ ‘તત્ત્વાર્થાધિગમ’ નામતું સૂત્ર છે. તેના ફર્તા ઉમાસ્વાતિવાચક છે. આ સૂત્ર સદ્ભાગ્યે હિંગંખર, શૈતાંખર, સ્થાનકવાસી અને તેરાપંથી એમ બધાય જૈનફિરકાઓને માન્ય છે. તેમાં એક સૂત્ર છે:- ‘પરસ્પરોપગણો જીવાનામ’ એટલે કે પારસ્પરિક ઉપયોગી થવું એ જીવમાત્રતું મૂળ લક્ષ્ય છે. વાત સાચી છે. ગમે તેવાં સાધનો સાથે એકલા માનવને છોડી હો. તેને ચેન પડવાતું નથી. એટલે પ્રાણીમાત્રમાં પણ માનવપ્રાણી એવું છે કે તેને ખીજ માનવસાથી વિના ચાલતું નથી. આમારી નરનારીના લગ્નથી કુંભરચના શરૂ થઈ. અને ધારેધીરે કુળ, ગામ, દેશ અને માનવજગતના સંબંધો બંધાયા તથા વિકસ્યા. ભારત જ એક એવો ધડાયેલો દેશ છે કે જ્યાં માત્ર માનવજગત સાથે જ નહીં, બલકે પ્રાણીજગત સાથેના મીઠામધુરા સંબંધની વાત આવે છે. ખીજાં પ્રાણીઓ કરતાં માનવ સાથેના માનવસંબંધોમાં જેમ વધુ મધુરતા રહેલી છે, તેમ વધુ કટુતા પણ જીલી થવાના પ્રસંગે વારંવાર જન્મી શકે છે.

ધણીવાર તે કટુતા સીધી પરસ્પરને વ્યક્તિગત રૂપર્થી છે. કેટલીક વાર તે વ્યક્તિગતરૂપર્થીતા પ્રશ્નની પાછળ હોઈ મહાન આદર્શ પણ હોય છે. ત્યાં પણ મૌલિક મધુરતા જળવવી અને કટુતા નિવારણ કરવું, એ કાર્ય ધાર્યું અટપટું અને કઠણું બને છે. છતાં જગત જેનાથી રકે છે, તે સત્ય, પ્રેમ અને ન્યાયના મૂળ સિદ્ધાંત માટે તે પાર પાડવું પડે છે. હેઠળ રામકાળથી ભારતમાં એ પ્રાણાલ ચાલી આવી છે. તેથી જ તો ભારતમાં સામુદ્દરિક અહિસાનો પ્રયોગ થઈ શક્યો હતો. રામ અને રાવણું વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો અને છતાં ભરતી વખતે રાવણુનું તેજ રામના હૈયામાં પેહું. એટલું જ નહીં રાવણનાં નજીફનાં જનોના સંબંધો પણ રામ સાથે મધુર રહી શક્યા. કૃષ્ણમુગે નિઃશર્ષી પ્રેરક સંબંધની શરૂઆત થઈ. મતલખ્ય કૃષ્ણ યુદ્ધમાં હાજર રવા, પણ નિઃશર્ષી

તરીકે રહ્યા. મંહાવીર યુદ્ધયુગે ડોઈ સાધુસાધ્વીને યુદ્ધમેદાનમાં નિઃશબ્દીપ્રેરક તરીકે પણ હાજર ન રહેણું પડ્યું. માત્ર સાધુના અગત્યના અંગ રૂપ અમણોપાસક ( એટલે કે ગૃહસ્થાશ્રમી આવક )થી કાર્ય ચાહયું. ગાંધીયુગે ગાંધીજીની રાહખરી તળે ભારતવાસી ભાઈખેનોએ દક્ષિણ આફિકામાં અને ભારતમાં પરિપૂર્ણ હથિયારોવાળા શાસનકર્તા સાથે સામુદ્રાયિક અહિસાતું યુદ્ધ કર્યું. તેમ જ તેમાં વિજય પણ મેળવ્યો. ગાંધીજી ગયા બાદ સામુદ્રાયિક અહિસાની પ્રક્રિયા સ્થગિત થઈ હતી. પણ ભાલનલ્કડાંડા પ્રયોગમાંથી પાછી એ સ્થગિત થયેદી પ્રક્રિયા ચાલુ થઈ છે. અલઅત્ત એણે લગ્ભાગ સર્વ પ્રયોગમાં સફળતા મેળવી છે. પરંતુ વ્યાપક પ્રયોગમાં જેટલા પ્રમાણમાં એનો વ્યાપક અનુભંગ હોય, તેથી લગ્ભાગ સર્વ પ્રયોગમાં હજુ દેખાઈ નહેતી અને હજુ દેખાઈ નથી. સાચંદ્રનાં ઋષિભાલમંહિરનાં નાણુંની ઉચ્ચાપત એનાં લાગતા વળગના પાસેથી જે રીતે મળો જવી જોઇએ તે હજુ મળો નથી. પણ મને ગળાદૂં ખાતરી છે કે જે સંપૂર્ણ સફળતા અસરકારક રીતે પાર પડી નથી તે પાર પડુંયે જ રહેશે. દેશના અને આંતરરાષ્ટ્રીય બધા પ્રકારના અન્યાયો સામે શુદ્ધ-પ્રયોગ જો સમરત અનુભંગ સાથે થાય, તો તેમાં નિજ્ય વિષે તદ્વાર થંકા થઈ શકે તેમ નથી. ચીનના હુમલાનું ન્યાયી નિરઃકરણ કરવાની પણ તેમાં ત્રૈય રહેદી છે. શુદ્ધપ્રયોગનું બેડાતું શાસ્ત્ર જેમ જેમ અચરાતું જશે, તેમ તેમ એની અનંતાનાં દ્ધ્યપાયેદી શક્તિએ બહાર આવતી જશે અને વિશ્વની માનવજાતને વલ્લભ અને આચરણીય બનતી જશે. આમ માતીને આ પુસ્તકમાં એને લગતાં પ્રવચનો પ્રગટ થાય છે.

### એક અગત્યની વાત

એક અગત્યની વાત ખાસ બાદ રાખવા કેવી છે :—

“ સામુદ્રાયિક અહિસાના પ્રયોગો ચાહે તેટલા પવિત્ર ભાવે અને અરાગદ્વૈપ વૃત્તિએ અચરાય છતાં નિષ્ઠુતિરૂપ વ્યક્તિના તેવા પ્રયોગોમાં જે રષ્યુણ અને સુદ્રમ બન્ને પ્રકારની અહિસા સચ્ચવાય છે; તેમાં કંઈક હ્યાજી

રહેવાની કારણું વ્યક્તિગત જીવનસાધનામાં સ્થૂળ અને સૂક્ષ્મ બન્ને પ્રકારની અહિસા સુશ્વક્રય છે, તે સમુદ્દરાયગત જીવનસાધનામાં સુશ્વક્રય નથી.” છતાં જ્યાં સમુદ્રાય વર્ષોથી ત્યાગ-તપ-નીતિમય આચાર વગેરેથી ધડાયેલો છે, તથા છેલ્લે જ્યાં આધ્યાત્મિક સંત વિભૂતિઓની જગતી ચોકી છે, ત્યાં તો સમુદ્રાયગત અહિસામાં પણ સૂક્ષ્મ અને સ્થૂળ બન્ને પ્રકારો સારી પેઢે જળવાય છે. કમમાં કમ બન્ને પ્રકારો સારી પેઢે વિકસે છે, તેમાં તો ના પાડી શકાય તેમ જ નથી.” આથી જેમ આપણે હાઈસ્કુલના શિક્ષણને કોણેજના કે પ્રાથમિક શિક્ષણના વિરોધી તરીકે ગણ્યતા નથી, પણ વિકસતો કુમ લેખીએ છીએ. તેમ જે રાજકીય અહિસામાં જરૂર પડ્યે શક્યની દ્રષ્ટ હોય, પણ રાગદ્વૈષ ધરાડાના ધ્યેય સાથે હોય! તેમ સામુદ્રાયિક સામાજિક અહિસામાં શુનેગારની સમાજપ્રતિષ્ઠા તોડીની તે પૂરતી સ્થૂળ હિંસા (વાસ્તવિક રીતે તો સ્થૂળ દ્વારા જ કહેવાય, ન) ક્ષમ્ય હોય, પણ શારીરિક કે આર્થિક દ્વારા પ્રાય: ત્યાજ્ય લેખાવાં જોઈએ. ટૂંકમાં રાગદ્વૈષનો ધરાડો અને શક્ષ ધરાડો તેમાં વધુ સહજ હોય.

આશ્રલું જે ક્ષમ્ય માની આગળ ન વધીએ, તો વ્યક્તિગત અહિસા પૂરતી અહિંમા સીમિત બની જાય. એટલું જ નહીં સમુદ્રાયોમાં તો હિંસા (સૂક્ષ્મ અને પણ તો સ્થૂળ પણ) વધતી જ જાય. કારણ કે નાનાથી માંડી મોટા લગીના ડોર્ચ પણ માનવની એ તો સામાન્ય ફરજ છે જ કે, તેણે જેમ ડોર્ચને જાતે અન્યાય ન કરવો જોઈએ તેમ ડોર્ચ વ્યક્તિ, ડોર્ચ સમૂહ કે ડોર્ચ રાજ્ય ભીજાને અન્યાય કરી રહ્યાં હોય તો તેના નિવારણ માટે સતત પ્રભાવશીલ રીતે ભયલું જ જોઈએ. આમ જે નથી કરનો તે માનવ ગમે તેટલો મોટો સંત કહેવાતો હોય તો યે હંજુ સાચો માનવ બન્યો નથી તેમ માનવું રહ્યું.

આ દાખિએ જોતાં સામુદ્રાયિક અહિંસાના પ્રથોગોનું આચરણ સર્વત્ર જરૂરી બની જાય છે. તે છ્યાં અને કેવી રીતે કરવું? અનુભંગિત તરફો તેમાં છ્યાં છ્યાં જોઈએ? વગેરે વિવરણ વાચ્યો આ પ્રવાગનો-

માંથી મેળવી શકશે. ગાંધીજીએ સત્તિનથ કાનૂનભંગ, અસહકાર અને સત્તાઅહ શખદો યોજયા છે. શુદ્ધિપ્રયોગમાં શુનેગારની સામાજિક પ્રતિષ્ઠા તોડવી, લોકશાહીમાં માનનારી સંસ્થાની રક્ષા કરવી, લોકશાહી કાનૂનને ભંગ ન કરવો વગેરે શખદો યોજયા છે. ‘સત્તાઅહ’માં મોટે ભાગે ત્ય વ્યક્તિગત હતું, શુદ્ધિપ્રયોગમાં વ્યક્તિગત ઉપરાંત ખાસ તો સમૂહગત છે. અને એકલી અંતઃ પ્રેરણા નહીં પણ અંતઃપ્રેરણા ઉપરાંત સંસ્થાગત સંચાલનની અનિવાર્યતા રહેશે. આ બધી બાબતો ખૂબ વિગતે વિચારીને વાચકોએ આ માર્ગ આગળ વધવાનું છે. વાસ્તવિકતાએ જોતાં તો આ પ્રયોગાનો જત અનુભવ સુસંસ્થા તરત્વને સામે રાખીને થશે, તેણે અંશે આ પ્રયોગમાં રહેલી અપરાંપાર ખૂબીઓનું દર્શન થઈ શકશે. મારી નાન પ્રાર્થના એ છે કે ‘નવું’ માની આ સાધનને ડેચ્પિલ્યુ અવમજૂ નહીં, બલકે જૂનાનું યુગાનુકૂલદ્વાર માની તેમાં પોતાથી જનતો સહયોગ આપે. અહિસા પરમોધમંની પ્રતીતિ તેમને તેમાંથી થયા વિના નહીં જ રહે. ધરથી માંડીને જગત સુધી તથા નાનાથી માંડીને વિશ્વભ્યાપી પ્રશ્ન લગ્ની તેમાંથી લડવાનું અને છતાં અંતરથી વધુ નળુક બેટવાનું આદભુત સમન્વયકારિદર્શન પણ એમાંથી જ થશે.

સોફના, તા. ૮-૬-૬૩

‘સંતખાલ’



## અનુક્રમણીકા

પ્રકરણ	વિષય	પાઠું
૧. સામુદ્રાયિક અહિસા પ્રયોગની અનિવાર્યતા	...	૧
૨. સામુદ્રાયિક અહિસા-પ્રયોગનાં તરતે	...	૧૮
૩. સામુદ્રાયિક અહિસા પ્રયોગમાં દાખાણું	...	૩૪
૪. સામુદ્રાયિક અહિસા-પ્રયોગમાં ત્રિવેણી	...	૫૫
૫. સામુદ્રાયિક અહિસા પ્રયોગની ભૂમિકા	...	૬૭
૬. સામુદ્રાયિક અહિસા-પ્રયોગનાં મુદ્દાઓ	...	૭૮
૭. વ્યક્તિગત અહિસા અને સામુદ્રાયિક અહિસા	...	૮૮
૮. સામુદ્રાયિક અહિસા અને શુદ્ધિપ્રયોગ	...	૯૯
૯. શુદ્ધિપ્રયોગનાં મૂળભૂત તત્ત્વો	...	૧૧૧
૧૦. શુદ્ધ પ્રયોગ અને લવાદી તત્ત્વ	...	૧૨૩
૧૧. શુદ્ધિપ્રયોગ અને રાજ્યાશ્રય	...	૧૩૭
૧૨. શુદ્ધિપ્રયોગમાં અનુઅંધનું સ્થાન	...	૧૪૭
૧૩. શુદ્ધિપ્રયોગનો કમ અને વિધિ	....	૧૫૪
૧૪. ધાંતિ સેનાનો પાયો અને યોગ્યતા	...	૧૬૫
૧૫. વિશ્વમાં અહિસાનાં પરિષ્યળોનું અનુસંધાન	...	૧૮૨



## સામુદ્દર્યિક અહિંસા પ્રયોગની અનિવાર્યતા

ભારત વર્ષમાં પ્રાચીન કાળથી આજ સુધી અહિંસાના અનેક પ્રયોગો થતા રહ્યો; તેનું કારણું એ છે કે ભારત અહિંસા પ્રધાન દેશ રહ્યો છે. જગત્કલમાંથી માનવસમાજ જેમ-જેમ નગર કે ગ્રામ તરફ આવતો રહ્યો તેમ તેણે સુસંકૃત થવા માટે પ્રયત્નો કર્યા. પરિણામે ધીમે ધીમે માણુસને એમ લાગ્યું કે “હિંસા કરતાં હોઈ પણ એક એવી વસ્તુ પ્રયત્ન છે જે માણુસ જ નહીં હિંસક પણું પણ વશ કરી શકે છે.” આ હતી અહિંસા. આ અહિંસાનો પ્રયોગ અહીંના ભારતના લોકજીવનમાં ઋષિ-મુનિ તેમ જ મહાન યુગપુરુષોએ સંક્રિય રીતે કર્યો. તેમણે અહિંસાની સ્ક્રદ્મ વ્યાખ્યાએ કરી; દૃષ્ટિ, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને તેમણે ચિંતન કર્યું. તેથી કુદુર્ભથી લઈને સમાજ, અર્થ, રાજનીતિ, શિક્ષણ, સંસ્કૃતિ ગ્રામથી લઈને રાષ્ટ્ર અને વિશ્વ સુધી દરેક બાબતોનો અહિંસાની દર્શિએ ઉકેલ આપ્યો. અને અહિંસાને ઉત્તરોત્તર પ્રગતિશીલ બનાવી.

આજના યુગે તેના પ્રયોગની અનિવાર્યતા ધણા કારણોસર જરૂરી છે. એક તરફ તો સામ્રાજ્યવાદી મનોવૃત્તિના કારણે; જૂની પ્રજા, નવી જાગૃત પ્રજાને સ્વશાસન આપવા માગતી નથી; બીજી તરફ આસનની પડાપડી માટે સમર્સ્ત વિશ્વમાં જે ખૂનામરકી થાય છે; તેમ જ વૈજ્ઞાનિક સંહારક અસ્વોની હરિક્ષાઈ—આ બધાં તત્ત્વો વચ્ચે માનવજીવન ગુંગળાઈને મરી રહ્યું છે. સમાજવાદ, સામ્યવાદ કે મૂડીવાદ ગમે તે વાદ આવે પણ શું એ માટે સતત હિંસક-સંધર્ષ જરૂરી છે? શું એનાથી કાયમી શાંતિ આવશે? વીસમી સદીનો ધૂતિહાસ જેવા જરૂરું તો આપણુંને એ રૂપી જરૂરાશે કે કાયમી શાંતિ માટે હોઈ એવા તત્ત્વની જરૂર છે જે જગતમાં પરસ્પર વિશ્વાસ અને

પ્રેમને કેળવી શકે ! એવી શક્તિ કેવળ અહિંસામાં રહેલી છે; અથવા અહિંસા દ્વારા પ્રેરિત પ્રયોગામાં રહેલી છે. તોમી રમભાણુા વર્ચ્યે જીતિ-સેના; યુદ્ધ વખતે રેડકોસ અને વિશ્વશાંતિ માટે સમજૂતીપૂર્વીકની મધ્યસ્થતા. એ તરફ જગત મીઠ માંડિને રહે છે ત્યારે આણુપ્રયોગની વિનાશક શક્તિનો ચિતાર વાચીને કાંપી ઉઠે છે ?

આતું કારણ શું છે ? એતું કારણ એજ છે કે કોઈ પણ માણુસ પોતાના જીવનનો અંત ન આવે તે માટે સતત ભથતો હોય છે. જીવનના દરેક ક્ષેત્રમાં જીવનને ટકાવી રાખવા માટે સતત પ્રયત્ન થતો જોવામાં આવે છે...નાનામાં નાની ઝડાઓ પણ પોતાના અસંખ્ય ઈડાઓને ટકાવી રાખવા માટે ભથતી હોય છે. જીવનતું આ રૂપદન દરેક સ્થળે જોવા મળે છે. એ જીવન સંધર્ષમાં જ્યાં પોતાના અસ્તિત્વની વાત આવી, ત્યાં બીજને ટકાવી રાખવાની પણ વાત આવી છે.

એ અહિંસા છે અને તેના સામુદ્દરિક પ્રયોગો સંપૂર્ણ માનવ-સમાજ ઉપર દૃષ્ટિ, ક્ષેત્ર, કાળ, લાવ પ્રમાણે જુદી-જુદી રીતે જુદા-જુદા દેશો અને યુગોમાં પણ થયા...! સમાજ, કાયદો, ન્યાય, સંજ અને અંતે ધર્મ એ આ મહાન પ્રયોગોના પરિણામ સ્વરૂપે જ આવ્યા છે.

## પ્રાચીન ભૂમિકા :

ભગવાન ઋપલદેવના કાળથી અહિંસાનો કંમિક વિકાસ સધાતો રહ્યો છે. તે આપણે ભારતીય સંસ્કૃતિના ઈતિહાસથી જણી શકીએ છીએ. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે તેમાં અહિંસાના વિકાસને હમેશાં પ્રધાનતા આપવામાં આવી છે.

ભગવાન ઋપલદેવે સમાજ-રચના કરી. તેમણે દોકાને માંસાહાર તરફથી વનરપતિ-આહાર તરફ વાળ્યા અને ઘેતી, પણપાલન વગેરે શીખવાઉથા. પરરસ્પરમાં વ્યવસાયિક વધડાએ. ન થાય તે માટે તેમણે

અલગ અલગ વ્યવસાયો થરે કરાવ્યા. ડોઈ બળવાન, કોઈ દુર્ખિણ ઉપર અત્યાચાર ન કરી એસે, કુટુંબ અને સમાજની વ્યવસ્થાઓ સુંદર રીતે વાલતી રહે, તે માટે તેમણે જુદા જુદા ધંધાએ—કાર્યોમાં આખાય સમાજને લગાડ્યો. સમગ્ર સમાજનું સંચાલન કરવા માટે કાયદા કાનૂન ન્યાય, અને મર્યાદાએની જોડવણું કરી. ચોતે સમાજ સંસ્કારક અને રાજ્યસંચાલક અનીને તેમણે પ્રગતનું હિત સાધ્યું. આ ધર્મી આખતો ભવિષ્યમાં વધનારી હિસાને અટકાવવા અને અહિસાની પ્રતિષ્ઠાપના કરવાનો જ પ્રયોગ હતો.

તેમના સમયમાં ભરત બાહુભિનું દંડ યુદ્ધ; એ પણ અહિસા તરફનું પગલું હતું. બન્ને રાજાઓની સેના ન લડે પણ બન્ને રાજાઓની બળ અજમાવી લે...! એમના પગલે ત્યારાધના ધણ્યા રાજાઓના દંડ યુદ્ધોની વાતો આવે છે.

ભગવાન મહાવીર અને ભગવાન યુદ્ધના કાળમાં યજોમાં ધર્મના નામે પણ મૂંગા પશુઓનું બલિદાન આપવામાં આવતું હતું. મોટા મોટા પણ સમારંભો વાલણો અને ક્ષત્રિયો મળાને કરતા હતા. નારી-જતિ અને શ્રી વણું સાથે પણ ધોર અન્યાય થતો હતો. તે વખતે ભગવાન મહાવીરે અને યુધ્યે આ હિસાએનો પ્રતિકાર કર્યો; અનેક ક્ષત્રિયો અને વાલણોને સમજાવી ધોર હિસાએ બંધ કરાવી. પરામાં માનવ બળિના બદલે આને કુળ-કુલ વગેરે અઠાવવામાં આવે છે, તે આ પ્રયાસોનું પરિણ્યામ છે. તે સિવાય તે યુગમાં થતી દાસ દાસી —ઝ્ય-વિઝયની ધોર હિસક પ્રયાને પણ અલિગણ (સૌભ્ય સત્યાગ્રહ) દારા બંધ કરાવી.

તે છતાં ક્ષત્રિયોમાં નિરોધ પશુઓનો શિકાર કરવો; તેમજ દૈવી દૈવોના નામે મૂંગા જનાવરોનું બલિદાન આપી; સુખભોગ કરવાની ઘર્તિ ખૂસી રીતે અર્ધ ન હતી. આ પ્રકારની હિસાને દૂર કરવા માટે મારવાડમાં આચાર્ય રલપ્રભસુરિજી, ગુજરાતમાં આચાર્ય હેમચંદ્રસુરિજી

અને હીરવિજયસુરિલુ; માલવામાં આચાર્ય સુહસ્તિગિરિલુ અને આચાર્ય સિદ્ધસેનલુ; તેમજ દક્ષિણ ભારતમાં આચાર્ય સંમતલદલ વગેરે અનેક આચાર્યાએ રાજા-રાણ્ણા ઢાકુરો અને જમીનદારોને પ્રતિબોધી, અનેક હિંસાકનક પ્રથાઓ બંધ કરાવી. એમની પરિપાઠીએ ચાલી જૈનાચાર્ય જવાહરલાલજી મ. સા. જૈનદિવાકર ચૌથમલજી મ. સા. વિગેરે મુનિ-વરોએ પણ અનેક રાજા-જાગીરદાર-જમીનદારોને પ્રતિબોધી અમારિપડું અમૃક દિવસો માટે વગડાવ્યો. આને પણ મૂક-પશુઓનું ખલિદાન રોકવા માટે ધણ્ણા પ્રયત્નો થઈ રહ્યા છે.

આ બધી બાખ્યોનો પડ્યો વિશ્વના ચોઆનમાં પણ વગર રહ્યો નહીં, પ્રેસિડેન્ટ એથાઇમ લિંકન જેવાએ પણ-દ્યાથી પ્રેરાઈને પ્રાણીએ સાથે થતી હિંસક કુરતા અને ગુલામોના ખરીદ વેચાલું અને તેમની સાથે થતા અમાતુષિક વ્યવહારો રોકવા માટે અમેરિકામાં કાયદો આપ્યો. તેનું અનુકરણ અન્ય દેશોમાં પણ થયું અને S. P. C. I. (society to prevent cruelty towards animals) પશુઓ સાથે થતી કુરતા રોકનાર સંધ અનેક દેશોમાં અરિતત્વમાં આવ્યો.

મહાત્મા ગાંધીજીએ પોતાના યુગમાં એક તરફ વિદ્યીશ સરકારની શાખણનીતિ તેમજ ભારતીય પ્રજા ઉપર થતા અન્યાએં વિરુદ્ધ અહિંસાનો સામુહિક પ્રયોગ કર્યો. ત્યા દેશમાં પછાત, દલિત અને પીડિત વર્ગ તરફ થતા અત્યાચારોને દુર કરવા માટે પણ અહિંસક દ્રષ્ટે પ્રતિકાર કર્યો. કેટલીક વાર તો આમરણું અનશન કરીને પ્રાણોને પણ હોડમાં મૂકી દીધા. ત્યારખાદ વિનોદાએ ભૂદાન વડે જરૂર્દસ્ત અહિંસક પ્રયોગ કર્યો અને તેનું પરિણામ એ આંધું છે કે વિશ્વ “ન ખુટકે હિંસા કરવાના-સંધર્થ કરવાના” મુદ્દા ઉપર વિચારતું થયું છે.

અગાઉના કાળમાં ને પ્રયોગો થયા હતા તે મોટે ભાગે વ્યક્તિગત હતા પણ આને સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગની જરૂર છે; એટલું જ નહીં ગાંધીયુગે તે માટેની ભૂમિકા પણ રચી છે. આને સામુદ્દર્યિક અહિંસાનો પ્રયોગ નવા પ્રયોગ હેઠે નથી; રહ્યો. તે છતાં એનો અર્થ ૨૫૭ કરી

લેવો હીક થરો કે ને અહિંસાનો પ્રયોગ વ્યક્તિ દ્વારા ગ્રેરિત થઈને જનસમૂહ દ્વારા આદોલિત થતો હોય તે સામુદ્ધાર્યિક અહિંસાનો પ્રયોગ છે.

## હિંસા કરતાં અહિંસા બળવાન છે

એ તો તદ્દન ૨૫૭૮ વાત છે કે હિંસા કરતાં અહિંસા વધારે બળવાન છે અને માણસોની ફૂર વિનાશક શક્તિઓ પણ અહિંસા આગળ નમી પડે છે ! અહિંસા જ્યારે માનવનો પોતાનો જ વિચાર છે ત્યારે હિંસામાં તેને પોતાનાપણું લાગતું નથી.

ભ. ઋષભદેવના સમયમાં ભરત બાહુભલિનું દનંદ યુદ્ધ થયું. પહેલાં નાટક યુદ્ધ થયું એમાં બાહુભલિ હાર્યા. પછી બાહુભલિએ કહ્યું: “હાર્યા એ કંખૂલ પણ હજુ શરીરબળની પરીક્ષા કરીએ !” બનનેએ મુણ્ઠ યુદ્ધ શરૂ કર્યું. ભરતે વાર કર્યો તે જીલતાં બાહુભલિને ચક્કર આવી ગયાં. પણ પછી ભાનમાં આવતાં તેમણે એવી દોડ મૂકી કે હમણાંજ ભરતને જમીનમાં દાઢી દૃશે ? પણ તેમનો ઉચ્ચકેદો હાથ ઉંચોઝ રહી ગયો ! તેમના મનમાં વિચાર આવ્યો...“અરરર...! હું આ શું કરં છું...? રાજ્ય માટે ભાઈનો વિનાશ છુંચું છું ! ”

વિનાશ માટે ઉપદેલો હાથ પોતાના વાળ તરફ ગયો. તેમણે ત્યાંજ હાથ અરકાવી દીધેં અને સાધુજીવન સ્વીકાર્યું ? એ હતો હિંસાનો અહિંસા ઉપરનો વિજય....!

આમ પણ જોવા જરૂરી એ તો હિંસામાં ડેવળ વિનાશજ રહેલો છે. તે સંસ્કૃતિ, સંસ્કૃતિના સ્તંભો તેમજ સ્મારકોને પણ ટકવા દેતી નથી. ઓસ મિશ્ર વગેરેની સંસ્કૃતિએના મંડાણું હિંસા ઉપર થયા તો આજે તેમના અવરોધ માત્ર. રદ્ધા. ત્યારે ભારતમાં અહિંસા ઉપર પહેલાંથીજ જોર અપાતાં અહીં હજુ સંસ્કૃતિ ટકી શકી છે. કાવ્ય; કણા, સ્થાપના વગેરેનો વિકાસ શાંતિ-અહિંસા કાળમાં થરો. પણ યુદ્ધ કે હિંસાના સમયે તો ડેવળ વિનાશજ પોતાનું આતંક જમાવે છે.

## અણુયુગ અને અહિસાના પ્રયોગો

આજના અણુયુગમાં તો અહિસાના સામુદ્દરિક પ્રયોગાની વધારે જરૂર છે. અણુયુગમાં ભયાનક શક્તો પોતાના હાથમાં હોવા છતાંથે પ્રતેક શક્તિશાળી રાષ્ટ્ર વિનાશના સતત ભય નીચે જીવે છે। રખે કોઈ જસુસ કૂઠી જાય તો....! રખે પોતાનાજ શાસ્ત્રાગારમાં કોઈ ચિન્ગારી ચાંપી હે તો? એ અણુયોગેની સંહારક શક્તિનો ઘ્યાલ એટલો બધો એના માલિકોને છે કે તેઓ સતત ભયના વાતાવરણ વચ્ચેજ જીવતા હોય છે, તેમજ દરેક એકખીજને શંકાની નજરે જુઓ છે! ત્યારે ધીરતર પ્રણ માટે તો ભયંકર વિનાશની ધૂંજરી ડેળવે છે. આવા સમયે જો અહિસાના સામુદ્દરિક પ્રયોગા થાય, એવા પ્રયોગ વીરો પાકે એ ધણ્ણીજ આશાજનક વસ્તુ ગણ્ણાવી જોઈએ. જગતની એવા પ્રયોગા તરફ આશાલરી મીઠ મંડાયા વગર નહીં રહે.

ગયે વખતે રવિશંકર મહારાજ શાંતિ સૈનિકો વિષે ખોલ્યા હતા. ધણ્ણાને એમ થરો કે આ શાંતિ-સૈનિકો એટલે શું? રાજ્ય પાસે સૈનિકો હોય છે; અનામત (Reserved) લશ્કર હોય છે. તે હરેક પ્રસંગે કામ કરી શકે છે તે છતાં શાંતિ-સૈનિકોની શી આવરણકતા છે?

લશ્કર, લશ્કરની ટેચે કામ કરી શકે-કદાચ તે હિંસાથી; જોળાખારથી શાંતિ આણી શકે, પણ સાચી છદ્યની શાંતિ તો સાચો અહિસંક જ આણી શકે. તેજ દુઃખીઓના દુઃખને દૂર કરી શકે અને આંસુઓને લૂંધી શકે.

શોલાપુરથી શ્રી જ્ઞાન આવ્યા હતા. તેમણે કલ્યાં કે આજે પુનામાં શાંતિસૈનિકોની વધારે જરૂર છે. આમ તો આવે વખતે રાહત આપી શકાય; મદ્દ મોદ્દલી શકાય પણ ધેર ધેર જરૂરને ધીરજ, આખાસન હું સંક્રિય રીતે મદ્દ કરનારનું મૂલ્ય વધારે છે. એની હાજરી જ પ્રસંગોથી પીડાયેલા લોકોને પ્રેરણા આપનારી બને છે. એવા શાંતિ સૈનિકોની

જેમ પૂનામાં જરૂર છે—તેમ જયલપુરમાં જરૂર છે—આસામમાં પણ જરૂર છે. આ શાંતિ—સૈનિકો સાચા અહિસક પ્રયોગવીરો હશે અને તેઓ જનતા પાસે એવા પ્રયોગો કરાવનારા હશે.

### અહિસક પ્રયોગકારની ચોચ્યતા

આપણે ને અહિસાના પ્રયોગાની વાત કરીએ છીએ તેમાં સામુદ્દર્યિક અહિસક પ્રયોગકારની વાત કરીએ છીએ. એ પ્રયોગકાર હોવો હોવો જોઈએ? આ પ્રયોગકાર જાતે સંપૂર્ણ અને પાડો અહિસક હોવો જોઈએ. એનું પ્રત્યક્ષ દર્શાન લોકોને તેના તરફ એંચનાં હોવું જોઈએ. ને જાતે અહિસાને આચરતો હોય તેનો પ્રભાવ કંઈક ઓ઱ જ હોય છે.

ગાંધીજીનું પ્રવચન રેઝિયેથી સંભળી શકાય છે; પણ ગાંધીજીને આંખ આગળ એકલતા જોવા—એનો પ્રભાવ કંઈક ઓ઱ જ પડે છે. આવો પ્રભાવ તેજ વ્યક્તિ પાડી શકે જ્યારે તે પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહને હોમી શકે. આ વસ્તુ લોકો માને છે એટલી સહેલી નથી.

ગાંધીજીના બહેન તે રળિયાત બહેન, તેઓ આશ્રમમાં રહી શક્યા નહીં. ગાંધીજી અસ્પૃષ્યતા વગેરેમાં માનતા હતા. તેથી તેમના બહેન કહેવા લાગ્યાં: “તમે આલદ્ધેષ્ટ વગેરેમાં માનતા નથી એટલે હું તમારી સાથે આશ્રમમાં રહી શકવાની નથી.”

ગાંધીજીને બહેન પ્રત્યે પ્રેમ અપાર હતો પણ જ્યાં સિદ્ધાંતની વાત આવી ત્યારે તેમણે સાછ કહી દીધું: “તમારે જવું હોય તો જવ; પણ હું મારા સિદ્ધાંતો નહીં છોડી શકું.”

બહેનને એમ થતું હતું કે જામેલી પ્રતિષ્ઠા કર્દી રીતે છોડી શકાય? પણ ગાંધીજીએ જામેલી પ્રતિષ્ઠાને ઢોકર મારી અને સિદ્ધાંતને સાચવ્યો હતો.

### જાતે અહિસક

એ પ્રયોગકાર જાતે અહિસક હોવો જોઈએ. જ્યાંસુધી લોકો ચોતે આદરોંનું પાલન ન કરે; ત્યાંસુધી તેમનો લોકોમાં પ્રભાવ પડતો નથી.

પૂ. જવાહરલાલજી મ. સા. નું ધારકોપરમાં ચાતુર્માસ હતું. ગાંધી-વિચારધારાના તેઓ પ્રખર સમર્થક હતા. ખાદી વિષે લોકાને સચોટ રીતે સમજાવતા, તેમના માટે પૂ. કસ્તુરભા પણ એમ કહેતા : “હિંદમાં એક જવાહર નથી એ જવાહર છે.” એ ખરં હતું.

તે ધારકોપર પ્રવયન સમયે કસ્તુરભાનું પણ પ્રવયન હતું. તેમણે સાદી લાષામાં ખાદી ઉપર પ્રવયન કર્યું. તેની ખૂબ જ અસર થઈ અને લોકા ટપોટપ ખાદીની પ્રતિશા લેવા માંયા.

પૂ. જવાહરલાલજી મ. સાહેબે કહ્યું : “હું તો તમને રોજ ખાદીનું કણ્ણા કરું છું, પણ કંઈ થતું નથી. પણ જે વ્યક્તિ પોતાના જીવનમાં આચરીને, અમુક વસ્તુમાં એાત - પ્રોત્સાહનને તે વિષે કહે છે ત્યારે એની જડપી અસર થાય છે.”

એટલે અહિંસક પ્રયોગકાર માટે અહિંસાનું જીવનમાં ઓતપ્રોત થયેલું આચરણ ધર્યું જ જરૂરી છે.

### વહેવાર અહિંસક ઉકેલ કરનાર

એવી જ રીતે સામુદ્દરિયિક અહિંસાના પ્રયોગકાર પાસે વહેવાર ખુદ્દ હોવી જોઈએ; જેના વડે તે ઉકેલ અહિંસા વડે કરી શકે. કુચારેક પ્રયોગકાર એક ઠસાને રોકવા જાય છે પણ બીજી હિંસા કરી એસે છે. એવા પ્રસંગોમાં આ અહિંસક પ્રયોગકાર વહેવાર ઉકેલ આણી શકનારો હોવો જોઈએ.

અહીં એક સાધુ - પુરુષ શ્રી ડેદાર નાથજી રહે છે. તેમણે એક વખત વ્યવહાર શુદ્ધ મંદળ રચ્યું. લોકા પાસે તેમણે પ્રતિશાપત્રો ભરાવ્યાં. ત્રણુચાર વર્ષ ઉપર તેમની પાસે એક પ્રશ્ન આવ્યો. “ખાદી આમોદોગ બોર્ડ માટે મકાન જોઈએ; પણ મુંખધ્યમાં ડાઈ મકાન મળતું નથી. ડાઈ આપે તો પાધડી માગે છે; તે ખાદી બોર્ડ જેવી નૈતિક સંસ્થા કઈ રીતે આપી શકે ?”

કોઈ અવહેવાર માણુસ હોત તો તે તરત કહેત : “ મુખ્યમાં મકાન મળતું નથી એટલે એ કામ બંધ કરી દો ! ”

પણ, કેદારનાથજી, ગાંધીજીના વહેવાર સાથી હતા, એમણે વચ્ચે વચ્ચે રસ્તો કાઢ્યો – તાર્કિક છતાં વહેવાર. “ દુકાનની પાધડી તો ન અપાય પણ તે ભાઈએ દુકાનની અત્યારસુધી જે જમાવટ કરી છે તેનો ગુડવીલ તરીકે બહલો આપવો જોઈએ.” એ ભાઈને સમજાવવામાં આવ્યું કે “ ખાદી આમોદોગનું કામ ચાલશે તો ગરીઓને રોજ મળશે – તારી આખરું પણ વધશે. એટલે ગુડવીલ લઈને આ મકાન આપી હો ! ”

એ ભાઈ માની ગયા. એમને ગુડવીલ તરીકે પાધડીથી એઓછા રૂપિયા મળ્યા અને તેમણે સંતોષ માન્યો. હવે જે આમ વહેવાર ઉકેલ ન થાય તો કાં તો નિયમો જડ થઈ જય; કાં તો ખાદી આમોદોગ બોડ જેવી સંસ્થાની એક શાખા બંધ કરવી પડે.

અહિસક પ્રયોગકાર માટે, એટલે વહેવાર હોવું ધણ્ય જરૂરી છે. અગવાન મહાવીરે અહિસાની બહુ જ જિડી વ્યાખ્યા કર્યા બાદ સાધુઓ માટે કાચા પાણીમાં પગ મૂકવાની મનાઈ કરી પણ લોકહિત માટે વિહાર કરવાની દ્રુટ આપી, એટલું જ નહીં રસ્તામાં નહીં આવે તો નૌકા દારા પાર કરવાની પણ નાત કહી.

### સુસંસ્થાઓ સાથે અનુભંગ :

એની સાથે એક ખીને ગુણ અહિસક પ્રયોગકારમાં હોવો જોઈએ તે એક તેણે સુસંસ્થાઓ સાથે અનુભંગ રાખવો જોઈએ. કેદારનાથજીના પ્રસંગમાં જોશું તો જણાઈ આવશે કે તેમણે વ્યવહાર શુદ્ધ મંડળ સ્થાપ્યું તેની સાથે ખાદી આમોદોગનો અનુભંગ ન હતો – તે છતાં શુદ્ધમંડળ માટે પણ એ પ્રશ્ન આવ્યો હતો કે લાંચ ન લેવી એ ખરું – પણ લાંચ આપવી પડે તો શું કરવું ? ત્યા થોંક નમતું મૂકવું પડેલું. આવા જટિલ પ્રશ્નોમાં નિયમો ઢીલા ન કરે તો પરિણામ એ આવે કે કાં તો મંડળ બંધ કરવું પડે, અગર તો પ્રાણ વિનાનું ખોખું

એ સંસ્થા બની જય. ત્યાં સુસંસ્થા સાથેનો અનુભંગ જળવવો એ અહિંસક પ્રયોગકાર માટે ધારું જ જરૂરી છે.

આ અંગે ગાંધીજીના જીવનમાં ડાંડા જિતરીશું તો ધારું ૨૫૦૨ થશે. જ્યારે બિહારમાં ધરતીકંપ થયો ત્યારે ગાંધીજીએ કહ્યું : “આ અસ્પૃષ્યતાના પાપના કારણે જ થયું છે. અને તે રહેશે ત્યાં સુધી આવા હુઃએ લેખવવાં જ પડશે !”

કવિવર રવીન્દ્રનાથે કહ્યું : “ગાંધીજી ! તમે આ શું કહો છો ? આ ધરતીકંપને અસ્પૃષ્યતા સાથે શો સંબંધ ?”

તેમણે કહ્યું : “હું વૈષણવ ધું. વૈષણવ સમાજ ઉપર કલંક એ માર્દ કલંક છે.”

એવી જ રીતે ડોઈ પૂનાની રેલ તારાજ સાથે ચિંભિરનો સંબંધ જોડે તો આપણે વિચારવું પડશે. આપણો આખી હુનિયા સાથે સંબંધ છે; અને સાચો અનુભંગ બનાવવો હોય તો હુનિયાના હુઃખ સાથે આત્મીયતા ડેળવવી પડશે. ગાંધીજીએ પણ એમ જ કહ્યું : “હુનિયાનું હુઃખ એ માર્દ હુઃખ છે. શાખદો સાથે મારે ડોઈ જઘડો નથી.” એટલે જનતા-જનાર્દનની આત્મીયતામાંથી તેમને લોકોનું બળ મળ્યું.

લોકોનું બળ મેળવવા માટે સર્વ પ્રથમ સામુદ્દરિક અહિંસાના પ્રયોગકારમાં જે ગુણો હોવા જોઈએ તે અંગે તુલસીદાસજી કહે છે :-

જે સહા દુઃખ પરછિદ્ર દુરાવા, વંદનીય જેહિ જગજસ પાવા....

સાધુ ચરિત શુભ સરિસ કપાસુ, નિરસ વિસય ગુણમય કુલનાસુ.

—જે વ્યક્તિ હુનિયાનું હુઃખ પોતાનું માને છે, અને તે હુઃખને સહેવા માટે કપડું જેમ પારકાના છિદ્રોને પોતે કષ્ટ સહીને ઢાકી દે છે તેમનું તે સાધુચરિત પુરુષ ખીજના છિદ્રોને પોતે કષ્ટ સહીને ઢાકી દે છે. તે ખીજના છિદ્રોને ઉધાડા કરતા નથી.

ગાંધીજીમાં આ શક્તિ હતી. એટલે જ લોકાની ભૂલોને તેઓ પોતાની ભૂલ માનતા; પરિણામે લોકા તેમને પોતાના માનતા.

પણ લોકશક્તિના પ્રવાહને વાળવા માટે કોઈ વ્યવસ્થિત સંસ્થા જોઈએ કરાણું કે ગાંધીજીને જગતના પ્રશ્નો લેવાના હતા. તેમણે સાધુ-સંસ્થા તરફ જોયું. સાધુઓ મોટા-મોટા વિદ્યાનો અને પૂજનીય હતા પણ તેમને જરૂર ને પૂછ્યું તો એમ જ કહ્યું કે “સામુદ્દરિક અહિસાનું મહત્વ શાખોમાં લખ્યું છે. ‘અહિંસા પરમો ધર્મः’”—એ સત્ત્ર એમે માનીએ છીએ.” પણ, આચરણમાં કંઈક જુદું હતું. સાદામાં સાદો પ્રશ્ન આવે તો હિંસા-અહિસા વચ્ચે ઓલા આતા હતા. સંપ્રદાયની જહોજલાલી કે બીજી સંપ્રદાયોનાં ખંડન માટે હિંસા જ વપરાતી હતી. એક મા અહિસક હોય છે પણ ખાળક રડે તો તરત લપડાક લગાવી હે; હિંસાનો ઉપયોગ કરે. તેમ સાધુ સમુદ્દર પાસે અહિસાની વધી વાતો હતી પણ માનવ સાથેના આચરણમાં કે અનુભવમાં આવેલી અહિસા ખંડ જ એઠી હતી.

એટલે, ગાંધીજી ડાંગેસમાં ચેડા, પણ, પણી વિચાર આવ્યો કે આમાં સત્ય, અહિસા બતાવીશું શી રીતે? ડાંગેસમાં જતાં પહેલાં તેઓ એના સામાન્ય સભ્ય બન્યા, સત્યસેવક બન્યા. ચોતે એરિસ્ટર હતા; પણ અભિમાન ગાળી નાખ્યું. આવો શક્તિશાળી માણુસ સંસ્થાને શા માટે ન ગમે? પ્રમુખને ભલામણુધાજમાંથી કુરસદ ન હતી તો ગાંધીજીએ તેમના બટન બીડી દીધા; કાગળિયાં વેરવિભેર રહેતા તે સરખા ગોઠવી દીધા. તેમણે કાયંકર્તાઓના મનમાં સ્થાન જમાવી લીધું.

તેમને ડાંગેસમાં ડાતરતાં લાગ્યું કે આદ્ધિકાને આવી હિંદની મહાન સંસ્થા દ્વારા મદદ કરાવવી જોઈએ; પણ તે થાય કેવી રીતે? ડાંગેસમાં હરાવ થાય તોથે ધંઢું થાય.

આદ્ધિકામાં તો તેમણે અહિસાનો પ્રયોગ કર્યો હતો; એટલે અનુભવ તો હતોજ. તેમણે વાત રજૂ કરી અને લોકાએ તેમને બોલવા માટે કહ્યું. ગાંધીજીને લાગ્યું કે આ વિદ્યાનો આમળ મારે શું બોલવું?

ગાંધીજીના પગ બોલતા બોલતા કાંપવા લાગ્યા. તેમની વાતની અસર થઈ. ગોખલેજ આવ્યા. તેમને ગાંધીજીએ વાત કરી. તેમણે પ્રમુખને વાત કરીને હરાવ પસાર કરી દીધો; વિશેષ ચર્ચા ન થઈ. આમ આ માણુસ ધીમે-ધીમે આગળ વધ્યા; અંતે તો તેઓ કેંચેસના સર્વસ્વથ થઈને રહી ગયા; પ્રમુખ બન્યા અને કેંચેસનું અહિંસાની દિશામાં ધડતર કર્યું.

જ્યારે કિસ્સ મિશન આવ્યું ત્યારે લોકોએ કહ્યું કે કેંચેસ પ્રમુખને મળતાં પહેલાં ગાંધીજીને મળો. તે સીધા ગાંધીજીને મળવા ગયા. ગાંધીજીએ કહ્યું: “કેંચેસના પ્રમુખ અત્યારે મૌલાના અભદ્રુલ કુલામ આજાદ છે; તે જે કરશે તેનેજ ખરાબર માનને, હું તો એક દેશસેવક છું.”

તેણે મૌલાના આજાદને બોલાવ્યા અને પોતે જે વિચાર્યું હતું તે મૌલાના આજાદ પાસે કરાવ્યું. આમ સંસ્થા સાથે તેઓ અનુભંગ તો રાખતાજ હતા.

પૂનામાં ગાંધીજી કેંચેસમાંથી નીકળી ગયા હતા, એ વાત તમે ખધા જણો છો. નીકળવાનું મૂળ કારણ એ હતું કે ગાંધીજીનો આગ્રહ હતો કે કેંચેસના બંધારણુમાં સત્ય અને અહિંસાને દાખલ કરવા.

કેંચેસીએનું કહેવું હતું કે “આ રાજકારણીય સંસ્થા છે. અમારે કેટલીક વરસુ શુપ્ત રાખવી પડે...ક્યારેક હિસ્ક સાધનોથી આકૃમણ ખાળવું પડે !”

ગાંધીજીએ કહ્યું: “રાજકારણીય સંસ્થા ભલે રહે, પણ તેમાં કાવા-દાવા ન હોવા જોઈએ! લોક સંગઠનોની મદદ વડે અહિંસા આવવી જોઈએ !”

મોટા ભાગના કેંચેસી લોકો ન માન્યા અને સત્ય તેમજ અહિંસાને બંધારણુમાં નહીં રાખીને “શાંતમય બંધારણીય રીતે” આ શખ્ફો મૂક્યા. અહીં એ ન ભૂલવું ધરે કે ગાંધીજી બંધારણીય રીતે ભલે કેંચેસથી અલગ થઈ ગયા છતા કેંચેસ સાથે અનુભંગ તો છેવટ સુધી

રાખ્યો. કારણું કે વિશ્વમાં રાજનીતિના ક્ષેત્રમાં અહિંસા લાવવી હોય તો આ રાજ્ય સંસ્થાને રીતી મૂકવી ચાલે નહીં.

## ભૂલો સુધારવાની નભ્રતા

સામુદ્રાયિક અહિંસાના પ્રયોગકારમાં ત્યારપછી જે ગુણ આવવો જોઈએ તે છે ભૂલો સુધારવાની નભ્રતા. માણુસો ભૂલો કરે છે; તેને સ્વીકારતા નથી; સ્વીકાર્યાં પછી સુધારતા નથી। આમાંથી દાંડાઈજનને છે. સાચા અહિંસાના પ્રયોગકારમાં એ વાત ક્યાંથી આવી શકે? તે ભીજની ભૂલોને પોતાની ભૂલો ગણુતો હોઈ ને તેનામાં ભૂલો સુધારવાની નભ્રતા સહેલે હોય તો આ વાત બની શકે.

સન ૧૯૪૨માં નેતાઓ પકડાઈ ગયા ત્યાર પહેલાં સરદારે અમદાવાદમાં સવાલનો જવાય આપતાં કહ્યું: “આજસુધી જે કંઈ કર્યું હોય તે કરો!”

શ્રી. કિરોલલાલ મશ્વરાળા હંજુ પકડાયા ન હતા. તેમણે હરિજન પત્રમાં લખ્યું: “જે ગાડીમાં લરકર જતું હોય અને એનાથી વધારે હિંસા થતી હોય તો તે ગાડીના પાટા જહેરમાં ઉઘેડી નાખો.” તેના કારણે પાટા ઉઘેડવાની પ્રવૃત્તિએ જોર પકુઝું. ગાંધીજી પાસે આ ઘધી ઘધરો જતી, પણ તેઓ આગામાન મહેલમાં કેદ હતા એટલે કંઈ કહી શકે તેમ ન હતા. જે કે શ્રી. કિરોલલાલભાઈએ એ નિવેદન અંગે પાછળથી પસ્તાવો વ્યક્ત કર્યો હતો.

તે વખતે સૌરાષ્ટ્ર ખાતે કાર્યકરોમાં એક વાત અંગે મતભેદ ચાલતો હતો. ભીજ લોકો કહેતા હતા કે પાટા ઉઘાડીને ભૂગર્ભમાં ચાલ્યા જવું. પણ ગાંધીજીના અદના શ્વિષ્યેને આ વાત અણ ઉત્તરતી ન હતી. આમ તો તેઓ નાના કાયંકરો જ હતા.

તે વખતે મારું ચોમાસું રાણુપુર હતું. આ સેવકો સાથે આ ચર્ચા ચાલતાં હું વ્યથિત થયો. મેં ચર્ચા ચાલતાં કહ્યું: “ગાંધીજીએ

સત્ય—અહિંસાનો વધારેમાં વધારે પ્રયોગ કર્યો છે. હું પોતે ગાંધીજી પાસે રહ્યો નથી એટલે જાત અતુલબત તો નથી. પણ એક સલાહ આપું છું. તમે જે કંઈ કરો તેનો જાહેરમાં એકરાર કરજો ! ”

પણ, ગુનાનો એકરાર કરે તો પોલિસ પકડે એટલે પાઠા ઉભેડનાર નાસી દ્શ્યટચા. માત્ર એક જ મહી જિબો રહ્યો ! પોલિસે આવીને પૂછ્યું : “ પાઠા કોણું ઉખેઝા ? ”

એણું કહ્યું : “ મેં ! ”

“ ખીળ કોણું — કોણું હતા ? ” પોલિસે પૂછ્યું.

“ ખીળનાં નામો હું દેતો નથી; પણ હું એમનો નેતા હતો ! ” તેમણે કહ્યું.

પોલિસે ખૂઅ માર માર્યો પણ તે અડગ રહ્યા. જેલમાં લઈ જઈને પકડી રાખ્યા. સ્વરાજ્ય આવ્યા પછી તો એ પણ દ્શ્યટી ગયા. તે દરમ્યાન એમનાં પત્ની અને કુટુંબ પણ અડગ રહ્યાં.

આગુંતતા

આમ જ્યાં જાહેરમાં ભૂલનો એકરાર કરતા આવડવો જોઈએ ત્યાં સાનુદાયિક અહિંસાના પ્રયોગકારમાં અગુંતતા પણ હોવી જોઈએ. જે કંઈ કરો તે ખુલ્લું કરો.

સ્વરાજ્ય મેળાવ્યા બાદ સમાજવાદીઓ કહેવા લાગ્યા : “ અમે પાઠા ઉખેઝા, ભાંગડેડ કરી એટલે વહેલું સ્વરાજ્ય આવ્યું.”

તેમને ૨૫૪૮ રીતે મારે કહેલું પડ્યું : “ તમે કામ કર્યું એ ખરું પણ સ્વરાજ્યનો યથ તો અહિંસા જ આપો ! ”

ખરેખર ભારત જે કંઈ કરી શક્યું છે; સ્વરાજ્ય મેળાયું કે ભૂદાન પ્રયોગ થયો એ બધા પાછળ જે શક્તિએ મોટાભાગે કામ કર્યું છે તે અહિંસા જ છે; અને તેની જ ૨૫૪૮ અને ઉધાડી શક્તિએ જ શક્તિશાળી અધિનિષ્ઠ સાભ્રાજ્યશાર્વીને ઝૂકાવી છે.

## કેની પાસે વધારે આશા ?

આવો જ પ્રેરોગ - સામુદ્દર્યિક અહિંસાનો પ્રેરોગ આખા વિશ્વના ધોરણે થાય તો જ શાંતિ - સુખ આવી શકે છે. એટલે આવા પ્રેરોગની આશા કઈ સંસ્થા પાસે વધારે રાખી શકાય ?

એ માટે ધડાયેલી સાધુ-સંસ્થાના સભ્યો પાસે જ વધારે આશા રાખી શકાય ! તેમો જ સમાજમાં રહીને સમાજ વડે કે સંસ્થાઓ વડે સામુદ્દર્યિક અહિંસાનો પ્રેરોગ કરાવી શકે તેમ છે.

ધથ્યાને એમ થરો કે માંધીજી, વિનોભાજી, રવિશંકર મહારાજ વિ. સાધુ સંસ્થામાં ન હતા, છતાંય ગૃહસ્થોમાં સાધુતાવાળા એ પુરુષો આ પ્રેરોગ કરી શક્યા તો પણ સાધુ અનવાની જરૂર શી છે ? પણ, આપણે એવા પુરુષો વિરલ જ જેશું - અને અપવાદનો કાયદો વહેવારમાં ન લાગુ કરી શકતો નથી. આવો પ્રેરોગકાર કાંતો સંતકોટિનો હશે કાંતો વાનપ્રસ્થી હશે.

ઉપરાંત અહિંસાનો સામુદ્દર્યિક પ્રેરોગ કરવો એટલે હિંસક-તામસી પ્રવૃત્તિઓનું નિયંત્રણ આખુંનું ! આ કાર્ય કેવળ સુસાધુ જ કરી શકે - કરાવી શકે તેમ છે. ધથ્યાવાર નેતાએનો જ્યાં પ્રલાવ નથી પડતો ત્યાં સંત-સાધુઓનો પ્રલાવ પડે છે. ખાસ કરીને નૈતિકજીવન ધડતરમાં.

દરેક માણુસ શાંતિ ધર્છે છે પણ તેને શાંતિનું વાતાવરણ મળતું નથી એટલે તે હિંસા કે અશાંતિ તરફ બેંચાય છે. સામ્યવાદીઓ પણ હમણું-હમણ્ણી શાંતિની, શ્વાસ-સંન્યાસની વાતો કરવા લાગ્યા છે; એ અહિંસાના વાતાવરણનો જ પ્રલાવ છે ને ?

આવું વાતાવરણ - અહિંસક વાતાવરણ સામુદ્દર્યિક પ્રેરોગો કરી દરેક ક્ષેત્રે જિલ્લાં કરવાની જરૂર છે ! તે થતાં જગતનાં સંયોગને બદલતાં વાર નહીં લાગે.

આજે વીશ દેશોએ એટમ-બોમ બનાવ્યા છે. એટલે શ્રી કૃષ્ણ-  
મેતને કહ્યું કે હવે એટમ બોમ નકારાં થઈ ગયાં છે. એટલે શિખર  
પરિષદ યોજવાની વિશ્વના મોવડીઓ વિચારણા કરે છે. આ એકંદરે  
શ્વરૂપ-હિંસાનો પરાજ્ય જ છે. તે છતાં શાંતિ ન મળતાં લોકો હિંસા તરફ  
વળે એ એટલું જ સહજ છે.

એટલે અહિંસામાં માનનારા લોકોને પોતાની નિષ્ઠા વધારે દદ  
બનાવવી પડશે. ધરમાં કોઈ પ્રશ્ન ભલો થાય તો વડીલો ચર્ચા કરે  
એમ અહીં પણ સાધુ-શિખિરમાં વિશ્વશાંતનો પ્રશ્ન ચર્ચવાનો છે. જે કે  
ખંડી કલ્ખાના સંતો નથી આવ્યા પણ અહીં સુંદર પ્રતિનિધિત્વ દરેકતું  
રજુ થાય છે. એટલે આપણી પાસે દરેકને વધારે અપેક્ષા હાય  
તે સ્વાભાવિક છે.

અહીં સામુદ્દરિક અહિંસક પ્રયોગોની છણાવટ કરી તેની નિષ્ઠા  
વધે એ જોવાનું છે. સાથે જ ડેર ડેર તપ-ત્યાગ બલિદાન દ્વારા પ્રજા  
અને સંસ્થાઓને સાથે લઈને તે અંગે વાતાવરણ સર્જવાનું છે.



## ચર્ચા - વિચારણા

### એક પ્રસંગ :

શ્રી. દેવજીભાઈએ આજની ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : સામુદ્રિક  
અહિંસા-પ્રયોગની પોતાની અસર છે-કાયમી અસર છે.

ભયાઉનો એક પ્રસંગ મને યાદ છે. સૌરાષ્ટ્રમાં, રાજકોટ,  
ભાવનગર વગેરે શહેરોના કારણે શ્રી વધારા સામે વિદ્યાર્થીઓ આંહાલન  
ચલાવી રહ્યા હતા. અમારે ત્યાં સ્થાનિક-વિદ્યાર્થીઓને પણ એનો નાદ  
લાગ્યો. તેમણે અશુક્ષ સાખોનોનો આશરો લઈને ત્યાં પણ હડતાળ  
પડાવી. ગાળા ભાંડીને કે પત્થર મારવાની ધમકીથી બધી દુકાનો  
બંધ કરાવી.

ખેડૂતમંડળના કાર્યક્રમોને લીધે તેમની સાથે મને પરિચય હતો. મેં તેમના આ કાર્યક્રમોનો વિરોધ કર્યો. પણ સ્થાનિક વેપારીઓ, જેમાં ડેટલાક ડાંગેસીઓ પણ હતા; તેમનો સહયોગ વિદ્યાર્થીઓને હતો. તેમણે ખાવાનું, પીવાનું પૂર્ણ પાડ્યું હતું. અમલદારો ઉપરથી તો મારી પડાયે હતા, પણ અંદરથી વલણું નરમ જણાતું હતું. અમારા સાથી લખમશીલાઈને સાથીદારોના દખાણુના કારણે દુકાન બંધ કરવી પડી. મેં દુકાન બંધ ન કરી. મારા ઉપર ખૂબ જ દખાણું આવ્યું. સગાં-સંખાઈઓએ પણ અહુ પ્રયત્નો કર્યા. ખેડૂતો, ખેડૂતમંડળના કારણે મારી મદ્દે આવતા ગયા તેમ તેમ વિદ્યાર્થીઓ ઉદ્કેરાતા ગયા. તેમણે મને અને ખેડૂતમંડળ બન્નેને ગાળો આપવી શરૂ કરી.

રાત્રે અમે ગ્રામસભા યોજુ; તે ન થવા દેવી, એવો વિદ્યાર્થીઓના પ્રશ્નનો મોચણો હતો. કચાઉમાં નવેં ફળારની વસતિનાં ત્રીજા ભાગના ખેડૂતો છે. સલા શરૂ થઈ. અને લખમશીલાઈએ હિસ્ક આંદોલનને વખોડયું. વિદ્યાર્થીઓ વગેરે ખૂબ ઉસ્કેરાયા; પથર મારવા શરૂ કર્યા વિદ્યાર્થીઓએ “ખેડૂત મંડળ સુર્દાયાદ” નાં સત્તો ઉચ્ચારવા શરૂ કર્યા.

આ સલામાં એક ખાબાજુ એટેલા હતા. તેઓ એ ન સાંખી શક્યા. તેમણે ત્રાડ પાડી; “યહ ક્યા લગાયા હેં? કુછ મનુષ્યતા રખો! જગતાત મર જાયેંગે તો તુમ કેસે જાયોંગે?”

ખસ આખું વાતાવરણ બદ્લાઈ ગયું. ખખા વિદ્યાર્થીઓની વિરુદ્ધ થઈ ગયા તેથા તોકાનીઓને ભાગવું પડયું. પોલિસને અમે અગાઉથી જ કહી દીધેલું કે અમે ડોઈના નામ આપણું નહીં, તેમજ ડોઈના ઉપર અમારે કામ ચલાવવું નથી.

અંતે સલામાં સર્વાનું મતે તોકાનોને વખોડાનારો હરાવ પસાર થઈ અયો. દુંકમાં સાધુના વચ્ચનની અસર અને ખેડૂતાના સાસુદાયિક અહિસ્ક શાંતિની અસરનો સુભેણ થયો. તે કામ પાર ઉત્તર્યું. ગુજરાતના વડાપ્રધાનનો સુંદર સહાનુભૂતિનો સંદેશ આ બદ્લ આવેલો.

## સામુદ્દરિક અહિંસા

શ્રી. માટલિયાળુએ સામુદ્દરિક અહિંસાનો વિકાસ પોરાણિક રીતે વર્ણવતાં કહ્યું કે વરાહાવતારમાં દાઢ, નૃસિંહાવતારમાં નહેાર, પરશુરામાવતારમાં ફરસી અને રામાવતારમાં ધતુંષ્પ; એમ દુષ્ટોના દંડ માટે હિંસ્ક સાધનો વપરાયાં છે; વામનાવતારમાં છળ વપરાયું છે. કૃષ્ણાવતારમાં શલ્વપ્રયોગમાં જલે ન લજ્યાતું બન્યું છે. અને લગ્નવાન મહાવીર અને બુદ્ધ વખતે અહિંસાનો સ્પષ્ટ રીતે વિકાસ થયો છે. ગાંધીયુગે આજ પીઠિકા ઉપર સામુદ્દરિક અહિંસાતું મંડાણ થયું છે. પ્રાચીનકાળમાં રાજ પરીક્ષિત લગી નાગનાતિ વ. સામે લડાયું છે; જ્યારે વિશ્વામિત્રે બધી જાતિઓને અપનાવી છે; માત્ર રોધીથી નહિ, પણ દીકરીઓની આપ લે કરીને પણ. તેથી જ પાંડવકુળમાં નાગકન્યા, ગાંધર્વકન્યા, રાક્ષસકન્યા વ. સાથે લગ્નો થયાં છે. લ. કૃષ્ણ તો ગોપ જાતિને અને પડેલી કુંભને સુંદર બનાવી પ્રતિષ્ઠિત કરી છે. આજે સામુદ્દરિક અહિંસા પ્રયોગના ચાર તત્ત્વો !

હવે આ અહિંસાને ચાર પ્રકારે વિચારવી પડશે :-( ૧ ) સમાજનું પરિવર્તન કરવામાં અહિંસા, ( ૨ ) દુષ્ટ તત્ત્વોને દ્યાવવામાં અહિંસા. ( ૩ ) પોતાના વિચાર પ્રચારમાં અહિંસા અને ( ૪ ) નારી જાતિ તથા પણત વર્ગાને પ્રતિષ્ઠિત કરવામાં અહિંસા. આ ઉપરાંત ગામડાં, મજૂરો આમોદોગી વ. ની સામેના વર્ગાની સામે અહિંસા. ટૂંકમાં આધિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય, એમ બધા ક્ષેત્રોમાં સામુદ્દરિક અહિંસા પ્રયોગો જલદી વિચારવા પડશે.

તા. ( ૨૧-૭-૬૧ )



## સામુદ્ધાયિક અહિંસા - પ્રયોગનાં તત્ત્વો

અહિંસાનો જ્યારે વિચાર સામે આવે છે ત્યારે સર્વ પ્રથમ વ્યક્તિત્વ નજર આગળ આવશે. કોઈએ આગળ વધવું હશે તો તેની શરૂઆત વ્યક્તિત્વથી કરવી પડશે. એવું જ સામુદ્ધાયિક અહિંસાના પ્રયોગનું છે. આ પ્રયોગ વ્યક્તિત્વની પ્રેરણાએ થશે; પણ તેનો સંબંધ સમુદ્ધાય ક્રેસમાં જ સાથે હોવો જોઈએ. તે માટે એણે સમાજને ઘડવો પડશે. સમાજ તૈયાર નહીં હોય તો વ્યક્તિત્વની પ્રેરણા નિષ્ફળ જશે. સામુદ્ધાયિક અહિંસા - પ્રયોગ એટલે કે વ્યક્તિત્વની પ્રેરણા ઝીલીને અહિંસક કાર્યકરા તૈયાર થવા અને તેમણે આપેા અહિંસક સમાજ જિલો કરવો.

### પ્રયોગમાં જોડાનારતી ખૂબી :

એટલે જ્યાં સુધી સામાજિક બળ સાથે સંબંધ રાખીને અહિંસાના પ્રયોગો નહીં થાય; ત્યાંસુધી સામુદ્ધાયિક અહિંસાનું તત્ત્વ નહીં પાંગરે. એ માટે વ્યક્તિએ પહેલાં જાતે પ્રયોગ કરવો જોઈએ અને પછી તે પ્રયોગ સમાજ ઉપર કરવો જોઈએ. આ યુગમાં આવો પ્રયોગ મહાત્મા ગાંધીજીએ કર્યો હતો. તેમની પાછળ સમાજનું બળ હતું. જો કે ભારતની સંસ્કૃતિના ધ્રતિહાસમાં અને હાઈમાં આ વરતુ તો હતી જ, પણ તેને ઉપર લાવવાનો એય ગાંધીજીને ક્રાણે જય છે. તેમને યથ મળ્યો તે સાંધુતાથી મળ્યો છે.

એકવાર ખ્રિસ્ટશ્રાણ શાસકોના અત્યાચારોથી તેઓ ખણું અકળાયા ત્યારે તેમણે વિનોદાણ પાસે એક વિચાર ખૂબું કે “હવે ન્યાય મેળવવા માટે બલિદાનની સળંગ પરંપરા ( હારમાળા ) જલ્દી થવી જોઈએ. ખ્રિસ્ટશરો કંઈ કરવા હેતા નથી. એટલે થોડાંક બલિદાનો તેમના આત્માને હયમબાવી શકશે.”

વિનોભાળએ સંમતિ આપી; પણ પછી એ વાત ત્યાં જ અટકી ગઈ; કારણું કે આખો સમાજ તૈયાર ન હતો. સમાજ તૈયાર ન હોય ત્યારે કોઈ પણ પ્રયોગ સફળ ન થાય.

એવી જ રીતે આખો સમાજ તૈયાર થાય એ કાર્ય પણ અધરને છે. એ માટે સ્વાર્થ; યશ વગેરાનું બલિદાન આપવું પડે. નોકરી છોડવી પડે, વકીલાત છોડવી પડે, વેપાર મૂકવો પડે! તેમજ કોઈ પણ સ્વાર્થ વગર અ-રાગ અને અ-દ્રોષ્યી ભરવું કોને ગમે? છતાં પણ એવા ધણ્ણા ભરજીવા લોકો નીકળા આવે છે જે જે પોતાનું બલિદાન આપીને સમાજ જાગૃત કરે છે. અદ્ધાનંદ, ગણેશશંકર વિદ્યાર્થી કે ગાંધીજીનું પોતાનું બલિદાન શ્રેષ્ઠ આદર્શ ઉપસ્થિત કરે છે. પણ આવી બલિદાનોમાં જે રોષ હોય; ગુસ્સો હોય તો તે અહિસક પ્રયોગની સીમામાં આવતાં નથી.

બાધુ ગતુ ખટારા વચ્ચે હોમાયા હતા. તેથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું હતું. તેમણે કહ્યું કે આવેશ અને રોષમાં આવી જઈને બલિદાન ન આપવું જોઈએ, તે ઉપયોગી થતું નથી. એક બાજુ હિંસા છે; ખીલ બાજુ અહિસા છે. સહેજ આવેશ, કોઈ, રોષ, આ અખા તરવે. અહિસાની વિરુદ્ધમાં છે, એટલે પ્રેરક વ્યક્તિએ ધણો જ ઊડો વિચાર કરવાનો રહે છે.

### અહિસક પ્રયોગના ભૂતકાળનાં ઉદ્ઘાટને

હવે આપણે અહિસક પ્રયોગનાં કેટલાક ભૂતકાળનાં ઉદ્ઘાટને જોઈએ. સંસ્કૃતિના ચરણું મંડાયા તે પ્રારંભકાળનો એક દાખલો છે.

**ભરત અને બાહુભિની :** આ બન્ને ભાઈઓ વચ્ચે તકરાર પડી. બન્ને મોટા મહારથી હતા. એટલે ધ્રુને ચિંતા થઈ કે આ એના કારણે અસંખ્ય સૈનિકોના પ્રાણું જરો, એટલે તેમણે કહ્યું કે પરસ્પર શક્તિનું માપ કાઢવું છે ને? તો ત્રાટક (દણિયુદ્ધ) કરો! જે હારે તે હારો. એથી કામ ન જરૂરું એટલે મુણ્ઠિ-યુદ્ધ બતાવ્યું.

ભરતે સુક્કી મારી. પછી બાહુભલિ તૈયાર થયા. પણ પછી વિચાર કર્યો કે માર્યાં પછી શું? તેમનો હાથ અટકી ગયો. અને યુદ્ધ સૂક્કી સંપર્મના મેદાને તેમણે પ્રસ્થાન કર્યું.

આ કદાચ અહિંસાના વિકાસના પ્રારંભના તથાજનો પહેલો પ્રસંગ હશે. તે છતાં પણ આપણે જેઠી શકીએ છીએ કે એ કાળે જે દંડ-વિધાન હતું તેમાં પણ “હા-કાર”, “મા-કાર” અને ખિકુ-કાર. આ ત્રણેયમાં પણ આજની પ્રાણ હણી લેતી જેગવાઈબાળી કોઈ સર્જ ન હતી. એટલે ભલે એ યુગને જંગલ-યુગ, વન્ય-યુગ કે પ્રામૃ સંસ્કૃતનો યુગ ગણ્યાવામાં; પણ માનવસમાજ માટે અહિંસાનું આચરણ ત્યારથી જ શરૂ થયેલું.

**રાજ શિબિર અને લગવાન શાંતિનાથ :**—લગવાન શાંતિનાથ અને રાજ શિબિર એ બન્નેનાં ઉદાહરણો. લગભગ સરખાં છે. જ્યા એક પારેવાને ગિધથી બચાવવા માટે બન્ને જાતે તોળાઈ જાય છે. અહોં ખાવા માટે પણ પરહિંસા-રોકવાનું કાર્ય રાજ્ય-રાજીનું છે, એનું સુંદર પરોક્ષ સૂચન મળે છે,

**લગવાન નેમિનાથ અને પશુવાડા :**—એવી જ રીતે એક દંડાંત નેમિનાથનું છે. નેમિનાથ લગ્ન કરવા જાય છે. જાન નગરદારે પહેંચે છે ત્યાં તેઓ પશુઓનું આકંદ સાંભળીને પૂછે છે?

“ લગ્ન પ્રસંગે મિજબાની કરવા! ” લોકો કહે છે. નેમિનાથને અળે આ વાત ઉત્તરતી નથી. લોકો કહે છે કે ‘ તેમને મારીને બ્યંજનો ઘનાવવામાં આવશે. તે સાંભળી નેમિનાથે કહું : “ લગ્ન જેવાં પવિત્ર કાર્યમાં આવી અપવિત્ર મિજબાની શા માટે? ”

લોકોએ દલીલ કરી કે લગ્નમાં તો આવું ચાલે જ !

**નેમિનાથ સમજવે છે :**—“ મનુષ્યના સુખભોગ માટે પંચેન્દ્રિય ગ્રાણીનો બેગ કેવો એ કોઈ રીતે સારું નથી ! ”

જાન પાછી વળાવે છે; અને એમ આદર્શ ઉદાહરણ રજૂ કરે છે. લગ્ન એટલે એ શરીરાત્માનું મિલન. તે પ્રસંગે અન્યનું ગ્રાસુ-વ્યપરોપણ ક્યાં સુધી ઢીક ગણ્યાય! ઓછાચાં એષું સામાજિક પ્રસંગોએ તો એનાથી દૂર રહેવું જોઈએ.

**પાર્શ્વનાથ અને તપ-હિંસા :** પાર્શ્વનાથના સમયમાં યજા-યાગ તો થતાં અને તેમાં પણ હિંસા તો થતી જ; પણ ધણ્યા તાપસો ધૂણી ધ્યાવી ને બેસતા અને તેમાં નિર્દ્દિષ્ટ ભરાતા જીવો તરફ દુર્લક્ષ સેવાતું.

એવા એક તપસ્વી કંઘઠની ધૂણીમાથી તેમણે જ્યારે સર્પ-સર્પિણી કાઢયા ત્યારે લોડાને થયું કે ધર્મ-કાય' કે તપ જેવા પવિત્ર પ્રસંગોમાં આવી હિંસા સારી ન લાગે! યજામાં હેમાતાં પણુંઓને પણ ન હેમવાં જોઈએ એવી તેમણે ભૂમિકા તૈયાર કરી.

**મહાવીર અને તે ડાળના પ્રસંગો :** ભગવાન મહાવીર અને ઝુદ્ધ ભગવાને પાર્શ્વનાથ પ્રલુએ તૈયાર કરેલી ભૂમિકા ઉપર યજામાં અપાતી પણખલિ અંધ કરાવી એટલું જ નહીં; તેમણે તે યુગમાં અહિંસાનું પાલન કેવી રીતે થાય તેનું જ્ઞાન-ભાન લોડાને આપ્યું. થોડાંક પ્રસંગો ઉપરથી એ વાત રૂપણ થશે.

(ક) સાધ્વી માનરેખાને ખખર પડે છે કે તેમતા પૂર્વાશ્રમના એ પુત્રો નભિ અને ચંદ્રયશ વર્ચ્યે એક હાથીના કારણે યુદ્ધ થવાતું છે. તે પોતાનાં ગોરાણીજીની આજા લઈને જય છે અને અનેને સમજવીને યુદ્ધ બંધ કરાવે છે. સાધુઓએ જાતે જર્ઝને શું કરવું જોઈએ તેનું આ સુંદર ઉદાહરણ છે.

(ખ) અન્જુન ભાગીનો પણ એવો જ એક પ્રેરક પ્રસંગ છે. તેનામાં પત્ની ઉપર શુંડાઓા દ્વારા થતો અનાચાર જોઈને પ્રતિહિંસા જગ્યી. તે રોજ ૬ પુરુષ અને એક સ્ત્રી એમ સાતની હત્યા કરતો. લોડા તે રસ્તે નીકળતા અરથરવા.

એ સમયે ભગવાન મહાવીર આવે છે અને સુદર્શન શ્રમણોપાસક દર્શન કરવા જય છે. લોકા ના પાડે છે, પણ તે સાચી અહિંસા રાખી અને બલિદાનની લાવનાને જગાડીને નીકળે છે.

ધસમસતા કાળ જેવા અજૂન માળાનું બધું અનુન અહિંસક પ્રયોગવીર સુદર્શન સાથે આંખે ચાર થતાં ઓસરી જય છે અને તે પણ સુદર્શનની સાથે જર્ખને ભગવાન મહાવીરનો શિષ્ય બને છે.

**ભગવાન યુદ્ધ અને અંગુલિમાલ :** એવાજ એક લયંકર લુંધારાનો પ્રસંગ યુદ્ધના જીવનમાં બને છે. લોકા તેમને એ રસ્તે જવાની ના પાડે છે. પણ યુદ્ધ જય છે; અહિંસાની પ્રગાઢ શક્તિ અને બલિદાનમાં તેમને વિશ્વાસ છે. પરિણામે અંગુલિમાલ યુદ્ધને મારવા આવે છે પણ પાસે આવતાંજ તેમનાં ચરણોમાં નભી પડે છે.

આ બધાં પ્રસંગો વ્યક્તિ અહિંસાની સંપૂર્ણ શક્તિ અને નિર્ભર બલિદાન આપવાની લાવના શું કરી શકે છે તે ખતાવે છે.

**ઉપગુપ્ત ભિન્ન અને અશોક :** અશોકે હથિયાર પડ્યાં, રાજ્યો જીત્યાં પણ તેને ખરો આનંદ ન મળ્યો. જ્યારે કલિંગના યુદ્ધમાં તે કારણુ દશ્ય જુદે છે ત્યારે ભિન્ન ઉપગુપ્ત પાસે આવે છે અને ત્યાં પહેલી વાર સંદેશ પામે છે “તે લોહીથી દંડથી યુદ્ધથી લોકાને જીત્યા; હવે તું પ્રેમથી લોકાને જીત....લોકાના હૃદય ઉપર રાજ્ય કર!”

અશોક તે દિવિસથી શર્વ સંન્યાસ કર્યો. ને કાર્ય અશોકની તલવાર ન કરી શકી તે કાર્ય અશોકની અહિંસા કરી શકી અને આજે પણ લોકા તેને જીત્યા નથી.

આમ આ અહિંસાનો પ્રયોગ વ્યાપક રીતે ચાલનો થયો; સમાજમાં તે માટે ભૂમિકાઓ કેળવાતી ગઈ. પરિણામે માંધીજુએ એ ભૂમિકા ઉપર રાજ્યની શક્તિને શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને સમર્સત ભારતનો સહયોગ મળ્યો. એટલુંજ નહીં લોહી રેઝા વગર સ્વતંત્રતા મેળવવાની નવી વાત ધતિહાસને પાને તેમજે લખાવી.

## સામુદ્દર્યિક અહિસાના પ્રયોગોના તથક્કાએ.

ઉપરના ભૂતકાળના પ્રસંગોનું વિશ્લેષણ કરતાં જણાશે કે વ્યક્તિના પ્રેરિત સામુદ્દર્યિક અહિસાના પ્રયોગો તથક્કાવાર થતા ગયા છે અને તેમાં સંશોધન ચાલતું રહ્યું છે. ભરત-ખાહુઅલિથી લઈને અરોક સુધીના શાસ્ત્ર-ત્યાગના પ્રયોગો રાજકીય ક્ષેત્રે પણ મહત્વાકંક્ષા માટે યુદ્ધ ન કરવાનું સૂચયે છે. શિબિર અને શાંતિનાથના જીવનપ્રસંગો શાસન ક્ષેત્રે “ભૂખ” જેવા પ્રસંગોએ પણ બીજાની હિંસા ન કરવાનું સૂચયે છે. નેમિનાથ ભગવાનના જીવનનો પ્રસંગ સામાજિક-મંગળ પ્રસંગ હિંસા ન થવી જોઈએ એમ સૂચયે છે. ત્યારે પાર્શ્વનાથ પ્રભુના પ્રસંગો તપ, યજા વિ. માં હિંસા ન થવી જોઈએ; એનું નિર્દેશન કરી જય છે.

આમ આ ભૂમિકા તૈયાર થતી રહી અને ભગવાનમહાવીર તેમજ ખુદ્ધે અને સમરસ્ત જીવનને આવરી લેવા માટે સામુદ્દર્યિક પ્રયોગનું ઇપ આપ્યું. યજામાં બલિદાન આપવામાં માનતાર આખા ક્ષત્રિય અને ધ્રુણાં વર્ણનું તેમણે ઇપાંતર કરી નાખ્યું.

ત્યારખાદ અરોકે સંપૂર્ણ ભારતમાં જે રીતે હિંસા થતી અટકાવી; પશુનીકલ્યાણ બંધ કરાવી કે માંસાહાર બંધ કરાવ્યો; તેથી આખી પ્રણમાં અહિસાને અલિવાનું નહું ચૈતન્ય જાગ્યું.

પછીના ધતિહાસમાં વિદેશી હૃમલાઓ-યુદ્ધો વગેરે એકતરએ થતાં રહ્યાં; પણ બીજી તરફ અહિના સંતો-સાધુઓ અને ધર્મગુરુઓ તરફથી અહિસાને પ્રચાર સતત થતો રહ્યો.

પરિણામે ગાંધીજીએ જ્યારે અહિસાની આ નૈતિક શક્તિને ઓળખી અને લોકાને જગૃત કર્યા; ત્યારે બલિદાન આપવા માટે આગળ આવવા ધર્યુંયે લોકા તૈયાર થઈ ગયા. સત્યાગ્રહ વખતે, સરધસ વખતે, સભા વખતે મૂંગે મોઢે ચોલિસની લાઠીઓ ખાતા અને કુયારેક તેમની જોળીઓના લોગ બનતા. અહિસક-સામુદ્દર્યનાં દર્શયો અદ્ભૂત જ ગણ્યાની શક્યાય.

## હિંસા કે અહિંસા :

અહિંસાનું આમ ઐડાથ્રુ થવા છતાં ધરણીવાર એવા પ્રસંગો બિલા થાય છે જ્યારે સહેલે હિંસા જેર પકડે છે; ત્યારે શું કરવું ? હિંસાના ઉત્તર પ્રતિહિંસા નથી જ; જો સમજાવટ કે વાટાધારથી વસ્તુનો નિકાલ આવી શકતો હોય તો તે કરવું વધારે સારું છે !

અશોકથી લઈને ગાંધીજી સુધી ને કંઈ કરી શક્યા તે અહિંસાના અણે જ થયું છે. લોકો ચંગેજ્યાન, નાહિરશાહ કે મહમ્મદ ગોરીને ખાદ રાખવા માગતા નથી કારણું કે લોકોને હિંસા-વિનાશનું સ્વરૂપ ગમતું નથી. હિંસાથી હિંસાના ગુણ્યાકાર થાય છે અન્યાયનો નાશ થતો નથી. એટલે જ તલવારથી અન્યાયનો પ્રતિકાર થઈ શકશે પણ તેના કરતાં અહિંસાથી સામનો થાય તો હિંસા વધશે નહીં.

## સહૃદી વધુ જવાખદારી સાધુઓની

તો, આવી અહિંસાના પ્રચાર માટે, એને સમાજવ્યાપી બનાવવા માટે જો ડોઝની પણ મોટી જવાખદારી હોય તો તે સાધુઓની છે કારણું કે તેમનો સીધો સંબંધ ધર્મ સાથે છે. રાજ્યની અહિંસાની એક મર્યાદા હોય છે. રાજ્ય ઉપર આધાર રાખનાર પ્રજા પણ તોષનો વ. વખતે હિંસાના સાધનોનો આયહ રાખતી હોય છે. તે વખતે સાચા લોક્સેવકો એને સાધુઓની ફરજ છે કે પ્રજાસંગઠનો દ્વારા પ્રજાને અહિંસાને માર્ગ હોરે, તાલીમ આપે. આજે એમ મનાય છે કે મતભેદો વગેરે ધર્મના કારણે બિલા થયા છે, તો હવે ધર્મ જ તેને સાંખ્યાના છે. એમ દરળ કપણું વેતરે છે પછી તેને સાંધે છે એવું જ કાર્ય સાધુઓએ કરવાનું છે.

ધર્માં લોકો કલેરો કે શાસ્ત્રમાં તો સાધુઓ માટે લખ્યું છે કે તેમણે ઉપદ્રવોથી દૂર રહેવું જોઈએ, ‘સંકિલેશકરં ઠાણं દૂરયો પરિવિજિએ’ સંકલેશ ચેદા કરનાર કારણ્યથી દૂર રહેવું જોઈએ. પછી તોષનો, હુલ્લડો કે હિંસા ચાલે તાં તેઓ કર્ય રીતે જાય !

આ વાક્યનો સંદર્ભ આ રીતે વિચારવો પડશે કે સાધુ હોય તર્ફાં ઉપદ્રવ ન હોવો જોઈએ એવો તેમનો પ્રભાવ પડવો જોઈએ. સાધુ હોવા છતાં જે ઉપદ્રવો થતાં રહે તો સાધુઓએ પોતાનાં તપ-ત્યાગ અલિદાન વડે દૂર કરવા જોઈએ.

ઉપરના શાસ્ત્રવાક્યનો ભાવાર્થ પણ એ જ છે કે પોતાના નિભિતે જ્યાં અથવા જેથી સંકલેશ પેઢા થતો હોય, તો તેથી દૂર રહેવું જોઈએ.

ઉપર મહનરેખા સાધ્વીનો પ્રસંગ જેયો, એ રાજીએ લડે છે ત્યાં તે સમાધાન કરાવવા જય છે. તે વખતે કાઈએ તેમને અટકાવ્યા નથી; જિલ્લાટું તેમનાં વખાણું કરેલ છે. એટલે કે નાહકની લડાઈ અટકાવી તેમણે થતી હિંસાને રોકી છે તેને ગુરુ-શાસ્ત્ર-શાસન તરણેતું સમર્થન મળ્યું છે. આજે તો વિચારક સાધુઓ જાતિમાં કે સંપ્રેદાયમાં ચાલતા કલેશા નિવારવા પ્રયત્ન કરે જ છે.

શેડ સુદર્શનના પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે તેમને લગવાન મહાવીર નિભિત રૂપે હતા પણ ત્યાંથી હિંસાને શાંત કરવા માટે તેઓ જ તીર્થ કર્યા પ્રશંસાના અધિકારી બન્યા છે. જે વખતે અનુંનમાળાનો આતંક ચાલતો હતો, તે જ રાણુ લ. મહાવીર રાજગૃહી નગરીમાં પધારે છે; એ પ્રસંગ સૂચ્યવી જય છે કે સાધુઓએ જ્યાં અશાંતિ ચાલતી હોય, તેઝાન ચાલતું હોય, ત્યાંથી નાસવું નહિ, બલ્કે સામે ચાલી ચલાવીને પોતે કે પોતાના દધ્યર્મ અનુયાયી દ્વારા અહિંસક રૂપે શાન્તિ સ્થાપવાનો પુરુષાર્થ કરવો.

તે ઉપરોત પણ શાસ્ત્રમાં દધિવાહન રાજની રાણીનો પ્રસંગ આવે છે. તેમને ભાવ આવ્યો અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા સમયે તેમને ગર્ભ છે એનો ઘ્યાલ ન હતો; પણ પાછળથી વિકાસ થતાં, તેઓ એનો પ્રસવ કરે છે અને બાળકને કાંખલમાં વીટાળી જંગલમાં મૂકી આવે છે. એક આદિવાસી તેને લઈ જય છે. રાજને તેની ખર પડે

છે. તે પોતાના ખાળકની ખાંગણ્ણી કરે છે. પણ, પેદો આહિનાસી આપવા છયાંતો નથી. એટલે બન્ને વચ્ચે અધડો થાય છે. સાધ્વીને તે વાતની અધર પડે છે અને તે આવીને સમાધાન કરાવે છે.

આવા સામાજિક પ્રસંગોમાં પણ સમાધાન કરાવવાનું : કામ સાધુએ કરતા હોય, ત્યારે ધર્મની વાત આગળ વધારવા માટે, ગૂંડાગીરી અને અધર્મને અટકાવવા હોય, અસત્યને, અપ્રમાણિકતા ને પ્રતિષ્ઠિત થતાં અટકાવવાં હોય તો સાધુપુરુષો એમાં રસ નહીં લે તો ભીજું કોણું એ કામ કરશે? સાધુએ નાનું ધર મૂકીને આખા વિશ્વને કુંભ કર્યું, ત્યારે સમાજનાં મૂહયો માટે પ્રાણ-પ્રતિજ્ઞા અને પરિયહ એમણે છોડવાં જોઈએ.

ગૃહસ્થોને કેટલીક મર્યાદા નડશે પણ સંતોને હરકત આવતી નથી. ગૃહસ્થો માટે પણ ત્રણ મનોરથો શાસ્ત્રમાં આપ્યા જ છે :—

- ( ૧ ) ક્યારે બાલ અને આળ્યંતર પરિયહ છોડી નિર્ણય બનું?
- ( ૨ ) ક્યારે સર્વથા આરંભ છોડી અનાસક્ત જીવન જવું?
- ( ૩ ) ક્યારે પંહિત મરણને પામું?

### સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગની તાલીમ

આ ત્રણ્ય મનોરથોમાં ઉડો વિચાર વ્યક્ત થાય છે. તે વ્યક્તિની સામુદ્દર્યિક અહિસા પ્રયોગની તાલીમ વગર થતું નથી. પરિયહથી મોઢ છૂટવો કણ્ણ...તેમાં પણ શરીરનો મોઢ છૂટવો વધુ કણ્ણ! એવીજ રીતે ગુસ્સાને જરવવો કણ્ણ; ગુસ્સાની સામે શાંત રહેવું એથી પણ કણ્ણ અને ગુસ્સાને ખાળી નાખવો-પ્રેમભાવ દર્શાવવો એ એનાથી પણ કણ્ણ કામ છે.

આવકો પ્રતિકુમણુ કરે છે ત્યારે પાંચ વ્રતનાં પદ્યકખાણુ કુંક સમય માટે લે છે. ધીમે ધીમે તે ડેળવાય છે. આ અધી તાલીમ છે. કોઈ એમ સમજે કે તાલીમ વગર હું ધારીશ તેમ કરી શકીશ તો તે ખોદું છે. વ્રત-પાલનથી વરતુનું કે સંક્રમ સ્વરૂપ સમજાય છે, આચરાય

છે તે તાલીમ વગર આવતું નથી. પરિણ્યામે નાની વસ્તુમાં પણ સિદ્ધાંત સચ્ચવાય છે કે વિસરાય છે તેની કાળજ રહેતી નથી. એઠેઝ લોકોમાં ક્યારેક હિંસા પ્રગટ થતી જોવામાં આવે છે. અહિંસાના પૂજનરી અને સમર્થક લોકો પણ ધર્મના નામે હિંસા ને ઉતેજન આપતા જોવામાં આવે છે. સિદ્ધાંત અને વહેવારના સુખેળ માટે તાલીમ ધર્થીજ જરૂરી છે.

## તાલીમ પામેલાનો વહેવાર

જેમણે સામુદ્દાયિક અહિંસાના પ્રયોગની તાલીમ મેળવી હશે તેનો વહેવાર ડેવો હોવો જોઈએ? તે અગે એક સુંદર ઉદાહરણ જૈન સ્ત્રોમાં ધર્મરચિ આણગારનું મળે છે.

તેઓ કડવું શાક લિક્ષામાં દહેરી લાવ્યા. હળાહળ એર જેવું. ગુરુએ પરઠી આવવા (નિર્જવ સ્થાનમાં નાખી આવવા) માટે જણાવ્યું. પણ તેમાંથી એક ટીપું નીચે પડ્યું. તેની સુગંધના કારણે કીડીએ રૂપોટિપ આવી અને અણગારે જોયું કે તે બધી ભરી ગઈ. અહીં સિદ્ધાંતનો પ્રશ્ન આવ્યો. કીડીએ નાની હતી; પણ સિદ્ધાંત મોટા હતો. ચોતાની ભૂલનો ભોગ ભીજને ડેમ બનાવી શકાય? અંતે એ શાક એમણે પોતે ખાઈને બલિદાન આપ્યું-પ્રાણ છોક્યા.

## ધર્મ એઠે શું?

એઠે અહિંસક પ્રયોગો કરવા માટે ધર્મને સાચા શખ્દોમાં સમજવો પડશે. સુદર્શન શ્રમણાપાસકના પ્રસંગમાં; અનુર્ધ્વનમાળાની પત્ની સાથે બલાત્કાર કરનાર છ લલિતગોણી (ગુંડા) પુરુષોને રાજ્યનો ટેકો હતો. એ ઉપરથી આકના રાજકારણનો પણ વિચાર થાય છે. આજે કેંચેસ સત્તા લેવા માટે ગમે તેવા લોકોને ચોષે છે કારણુંકે ઉપર જવા માટે લધું કરવું પડે છે. એમાં એકલી કેંચેસનો દ્વાર નથી. જો રાજ્ય સારું બનાવવું હોય તો સારા માણ્યસોને રસ

લઈને મોકલવા જોઈએ, એવી જ રીતે ધર્મ-અહિંસાને સામુદ્દર્યિક રૂપ આપવું હશે તો એનાથી દૂર ભાગવાથી કામ નહીં ચાલે.

ધર્મ રક્ષાશે તો જ પ્રજા રક્ષાશે. જે ધર્મથી લોકોનું રક્ષણ ન થતું હોય તો સમજવું કે ત્યાં ખરો ધર્મ નથી. ધર્મ કોઈ ભાષણું ના વિષય નથી. એ તો સતત આચરણની વસ્તુ છે. સત્યને મોખરે રાખી જીવનમાં અહિંસાનું આચરણ કરતું એ જ ધર્મ છે.

### હિંસાના પ્રકાર :

સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગની વાત આવે છે એટલે સર્વ પ્રથમ હિંસા કેટલા પ્રકારની છે તે જાણી લેતું પણ જરૂરી છે. હિંસાના એ પ્રકાર છે : ( ૧ ) દ્વયહિંસા અને ( ૨ ) ભાવહિંસા. કદાચ સકારણે કોઈ દ્વયહિંસા કરે તો તે ક્ષમ્ય ગણ્યાય છે. જેમકે ડોકટર દર્દીને જેરની દ્વારા આપે છે; પણ તે બચાવવા માટે. તેવી જ રીતે તે એપરેશન કરે છે અને દર્દી મરણ પામે છે તો તેવી હિંસા ક્ષમ્ય ગણ્યાય છે. પણ ભાવ-હિંસા કદી ક્ષમ્ય બનતી નથી. કોઈ ઉપરથી સારું બતાવે; ખુશામત કરે પણ અંદરથી કપટ રાખે તો તે વધુ હિંસક છે. અહીં ઉપરથી હેખાતો અહિંસક અંદરથી વધુ હિંસક છે; ત્યારે પેલા ડોકટરના કેસમાં તે હિંસક હેખાતો છતાં વધુ અહિસક છે.

જૈન ગૃહસ્થોના ( શ્રાવકોના ) અહિસા પ્રતનું નામ છે—રથૂળ પ્રાણુત્પાત-વિરમણ વ્રત. એટલે રથૂળ હિંસાથી દૂર થવું. એમાં સાધુઓ માટે તો જ્યાં સંપૂર્ણ હિંસા નિવૃત્તિનું મન-વચન-કાયાથી પ્રિપણું છે ત્યાં આવકો માટે જાણી કરીને, હિંસા કરવાની ભાવનાએ હિંસા કરવા તથા કરવવાની નિવૃત્તિ સ્વચ્છવામાં આવી છે. જે કર્મથી સામાની હિંસા થશે—તે જાણી કરવું એ પોતાના અર્થમાં પૂર્ણ-હિંસા છે. એટલે અહિસાનો સામુદ્દર્યિક પ્રયોગ કરનારે સર્વપ્રથમ તો લોકમાનસને ભાવ-હિંસા તરફથી વાળવાનું છે. હૃદલડો, રમભાણો કે તોકાનો ઝાટે છે ત્યારે ધણા લોકો ક્રમલો કરે છે—તેઓ તો નિંદ્નીય છે પણ એમનાં વખાણું કરનાર

એથી પણ ઉત્તરતી કોઈના છે. આ ભાવ-હિંસા જ; હિંસાને માનસમાં જગાડતી રહે છે. પરિણામે નાના અધડાથી લઈને વિશ્વયુક્ત થતા આપણે જોઈએ છીએ.

## અહિંસક પ્રચારકની જવાખદારી

આવા તોઝાન કે હુલ્ખલો સમયે તો અહિંસક પ્રચારકની જવાખદારી સંવિરોષ વર્ધી જાય છે. ધણું કહેરો કે તોઝાનો અટકાવવાં રાજ્યનું કામ છે. આ લોકો એમ પણ કહે છે કે રાજ્યે જોળીબાર પણ કરવો નહીં. તો કામ કર્છ રીતે ચાલે ?

આવા સમયે સાચા અહિંસક પ્રચારકો ઇપે સાધુઓની પર્વિત્ર જવાખદારી મોટી આવે છે. તેમણે પ્રજાને એ રીતે ધર્મની જોઈએ કે તેને તોઝાન કરવાનો સમય આવે જ નહીં. જે કાઈવાર આવે જો પણ તેણે ચોતાનાં તપ, ત્યાગ, અલિદાન વડે, રાજ્યને દંડ-શક્તિ વાપરતાં અચાવી લેવું જોઈએ. છોકરો પડતો હોય તો માતા એસી નહીં રહે-તે જોખમ ઘડીને પણ તેને અચાવશે. તેમ સાધુ પણ છકાયના મા-ધ્યાપ છે. અન્યાયના પ્રસંગોએ તેમણે સામુદ્દરિક અહિંસાના રસ્તા અતાવવા જોઈએ.

## સત્ય-અહિંસાને સમાજવ્યાપી ઘનાવવા ઘટે

અમારા પુ. ગુરુહેવે એકવાર ગાંધીજીને પૂછેલું કે “લડાઈજીતવા માટે ધર્મરાજ થોડું જૂદું બોલ્યા હતા। તો આપણે ‘પણ કોઈની સેવા માટે, કોઈના હિત માટે થોડું અસત્ય બોલીએ તો શું વાંધો છે?’”

ગાંધીજીએ કહ્યું: “એ મહાપુરુષ માટે હું કંઈ નહીં કહું. પણ સત્યના લોગે સ્વર્ગનું રાજ્ય મળતું હોય તો હું તેનો ધનકાર કરું”

સત્ય બોલવું એક વાત છે; પણ તેને સામાજિક ઘનાવવું એ ભીજી વાત છે. દુનિયા ઉપર આકૃત આવે ત્યારે ભાર્ગ અતાવવો જોઈએ. ગાંધીજીને સ્વરાજીની ધૂન એટલી વર્ધી હતી કે તેમને સત્ય પહેલાં અને

અહિસા બીજુ એમ કહેવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. તેમના મને સામજિક ન્યાય જળવવા, સત્ય જળવવા, અહિસંક પ્રયોગો કરવા માટે સ્વરાજ્ય જરૂરી હતું. એટલે તેમણે એ પ્રાપ્ત ક્ષું પણ અહિસાને સમાજ વ્યાપી બનાવીને.

હવે સ્વરાજ્ય મળ્યા બાદ એ રાજ્યને સારું બનાવવાની એટલી ફરજ અહિસંક પ્રયોગકારો ઉપર આવી પડી છે. એટલે સર્વપ્રથમ રાજ્યસંસ્થા પછી લોકસંસ્થા, લોકસેવક સંસ્થા અને પછી સાધક સંસ્થા એ રીતે દરેકને પવિત્ર બનાવવી જોઈએ. આમ નહીં થાય તો સામુદ્દરિક અહિસાની વાત, સામુદ્દરિક પ્રમાણિકતાની શુદ્ધ નીતિની વાત અમલી થરો નહીં.

•

એટલે આજે દરેક ક્ષેત્રે અહિસંક પ્રયોગો કરવા જરૂરી અને છે, તેમ કરવા જતાં કઈ સંસ્થા અહિસાનો વિચાર કરે છે; તે પછી કયાં સંગઠનો છે જે અહિસા અને નીતિમાં માને છે; પછી કઈ સાધક-સંસ્થા છે કે જે સત્ય અને અહિસાને સામે રાખીને ચાલે છે તે બધું ક્રમવાર તપાસીને તેને ટેકો આપવો પડશે. કાંતો નવી સંસ્થાએ જીભી કરવી પડશે. ગાંધીજીનો પ્રયોગ, તેમનો વ્યક્તિત્વન હોતો. પણ દેશનો પ્રયોગ હતો. એ પ્રયોગ ચાલુ રહેત તો દેશમાં આજે જે સ્વાર્થ, સત્તાલોલુપતા, લાંઘદરશત, સડો વિગેરે જોવા મળે છે તે દૂર થઈ જત. હજુ પણ મેંથું થયું નથી. દરેક ક્ષેત્રે પ્રભાવ પાડવા માટે અહિસાના વ્યાપક પ્રયોગ ચાલુ કરવા જોઈએ અને તે માટે અહિસંક સાધકોએ આગળ આવવું જોઈએ. એકવાર અહિસાનો સામુદ્દરિક પ્રયોગ થયો કે ધણું પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ થઈ જશે.



## ચર્ચા - વિચારણા

સતો અને સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગો

શ્રી. પૂજનભાઈએ ચર્ચાનો આરંભ કરતાં જણાવ્યું : “ સ્વામી સહજનંદળાએ આખી કાઠી જતિનું પુનરુત્થાન કર્યું. શ્રી. રવિશંકર મહારાજે સાખરકાંઠા, મહીકાંઠાના પછાત વર્ગના લોકાને હોયા. બાખર જેવા ગુનેગારને પણ અંતે ફાંસી થઈ ત્યારે મહારાજને મળાને કહેવાનું મન થયું કે “ તમે બતાવેલ રસ્તો ખરો હતો. પણ મારાં કૃત્યો બદ્લ આ સન્ન મને ઓછી લાગે છે ! ”

એટલે સંતપુરુષોની આ અસર સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગની દિશા સૂચયે છે.

**સમાજનું ધડતર થયું જોઈએ !**

શ્રી. હવળભાઈ : “ દશ વર્ષ પહેલાંની વાત છે.

લીંબડી સંપ્રદાયના એક વયોવૃદ્ધ, શાની અને ચારિશ્ચિલ સંત કુચ્છના એક મોટા ગામમાં ચાતુર્માસ નિમિત્તે આવ્યા હતા. ત્યાં ૬૦ ધરો સ્થાનકવાસી જૈન સંપ્રદાયના હતા. પણ ગામમાં ઉપ-સંપ્રદાયો હોઈને કુસંપ તેમજ કાંટાઓ ધણા હતા. તેમણે બધાને બોલાવીને કહ્યું. પણ, તેની ધારી અસર ન થઈ. તેઓ ડાંડા વિચારમાં પડ્યા. જો મારા વચ્ચેની અસર ન થાય તો હું ચાતુર્માસ રહીને પણ શું કરી શકીશ ? કુસંપ ચાલુ હશે તો લોકો વ્યાખ્યાનેનો પણ ઉધ્યો અર્થ દેશે. તેમજ મારાં પ્રવચનોમાંથી દરેક મનક્રાવતો અર્થ કાઢવાને બદલે અનર્થ વધારે ફેલાવશે.

તો કરવું શું ? ચાતુર્માસ માંડી વાળું, એ પણ એક રસ્તો છે. પણ, તે નિષેધાત્મક અહિંસાનો. એટલે કે એક બાજુનો રસ્તો છે ત્યારે લગવાન મહાવીરનો રસ્તો સર્વાંગી છે. તેમણે અહિંસાની વિધેયક

બાજુ લઈને જહેર કર્યું. “જ્યાં સુધી એક જ સંપ્રદાયમાં પણ કુસંપના કારણે ભાગલા છે ત્યાં એ સંપ્રદાયના પૂજય એવા સંત આહાર પાણી ડેવી રીતે લઈ શકે ! ”

તેમણે ઉપવાસ શરૂ કર્યા. વાતાવરણમાં ખળભળાટ મળ્યો. પાંચમે દિવસે ખધા ભેગા થયા. પોતપોતાની ભૂલેલા તેમણે કંઘૂલી અને આખા સંધમાં એકતા-સુસંપત્તું સુવાસિત વાતાવરણ પ્રસરી ગયું.

પણ, એ જ સાધુ ભીજ કરાયામાં ગયા. ત્યાંના કુસંપને શમાવવા પ્રયત્નો કર્યાં પણ કારગત ન થયા.

આનું કારણ એ લાગ્યું કે ત્યાં ચાર જુદા જુદા ધર્માના-સંપ્રદાયોના માણસો હતા. ભીજું ત્યાં સરળ સ્વભાવના ઘેતી કરનાર લોકો કરતાં તે કસબામાં વેપારી લોકો વધારે હતા. આ રીતે વિચારતાં મને એએક બાબતો મુખ્ય લાગી ? — ( ૧ ) જેણે અન્યાય નિવારણના કાર્યો કરી લોકશર્કા જલી કરી છે એવી સંસ્થા દ્વારા આવા પ્રયોગો કરવા પડશે. ( ૨ ) તે સંસ્થાની સાથે લોકસંસ્થાઓ, સાધુ-વિજૂતિઓ, સેવક-સંસ્થાઓ, સુરાજ્ય સંસ્થાઓનું જોડાણું પણ જોઈશે. તો જ દ્વેક સ્થળે સામુદ્દર્યિક અહિસાની દિશા દ્વારા રસ્તાઓ નીકળશે અને સમાજનું ધડતર થશે.

**શ્રી. માધલિયા :** રાજ્યસંસ્થાનો જે કે પહેલો વિચાર કરવો જ પડશે. પણ સામુદ્દર્યિક અહિસા તો લોકામાં આપોઆપ પડેલ ધર્મ સંસ્કારના કારણે ધારણ થશે. રોમમાં લશ્કર અને ધર્મગુરુઓ પણ નિષ્ઠળ નીરદ્યા ત્યારે નિઃશ્વાસ બહેનોની કટારો નીકળી અને વિજ્ય મળ્યો. આમ વ્યક્તિ કે સમૂહ ગમે તે રીતે પણ લોકામાં પડેલ શીલ-સદાચારનું તત્ત્વ અને તેના પુરસ્કારકર્તાઓ જ જે અનિવાર્ય ઉપયોગી દેખાશે તો સંસાર સર્વગમન અની જશે.

( ૨૮-૭-૬૧ )



( ૩ )

## સામુદ્દર્યિક અહિંસા પ્રયોગમાં દ્વારા

સામુદ્દર્યિક અહિસાના પ્રયોગાનો મુદ્દો એ રીતે વિચારવાનો છે. એક તો વ્યક્તિગત રીતે દુઃખ સહન કરવું અને ભીજે સામુદ્દર્ય માટે દુઃખ સહન કરવું, દુનિયાનું બધું થતું હોય અને સહન કરી લેવું તે એક વાત છે અને સામુદ્દર્ય માટે, સંસ્કૃતિની રક્ષા કરવા માટે વેઠવું પડે તે ભીજી વાત છે! આ અંગે થોડુંક અગાઉ વિચારાઈ ગયું છે.

એના ઉપરથી; સામુદ્દર્યિક અહિસાના પ્રયોગમાં ડોઈ દ્વારાણુને અવકાશ છે કે હેમ તે પ્રયત્ન ઉલો થાય છે! અને આવું દ્વારાણુ હિસામાં ઘેપે કે અહિસામાં? દ્વારાણુ એટલે દ્વભન. જે દ્વારાણુમાં સ્વેચ્છાએ ચોતે ચોતાની કે ભીજની ભૂલેને સાક કરવા માટે પ્રાયશ્રિત લીધું હોય, તેનુ દ્વારાણુ અહિસક હોય છે. પણ જેમાં વ્યક્તિ ચોતે ચોતાની ભૂલેનો એકરાર કરીને સાક કરતો નથી, ત્યાં ભીજી ચોત્ય વ્યક્તિ, સમાજ કે રાજ્ય દ્વારા દ્વારાણુ થતું હોય છે એમાં એક જાતની સુદ્ધમ હિસાનો અંશ હોઈ શકે છે. પણ જે હિસાની પાછળ અહિસાનું તત્ત્વ હોય તે હિસા ખરેખર તો અહિસાની દિશામાંજ પગલું છે. ડોકટરની વાફકપતું દુષ્ટાંત અગાઉ એ સંદર્ભમાં મૂડવામાંઆવેલું.

શાસ્ત્રમાં હિસાના એ પ્રકાર કહેવામાં આવ્યા છે ( ૧ ) અશક્ય પરિહારવાળી હિસા, ( ૨ ) નિવાર્ય હિસા. એક હિસા એવી છે કે જેને નિવારી શકાતી નથી; જેમકે ખાવા-પીવા તેમજ શાસ લેવા માટે સુદ્ધમ જીવાની હિસા થાય છે. આવી હિસાથી આવક નહીં, સાંધુ પણ બચી શકતા નથી. એવીજ રીતે પ્રાભાણ્યકૃપણે ગૃહસ્થજીવનમાં ધંધે કરવાથી પણ ચોડીક અનિવાર્ય હિસા થઈ જય છે. આ હિસા અનિવાર્ય છે. ત્યારે સ્વાદ કે વાસના માટે જાણી કરીને નાની મોટી હિસા કરવી તે નિવારી શકાય છે અને તેને અનિવાર્ય ન ગણ્યાવી શકાય.

પણ, જે અન્યાયના નિવારણ માટે વિરોધીઓ સાથે લડતું પડે તો તેવી હિંસાને, અનિવાર્ય હિંસા ગણુવામાં આવી શકે. મહાભારતનું યુદ્ધ એવા પ્રકારનું યુદ્ધ હતું. કચાંક અન્યાય, શોષણ કે સત્તામણી થતી હોય; શિંકાર, માંસાહાર કે શોખ માટે પ્રાણીવધ થતો હોય કે ગૂંડાળીરી કરીને સમાજને લય પમાડતો હોય. તેની વિરક્ષમાં યુદ્ધ કરતું પડે તો તેવી નાની હિંસા અનિવાર્ય અની ક્ષમ્ય બને છે. એના બદલે કેશે સામાજિક અન્યાય સર્જેરી હોય કે સર્જવા કે વધારવામાં સીધી કે આડકતરી રીતે ભાગ લીધો હોય, તેને માટે તે હિંસા ક્ષમ્ય નથી તેમજ એવા શોષકો, ગૂંડાઓ, અન્યાયી અને અયાચારીઓને સાથ આપવો પણ અક્ષમ્ય હિંસા ગણુશે.

ભગવાન મહાવીરના સમયે તેમના એક સમ્યકુદ્ધિ અને શ્રાવક પ્રતિધારી અનુયાયી ચેટક રાજ માટે એક આતું યુદ્ધ અનિવાર્યપણે આવી પડેલું. તેઓ ન્યાયની પ્રથમે રહ્યા. તે વખતે લોહીની નહીંઓ વહી, પણ એ બાધતનું રાજના અંતઃકરણમાં લારેભાર દુઃખ હતું. તેમનું આત્મભાન લોપાયું નહતું. એટલેજ મર્યાદાએ તેઓ સ્વર્ગ ગયા હતા. ત્યારે સામે પક્ષે ક્રાણિક વગેરેના અતિ-ગર્વના કારણે આ યુદ્ધ સર્જયું. તેમની હિંસા ક્ષમ્ય ન હતી; શાસ્ત્રો કહે છે કે તેની કે તેના પક્ષકારોની ગતિ પણ તેવી જ થઈ.

કુંકમા માનવ વ્યક્તિ, માનવ-સંસ્થા, માનવમન્માજ અને પ્રાણી સમાજિક વગેરેના સંબંધમાં આમ વિવેકપૂર્વક હિંસા-અહિંસાનો તોલ કરવો પડશે. અહિંસાની દિશામાં કે પગલાં ભરાતાં હોય; અને તેમાં દ્યાખણા કારણે થતી નજીવી અનિવાર્ય હિંસાને ક્ષમ્ય ધર્ષણી શકાય. ખરેખર તો આ દરેક પ્રસગોમાં અંતિમ પરિણામ અહિંસક હોવા જોઈએ અને દરેક વાતનો વિવાર વિવેકપુરઃ સર હોવો જોઈએ.

અનિષ્ટાને દૂર કરવા માટે અમૃતું પ્રકારતું દ્યાખું તો લાવતું પડશે. એ અંગે આપણે અગાઉ અહિંસાના પ્રચોગને સંક્ષિપ્ત

ઇપરેખમાં વિચારી ગયા છીએ. તે ઉપરથી વિશ્વમાં અહિસાના સામુદ્ધાયિક પ્રયોગો માટે કૃત્યા કૃત્યા દાખાણો, કૃત્યે કૃત્યે સ્થળે અનિવાર્ય ગણ્યાય તેનો વિચાર કરીએ.

ભારતના સાંસ્કૃતિક ઈતિહાસમાં ત્રણું પ્રકારનાં દાખાણો જેવા ભળે છે; જેથી સાંસ્કૃતિક સાતત્ય જળવાઈ રહ્યું છે. જૈનોના ઠાણ્યાંગ સૂતમાં કહેવામાં આવ્યું છે :—

“ ચત્તારિ પુરિસ જાયા પણતા તેજહા, આયંદમે જામમેગે નો પરંદમે, પરંદમે જામમેગે નો આયંદમે, એરે આયંદમે વિ પરંદમે વિ, એરે જો આયંદમે જો પરંદમે વિ । ”

દાખાણુંની ચોખાંગી બતાવતાં કહેવામાં આવ્યું છે કે “ એક પુરુષ એવો છે જે જે પોતાનું દમન કરે છે; બીજાનું નહીં. ( ૨ ) બીજો પુરુષ બીજાનું દમન કરે છે પણ પોતાનું નહીં. ( ૩ ) ત્રીજો પુરુષ પોતાનું દમન કરે છે અને બીજાનું પણ દમન કરે છે; અને ( ૪ ) ચોથો પોતાનું દમન કરતો નથી તેમજ બીજાનું પણ દમન કરતો નથી.

### આત્મદમન - પરદમન :

જૈન સૂત્ર ઉત્તરાધ્યયનમાં કહેવામાં આવ્યું છે :—

અપ્પા ચેવ દમેયવ્વો, અપ્પા હુ ખલુ દુદમ્મો ।

અપ્પા દંતો સુહી હોઈ, અસ્થિં લોએ પરસ્થય ॥

અને

માડહં પરેહિં દમંતો, બંઘળે હિં વહેહિં ય

—એટલે કે આત્મા ( પોતાના ) ઉપર દમન ( દાખાણું ) કરવું જોઈએ. આત્મદમન કરવું ખરેખર કઠણું છે; પણ તેમ કરનાર આ લેક્ક અને પરલોક બન્નેમાં સુખી થાય છે. આત્મદમન એટલે સ્વેચ્છાપૂર્વે દાખાણું લાવીને વૃત્તિનો ત્વાગ કરવો. આજના યુગના સંદર્ભમાં એમ ફરી શકાય કે આત્મદમન કરવાથી પોતાનું અને

જગતનું ભલું થાય છે. જાતે અમૃત બાબતોમાં દમન નહીં કરીએ તો અન્ય વડે આવશે જ. એના કરતાં સ્વેચ્છાએ દમન કરવું વધારે સારું છે. આત્મદમનમાં સ્વાર્થીનતા છે, બાબ્દદમનમાં પરાર્થીનતા છે.

પરદમન એટલે પારકા વડે દ્યાણપૂર્વક વૃત્તિનો નિરોધ કરવો. જો સંસ્થા, રાજ્ય, સમાજ વગેરેની કોઈ પણ વ્યક્તિ પોતાની ઉપર સ્વેચ્છાએ આત્મદમન ( દ્યાણ ) ન સ્વીકારે તો તેને સંસ્થા, સમાજ, રાજ્ય વગેરેની સુખ્યવરસ્થા જળવવા માટે બહારનું દ્યાણ સ્વીકારવું પડશે. એ માટે જૈનસ્ત્રોમાં એ શબ્દો છે ( ૧ ) પ્રાયશ્રિત, ( ૨ ) દંડ. પ્રાયશ્રિતમાં વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી શુદ્ધ માટે જાતે દમન ( દ્યાણ લાવે ) કરે છે. ત્યારે દંડમાં આચાર્ય કે સંધનો વડો અગર શાસનાધિકારી તેના ઉપર દ્યાણ લાવે છે. આચાર્ય તેને દીક્ષામાં નાનો કરી; સંધના વડા તેની સામાજિક પ્રતિષ્ઠા ધટાવી અને શાસન-અધિકારી તેને દંડ કરી સળ કરે છે આવી સળમાં થોડીક હિંસા થાય છે. પણ, એક વ્યક્તિ અંગ થતી થોડી હિંસા વડે સમાજ, ન્યાય કે વ્યવરસ્થાની સમતુલા જળવાતી હોય તો તે અહિસાની દિશામાં પગલું ગણ્યાશે.

### દ્યાણ-દમન :

દ્યાણ અને દમન એ શબ્દો સમજવા જેવા છે. દ્યાણમાં “ ભાવ ” ખુપાયેલો છે એટલે કે તે ભાવ પ્રગટ કરે છે ત્યારે દમન એ ભાવનું હિયા રૂપાંતર છે. આમ એ બન્ને જાબ્દોનો ભાવાચાર્ય એક જ થાય છે.

ઉપરની ચોઅંગીમાં બતાવેલ પહેલા પ્રકારના પુરુષો સાધુ-પુરુષો હોય છે; તેમો સ્વેચ્છાએ જાતે પોતાની અને સમાજની ભૂલોનું પ્રાયશ્રિત સ્વીકારી આત્મદમન કરે છે. ત્રીજ પ્રકારના પુરુષોમાં આચાર્ય, નેતા કે અધિકારી આવે છે જેમને પોતાનું તેમ જ પારકાનું દમન કરવું પડે છે. આવા લોહા ઉપર અહિસાના સામુદ્દરિક પ્રયોગોની

વધારે જવાખદારી રહે છે. ભીજી પ્રકારના લોડો એટલે હિંસક, અનુની કે દાંડતત્ત્વો હોય છે. ત્યારે ચોથા પ્રકારના લોડો નિષ્ઠ્ય, આળસુ હોય છે. એવા લોડોથી કોઈ પણ પ્રકારના સમાજ વિવેકની આશા રાખવી વધારે પડતી છે. એવા તામસી લોડો જ્યાં વધારે હોય તેવા સમાજમાં અનિષ્ટોનો વધારો થતો હોય છે, અને સમાજ દુઃખી, અવ્યવસ્થિત અને અશ્વાંત થતો હોય છે.

### ગાંધીજીનું આત્મહનન અને પરદહન :

આત્મહનન સાથે પરદહનની વાતને વધુ સમજવા માટે આપણે મહાત્મા ગાંધીજીનાં જીવન પ્રસંગો લઈએ.

હરિજન આશ્રમમાં એકવાર ગાંધીજીના નાના પુત્રે મીઠું લેવાની હઠ કરી. આશ્રમનો નિયમ હતો કે મીઠું વાપરવું નહીં. કસતુરથા કંઈક નરમ થયા પણ ગાંધીજીએ સાંક કહી દીધું કે આપણે કરેલા નિયમનું પાલન આપણે કરવું જ જોઈએ.

બાળકે હઠ પકડી કે નહીં ખાડ. બાપુએ સાંક કહી દીધું કે ખાવું હોય તો આ ! પણ મીઠું નહીં ભણે ! તે સાથે બાપુનો નિયમ હતો કે બધા ન ખાય ત્યાં સુધી તેઓ ન ખાતા ! હવે છોકરો ન ખાય તો ખાપ ક્યાંથી ખાય ? સાંજ સુધી ખાપ-દીકરા બન્નેએ ન ખાધું. પણ પછી દીકરાએ મીઠું મૂકી દીધું અને તેની આદત સુધરી : તે વખતે બાપુ જરાક ઢીલા પણ હોત તો આશ્રમમાં કોઈ નિયમ છેત જ નહીં. આમ આત્મહનન સાથે પરદહન તેમણે કર્યું.

ધણા લોડો કહેશે કે જેની બુદ્ધિ ખિલી નથી, એવા બાળક જિપર આવું દ્યાખ્ય લાવવું જરૂરી છે ? બાળકમાં તો પાડે તેવી ટેવ પડે એટલે આમ કરવું જરૂરી છે. તેમાં પણ સ્વજનો માટે તો વધુ કડક થઈએ તો કે નિયમો ટકી શકે. એટલે એમ કરવું અનિવાર્ય બને છે.

એક બાળક આંદું છે. વેહ તેને દુધ સિવાય કંઈ પણ આપવાની

મનાઈ કરી છે. તે વખતે જે મા તેને કંઈક ગળપણું આપે તો તેના રેખમાં વધારો જ થશે. અહીં ખરેખર દ્વારા રોગી ઉપર નહીં પણ રોગ ઉપર છે. એટલે સમાજમાં જ્યાં અનિષ્ટો ચાલતાં હોય; ફૂલતાં-ફાલતાં હોય ત્યારે તેમને અપ્રતિષ્ઠિત કરવા માટે સીધું દ્વારા અનિષ્ટ-કારો ઉપર અને આડકતરી રીતે અનિષ્ટો ઉપર લાવવું જ પડશે. તે વખતે સમાજ હિતેશ્રી પુરુષો સામાજિક ભૂલ્યો સાચવવા માટે દ્વારા નહીં લાવે તો સમાજ વ્યવસ્થા બધી ચૂંચાઈ જશે. છોકરાને ઝોડકો થયો હોય અને મા પંપાલ્યા કરે તો છોકરો હેરાન થાય. ત્યારે માએ પર કાઢી નાખવું જ જોઈએ. એવી જ રીતે સામાજિક અનિષ્ટોના ઝોડકાને સમાજસેરકોએ પંપાળવો નહિ પણ દ્વારા લાવીને સાઝ કરી નાખવો જોઈએ.

ગાંધીજીને બીજે એક પ્રસંગ છે. તેઓ જ્ઞેલમાં હતા, ત્યારે કાકાસાહેયે એક વાર કહ્યું : “ આજે મારે પરૈયું ખાવું નથી ! ”

પછી બાપુજી માટે કોઈ પરૈયું લાવ્યું. કાકાસાહેયનું મન વિચલિત થયું. તેમણે પરૈયું ખાઈ લીધું. બાપુને ખરી પડી તો તેમણે તેને ગંભીર અર્થમાં લેખીને કહ્યું : નેતાની વધારે જવાબદારી છે. તેની જીણામાં જીણી વાતનું અનુકરણ સમાજ કરે છે. જગત આપણી સામે ભાંટ માંડે છે. આપણે વત લઈને તોડીએ તે ન ચાલે ! ” તેમણે પ્રાયશ્રિતરૂપે પરૈયું આળવન નહીં ખાવાનો નિર્ણય કર્યો. કાકાસાહેયને પણ ભૂલ સમજાઈ અને તેમણે પણ પરૈયું છોડ્યું.

જ્યારે અહીં સ્વરાજ્યની લડત ચાલતી હતી ત્યારે ચર્ચિલ યુદ્ધ ચલાવતા હતા. તે વખતે તેને વધારે તાણું ન પડે તે માટે રવિવારે પિછેટિંગ બંધ રાખવાનું ગાંધીજીએ સુચયંયું હતું. એક બાજુ ચર્ચિલને રવિવાર માટે ચિંતા ન વધારવી. બીજુ બાજુ સુભાષભાજુને કોંગ્રેસમાંથી રાજ્યાનામું આપવું પડે તેવી પરિસ્થિતિ સર્જવી. એ બાપનું “ છે યુદ્ધ તો જગતવું. પણ પ્રેમ રાખો ! ” સુત્તને ચરિતાર્થ કરતું હતું. ક્યારેક

ખીજ માટે આત્મદર્શન કરવું પડે; તો ક્યારેક પોતાના ઉપર દ્વારા  
લાવીને ખીજ ઉપર દ્વારા લાવવું અનિવાર્ય બની રહે છે.

પરદર્શન કે દ્વારા એ જ વ્યક્તિ કરી શકે ને આત્મદર્શન કરતો  
હોય. તેના અભાવે સમાજ અને જાંસ્થાચો ખગડી જાય છે કાં વેર-  
વિષેર થઈ જાય છે.

## દ્વારાણના પ્રકાર

પ્રાચીન કાળની પરપરાને દર્શિમાં રાખીને ભારતના સમાજ-  
શાસ્ત્રીઓએ ત્રણું પ્રકારનાં દ્વારાણું નઝી કર્યાં હતા :— ( ૧ ) આધ્યાત્મિક  
દ્વારાણું; ( ૨ ) નૈતિક-સામાજિક દ્વારાણું; અને ( ૩ ) રાજકીય દ્વારાણું.  
હવે આ અધારે વિગતવાર નિયારીએ.

**આધ્યાત્મિક દ્વારાણું :** આધ્યાત્મિક દ્વારાણું સહુથી ઊંચું અને  
શુદ્ધ અદ્વિતીય દ્વારાણું છે. આ દ્વારાણુના કારણે માનવસમાજમાં કદિ  
હિંસા ન થાય એ રીતના વ્યવસ્થા ગોઠવવાની હોય છે. જેમ માંદા  
ન પડવા માટે નિયમિત ખાન-પાન અને પથ્યનું પાલન કરવું જરૂરી  
છે તેવું આતું છે. તે છતાં રોગ થાય તો ઉપવાસ-લંઘણ વિ. કરીને  
નિસર્ગોપચાર વડે. તેનો ધ્યાન કદાચ લાંબો અને દુઃખદ હશે પણું તે  
તાત્કાલિક જલદ દવાએ ખાઈને નવા રોગો પેદા કરવા કરતાં સારું  
ગણ્યાય. તેવીજ રીતે આધ્યાત્મિક દ્વારાણું પહેલી નજરે મોટું અને દુઃખ  
ભરેલું લાગે છે, પણ તેનું પરિણામ સ્થાયી ઉકેલમાં આવે છે. જો કે  
આ દ્વારાણું લાવનાર વ્યક્તિ માટે તો એ સહજ હોઈને તેને આકર્ષણ  
લાગતું નથી; પણ સમાજનું દ્વિતી હયમચાવી મૂકનાર તે હોય છે.

ભગવાન મહાવીરે પાંચ માસ પચ્ચીસ દિવસનો અભિગ્રહ  
સમાજ ઉપર આધ્યાત્મિક દ્વારાણ લાવવા માટે કર્યો તારે તે વખતનો  
સમાજ ખળખળી ઊઠ્યો હતો. પણ તેની સમગ્ર સમાજ ઉપર અસર  
થઈ અને સાર્વા મૂલ્યોની પ્રતિષ્ઠા થઈ અને દાસીપ્રથાનું અનિષ્ટ  
ફૂર થયું.

મહાતમા ગાંધીજીએ હિંદુ ધર્મનાં કલંક સમાન અરપૃથ્યતા સામે આમરણ અનશન કર્યું તારે આખો હેશ ખળબળી જાઈયો હતો. પણ તેનાથી ધર્મા પંડિતો અને ધર્મનાયકોએ યુગધર્મ એળખી લીધો અને દેશ તેમજ દુનિયાને મોટો લાભ થયો. હિંદુ-સુર્ખિમ એકતા માટે બાપુના હિલ્લીના ઉપવાસોનું પણ એજ કારણ હતું. અંતે એવું થઈ અયું હતું કે બાપુનું શરીર હિંદના મહાસમાજનું બની ગયું હતું.

આમ આધ્યાત્મિક દ્યાણનો સીધો એને વહેવારિક અર્થ એ થયો કે વ્યક્તિઓ, તેને વિશ્વક્રીદિતો કુટુંખીજનો. ઉપર પોતાના તપત્યાગનું દ્યાણ લાવે. તેની અસર એ થાય કે સમાજને અનિષ્ટો અનિવાર્યિતે દૂર કરવાં પડે. આમાં સમાજને પ્રારંભમાં દુઃખ તો થાય; પણ અનિષ્ટો દૂર થતાં તેનું પરિણામ એકાંત સુખિતે આવે.

**નૈતિક-સામાજિક દ્યાણ :** નૈતિક સામાજિક દ્યાણનો કુમ ખીજે મૂક્યો છે. એનો ઉલ્લેખ મનુસમૃતિ, પારાશર સમૃતિ, યાશવલ્કય સમૃતિ તેમજ નીતિશ્રીમાં મળે છે.

કાઈ વ્યક્તિ કે સંસ્થાની ભયંકર ભૂલને સુધારવા માટે ચોક્કસ સિદ્ધાંતને અનુસરનારી વ્યક્તિ, સંસ્થા કે સમાજ અહિસક દ્યાણ સામે રાખી સામાજિક અસહકારનું કે પગલું ભરે છે એની સાથેજ વ્યવસ્થિત જનસંગઠનો કાયદાના રક્ષણુપૂર્વક તપ-ત્યાગયુક્ત રહીને ગુનેહગારના હૃદયને રૂપર્થ કરવા માટે પ્રયોગ કરે છે; તેથી સામાજિક-નૈતિક દ્યાણ લાવી ગુનેહગારને ગુનો કખૂલ કરવા બાધ્ય કરે છે; તે આ દ્યાણનું કારણ છે. આ દ્યાણ વડે વ્યક્તિ પોતાની ભૂલની ભયંકરતાને અનુભવે અને તે કે સમાજની અન્ય વ્યક્તિ ફરી તેવું ન કરે તે આ દ્યાણ લાવવાનું પ્રયોગન હોય છે. તે છતી પણ વ્યક્તિ ન સુધરે તો તેનો અહિષ્ઠાર કરો એ આ દ્યાણની ઉચ્ચતમ મર્યાદા છે.

**વર્તમાન યુગમા બાધીજીએ આ દ્યાણને રાજનૈતિક ક્ષેત્રે વાપર્યું.**

તેમણે બિનીશ રાજ્ય સામે આ દ્વારા ત્રણ પ્રક્રિયા વડે આહુયું :  
 (૧) સત્યાગ્રહ, (૨) પિક્ટોગ અને (૩) અસહયોગ આંદોલન.

આવું આંદોલન; રચનાત્મકપાર્થ્યકરોની સર્વાંગી દર્શિવાળી સંસ્થાના માર્ગદર્શન હેઠળ. અને વિશ્વાતુભંધલક્ષી સાધુસાધ્વીની પ્રેરણુથી ચાલે તો તેની ધારી અસર થાય. કદમ્બ તેના ઉપર સીધી અસર ન થાય તોએ તેની સામાજિક પ્રતિષ્ઠા તો અવરય દૂરી પડે. ભૂતકાળમાં ભારતે ગાંધીજી દ્વારા અને એક વિશ્વલક્ષી રાજકીય સંસ્થા ડેંગ્રેસ દ્વારા આવેલા પ્રયોગ બિનીશ રાજ્ય સામે કર્યો હતો; તેની ધારી અસર પણ પડી. આને ફરી આ બને દ્વારાણું જાગૃત કરવું વધારે જરૂરી છે, કેથી ભારતના આતારિક દોષો તેમજ વિશ્વના દોષો ધરી શકે.

જ્યાં આધ્યાત્મિક દ્વારા એકલું ઉપયોગી ન થાય ત્યાં દેરેક ક્ષેત્રે નૈતિક-સામાજિક દ્વારાણે પ્રયોગ અનિવાર્ય બની રહે છે.

### રાજકીય દ્વારાણુ

ઉપરના એ દ્વારાણાનાં સંદર્ભમાં રાજકીય દ્વારા પણ અનિવાર્ય છે; પણ એનો નંબર છેલ્લો રહેવો જોઈએ. કારણ કે રાજકીય દ્વારાણમાં આર્થિક અને શારીરિક સરળઓ મુખ્ય રહે છે. આધ્યાત્મિક દ્વારાણમાં માનસિક સરળ મુખ્ય હોય હોય છે, જ્યારે નૈતિક-સામાજિક દ્વારાણમાં સામાજિક સરળ મુખ્ય હોય છે. એકલી શારીરિક સરળઓ હોમેશાં અનિષ્ટાને વધારવામાં મહદ કરે છે એટલે જ્યાં આધ્યાત્મિક નૈતિક-સામાજિક દ્વારા પણ નિષ્ઠળ નીવડતાં હોય ત્યાંજ રાજકીય દ્વારા લાવવું જરૂરી થાય છે.

કેવળ રાજકીય દ્વારાણો અર્થ એવો થાય કે રાજ્યના કાયદા કાનૂન અને દંડવિધાનને માન આપવું. તેથી કાયદો-પોલિસ કે હિસા શક્તિની પ્રતિષ્ઠા જમે છે. રાજ્યના હાથમાં હદ્દાંહારની શક્તિ આવી પડે છે. પરિણામે ધર્મ, સંરક્ષિત અને સમાજ-શક્તિ ત્રણોથ કચડાઈ જાય છે., કે રાજ્યમાં ઓછા કાયદા અને સરળ છે તે રાજ્ય સારું છે.

રશિયાએ આ આદર્શ રાખ્યો. પણ ત્યાં આધ્યાત્મિક દ્યાણવાળી સાંધુને ધર્મસંસ્થાને અવગણી નાખવામાં આવી. સંસ્થાના હોષોને અવગણ્યા હોત કે સામાજિક તાકાત જિલ્લી કરીને અવગણ્યા હોત તો વાંધો ન હતો. પણ ત્યાં પ્રચંડ દંડશક્તિ દારાએ બધું થયું એટલે રશિયા લશ્કરવાદમાં અટવાઈ ગયું. પરિણામે ત્યાં લોકોમાં કે આત્મસંતોષ હોવો જોઈએ તે નથી; અને લોકો હંમેશ માટેના રાજ્યના દ્યાણની ગુલાભીમાં જ જીવતા હોય છે. પણ, ભારતમાં ગાંધીયુગે નૈતિક-સામાજિક અને આધ્યાત્મિક દ્યાણ આણી સંગઠિત અને સામદ્ય રૂપે સ્વરાજ્ય લઈને તેનું ડેવું. પરિણામ આવી શકે છે તે દેખાયું છે.

આ નશેય દ્યાણોનું મહત્વ પણ કે કુમભાં રજુ કરાયું છે તે જ કુમે જળવાઈ રહેવું જોઈએ. આધ્યાત્મિકથી કામ ચાલતું હોય તો નૈતિક-સામાજિક દ્યાણ ન લાવવું જોઈએ અને એ બન્નેથી કામ નીકળતું હોય તો રાજનૈતિક દ્યાણ ન લાવવું જોઈએ. પહેલાં એ દ્યાણોમાં શુભલાવના તપ-ત્યાગ, પ્રભુપ્રાર્થના શુભસંકલ્પ, શુભસ્ફુરોચ્ચારણ દારા વાતાવરણ તૈયાર કરવાનું હોછ તેવાં અહિસક દ્યાણો ને સામુદ્દરિક અહિસાના પ્રયોગમાં લાવવામાં આવે છે, તે દ્યાણ રૂપે નહીં લાગે.

### દ્યાણ હિંસા કે અહિંસા

કેટલાક લોકો દ્યાણને હિંસા કહીને સામુદ્દરિક અહિંસાના પ્રયોગમાં વાપરતા નથી. તેઓ વ્યક્તિગત ઉપવાસોમાં માને છે પણ સમૂહ વડે મોટું આંહોલન ઉપાડી, ઉંહાપોછ મચાવી ગુનેગારની પ્રતિષ્ઠા તોડવી, તેના પ્રત્યે સમાજમા ધૂણ્ણા પેદા કરવી કે તેનો સમાજ દારા અસહકાર કે અહિષ્કાર કરાવવામાં એક નૈતિક સામાજિક દ્યાણ લાવવામાં સ્થક્ષમ હિંસા માનતા હોય છે. એટલે તેઓ આવા આંહોલનોમાં પડતા નથી. આવાજ લોકો હાંડતત્ત્વો, અનિષ્ટો, સામાજિક બ્યવસ્થા તોડનારાએ સામે મૌન રહે છે; પણ પ્રજાના જનમાલને તુકાણ પહોંચાડતા બા તત્વોની રક્ષા કરવા માટે

પોલિસને ગોળીખાર કરવો પડે તો તેનો વિરોધ કરતા હોય છે. હવે રાજ્યને તો પ્રજના જનમાલનું રક્ષણ સૌંપવામાં આવ્યું છે. એટલે જો આ લોકો સરકાર ગોળીખાર ન કરે એમ છચ્છતા હોય તો તેમણે દાંડ-ગુણહેંગાર કે અનિષ્ટ તર્ત્વો માથાભારે ન થાય તે માટે નૈતિક સામાજિક દ્યાણ લાવું જોઈએ અને તેમને જનમાલને નુકશાન પહેંચાડતાં અટકાવવા જોઈએ. આવા નૈતિક સામાજિક દ્યાણવાળા અહિસક પ્રતિકારને શુદ્ધ પ્રયોગ આપણે કહીએ છીએ.

એટલેજ દ્વિલાખી રાજ્યને તોડવા માટે જ્યારે ૧૬૫૬ માં મહાગુજરાત જનતા પરિષદ દ્વારા તોઢાન થયું; પત્થર મારો કરાયો ત્યારે તે મહા હિસાને નિવારવા માટે આપણે જનસંગહનોની અહિસક ટુકડીએ. મોકલી સંક્રિય પગલાં લીધાં; શાંતિ સ્થાપવા માટે શાંતિ સૈનિકોને મોકલ્યા અને આ તોડાની લોકાને વખોડવા માટે તથા જનતાને સાચી વસ્તુ સમજાવવા માટે નિવેદનો ખાહાર પાખાં. તે વખતે સર્વોધ્યો લોકાને ગળે આ વાત જિતરતી ન હતી. એક વર્ષ પછી સંત વિનોદાજ ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે સ૪૪ કલ્યું: “પ્રજના પત્થરમારા કરતાં સરકારની ગોળી અહિસાની વધુ નજીક છે. કારણ કે પ્રજને પત્થરમારે। કરવાનો અધિકાર કોઈ એ આપ્યો નથી જ્યારે પ્રજની જનમાલની સુરક્ષા માટેનો પરવાનો પ્રજનએ સરકારને આપ્યોજ છે.”

એટલે સામુદ્દરિક અહિસા પ્રયોગમાં લાવવામાં આવતું દ્યાણ મોટી હિસાને અટકાવવા માટે નાની અને સુક્રમ હિસા હોઈને ક્રમ ગણ્યી છે કારણ કે તે અહિસા-લક્ષી હોય છે.

### કેટલાંક ઉદાહરણો

આને વધુ સ૪૪ કરવા માટે આપણે થોડાંક ઉદાહરણો લઈએ. પહેલો પ્રસંગ રામનો છે. રામ વાલીને મારે છે ત્યારે ઓથે રહીને બાધુ મારે છે. કારણ કે તે નાનાલાઈ સુગ્રીવની પત્નીને ધરમા રાખીને એડો હતો. રામચંદ્ર માટે બાદ્ધ હિસા કરતાં સંસ્કૃતિનો નાશ

મોટી હિંસા હતી. તેમણે સુગ્રીવને સામે થવા માટે મોકદ્યો અને એથે રહીને વાલીને બાણ માર્યું. કારણ કે કારણ વગર તેઓ વાલીને મારી શકતા ન હતા. જે સમજવટથી પતે તો પતાવવું હતું. ન પતે તો અન્યાયને ઠાર કરવાનો હતો જેથી સંસ્કૃતિનાં મૂલ્યોનું રક્ષણ થઈ શકે. આ પ્રસંગમાં એક બીજી વાત પણ છે કે જે ગુર્સે થઈને વાલી સુગ્રીવને મારી નાખે તો પછી રાવણ સામે યુદ્ધ કરવામાં તેમને કોઈ રાહભર ન રહે. એટલેજ તેમણે સુગ્રીવને માળા પહેરાવીને મોકદ્યો હતો જેથી એ બાઈની સ્પષ્ટ એણખાણ થઈ શકે.

અહીં એ પણ વિચારવાનું છે કે જે એક અનિષ્ટ સમાજને તુકદાન પહેંચાડતું હોય અને બીજું વ્યક્તિને, તો વ્યક્તિને થતું અનિષ્ટ નાટ કરી સામાજિક અનિષ્ટને રોક્તિ જોઈએ. આ સમાજ એટલે શરીર નહીં, પણ સંસ્કૃતિ. તેના રક્ષણ માટે રામે વાલીને છુપાઈ ને માર્યા તે યુદ્ધના નિયમ વિરુદ્ધ હોવા છતાં, મોઢું અનિષ્ટ રોકનારાં હતું.

બીજે પ્રસંગ છે શ્રીકૃષ્ણ લગ્વાનનો. તેમણે શત્રુ સંન્યાસની પ્રતિજ્ઞા લિધેલી પણ જરૂર પડી ત્યારે રથનું પૈકું પકડીને ફેરંયું ખરું. તે સિવાય તેમણે ધર્મરાજ પાસે “અશ્વિત્થામા હૃતઃ નરોવા કુંજરોવા” એવું અખ્યાત સત્ય એવાંયું. એતું કારણ હતું કે દુર્યોધનનો પક્ષ અન્યાયનો હતો તે છતાં તેની સાથે લીધમ દ્રોષું જેવા મહારથીએ. સત્યને ઉપર મુક્તિને લડે તો દાંડાઈનીજ જીત થાય. એટલેજ તેમણે લોદું તપે ત્યારે ધા કરવાની નાતિ અપનાવી દ્રોષુાચાયાંને શત્રુ-ત્યાગ કરવાની ફરજ પાડી. અંતે દુર્યોધન હાર્યો અને પાંડવો જીત્યા. જે તે વખતે અન્યાય અને દાંડાઈ ને વિજય મળત તો સામાજિક મૂલ્યો ધરી જત. એટલે એ નથળાઈ ક્ષમ્ય ગણુવામાં આવી.

ત્રીજે પ્રસંગ એક પઢાણુની બકરીનો છે. તે બકરી સારાં દૂધ આપતી હતી. એક વખત એક વાણિયાના દીકરાને દૂધની ખૂબ જરૂર હતી. ખ્યાંયે દૂધ ન મળ્યું. એણે આ પઢાણુની બકરી જોઈ અને

આસપાસ કોઈ ન હોઈને દૂધ ઢોણી લીધું. પડાણુની સ્વીને આ વાતની અભર પડી ગઈ. તેણે પડાણુને પાને ચઢાવ્યો : “ આજ તો અનિયેકા એટા દૂધ ચૂરા ગયા; કલ બકરીભી જહા જાયેગા ! ”

બહેનોમાં તો વાણીની શક્તિ હોય છે. તે સારા માર્ગે પણ ચઢાવી હે અને અવળા માર્ગે પણ ચઢાવી હે. પડાણુને ચઢ્યો ગુર્સે. તે દૂરો લઈને નીકળ્યો અને પહેંચ્યો. વાણિયાની દુકાને. બાપા સમજ ગયા. અને છોકરાને ધરમાંથી ધસડીને ભરબજરમાં લઈ આવ્યા. કોઈ કંઈ ઓલે તે પહેલાં તડાતડ ત્રણ-ચાર ટોકી દીધી. લોકો ભેગા થઈ ગયા. અને છોડાવવા લાગ્યા પણ બાપ ન છોડે. અંતે પડાણું દિલ પણ પિગળ્યું. તેણે કહ્યું ; “ અરે લાઈ બચ્ચા હૈ ! છોડ હે ! ”

બાપા કહે : “ ના એ ન ચાલે ! આજે દૂધ ચોરી આવ્યો કાલે એ શું નહિ કરે ! ”

અંતે પડાણે છોકરાને છોડાવીને માઝ કરાવ્યો. બાપ છોકરાને લઈને ઘેર આવ્યા. છોકરાની માઝે ઠપકો દેતાં કહ્યું : “ મારી નાખવો હતો. ”

બાપાએ કહ્યું : “ મારા હાથના ત્રણ તમાચાથી તો એ બચ્યો છે નહીંતર ચેલો. પડાણું હુમેશ માટે દૂરો ધોંચી હેત ! ”

છોકરાને મારતી વખતે બાપના હૃદયમાં તો અહિંસા જ હતી. આમ મોટા અનિષ્ટને નિવારવા માટે જે દ્વારા લાવવામાં આવે અને તેમાં થોડીક હિંસા થાય તો તે ક્ષમ્ય ગણ્યાય છે.

**દ્વારા કોણ પહેલું કરે ?**

પ્રશ્ન એ છે કે આવાં અનિષ્ટોનાં નિવારણ માટે આધ્યાત્મિક દ્વારા કોણે કરવું જોઈએ ? એ માટે તો આધ્યાત્મિક શક્તિ ધરાવતા સાધુ-સંન્યાસીઓએ આગળ આવવું જોઈએ. ચોતાનાં આધ્યાત્મિક દ્વારાથી કામ ન સરે તો તેમણે સામાજિક-નૈતિક દ્વારાનો પ્રયોગ કરાવવો જોઈએ !

ધથ્યા લોડા કહે છે કે સાધુઓનું કામ તો ઉપરેશ આપવાનું છે. તેમને સાંસારિક બાયાતોમાં પડવું ન જોઈએ! ચીન અને રશિયાનાં ડિશાહરણો આપણી સામે જ છે. જે સાધુ સમાજ અનિષ્ટો સામે આંખેમીં ચામણું કરશે તો તેમની સાધનામાં આવે વર્ગ અંતરાયો આખુશે એટલું જ નહીં ધથ્યાવાર તેમની પ્રતિષ્ઠા તોડવાનું કાર્ય પણ કરશે.

ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે :—

ચરે પયાઈ પરિસંક્રમાણો, જં કિંચિ પાસં ઈહ મજ્ઞમાણો

—એટલે કે સાધુ ખૂબ જોઈ જોઈને ચાલે અને વચ્ચે જે પાશ-બંધન આવે તેનાથી બચે. એનો અર્થ આજે તો કેવળ કીડી-મડોડી જોઈને ચાલવાનો કરવામાં આવે છે; પણ ખરેખર તો વ્યાપક અર્થમાં સમાજમાં ચાલતાં અનિષ્ટોનાં પાશ બંધનોનો વિચાર કરે કે આ અનિષ્ટ દૃશ, સમાજ, ધર્મ કે સંસ્કૃતિને નુકસાન પહોંચાડનાર છે કે નહિ? જે એમ હોય તો તેવાં પાપોને દૂર કરવા માટેનું સતત ચિત્તન કરે અને તેમને તોડતો ચાલે, એમ ધટાવી શકાય.

તે માટે એક ચોલંગી ઢાખુંગ સૂત્રમાં કહ્યું છે :—

આપણો નામ મેળે વજં પાસેઈ, નો પરસ્સ,  
પરસ્સ નામ મેળે વજં પાસેઈ નો અપ્પણો;  
એગે અપ્પણો વિ વજં પાસેઈ, પરસ્સ વિ,  
એગે નો અપ્પણો નો પરસ્સ વજં પાસેઈ

—એવી જ રીતે એક ચોલંગી “વજનું પાસેઈ” પછી “વજનું ઉદ્દીર્ણી” ની છે અને ત્યાર પછી “વજનું ઉત્તસમેઈ” ની ચોલંગી છે. આ ત્રણે ચોલંગીઓમાં “વજનું” એટલે ચોંતાના અને સમાજના અનિષ્ટો જોવાની ઉદ્દીર્ણું — ધટાડવાની તેમજ ઉપથમન કરવાની અનુકૂમે વાત કરેલામાં આવી છે.

અહીં કે “વજ્ઞ” શબ્દ છે તેના સંસ્કૃત ભાષામાં ત્રણ રૂપો થાય છે. (૧) વજ્ઞ (૨) અવદ અને (૩) વજ્ઞ એતી ટીકા જેતાં તેનો ૨૫૪૮ ખ્યાલ આવી જશે:—

વર્જયતે ઈતિ વર્જયમ्, અવદ્ય વા અકાર લોપાત् વજ્રવદ વજ્ઞ વા ગુરુત્વાત् હિસાનૃતાદિ પાપંકર્મ, તદાત્મન: સંબંધિ કલહાર્ડી પશ્યતિ પશ્ચાત્ત્પાત્તિવાત ન પરસ્ય તં પ્રત્યુદાસીનત્વાત्। અન્યરસુ પરસ્ય નાત્મન: સાલિમાનત્વાત्। ઈતર ઉમયો: યથાવદવરસુ વોધાત्। અપરસુ નોમયો વિર્મૂઢત્વાત्। દૃષ્ટ્વા એક આત્મન: સમ્બન્ધ અવદ્યમુદીરયતિ, ભણતિ યદુત મયાકૃતમેતદિતિ... એં ઉપશમયતિ પાપંકર્મ:।

અર્થાત्—જે વસુ વજ્ઞનીય છે—દોડવા લાયક છે તેને વજ્ઞ કહે છે. પાપ પણ અવદ હોઈને તે પણ વજ્ઞ છે, અથવા વજ્ઞની પેઠે ભારે હોવાથી પાપ—અનિષ્ટ હિસા—અસત્ય વિ. પાપકર્મને પણ વજ્ઞ કહ્યાં છે.

ઉપરની ચોભંગામાં પહેલા પ્રકારનો પુરુષ પોતાનાં પાપો, દોષો કે અનિષ્ટોને જુઓ છે પણ જિનકલ્પી સાધુ હોઈને ખીજના અનિષ્ટો પ્રત્યે ઉદાસીન રહે છે. ખીજ પ્રકારનો પુરુષ માત્ર ખીજના જ દોષો જુઓ છે—પોતાના નહીં, ત્રીજ પ્રકારનો પુરુષ પોતાના અને સમાજના અન્તેના દોષો જુઓ છે; ત્યારે ચોથા પ્રકારનો પુરુષ મૂઢમતિ હોઈને તેને કૃપાંઘ અનિષ્ટો હેખાતા નથી। આમાં સ્થવિર કલ્પી ( સમાજની વચ્ચે રહી સાધના કરનાર ) સાધુ માટે ત્રીજો ભાગ છે. તે અનિષ્ટો સામે આંખ મીંચામણું કરી શકે જ નહીં. તેમજ માત્ર અનિષ્ટો જોઈને તે ન એસી શકે. તે અનિષ્ટોને ખુલ્લાં પાડે, અનિષ્ટોનો છંકરાર કરે—કરાવે છે અને આ રીતે તેમની પ્રતિષ્ઠા ધયાડી સ્વપરના અનિષ્ટોને શાંત કરે તેમજ કરાવે છે.

અહીં અનિષ્ટોને તોડવા; ખુલ્લાં પાડવા ( ઉદીરણું ) અને ઉપશમન કરવા એ ત્રણ્યું બાબતો અહુજ સ્પષ્ટતા પૂર્વે કહેવામાં આવી છે. જ્તાં

ધર્માં લોકો કહેશે કે અનિષ્ટો અંગે ઉહાપોછ કરવો એ તો નારદ્યાવેડા છે. ચોરને કહે કે ચોરી કર અને શેઠને કહે કે જગ. પણ ખરી રીતે વાત એવી નથી. અહીં ઉદ્દીરણાની સાથે ઉપશાંત કરવાની વાત પણ છે. જ્યારે સામૂહિક રૂપે સમાજમાં અનિષ્ટો સામે આંખમિચામણાં થતાં હોય; કોઈ પણ ન્યાય આપવામાં લાયાર બને; પંચો પાસેથી પણ સાચો ધનસાક્ષ ન ભણે, દાંડ તરનો જોર કરે તેમજ સમાજમાં સત્ય-શીલ-સદાચાર ચૂકાતાં હોય ત્યારે સાચો સંત કર્દી રીતે ચૂપ એસી શકે? ધર્માં કહેશે કે લાકડું લાકડાને ભારે પડશે, આપણે શું? પણ કોઈ એ ભાર તો નાખવો જોઈએ ને? નારદજી આ ભાર નાખવાનું કામ કરતા હતા. એવી જ રીતે સાચો સંત પણ જતે સમાજની અતિવિધિથી જગૃત રહીને સમાજને જગૃત કરતો હોય છે. તેમ જ સમાજમાં જગૃતિ આણી તે “વજજ ઉવસ્તમેય” એટલે કે પાપને જાંત કરતો હોય છે.

### પાલણુપુરનો એ પ્રસંગ :

પાલણુપુરની ગઢવી બાળનો પ્રશ્ન ભારી પાસે આવ્યો. લોકો કહેતા હતા સંતભાલને (ભને) શી પડી હતી. તેમણે પંચ નીમ્બું તે નાકામયાખ નીવડ્યું તો પછી સમાજ ન જગે ત્યાં સુધી ઉપવાસ તમે શું કામ કર્યા હતા? ડોક્ટર પ્રાયશ્ચિત લેવા તૈયાર થયો પછી તો પ્રશ્નને છોડવો જોઈએ ને?”

આ પ્રશ્ન ઊડાણુથી સમજવા જેવો છે. પ્રસંગ લાંબો છે પણ ટૂંકમાં ચારિય-શીલ રક્ષા અને સંસ્કૃતિ-રક્ષાનો છે. વળી એ પ્રશ્ન લેવા ભારે હું (સંતભાલ) જતે ગયો ન હતો. પણ, ભારી પાસે જે. આની પડે તો સંત તરીકે ભારી કોઈ ફરજ ખરી કે?

વાત એમ હતી કે ગઢવી બાળા અને ડોક્ટર વચ્ચે ગ્રેમ-સંખ્યાઓ. ડોક્ટર, શિક્ષક વિ. એવો વર્ગ છે જેના ઉપર સમાજને

વિશ્વાસ હોય છે. તેવા સેવાના ક્ષેત્રમાં રહેલ વ્યક્તિ પાસે બહેન, દીકરીએ વગર સંકેતે જાય છે. આવી વ્યક્તિ ચેતાની જવાબદારી ભૂલી કુંવારી ખાળાને ઇસાવે, સમાજ કંઈ ન કરી શકે, કોઈ ન્યાય ન આપી શકે ત્યારે સંતની જવાબદારી વધી જાય છે.

મારી સલાહથી મહિલા મંડળે આ પ્રશ્ન ઉપાડી લીધે. ડોક્ટરે ભૂલનો રવીકાર કર્યો કારણ કે તેના ગ્રેમપત્રો પકડાયા હતા. પંચ જે કંઈ પ્રાયશ્રિત આપે તેને સ્વીકારવાની એણે તૈયારી બતાવી હતી. પણ ધેર ગયા પછી ડેટલાંક મલિન તત્ત્વોએ તેને ચઢાવ્યો અને તે ફરી ગયો.

આ સ્થિતિએ પંચની મર્યાદા પણ આવી ગઈ હતી; સરકાર કે કાયદો કંઈ કરી શકે તેમ ન હતું, એટલે મારે ઉપવાસ જાહેર કરવા પડ્યા. સથાજ ફરી જાગૃત થયો. તેણે પંચના ઇંસલાને માન્ય કરાવવાની જવાબદારી ઉપાડી. ડોક્ટરે પણ ફરીથી પ્રાયશ્રિત લેવાની અને ઇંસલો સ્વીકારીને પાળવાની તૈયારી બતાવી. મેં પણ પરિણામની છંછા સિવાય ઉપવાસ છોખ્યા. ડોક્ટરના પ્રાયશ્રિતને ત્રણ સજાએ. નક્કી કરવામાં આવી અને તેણે જે કે ચિઠ્પી જાપાડે તે સજાતું પ્રાયશ્રિત લેવાતું સ્વીકાર્યું. પ્રયોગ સંકેતી લેવામાં આવ્યો. અહીં ડોક્ટરને સજ મળે તેના કરતાં સંસ્કૃતિ-રક્ષાનો પ્રશ્ન મહત્વનો હતો. એટલે સંત તરીકેની મારી હાજરીની જવાબદારીએ જ મને ઉપવાસ કરવા પ્રયોગ હતો.

## સત્ય, ગ્રેમ અને ન્યાય

સામુદ્દરિયિક પ્રયોગમાં નૈતિક દ્વાણું વખતે સત્ય, ગ્રેમ અને ન્યાય એ ત્રણે અંગે પણ વિચારવું પડશે કે ડાને ડેટલું મહત્વ આપવું? સામાજિક મૂલ્યોની રક્ખા માટે અંગત સત્ય કરતાં સામાજિક સત્યને વધારે મહત્વ આપવું પડે છે. ત્યાં દ્વાણ સત્ય કરતાં આવસત્યતું મહત્વ વધારે ગણ્યતું જોઈએ. એનાથી કદાચ સામા પક્ષતું દિલ દુઃખ્ય પણ સામાજિક સત્ય જળવાય છે કે નહિ, તે જોવું રહ્યું.

૧૯૪૨માં ગાંધીજીને જ્ઞેલમાં પૂર્ણ બાદ તે વખતના સુંઘર્ઠના ગવર્નર સર રોઝર લૂભ્લીએ તેમને છાપાની કાપવી બતાવીને કહ્યું કે જુઓ તમારા લોકોએ આટલા રેલવેના પાટલા ઉખેડયા, આએલો પત્થર મારો કર્યો। પણ ગાંધીજીએ જવાખમાં કંઈ જ ન કહ્યું. આ મૌનને અસત્ય મળ્યું હ નહીં જ... સામાનિક સત્ય એ હતું કે લોકો દારા થતી આવી નાની હિસા કરતાં, ખિટિશ શાસકોની ચુલાભીમાં રાખવાની ભાવ હિસા ભયંકર હતી. ગાંધીજી એમ કહે કે લોકોએ ખોટું કર્યું છે તો લોકનો જુસ્સો વરી જય! એટલે તેમણે મૌન રહેવું પસંદ કર્યું.

કાર્બ્રીર ઉપર પાંકિસ્તાનનો હુમલો થયો ત્યારે ભારતને લખફર મોકલવું પડ્યું. તે વખતે ગાંધીજીએ સંમતિ આપી હતી. આમાં હિસા થવાની હતી પણ આતતાયોની ભયંકર હિસા કરતાં આ પ્રતિકાર-ત્મક હિસા તુચ્છ હતી. આવા અટપટા પ્રશ્નોમાં સામાનિક સત્ય જળવાઈ રહે તેવું વર્તન રાખવું જરૂરી છે. ક્યારેક મૌન રહેવું પડે, તો ક્યારેક કહેવું પણ પડે.

### દ્વાષ્પમાં સૂક્ષ્મ હિસાનો વિચાર

આમ દ્વાષ્પ દારા થતી સૂક્ષ્મ હિસામાં ચાર વાતોનો વિચાર કરવો જરૂરી બને છે :—

(૧) દાંડ તર્ખે દારા થતી હિસા કરતાં રાજ્ય દારા થતી હિસા મૌખ છે.

(૨) રાજ્યહિસા કરતાં સામાનિક હિસા ક્ષમ્ય છે.

(૩) અંગત સત્ય કરતાં સામાનિક સત્ય મહત્વનું છે.

(૪) આસપાસ દેખાતા સત્ય કરતાં, અધ્યક્ત સમાજનાં સત્ય ને મુખ્યતા આપવી.

એ દર્શિએ થતું દ્વાષ્પ સામુદ્દરિક અહિસાના પ્રયોગમાં અસરકારક બને છે.



## ચર્ચા - વિચારણા

શ્રી આટલિયાળુએ ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : “ દેશમાં વ્યક્તિગત સાધનાની માન્યતા બંધાવવાનું કારણું મારા મત પ્રમાણે આ છે કે લોકો એમ માને છે અને સમજે છે કે કર્મ વ્યક્તિગત બંધાય છે અને કર્મથી છૂટકારો મેળવવો હોય તો મૂળે વ્યક્તિગત સાધના જરૂરી છે. એને બદલે, વ્યક્તિગત કર્મની જેમ સામુદ્દરિક કર્મો પણ હોય છે અને તે માત્ર વ્યક્તિગત સ્થૂળજ નહીં, સામુદ્દરિકપણે સ્રુક્ષમ, સ્થૂળ અને નૈતિક રીતે હોઈ શકે એ વાત ગણે ઉત્તારવામાં આવે તો તે કર્મના ઉકેલનો પુરુષાર્થ સામુદ્દરિક થવાનું સરળ થઈ જય.

પ્રથમ આપણે સામાન્ય દ્વારાથી જોઈએ. ચાનો ખાલો પીનાર જરાક ઉડો વિચાર કરે તો ચાના બગીચામાં મજૂરી કરનાર મજૂરનો; શેરડીનાં ઘેતર, સાંકર બનાવવાનાં કારખાનાં વગેરે બધી વાતાનો તેને ખ્યાલ આવી શકશે, જેમ હિવાસળીમાં, ગંધક, લાકડાં; તેમ જ્યાસેલમાં છીરાના તેલના કુવા એમ દેશ-પરદેશ તથા ત્યાંના માણસોનો શું ફૂલો છે તે તરત ખ્યાલમાં આવશે. દૂંઘનો વિચાર કરતાં, ગોવાળ અને ગાયો વગેરેના સવાલ જોડાશે.

એવી જ રીતે આસામનાં તોઢાન, મુંબઈ-ગુજરાતનાં તોઢાન, હિંદુ-મુસ્લિમ હુલ્લડો એમાં આપોને આપો સમૂહ કામ કરતો હોય છે મન આંદોલન જીલે છે અને સામુહિક વેર અને સામુહિક કોધનાં આંદોલનો પડે છે. એવી જ રીતે સરખી તરફ સમૂહ વળે તો સામુદ્દરિક રીતે પુણ્ય દાન વગેરે મનમાં જાગે છે. કંઈ મુના વિ. ની હેનારત વખતે આખા દેશનો દાન-પ્રવાહ તે તરફ વળે છે.

વ્યક્તિનો સમૂહ સાથેનો સંબંધ આમ રહે છે. એક વ્યક્તિ કાપડમાં “ ઓન ” કરે છે તો આપો સમુદ્દર એમાં ધસડાય છે. ત્રંયુગે સંપર્કો વધારી મૂક્યા છે. તે અગાઉ આઠથ લાંબા પહેણા

સંપર્કો ન હતા. એટલે ગામડાનો નિકાલ ગામડામાં થતો. પણ આજે પુણ્ય-પાપ એ બધું સામુહિક રૂપે થઈ રહ્યું છે ત્યારે કાયાકલેશ-ઉપવાસ કે આમરણુંત અનશન પણ સામુદ્દરાયિક બનવા જોઈએ, ગાંધીજીનું તપ એ રીતે સફળ થયું છે. સૌરષ્ટ્રનાં ચારણેઓએ પણ સામુહિક રીતે કાયો કર્યાં છે. તેના દાખલાઓ છે. દા. ત. કોઈ રાજની એક ચારણું ખાઈ ઉપર વિકારી દર્શિ પડી અને એણે ખરાખ માગણી કરી, તો તે ખાઈએ રતન કાઢી આપ્યાં. કેટલીક ખાઈઓએ જન પણ આપી દીખાના દાખલા છે, તેથી આપી કોમતી અસુક પ્રકારની છજાત ખંધાઈ ગઈ.

**શ્રી. દેવલુભાઈ :** “ કેનેની પચ્ચીસ કિયાઓમાં સામુદ્દરાયિક કિયા આવે જ છે આજના યુગપ્રમાણે વ્યવસ્થિત શાસ્ત્ર રચાય તો જૈન સાધુ સાધીના ખમીર જયકી ઊંઠે, ”

**શ્રી. ખળવંતભાઈ :** “ સામુદ્દરાયિક અહિસા અંગે દમણુનો દાખલો હું આપીશ, તેનાં પોતાનાં લયરથાનો પણ છે, દમણુભાં ફિરંગીએ આવતાં લોડો ગાળો દેવા લાગ્યા અને લાગ્યા. ઈશ્વરભાઈ પકડાયા પણી ખીજ કોઈ નેતા તરીકે આગળ આવ્યા નહીં. તેથી એ માણુસો ગોળાથી વીધાયા, એક ઢાર થયો અને ખીજના પગે ગોળો મારી. જો કે એક જણું મરવાની નિર્ભયતા સાથે આગળ આવ્યો તો ચેલિસ તેને ગોળો ન મારી શકી; પકડીને લઈ ગઈ.”

**શ્રી. માટલિયા :** “ આ દાખલાઓ ટાક્યા, તેમાં અહિસાની દર્શિએ લડત ન હતી. એમાં એકું નેતાની અઙ્ગ પરથી લોડો ગયા ન હતા; વ્યવસ્થા પણ ન હતી અને શિસ્ત પણ ન હતી. બધા રાજકીય પક્ષોનો થાંકુમેળો. ત્યાં દાખલ થયો હતો. એટલે આવી સ્થિતિમાં રોળાનો કાયદો આવે તેમાં નવાઈ નથી. પણ, ગાંધીજીએ દેશને જે લડતની હોરવણી આપી તેની પાછળ વ્યવસ્થા હતી; ચોક્સે ધ્યેય હતું. તે છતાં બહુજન સમાજના દોષો દાખલ થાય તે સહજ

હતું. માટે તેમણે ચૌરીચોરાનો પ્રસંગ બનતાં ધડતને તરત અટકાવી દીધી. તેવી જ રીતે પ્રસંગ પડતાં ફરી પાછું સમૂહ વડે કાર્ય લીધું.

જે બંદું વિચારીએ તો કાંચેસે પોતે પણ, સત્ય અને અહિસાને બંધારણુનાં ધડતરમાં નહોતાં લીધાં. એટલે સ્વરાજ્ય ખાદ અહિસક સમૂહ લડતમાં ગાંધીજી અને ચુનંદા સાથીએ એકલા પડી ગયા હતા. નોઆખલીનો પ્રસંગ એ સ્થાયે છે. માટે આજે જેમ સામુહિક યુગ છે, તેમ સંસ્થા દ્વારા ધડાયેલાં માણુસોને સામુદ્દાયિક અહિસાના પ્રયોગો કરવા પડે તેનું છે. જેમ હિસક શાસ્ત્ર વાળી સેનાને વ્યૂહરચના, રોજની તાલિમ જરૂરી હોય છે તેમ અહિસક સેના માટે પણ હોય છે; અને તે ગોઠવવી પડશે.”

**શ્રી. બધાવંતભાઈ :** “પણ આપણી પાસે એવા શાંતિ સૈનિકો ક્યાં છે? એટલે જ વિનોભાજ પણ થાકી જતા હોય તેમ લાગે છે?”

**શ્રી. હેવળભાઈ :** “શિદ્ધાત તો સર્વાંગી કાંતિની વ્યક્તિથી જ થાય છે; તેમાં વાંધો નથી પણ એની જાસરથી સમૂહમાં ધડતર થવું જોઈએ. ગાંધીજીનું એથીજ આપણું વધુ બેંચાણું રહે છે.”

પછી વર્ગસભ્યોની ચર્ચા ચાલી તેતું તારણું નીકળ્યું :—

“સાધુસંસ્થાની અનિવાર્ય જરૂર છે. પણ સામુદ્દાયિક અહિસાના પ્રયોગની પહેલ કાર્ય વિભૂતિથી થશે. તેણે સંસ્થા દ્વારા સામુદ્દાયિક અપીલ થાય એવા પ્રયોગો કરવા પડશે. એમાં ખાડા ટેકરા આવે જવાના. પણ એ કાર્યક્રમ વ્યવસ્થિત ચલાવવો જોઈએ. તેમજ અદ્ધારૂર્વક થોડાક મરળવાઓએ પ્રાણું પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભોગે સતત જગૃત રહીને લાગ્યા રહેલું જોઈએ. (તા. ૪-૮-૬૧)



## સામુદ્દર્યિક અહિંસા-પ્રયોગમાં ત્રિવેણી

સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગમાં દ્વારા વિ. અંગે અગાઉ વિચાર કરવામાં આવ્યો છે. સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગને વિશ્વવ્યાપી બનાવવાનું ધ્યેય એ છે કે વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા જળવાઈ રહે. આ સુખશાંતિ જળવવા માટે ત્રણ ભાષ્ટો ઉપર લાર મૂકવામાં આવ્યો :—સત્ય, પ્રેમ ( અહિંસા ), અને ન્યાય ! ત્રણેય ભાષ્ટો સચ્ચવાય તો તો એણ છે. પણ ધર્માદ્ધિવાર એવી પરિસ્થિતિ આવીને જિલ્લી રહે છે કે ત્રણેમાં કોને અચ્ચવવા અને કોને જતા કરવા ?

આ અંગે આપણે વાકીના પ્રસંગમાં રામ સંબંધી જેણું કે તેમણે સત્ય અને ન્યાયને જળવવા માટે અહિંસાને જતી દરી; શ્રીકૃષ્ણને મધાલાન્તમાં સત્ય ને જતું કહ્યું અને તેનાથી આગળ વધીને ન્યાયની વાત આવી તો સત્ય અને પ્રેમ બન્નેને જતાં કર્યાં. ત્યારે ગાંધીજીના પ્રસંગમાં જોઈશું તો જણાશે કે તેમણે સ્થૂળ રીતે પ્રેમ અને અહિંસા જત કર્યાં પણ સત્યનો આગ્રહ રાખ્યો.

એટલે, દરેક પ્રશ્નોનો સામાન્ય સપાઠીએ વિચાર કરીએ તો પ્રેમ રહેતે સારું છે. પણ ધર્માદ્ધિવાર સમુદ્દરયના કામ આવે ત્યારે સત્યને અચ્ચાવું પડે છે. પ્રેમ અને સત્ય બન્ને રહેતે તો અવ્યક્ત ન્યાય બન્નો રહે છે; પણ નિરોપ પ્રસંગ આવતાં જો કોઈને જતું કરવાનું આવે તો પ્રેમ મને સત્યમાંથી પ્રેમને જતું કરવું જોઈએ. બન્ને રહેતે તો સારું, પણ છુા સામાજિક કાર્યો અને પ્રશ્નો આવે ત્યારે પ્રેમ જળવાય નહીં, પણ સ્થને પકડવું જોઈએ. ગાંધીજીએ કહ્યું “ સત્ય એજ પરમેશ્વર ! ” કૃષ્ણારે હિંદુઃ : “ સત્ય નામ સાહેભકા ” ગાંધીજીએ સત્ય માટે જવનને હાડમાં મૂક્યું. રથૂળ રીતે પ્રેમ અને અહિંસા જતાં દેખાયા. કેટલાકના કવા ખ્યા; તે છતાં સત્યનો આગ્રહ રાખ્યો.

હવે સત્ય અને ન્યાયનો પ્રસંગ આવે ત્યારે શું કરવું ? એ અગે રામ અને કૃષ્ણના પ્રસંગો મૂક્યા હતા. તેમને જીડાણુથી ન સમજુએ તો અર્થનો અનર્થ થઈ જશે. ન્યાયનો પ્રશ્ન આવે ત્યારે સામાજિક ન્યાય ને બચાવવા માટે પરિસ્થિતિ વશ સત્યને ગૌણ ગણુવું પડે છે. કરણું કે ન્યાય એક રીતે પોતાનામાં અવ્યક્ત કે સામાજિક સત્યનો પ્રકાર છે. એટલે મહાન સત્યને જાળવવા માટે નાનાં સત્યને મૂક્યું પડે તો તે વધારે છિંઘનીય છે,

અગુપૈતતા સારી વાત છે પણ ડેટલાંડ પ્રસંગો એવા આવે છે તે વખતે કાં તો મૌન રાખવું પડે કાં તો વાત છુપાવવી પડે. તે વાતને હંમેશ માટે છુપાવવા આતર નહીં પણ થાડો. સમય એક અનાધિકારી વ્યક્તિથી છુપાવવા માટે, છુપાવવી પડે. યુધિષ્ઠિર “નરોવા કુંજરો વા” એદ્યા એ અસત્ય કહેવાય એ વાત ધર્મરાજ જાણુતા હતા. પણ દ્રોણાચાર્ય પૂછે છે ! “ અશ્વસ્થામા હતા ? ”

ત્યારે તેમણે કહ્યું : “ નરોવા કુંજરો વા ! ”

કુંજર શખ્દ ધીરથી બોલે છે. ૨૫૭૮ રણુકો બિઠો નથી, પરિણમે રથ જીમીનમાં એસી જાય છે. એનો અર્થ એ કે અસત્ય એ અસતતજ છે. છતાં આ અનાય બન્યો એ પણ હકીકત છે. તે પણ ખુદ જીણું લગવાનની ગેરણુથી શ્રીકૃષ્ણ શસ્ત્ર-સંન્યાસ કર્યો તે છતાં પૈડું ઝેવી તેનો સૂદર્શન ચક્ર રૂપે ઉપયોગ કર્યો તે પહેલી નજરે યોગ્ય નથી લગતું. પણ, જે ઉણુપ દેખાય છે તે પરિસ્થિતિનું-પરિવર્તન કરવા આતર કરવું પડ્યું છે. તમે સત્યને વળગી રહો એમજ કહેવાય પણ પરિસ્થિતિને સામે રાખશો તો તમને દોષ નહીં દેવાય. પરિસ્થિતિનું પરિવર્તન જરૂરી છે. તે નહીં થાય તો કદાચ વ્યક્તિ આગળ વધશો પણ સમાજ માગળ વધી શકશો નહીં.

આ ઉપરથી આપણે એવા નિષ્કર્ષ ઉપર આવીએ છીએ પ્રથમ ન્યાય, પછી સત્ય અને ત્રીજું પ્રેમ એ કુમ રહેવો જોઈએ. એમ નીં થાય

તો સત્ય સામાજિક સત્ય બની શકશે નહીં માત્ર વ્યક્તિગત રહેશે. તેમ કરવા જતાં સમાજ વહેવારમાં દંબ અને ગુપ્તતાની ઐલખાલા વધી જશે. ધર્મ-(સાધુ) સંસ્થાનો, સાધક (લોકસેવક અથવા આવક) સંસ્થાનો અને લોક-સંસ્થાનો સાથે વિચાર કરતા હોઈએ ત્યારે સામાજિક ન્યાય ખાતર સત્ય દુલાય છે, એટલે ન્યાયને પ્રથમ, સત્યને ખીજું અને પ્રેમને ત્રીજું એમ લેવા પડે છે. ન્યાયને લઈએ ત્યારે સામાજિક કક્ષા પણ જોવી પડશે.

ગઈ કાલની ચર્ચામાં પૂજનભાઈએ કહ્યું કે જ્યાંસુધી બધા સંગઠનો ( સાધુ-સંસ્થા, લોકસેવક સંગઠન, લોકસંગઠન અને રાજ્ય સંગઠન )નો અનુઅંધ નહીં થાય ત્યાં સુધી ઉણ્ણેથો રહેવાની છે. એક ટેકાણે અહિસા પળાય અને ખીજે ટેકાણે વિકલ્પો પડુચા હોય તો ખામી રહી જશે. સમાજના અટપટા પ્રશ્નો આવે કે ભાંજગડ પડે ત્યારે સાધુઓએ આગળ આવવું જોઈએ તે વખતે એમ ન કહી શકાય કે તેઓ તઠસ્થ છે સલાહ કે માર્ગદર્શન નહીં આપી શકે. ખરી રીતે તો આ સાધુ-સમાજની શરમ છે. સાચો તાદાતભ્યવાળો હોય તેજ તઠસ્થ રહી શકે, નહીંમાં પડ્યો હોય તેજ તરવાતું જાણ્ણી શકે. ખદાર તીરે રહીને તમારો જુએ તેને તરવાનો અનુભવ હોતો નથી.

ઠાણુંગ સૂત્રમાં કહ્યું છે :—

તથો આયરકખા પણત્તા, તંજહા ઘમ્મિયાએ પઢિચોયણાએ પઢિચો-  
એત્તા ભવદ્દ, તુસિણી વા સિવા, ઉહિતું વા આયા એગંતમવકમેજબા.

એટલે કે આત્મરક્ષા વણું પ્રકારે થાય છે : (૧) ધાર્મિક પ્રેરણ્યાથી સમાજને પ્રેરિત કરે કે આ વરસ્તુ તમારા માટે કર્તાંબ્ય છે તે કરવી જોઈએ અને આ કર્તાંબ્ય નથી માટે ન કરવી જોઈએ, (૨) જ્યાં હિપદેશ કે પ્રેરણ્યાનો વિષય ન હોય ત્યા મૌન રહેવું જોઈએ; અગર તો ઉપેક્ષા લાવ રાખવો જોઈએ. (૩) જે પ્રસંગ આવે અને ઉપેક્ષા લાવથી

નહિ રહી શકતું હોય તો પોતાના આત્માનું એકાંતમાં જઈને નિરીક્ષણ  
કરવું જોઈએ.

આ શાસ્ત્ર પ્રમાણું સ્પષ્ટ કહે છે કે કયાં અને ક્યારે તથસ્થ  
રહેવું અને કયાં પ્રેરણા કરવી તેમજ કયાં મૌન રહેવું અને કયાં ઉપદેશ કરવો.

કુંકમાં જગતના પ્રશ્નો સમજે તે સાધુ છે. મુનિનું લક્ષણું પણ  
એજ રીતે ઘતાવવામાં આવ્યું છે :—

મન્યતે જગત સ્ત્રીકાળ વસ્થામિતિ મુનિ :

જે જગતની ત્રણે કાળની અવસ્થાઓ, ઘનાવો, ગતિવિધિઓનું  
મનન કરે છે; વિચારે છે તેજ મુનિ છે.

આ એક બાળુ છે ત્યારે તેની ખીજુ બાળુ પણ છે, વૈદિક અંથેમાં  
કહ્યું છે કે અલયર્થાશ્રમ જરૂરી છે, પણ ગૃહસ્થાશ્રમ નહીં સેવે ત્યાં  
સુધી ગૃહસ્થાશ્રમનો અનુભવ નહીં થાય. એટલે ત્યાં ચાર આશ્રમનો  
ક્રમ આવ્યો.

\* ગીતામાં કહ્યું છે :—

કામ્યાનાં કર્મણાં ન્યાસં, સંન્યાસં કવયો વિદુ

એજ રીતે જૈન સૂત્ર દ્શવૈકાલિકમાં પણ કહ્યું છે :—

જે યં કતે પિયે ભોએ લધે વિપિણિ કુચ્ચિ ।

સાહીણે ચયા ભોએ સેહુ ચાદ્રિ કુચ્ચિ ॥

સાચો ત્યાગી એ છે કે સામે ભોગોની સામગ્રી પડી છે છતાં  
એ પ્રિય સુખ ભોગોને ત્યાગે એજ ત્યાગી સંન્યાસી છે. રામકૃષ્ણ  
પરમહંસ પાસે પત્તી હતી યૌવન હતું, પણ તેમણે વિચાર્યું કે એવો  
ઉપભોગ કરવા કરતાં ઉપયોગ કરું એ વધારે સારું છે. તેમણે એને  
પણ સાધનામાં લગાડી, એવા ગૃહસ્થાશ્રમી પણ સાધુ થઈ જાય.  
શાકરાચાર્યો પૂર્વજન્મના સંસકારના કારણે અલયારી રહીને સાખુતા

સ્વીકારી. ગાંધીજીએ કહ્યું છે કે કાંતો સંયમ, કાંતો જવાખદારી બન્નેને છોડી હો તે ન ચાલે. કહેવાનો ભાવ એ છે કે પારંગત થઈને તટસ્થ થઈ શકે, પણ પ્રશ્નો સમજ્યા વગર દૂર ભાગવાની વૃત્તિ, એ તટસ્થતા નથી.

એટલે પરિસ્થિતિ-પરિવર્તન કરવા કે બગડેલા અનુભંગો સુધારવા, અહિસાનું પાલન કરવા-કરાવવા માટે જવાખદાર સાધુસાધીઓએ પોતે અગર તો જનતા દ્વારા તપ-ત્યાગ અલિદાનની પ્રક્રિયા ચલાવવી પડેશે પરિસ્થિતિ પરિવર્તન કેવળ ઉપદેશ કે પ્રેરણાથી થતું નથી.

એ માટે લાંખી દર્શિયે સંપૂર્ણ વિચાર થવો જોઈએ. ગાંધીજી પાસે એવી દર્શિ હતી. તેમણે લાંખી દર્શિયે સામુદ્દરિક અહિસાના પ્રયોગો કર્યાં હતા. તેમાં ચોજના હતી, નિર્દ્દેશન હતું અને રૂપણ પરિણામની કલ્પના હતી. એનું હમણું જોવા મળતું ન હતું. વિનો-ભાજીએ શાંતિસેના માટે ધણું નામો લખ્યાં પણ સમય આવે કોઈ ઉપયોગમાં ન આવ્યા.

એટલે અહિસાનો સામુદ્દરિક પ્રયોગ કરતી વખતે લાંખી દર્શિમાં એ રૂપણ્ઠતા હોવી જોઈએ કે કટોકરીના કાળે સત્ય, પ્રેમ કે ન્યાય ત્રણમાં કોને મહત્વ આપવું જોઈએ.

૧૯૫૬માં મહાગુજરાતનાં તોઝનો વખતે અમદાવાદમાં ગોળાખાર થયો. રવિશાંકર મહારાજને આની ખરર પડતાં ખૂબ દુઃખ થયું. તેમને ડ્રાગ્રેસ તરફ પક્ષપાત હતો જો કે છેલ્લે છેલ્લે ડ્રાગ્રેસના સંખ્ય તરીકે તેઓ મટી ગયા હતા? વિનોભા-વિચારસરણીના કારણે પ્રાયોગિક સંધના પ્રમુખ પણ મટી ગયા. તે છતાં ડેટલીક વ્યક્તિઓ સંસ્થામાંથી છૂટી થાય તો પણ તે વિભૂતિ હોય છે અને પોતે સંસ્થાઓએ હેઠાં છે. દાદા ધર્માધિકારી, રવિશાંકર મહારાજ, વિનોભાજી, બખલમાદ વિ. વિભૂતિઓ છે તેઓ સંસ્થા છોડે પણ વિવેક ન ભૂલે. રવિશાંકર મહારાજે જહેર કર્યું કે “સરકારે ગોળાખાર ન કરવો જોઈએ!” પણ તેમના મનમાં મંથન હતું.

તેઓ પાલણુપુર ચોમાસા વખતે આવેલા, તે વખતે ગણ્ણોત્થારા અંગે શુદ્ધ પ્રયોગનો વિચાર ચાલતો હતો અને તેમણે વિચારને અંતે તેને ટેકા આપેલો. મેં ગુજરાતના તોકાનો વખતે નિવેદન કરેલું કે “ સરકારને ગોળીભાર કરવાની ત્યારે ફરજ પડી જ્યારે ડોછ લોકોએવક કે સંત ત્યાં હાજર ન થયા ! ” રવિશંકર મહારાજને એમ લાગેલું કે આથી સરકારના ગોળીભારને ટેકા મળી રહ્યો છે. જ્યારે મેં ગોળીભારનું સમર્થન નહોંઠું કર્યું પણ પરિસ્થિતિનો અંદાજ રજુ કરેલો.

વિનોભાળએ એ તોકાનો અંગે ગુજરાતમાં પ્રવેશ્યા ત્યારે કલ્યાંહ કે લોકાને કટલો બધો ગુર્સો આવી ગયો હશે કે તેમણે તોકાનો કર્યાં હશે ! તેમને પણ ગોળીભાર અનુચ્છિત લાગતો હતો. પણ એમ જેમ ગુજરાતમાં આગળ વધ્યા ત્યારે તેમને સાચો ઘ્યાલ આવ્યો અને અંતે તેમને કહેવું પડ્યું કે “ લોકોના પથર મારા કરતાં પોલિસની ગોળી આઈં સાતી વધારે નજીક છે ! ”

પોલિસને પ્રણાયે સરકાર મારકૃત લોકોના જનમાલના રક્ષણુનો પરવાનો આપ્યો છે; લોકાને પથરનો નથી આપ્યો. એવી જ રીતે લશકરનું છે. સૂરતમાં વિનોભાળએ કલ્યાંહ કે “ પાકિસ્તાની સરહદે જે લશકર છે તેને હટાવી લેવું જોઈએ અને પરિણામ જોવું જોઈએ ”

તે વખતે મારે કહેવું પડેલું કે એ વિધાન અવાસ્તવિક છે. જ્યાંસુધી પ્રણના રક્ષણુની ખીજ વ્યવસ્થા ઉલ્લિ ન થાય અને પ્રણ ધર્યે નહીં ત્યાંસુધી આવું જોખમ ન ખેડાય. ”

તે વખતે વિનોભાળએ જલેરમાં કહેલું કે “ સંતથાલ જૈન સાધુ હોવા છતાં લશકરને ટેકા આપે છે ! ” એજ વિનોભાળને ગુજરાતમાં આગળ વધતા વિચારો બદલવા પણા. એનું એક કારણું તો ર૩૪૭ છે કે વિનોભાળનું ધડતર વ્યક્તિગત થયું છે અને સંસ્થાના સવાલોને જુદી રીત વિચારે છે.

અહિંસાના પ્રયોગો અગે કેમ કેમ જડા જિતરતા જઈએ  
તેમ તેમ નવા નવા વિચારો આવે. ટેટલાક પ્રેસંગોમાં બ્યક્ટિતનો નિરોધ  
કરવો પડે તો તે કઈ રીતે કરવો? ટેકો આપવો હોય તો તે કઈ રીતે  
આપવો. આ બધાનો વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ.

જ્યુપ્રેકાશજીએ સૌથી પ્રથમ જીવનદાન આપ્યું અને વિનોભાજીએ  
જાપ્યું ત્યારે તેમની આંખમાં પાણી આવી ગયાં અને તેમણે પણ  
કહ્યું કે આજથી હું પણ જીવનદાની આ વાત નવી ન હતી. વિનોભાજી  
અગ્રેસર હતા. પણ એક રાજકીય સંસ્થાનો માળુસ આઠલી હુદે સર્વોધ્ય  
માટે જય ત્યારે ભાવાવેશમાં આવી ગયા વગર ન રહી શકાય પણ શું  
સિદ્ધાંતમાં બન્ને સંસ્થાનો મેળ ખાય છે તેનો વિચાર ન થતાં અથડામણ  
જરૂર થશે. ચીનની ભારત સરહદ, અગે ગુજરાતના સર્વોધ્યાએએ  
વિરોધ કર્યો તો સર્વસેવા સંધને તે સુધારવો પડ્યો. સંસ્થાતું ચોક્કસ  
સિદ્ધાંતે ઘડતર ન થાય અને અનુભંગ ન જળવાય; તો તે સંસ્થા  
પરસ્પર અથડાતા સિદ્ધાંતો વચ્ચે નિષ્ઠિય થઈ જશે. એટલે જ જ્યાં  
સર્વોધ્યમાં એકતરએ શાસન-મુક્તિની વાત આવે છે ત્યાં બીજી બાજુ  
શાસનનો આશ્રય દેવો પડે છે.

એટલે સામુદ્દરિક અહિંસાના પ્રયોગમાં લાંખી દણિ, સાચ્ચો  
અનુભંગ અને વિવેક આ બધી બાબતોનો સુમેળ કરવો પડશે.  
જૈનધર્મમાં આ બધાનું એડાણું થયેદું છે. લોક સેવક સંસ્થા સાથે  
સાધુસંસ્થા જોડાયેલી હતી. એટલે આખા સમૂહને અહિંસાના માર્ગ  
લઈ જઈ શકાયો છે. સામુદ્દરિક અહિંસાના પ્રયોગમાં રાજ્યસંસ્થાનું  
સ્થાન ત્રીજા નંબરનું જરૂરી છે. ન્યાય માટે રાજ્યસંસ્થા, પ્રેમ માટે  
લોકસંસ્થા અને સત્ય માટે સાધક-સંસ્થા જરૂરી છે. મહાભારતના  
સમયમાં સાધક-સંસ્થા સરખો રીતે કામ કરતી હોત તો શ્રીકૃષ્ણને જે  
કંઈ કરવું પડ્યું તે ન કરવું પડત. સાધુસંસ્થાએ તો સર્વોપ્રથમ જગૃત  
થવાની જરૂર છે. તેની ઉપરોગિતાની છણુવટ કરતાં મુનિશ્રી

નેમિયંડળાએ કહેલું કે “તેમણે વણુ વાતો કરવી જોઈએ. ઉપરેશ, પ્રેરણા અને આદેશ !” આદેશ એટલે આજા અને તેના ખંદે હુકમ એમ મુક્કીએ તો તેનો ખરો ઘ્યાલ આવી શકશે. હુકમ સત્યની જગતવણી માટે હોય; લડાઈ માટે નહીં. સામાજિક સત્યની જગતવણી માટે વણુ પ્રકારનાં દ્યાણો. વણુ પ્રકારનાં દ્યાણો. આધ્યાત્મિક દ્યાણ, સામાજિક નૈતિક દ્યાણ, અને ત્રીજું રાજ્યનું દ્યાણ જરૂરી છે પણ તેમનું ચેકિંગ તો સાધુસંસ્થાએ રાખવું પડશે; અને જરૂર પડતાં ખલિદાન પણ આપવું પડશે. પહેલો હુકમ સાધુસંસ્થાનો છે. તેણે આદેશ આપવો પડશે, પ્રેરણા આપવી પડશે અને ઉપરેશ આપવો પડશે. બીજો હુકમ દોકસેવકનો છે. તેણે રચનાત્મક સંસ્થા બનાવવી પડશે. ત્રીજો નંબર દોકસંગઠનનો છે. ચોથે નંબરે રાજ્યસંસ્થાને લેવી પડશે.

કોઈને પ્રશ્ન થશે કે આવું કાયঁ કોઈ જૈન સાધુઓએ કર્યું છે ? જો સાધુઓ હથિયાર લેતા થશે; આલણો શર્વ પકડશે, તો ક્ષત્રિયો કેવા રહી બશે ? પણ માની લ્યો કે અન્યાય સામે ક્ષત્રિયો ન જગ્યા આલણો નહીં ચેત્યા તો કોઈકે જગવું પડશે.

એવો પ્રસંગ જૈન કાલિકાચાર્યનો છે. સરસ્વતી નામની એક સાધ્વીને રાજ બદ્ધરાહે ઉપાડી ગયો. આલણો પણ રાજને સાચું ન કહી શક્યા, જૈન આવકો પણ કાયરતા ધારીને એ અનીતિને મૂંગે મોઢે સહેતા રહ્યા. ભત્યા કે રાજની બીડ કોઈ ન બોલ્યું. કાલિકાચાર્ય નામના જૈન સાધુને ખખર પડી. તેમણે પહેલાં તો ઉજનજયિનીના આલણો, મહાજનો અને આવકો વ.ને રાજને સમજાવી સરસ્વતી સાધ્વીને છોડાવી લેવાનું ડિલ્યું; પણ તેઓ કોઈ સળવલ્યા નહીં. છેવટે પોતે રાજને સમજાવવા જાય છે. પણ સત્તામાં મદાંખ રાજ બર્દાંભિલ્લ સમજે શાને ? આખરે ન છૂટકે સિંધુ સૌવીર દેશ જઈને કાલકાચાર્ય શહેરાજને તેરી લાભ્યા, પોતે પણ સેના સળ્ણને સથાન મુદ્દ કરવા માટે ઉજનજયિની આંધ્યા. બર્દાંભિલ્લ દ્યાણને જવતો પકડી બેખામાં આવ્યો. અને સાધ્વીને બચાવી લેવામાં આવી ! નવકાટિ સહિત

શુદ્ધ અહિંસાની પ્રતિજ્ઞા લેનારનું વત તુઠ્યું કે નહિ? ઉપરથી તો હેખારો કે પ્રતિજ્ઞા ભાગી પણ અંદરથી આતમા જળવાઈ રહ્યો. પાછળથી આચાયેં ચોતાનો સાધુવેષ સ્વીકાર્યો, અને સંધે તેમને ફરીથી આચાર્ય પદ આપ્યું. શાસ્ત્ર ધરીને તેમને ને અત્યાચારી રાજનો પ્રતીકાર કરવો પણો, તે માટે ચોતે થોડું પ્રાયશ્ચિત્ત લીધું.

એટલે સાધુ-સંન્યાસી ઉપર તો મોટી જવાઅદારી છે. આને અમેરિકા મૂડીવાદ અને લોગવિલાસમાં પણું છે; રશ્યા શસ્ત્રો અનાવવામાં પડ્યું છે અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણુકારા વાગે છે ત્યારે પાંડિતજી નેહિને કેવું લાગતું હશે? તેઓ કહે છે કે “દુનિયામાં લડકો થાય તેમ છે ત્યારે હિંદ્દીઓ એક થાય”! આવા સમયે સાધુ સંન્યાસીઓ ચૂપ એસી રહેશે? તો તેમનું સ્થાન એધી બેસરો.

આને દેશમાં ચોમેર અસંતોષ છે. પંજાબી અને ડિલી એમ ભાષાને નામે અથડામણો ચાલે છે, સત્તા અને ધન લોલુપ્ત બળો આગળ આવી રહ્યાં છે તે વખતે સામુદ્દરિક અહિંસાનાં પ્રયોગો કરવા જોઈએ. અમલદારોમાં લાંચ રૂસ્વેટ પડી છે અને ગામડામાં દાંડ તર્ફો પડ્યાં છે. તેમની સામે શુદ્ધ પ્રયોગ શરીર કરવો જોઈએ. વહેવારમાં નૈતિક સામાજિક દબાણને લાવવું પડશે, નહીંતર દાંડતત્ત્વ, સરમુખતારી કે લદકરશાહી જોર કરી જશે; પ્રણ ખૂમો પાડતી રહી જશે અને સાધુઓ ઉપરેશ આપતા જ રહી જશે. એટલે ઉપરેશની સાથે આચાર, પ્રેરણાની સાથે રચના; અને પ્રેમ તથા આહેશની સાથે ન્યાયને જોડવા પડશે. આપણું સદ્ગુરૂભાગ્ય એ છે કે ધડતર પામેલી કંગ્રેસ જેવી સંસ્થા રાજ્યનું વહનકરે છે અને દુર્બાળ્ય એ છે કે સંસ્કૃતિ પ્રધાન દેશ હોવા છતાં તેને હિંસાત્મક પગલાં લેવા પડે છે. આવા સમયે સામુદ્દરિક અહિંસાના પ્રયોગાનું મૂલ્ય અનેકમણું વર્ધી જાય છે.



## ચર્ચા - વિચારણા

શ્રી. મારલિયાએ આજની ચર્ચાનો પ્રારંભ કરતાં હણું : “ સામુદ્દાયિક અહિસાના પ્રયોગોની તાત્ત્વક ખાનુ છણવાનો મારો વિચાર છે. આજનો યુગ એવો છે કે સ્થળ, સ્ક્રિપ્ટ અને વહેવારિક એ ત્રણેય રીતે સામુદ્દાયિક કર્મો છણવાં રહેશે. જેમ વ્યક્તિત્વની સારાં માઠાં કર્મ હોય છે, તેમ સામુદ્દાયિક રીતે પણ સારો માઠાં કર્મ હોય છે. આજે કૂદાંતી સંયોગો એવા જીવા થયા છે કે સામુદ્દાયિક મુક્તિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવી પડશે. જૈન પરિલાષામાં જેને સંવર, નિર્જરા અને લાવના કહેવાય છે, તે રીતે, આ યુગમાં ગાંધીજીએ પહેલ કરીને આપણો માર્ગ સરળ કરી આપ્યો છે.

સૌથી પ્રથમ સમ્યગ્-જ્ઞાન ઇપે ગાંધીજીએ સાચી વાત સમજવી. પુષ્ય અને વ્રત તરફ સમગ્ર પ્રજને દોરી. રાજતંત્ર બદલવાનો ભગીરથ પુરુષાર્થ પ્રેર્યો. તે જમાનામાં કેટલાક પ્રાંતો (બંગાળ પંજાય યુ. પી.) ત્રાસ કે હિસાથી સ્વરાજ્યની વાત કરતા હતા. કેટલાક પ્રાર્થનાથી સ્વરાજ્ય ભળશે એમ માનતા હતા. એકમાં આત્મશક્તાનો અભાવ; અને ખીણમાં પ્રજનખળ ઉપરનો અવિશ્વાસ હતો. આ ઘધાનુ પરિવર્તન કરી મધ્યમ અને સાચો માર્ગ તેમણે આપ્યો. મિથ્યા શક્તા તોડી અને અને સમગ્ર પ્રજનની શુદ્ધિ કરી. ત્યારબાદ ચર્ચા, લેખો, પરિષ્ઠો વ. દારા વિવિધ રીતે દેશબ્યાપી આંદોલન કરી મૂક્યું.

આશ્રમવાસીઓને કડક નિયમો આવ્યા. સામાન્ય પ્રજને નાનાં નાનાં વ્રતો આપ્યા :— (૧) અ. રાષ્ટ્રીય શિક્ષણ ન લેવાય, (૨) પરદેશી તેમાં પણ વિહેશી ભાલ ન લેવાય. (૩) દાઢ ન પીવાય, (૪) અદાલતમાં ન જવાય. આમ વ્રતો આપી સંવર કર્યો. પ્રાર્થના દારા લોકોને એક કર્યા. બ્યાપક પ્રજનસેના તૈયાર કરી રચનાત્મક કાર્યક્રમો આપ્યા. દરેક ક્ષેત્રે અહિસા અને સત્યના ગણે માપવાનું શિક્ષણ પ્રજને આપ્યું. લોકોની દણિ ઘડાવા લાગી.

વિદ્યાપીઠની સ્થાપના, ખાદી આમોદોગની સ્થાપના આમ એક બાજુથી શુદ્ધના લક્ષ્યે તેમણે શુલ આપ્યું. હિં-મુસ્લિમોને અનેદાખાવે

જેતા રહેતા શીખવ્યું. સામુદ્દરિક સંવર ઉપરાંત તપતું પણ તેમણે કામ કર્યું. વિચારોની અને સંસ્કારોની નાભળાઈ દૂર કરતાં શીખવી. અસહકાર, પીડેટીંગ, વગેરે છતાં વિનય અને નઅતા ન ચૂકાય તેવી જાગૃતિ આપી. બિંદિશો સાથે લડવા છતાં તેમનામાંના સહયુદ્ધો લેતાં શીખવ્યાં. જે ધર્મિકો સામે ઉપવાસો કર્યા તેમનું પણ દિલથી કામ કર્યું. “અનિષ્ટ સામે લડવું પણ પ્રેમ રાખવો” આમ સેવાનો સાચો સંસ્કાર વ્યાપ્ત કર્યો.

સામુદ્દરિક ભૂલનો એકરાર કરતા શીખવ્યો. કસ્તુરાંના જેવાની નાની ભૂલને મોટી ગણી જાહેરાત કરી. એકરાર અને પરસ્તાવાનો સંસ્કાર દદ કર્યો. કેંગ્રેસ અધિવેશનમાં સાધાઈ એ એમનોજ વારસો છે. આવાપીવામાં ખ્યાલ રાખવો, ભોગો એછા કરો, સાદા છતાં રવચ્છ રહો, એ તેમણે શીખવ્યું. સામુદ્દરિક ઉપવાસ એમણે શીખવ્યા. આશ્રમમાં ભૂલ થાય તેને પોતાની ભૂલ ગણી જગતની એકરૂપતાથી એ પાપ આપણું પંડતું ગણીને ધોવાની પ્રેરણા પાઈ.

ભાવનાથી પ્રજાની ડેમવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ વગેરે ગાઠો દૂર કરતા શીખવી. તેમણે દેશને પં. જવાહરલાલ નેહાર, વિનોભા જેવી ઉચ્ચ પ્રકારની નેતાજીરી આપી. સાધુઓમાં પણ સળવળાઈ પેદા થયો. જેના પ્રતાપે આજે આપણે સાધુ-સાધી શિબિર ચોળું રહ્યા છીએ. આમ પરિસ્થિતિ પરિવર્તનનો જે પાયો ગાંધીજીના નિભિતે નખાયો છે તે આપણે સાચવવાનો અને વિશેષ વ્યાપક ઘનાવવાનો છે.

આ યુગ બ્યક્ઝિતાત્મક પ્રયોગોનો નથી. જે કે સામુદ્દરિયને દર્શિમાં રાખ્યાને કરાયેલાં બ્યક્ઝિતાત્મક અલિદાનો પણ નિષ્ઠળ જતાં નથી. એ રીતે અણોથ શાંકર વિદ્યાર્થી, રજ્યાન્દાલી-વસંત વ.નાં અલિદાનો તરત અસરકારક થયાં હતાં. એટલે તાલીમ આપવાની એટલીજ જરૂર છે. લશકર કે

પોલિસને અપાય એ રીતે પ્રથમ ખાલ્ય પ્રયોગની રીતે શુદ્ધ પ્રયોગ અને અંતે શાંતિ ખાતર હોમાવાની તાલીમ આપવી જોઈશે, માણુસ એકુદમ, એક દણકે ભરવા માટે તैયાર—જોબો નહીં થાય—તેને જોબો કરવો પડશે.”

**શ્રી. ઘળવંતભાઈ :** “ દીવ-દમણુમાં મેં જેયું કે લોકો ખરે વખતે ડગી જાય છે. ”

**શ્રી. દેવજીલાઈ :** “ એ ઉદાહરણ લેવા જેવું નથી. એ લોકો પ્રાણ, પ્રતિજી અને પરિઅહના ત્યાગની ભાવનાથી ગયા હતા? ”

**શ્રી. પૂંજલાઈ :** “ દાંડીકૂચ વખતે કોઈ ડગું ન હતું. રાહયરી સાચી હોય તો લોકો નહીં ડગે. દોરનાર સાચો અને વ્યાપક હોય, હોમાનારની સમજ પૂર્વેની શ્રક્ષા હોય તો આજના યુગે સામુદ્દરિક અંહિસા જરૂર કારગત થશે. તેમજ અનિષ્ટોની અપ્રતિષ્ઠા અને ધર્ષણાની પ્રતિષ્ઠા થશેજ. ( તા. ૧૧-૮-૬૧ )



## સામુદ્ધાયિક અહિંસા પ્રયોગની ભૂમિકા

સામુદ્ધાયિક અહિંસાના પ્રયોગો અંગે આપણે વિચાર કરી રહ્યા છીએ, તેનો પ્રયોગકાર કેવો હોવો જેઠીએ; તેનાં સાધનો, તેની પ્રક્રિયામાં દબાણું; તેમજ સત્ય-પ્રેમ-ન્યાયની ત્રિવેણીમાં કયાં, કોને, કેટલું મહત્વ આપવું એ અંગે વિચારણા થર્ડ ચૂકી છે. આજે આ પ્રયોગોની ભૂમિકા શી એ ઉપર વિચારવાતું છે.

આ સામુદ્ધાયિક અહિંસાના પ્રયોગોની ભૂમિકામાં મુખ્યત્વે એ બાધ્યતો રહેલી છે, (૧) સમાજને અહિંસા તરફ લઈ જવો; (૨) રાજ્યની અથવા કોઈપણ પ્રકારની દંડશક્તિનું પ્રમાણ ધરે. હુંકમાં, માનવ સમુદ્ધાય વધારે ધર્ષણ્યથી કઈ રીતે બચે અને શાંતિથી શી રીતે રહી શકે એ આ પ્રયોગોની ભૂમિકા છે.

એ માટે આપણે દિલીપ રાજનો દાખલો સમજવા કેવો છે. વિશ્વિષ ઇધિની નંદિની આયને તે ચરાવે છે. ત્યાં સિંહ આવે છે અને ગાય ઉપર તરાપ મારે છે. એટલે રાજ સાવધ થર્ડને સિંહને મારવા જય છે. ત્યારે સિંહ કહે છે : “તું મને શું મારવાનો હતો ? હું તને પણ મારી શકું છું. પણ મારી બે વાત સાંભળ :—

એકાતપત્ર, જગત : પ્રમુદ્રં, નવંબર : કાંતમિદંવપુશ  
અલ્યસ્ય હેતો ર્વહુ હાતુમિચ્છન्, વિચાર મદ્દ : પ્રતિમાસિમેત્વમ् ।

તારી પાસે સુંદર મજાનું એકછની રાજ્ય છે, નવી જીવાન ઉગ્મર છે, તારું આ સુંદર શરીર છે, એ બધાની ચિંતા નહિ કરતાં તું એક આયની પાછળ પોતાના વહાલા પ્રાણુને ગુમાવવા તૈયાર થયો છે, એતો બોડા લાભ માટે મોટી હાનિવાળી વાત છે. એટલે તું મને અવિચારી લાગે છે. તું છંછે તેથું દાન આપવાની શક્તિવાળો છે, તે

અધું છોડીને એક ગાયને ચારવે છે ? આવી સે। ગાયે તો તું દાનમાં આપી શકે છે.”

અહીં દિલીપરાજ તે છતાં ગાયને બચાવવા પોતાને હોમવા તૈયાર થાય છે, તેનો વિચાર કરશું તો જણાશે કે તે અહિસાની ખૂભી છે ! એક જ ગાયની સંભાળ માટે આઠલો બધી લોગ ? રાજ્ય, અંતઃપુર તેમજ વ્યવસ્થાનું થું ? કયારેક ધર્મ અને સિદ્ધાંતની વાત આવતી હોય ત્યારે બીજી બાયટોને—સ્વાર્થની વાતોને એક બાજુ મૂકવાં જોઈએ. સ્વાર્થનષ્ટ થતો લાગતું હોય તો પણ ધર્મ આગળ તેને ગૌણ માનવું જોઈએ.

રાજ દિલીપ સિંહને કહે છે :—

‘ ક્ષતાત્ કિલત્રાયત ઇત્યુધ્ય ક્ષત્રસ્ય શબ્દો સુવનેષુશ્ફૃ :’

—કોઈ આકૃતમાં હોય તેને બચાવવો એ ક્ષત્રિયનો ધર્મ છે; અને હું ક્ષત્રિય છું. એટલે ક્ષત્રિયોએ એ કાર્ય કરવું જોઈએ કે મોટા માણુસ નાનાને ન દ્યાવે—તેની હિંસા ન કરે તેનું ધ્યાન રાખે. તે માટે અવસર આવે તે પોતાના વિલાસ અને સ્વાર્થને પણ તિલાજલિ આપે.

પણ, જો ક્ષત્રિય એ ધર્મ ન પાણે તો ? કાલિકાચાર્યના દાખલામાં એ વાત રૂપણ છે કે જો સાધ્વીનું શીલ રાજને હાથે લૂંટાત તો સમાજમાં શું છાપ પડત ? કાલિકાચાર્ય ક્ષત્રિયોને કહ્યું કે આ સાધ્વીનું શીલ બચાવવું જોઈએ; પણ તેઓ ન માન્યા. શ્રાવકો, મહાજનો અને બ્રહ્મણોને કહ્યું પણ તેઓ તૈયાર ન થયા. એટલે તેમણે હથિયાર હાથમાં લઈને લડાઈ કરી. તેમના માટે સાધ્વીની શીલરક્ષા સાથે સંસ્કૃતિની રક્ષા કરવાનો મોટા પ્રશ્ન હતો, તે છતાં તેમનો માર્ગ ધર્મનો કહેવાયો.

ત્યારે પ્રસન્નચંદ્ર રાજ્યિનો પ્રસંગ જુડો છે. તેઓ સાધુધર્મમાં હોવા છતાં માનસિક રીતે પોતાના પુત્ર માટે મનથી લડવા જય છે. આ

ધર્મ નથી. કેવળ અમતાના કારણે તેમણે માનસિક યુદ્ધ કર્યું. અને તેમને કે દોષ લાગ્યો તેતું પરિણામ તે વખતે કાળ પામે તો સાતમી નરકનું હતું.

આમ દરેક પ્રવૃત્તિ પાછળનો આશાય પહેલાં તારવવો જોઈએ; કેથી ધર્મ, અધર્મનો ઘ્યાલ આવી જશે. એ છેડા છે તેમાંથી વચ્ચેલો માર્ગ લેવો જોઈએ.

સામુદ્દાયિક અહિસાનું પણ એવું છે. તેમાં પણ વચ્ચેલો માર્ગ કાઢવાનો છે. રાજ્યની દંડશક્તિ ન વધે તેમ પ્રજામાં અહિસક શક્તિ વધે એ બન્ને વાતોને વચ્ચેમાં લાવીને રાખવી છે. આ ગ્રંથિયા માટે જ શુદ્ધિપ્રયોગની વાત આવી; ત્યારે ઉપવાસ કરનારના અધિકારનો વિચાર કરવો પડે છે કે હું કે માટે ઉપવાસ કરું છું; તેવો દોષ મેં તો કર્યો નથી ને? અહીં પણ વ્યક્તિગત અહિસાની વાત કરતા નથી પણ સામાજિક અહિસાની વાત કરીએ છીએ.

આ સામાજિક અહિસાને વધારવા માટે શું કરવું જોઈએ? આપણે ત્રણું સંસ્થા વિષે જોઈ જયા — રાજ્યસંસ્થા, લોકસંસ્થા અને ધર્મસંસ્થા. અહીં રાજ્યને પ્રથમ લેવું પડશે. રાજ્ય પવિત્ર ત્યારે જ ખંતી શુકે જયારે તેની દંડ શક્તિ ઓછી હોય। કરવેરા ઓછા થાય. પ્રજા શાંતિથી જુવે.

સુરાજ્ય માટેની કદ્દમનામાં પાંચ તરવો કહેવામાં આવ્યા છે :—

દુષ્ટસ્ય દંડः, સુબનસ્ય પૂજા, ન્યાયેન કોષસ્ય ચ સંપ્રવૃદ્ધિ ।  
અપક્ષપાતો, નિજરાષ્ટ્રચિતા પંચાડપિ ધર્માનૃપણગવાનામ् ॥

—એટલે કે દુષ્ટને દંડ, સજાનનોની પૂજા, ન્યાયીભંડાર સમૃદ્ધિ, અપક્ષપાત તેમજ પોતાના રાષ્ટ્રની હિતચિતા એ પાંચ શાસકોના ધર્મ છે. તેને કારણે તેતું રાજ્ય સુરાજ્ય થાય છે.

હવે એ રાજ્ય અહિસક ક્યારે બને? જ્યારે દુષ્ટને દંડ કરવામાં

એછામાં એછી હિંસા કરવી પડે! આ માટે જેમ રાજ્યની જવાબદારી છે તેમ પ્રજાની પણ છે. પ્રજા જે દુષ્પ્રકૃતિ કરે તો તે પ્રાલિસની દરમ્યાનગીરી ન દુષ્પ્રકૃત કરવી પડે.

શ્રી. મારલિયાળ માલપરા ગયા તે વખતે સ્પષ્ટ ખ્યાલ હતો કે કામ કરવું હોય તો ગામડામાં જવું અને તેમણે પ્રથમ લોડામાં પ્રવેશવા માટે શિક્ષણું કામ લીધું. પછી અનેક પ્રશ્નો બિલા થયા. ખાંડારવટીયાની ધોંસ વધી. લોડાનાં નાડ કરતાં હતાં. ખૂબ મુંજવણું થઈ કે હવે શું કરવું? પોતે નાચી કર્યું કે મારે નિર્બિય થઈને દુરવું. પણ આખા ગામ ઉપર ધોંસ આવી ત્યારે સંરક્ષણ દળ બિલું કર્યું. પ્રાલિસ આવી ત્યારે કહ્યું કે મારા ધર પૂરતી પ્રાલિસની સહાય જરૂરી નથી. તેઓ ગામ ખાંડાર એકલા રહ્યા. ગામલોડાની સહાયથી એક શાળા ચલાવી તેમાં બગડેલા ચાર છોકરાઓ જોડાયા. ત્રણ સક્રણ થયા. પણ ચોણો ભીજાને બગાડે એવો હતો. ધણ્ણા પ્રયત્નો કર્યા પણ તે ન સુધર્યો. એટલે પ્રાલિસને સોંપવો પડ્યો ત્યાં સીધો થઈ ગયો. આમ ન દુષ્પ્રકૃત પ્રાલિસનો આશરો લેવાય અને વધુ અહિંસા અટકાવવા માટે નાની હિંસા કરવી પડે તો તેને ક્ષમ્ય ગણ્યું જોઈએ.

રાજકોટ વેચાણ વેરા લડત વખતે હું રાજકોટ હતો. ટેબરલાઈ અને ગૃહપ્રવાન રોજ આવે એટલે પ્રાલિસના ઉપરી પણ આવતાં. એકવાર એ ઉપરી કહેવા લાગ્યા કે આ રાજકોટ પક્ષો નાના નાના છોકરાને ચઢાવે છે. પછી છોકરાંઓ પ્રાલિસને ગાળો લાંડે છે; મશકરીઓ કરે છે અને પથર મારે છે. આખા દિવસની ચાડીલી પ્રાલિસ ભીજવાય એટલે સોટી મારી બેસે, ત્યારે પાછા દોષ હેવા નીકળી પડે છે. અમારા મનમાં પણ આવે લાઠીમાર કરવો પડે છે તેનું દુઃખ થાય છે. મેં એક છોકરાને ધમકાવ્યે; તો તે ભૂતરી ગયો. આ જોઈને ખૂબ દુઃખ થયું. આ પ્રાલિસવડાના કહેવા ઉપરથી લાગ્યું કે પ્રાલિસને પણ અહિંસા વહાલી છે.

મેં પ્રધાનો અને કાર્યકરો સમક્ષ થાંત - સેનાની વાત કરી તારે નારણુદાસ કાકાએ કહ્યું : “ હવે સરાજ્ય છે ! એટલે ચોલિસ જ શાતિ સેનાનું કાર્ય કરવું જોઈએ ! ”

મેં કહ્યું : “ આપણે તૈયાર નહીં થઈએ ત્યાંસુધી ચોલિસ કંઠ જ કરી શકશે નહીં ! તેની મર્યાદા છે ! ”

આજે સહૃથી વધારે તાકાત રાજ્ય પાસે છે. જે અહિંસાને માર્ગ રાજ્યને લઈ જવું હોય તો ચોલિસ અને તોઝાનીએ વચ્ચે અહિંસાની વાડ જિલ્લી કરવી જોઈએ. આ કાર્ય સાધુએ કે લોક્સેન્કોએ ઉપડી લેવું જોઈએ. તોઝાનના પ્રસ્તુતોમાં જે સાધુએ કે સેનકો હાજર થાય તો ધણો ફરક પડે છે. તેમની હાજરી માત્ર ધણું કામ કરશે. તો અલિદાન આપવાની ભાવના તો કેટલું ભવ્ય કામ કરી શકશે ?

મુખ્યદ્વારા દિલ્લાયી રાજ્ય વખતે અમદાવાદનાં તોઝાનોને શાંત કરવા માટે ભાવનળકાંહામાંથી આમ ટ્રૂકડીએ ગઈ. તે વખતે તોઝાનો શાંત થયાં. પણ, ૧૯૮૮ માં પાછાં તોઝાનો થયાં. કોઈ કહેરો કે તેથી પ્રક્રિયા તો અટકી નહીં. તેમ જ મહાગુજરાત પણ આવી ગયું. તો સામુદ્ધારિક અહિંસાના પ્રયોગોની શું અસર થઈ ? તેનો જવાબ એ છે કે અસર તો થઈ અને મોટાં તોઝાનો થતાં અટક્યાં.

છેલ્લી ટ્રૂકડીમાં ૬૦૦ થી ૭૦૦ માણુસો ગયાં. તેમાં ભરવાડ, હરિજન, ડોણા વ. ડોમોના લોકો હતા. તેમનો સામનો અમદાવાદમાં ૫૦૦૦ ના ટેણાં સાથે થાય છે. કોઈ પત્થર નાખે છે; કોઈ ગાળો ઓદે છે. કોઈ લુંગડાં ઘેચે છે. તે વખતે રાજ્યની ફરજ હતી કે આ લોકોનું રક્ષણ કરવું પણ, આમડાંચાળાએ સ્પષ્ટ કહ્યું કે “ એ અમારા ભાઈએ છે; તેઓ કે કંઈ કરે તેને અમે સહન કરી લઈશું. આપને ફરજ તરીકે હાજર રહેવું હોય તો રહો પણ વચ્ચે ના પડશો એ વિનંતિ છે. ” આવા શાતિ ચાહકો ઉપર માળોનો વરસાદ પડે છે. મસ્કરીએ થાય છે પણ તેઓ બધું સહે છે. ગામમાં જે કોઈ આતું

એલે તો ખૂનામરકી થઈ જય. તેના બદ્લે ગણો, માર, અપમાન સહે છે. એનો ચેપ અમલદારોને લાગ્યો. પોલિસ અધિકારી એ ટૂકડીની સાથે હતા. તેમની ઉપર નાના છોકરા ઘેલીમાંથી મૂઢી ભરી લરીને ધૂળ નાખ્યા કરે પણ, તેઓ કંઈ જ ન એલયા. જે થોડાક અહિસક માણુસો શિસ્તબદ્ધ રીતાં સક્રિય કામ કરતા થઇ જય તો તેની અસર વધે છે. કાપાકાપી ચાલે-હિસા થાય ત્યાં નથળાને પણ જુનુન ચઠે. તેમ અહિસામાં પણ જોશ આવે. અહિસાનો પ્રયોગ ચાલે તો નથળા ઉપર, સથળા ઉપર, હિસક ઉપર, રાજ્ય ઉપર બધા ઉપર એની અસર થાય જ છે. પેલા અમલદારો સમજ ગયા કે અત્યારે કંઈ થાય નહીં. આ એક રીતે અહિસક પ્રક્રિયાનું પરિણામ જ હતું.

હવે એ જ વાત રાજ્યમાં લાવવી હોય તો ડોઈ એવી પ્રક્રિયા મૂકવી જોઈએ; જેથી રાજ્યની દંડશક્તિનો કંમે કંમે ધટકો કરવો પડે. ધણા એમ કહેશે કે રાજ્ય એમાં માનતું જ ન હોય તો। એ વાત બરાબર નથી. હૈદ્રાબાદમાં રાઝકારોએ જૂદ્મોનો પાર ન રાખ્યો. ગામનાં ગામ બાળી મૂક્યાં. દૂંટ-ખૂન અને અત્યાચારોની રમઝટ એલાવી. છતાં પંડિતજી ધીરે હૃદયે વિચાર કરતા હતા. મુન્શીજી ત્યાં હતા. તેમની તથા લોકોની છંચા હતી કે ભારત દરમ્યાનગીરી કરે. એટલે ત્યાં લરકર મોકલાયું. તે વખતે પણ નાહક હિસા ન થાય. લોકોની સત્તામણી ન થાય એ અંગે સખત તકેદારી રાખવાનું જણ્યાયું. તેણું દ્વિસમાં નુલ્જવી લડાધ્યા હૈદ્રાબાદનો કંપણે લઈ લીધ્યા. (એવું જ ગોવાના પ્રસંગમાં થયું. શાંતિ-વાટાધારો કામ ન કરે ત્યાં થોડીક હિસા વાપરવી પડે પણ તેનું પરિણામ લોકોની સ્વતંત્રતામાં આવ્યું એ જોવું રહ્યું) હૈદ્રાબાદના કંપણ બાદ પંડિતજી એવી મતલબનું એલયા કે રાજ્ય તો મહ્યું પણ ગાંધીજી અને શું માનત? આફભણું કે અના-કમણું? રાજ્યનો વડો જ્યારે આવી હિસા અંગે વિચાર કરે ત્યારે માનવું રહ્યું કે રાજ્ય પોલિસ અને ગોળામાં સંપૂર્ણપણે માનતું નથી. શ્રી. મેરારજ દેસાઈ જેવી વ્યક્તિએ તોષાન બંધ કરાવવા માટે ઉપવાસ

કરવા લાગી જય ત્યારે માનવું રહ્યું કે, રાજ્ય અહિસા તરફ વિચારતું થયું છે. આ તાલીમ બાપુજીના પ્રતાપે દેશમાં આવી છે.

એની ખીજુ બાજુ પણ છે. તે નિરાશાજનક લાગે છે. શિક્ષકોએ ઉપર તડી પાડી. પટણુમાં મદ્દત સુસાફરી કરતા સુસાફરોને પડકદ્યા. તેમના ઉપર ડેસ ચાલ્યો. તો મેન્જરસ્ટ્રોટ ઉપર વિદ્યાર્થીઓ અને લોકો હુમલો લઈ ગયા અને આરોપીને છોડાવીને લઈ જવા લાગ્યા. પોલિસ આવી. તો ઝાન વધું થતાં ગોળાભાર કરવો પડ્યો. દશભાર જણું ઘવાયા. આમ એક બાજુ હિંસા કરવી પડે છે; ખીજુ બાજુ અહિસાના પ્રયોગો કરવાના છે. રાજ્યને જે સંસ્થાનું નેતૃત્વ મળ્યું છે તેના નેતાઓ અહિસામાં માને છે પણ જે પોલિસ મળી છે તેનું ધડતર જૂના શાસકો અંગેઝેના હાથનું છે. ત્યારે નવી પ્રજને આજના રાજનૈતિક દળા ઉંઘી દ્વારા વણી આપતા હોય છે. પરિણાસે મહાત્મા ગાંધીજીએ જે સામુદ્દરિક અહિસાની તાલીમ આપી હતી તેનાથી આપણે પીછેફઠ કરતા જઈએ છીએ. તેથી ગોળાભાર, લાઠીભાર વગેરે કરવા પડે છે. એની સાથે દાંડતરવો જેર કરતાં જય છે.

એટલે પહેલો મુદ્દો છે રાજ્યની દંડ શક્તિ અહિસા તરફ કેમ વળે? એ માટે સર્વગ્રથમ તો પ્રજને ન્યાયથી જીવતા ડેળવવી જોઈએ. ન્યાય ત્યારે જીવનમાં પ્રવેશે જ્યારે માણુસ સ્વતંત્ર અને નિર્ભય થઈને ફરી શકે! એ માટે દંડ-અન્યાયી તત્ત્વો આગળ તેને નમનું ન જોઈએ. બને તો એવાં તત્ત્વો સાથે ભળવું ન જોઈએ અને તેમને દૂર કરવા માટે કદાચ દબાણ કે નજીવી હિંસા વાપરવી પડે તો તે વાપરવી જોઈએ.

એક યુવાન બાળાનો પ્રસંગ મને યાદ છે. તેની ડોઈ યુવકે છેડતી ફરી તો તે છોકરીએ તેને ચંપલ માર્યાં. આમાં હિંસા તો થઈ પણ શીખને બચાવવા માટે એમ કરવું પડે તો તે ક્ષમ્ય છે. સમાજને ન્યાય મળે, સમાજમાં હોષે. ઓછા થાય એજ અહિસંક સમાજની! દશામાં સક્રિય પગલું છે.

પાલણુપુરની ગઢવી બાળાનો પ્રશ્ન મેં ગયે વખતે ૨જુ ક્રેલો. એમાં છોકરી ઉમ્મરલાયક હતી. ધારે તો મા-બાપથી વિરુદ્ધ જઈને ડોક્ટર સાથે પરણી શકે. જે કે ડોક્ટર તો પરણેલો હતો. એટલે તે એને રખત તરીકેજ રાખત! અહીં એ વાત કરતાં મહત્વની વાત તો પરણિયત ડોક્ટર ઉપર સમાજનાં વિશ્વાસની હતી. બાળાનો બાપ નરમ સ્વભાવનો હતો; પણ મામે અમૃક પ્રકારનો હતો, જે ડોક્ટરને ઠાર કર્યા વગર ન રહેત. એટલે ડોક્ટરને એક મહિનો બહાર કાઢ્યો. તેનું ખૂન બચ્ચી ગયું. ધણાને એમ થતું હશે કે મહારાજ આવાં કામમાં શા માટે પડતા હશે. મને તો લાગ્યું કે સામાજિક ન્યાયની જળવણી માટે તેમજ હિંસાના ચુણાકાર અટકાવવા માટે એક સંત તરીકે મારી પાસે પ્રશ્ન આવે તો તેનો ઉકેલ મારે નાતિ-ધર્મની દષ્ટિએ આણુવો જોઈએ. ડોક્ટર કદાચ ન સુખર્યા હોય પણ તેથી સમાજ સચેત થઈ ગયો.

સમાજમાં અહિંસાનો પ્રચાર સામુદ્દરિક ઇથે કરવો હોય તો મનમાંથી કિનો કે પ્રતિહિસાના તત્ત્વોને દ્યાવી દેવાં જોઈએ. અર્જુનના મનમાં બળાપો હતો એટલે તેણે “ દુષ્ટભુષ્ટ દુર્યોધન ” એ શબ્દ વાપર્યો. ત્યારે શ્રીકૃષ્ણ કહ્યું : “ લાઈ તારો બળાપો કાઢી નાખ; પણ લડ ! ત્યારે તને પાપ નહીં લાગે ! ” જે સામુદ્દરિક હિંસામાંથી, સામુદ્દરિક અહિંસા તરફ જરૂર હોય તો રાજ્યને હિંસા ન કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ.

આમ આપણે સામુદ્દરિક અહિંસાના પ્રયોગાની ભૂમિકા માટે સર્વ પ્રથમ નિર્ભયતા ઉપર આવ્યા. પણ દાંડ શક્તિઓને નહીં નમતું એ વાત ઉપર આવ્યા. તેમજ સામાજિક ન્યાય જળવવા માટે શૈદીક હિંસા કે દ્યાણ જે કંઈ ઓછું હિંસાજનક હોય તે કરવું એ સિદ્ધાંત ઉપર આવ્યા. સાથેજ આવી કોઈ પણ પ્રક્રિયા વખતે પ્રતિહિસા-પ્રતિદ્વષ ન જગે તેનું ધ્યાન રાખવું જોઈએ અને ન્યાયની જળવણી માટે જે રાજ્ય ઉત્ત્યાત પગલાં લેતું હોય તો તેને સાથ આપવો જોઈએ. તેમજ તેને હિંસા ન કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ. બીજુ બાજુ ન્યાય માટે હેઠળીક વખત દફ્તા ઘતાવવી જોઈએ.

એક આઈની તેના પતિની સામે જ એક અંગેને છેડતી કરી. રટેશન હતું પણ કોઈ તેની આખર બચાવવા તૈયાર ન થયું. ત્યારે પુરુષોત્તમ પંચા નામના એક આર્યસમાજ ભાઈ તરત રિવોલ્વર કાઢીને અંગેજનો હાથ પકડી લે છે અને તેની સામે તાકે છે. તે તરત ચાલ્યો જાય છે.

આઠવી ભૂમિકા ડુળવાઈ ગયા બાદ પણ ઐતિહાસિક વાયતો જરૂરી બને છે. એક તો એ કે જ્યારે હિંસા કે તોકાન ફાટી નીકળે ત્યારે પંચ-ન્યાયના વડાઓએ શાંતિ કરવા આગળ આવવું જોઈએ. પરમશાંતિ સાથે જ્યારે સાધુસંસ્થાની વિભૂતિઓ કે નેતાઓ આગળ આવશે ત્યારે હિંસા નોકાન શાંત થઈ જશે. હુલ્લડ વખતે એકવાર પંડિત જવાહરલાલ નેહાર અહાર પણ હતા. એક ખીજે પ્રસંગે જ્યારે એક બાઈનો હાથ પકડીને એક ગુંડો તેને પરાણે લઈ જઈ રહ્યો હતો. ત્યારે તરત એની પાસેની તલવાર ઐંચીને પંડિતજીએ કહ્યું કે “તને શરમ નથી આવતી !” ગુંડો તરત નાસી ગયો. બાઈ પોતાને ધેર ચાકી ગઈ.

આના ઉપરથી એ વાત પણ તારવી શકાય છે કે ન્યાય માટે અલિદાન આપવા તૈયાર રહેવું જોઈએ. એથી સમાજમાં એક સંસ્કાર વ્યાપ્ત થશે કે એક બાઈની આખર લુંટાતી હોય તો લોકોએ સામના કરવો જોઈએ.

પણ બ્યક્ટિની બ્યક્ટિતગત રીતે મર્યાદા છે અને રાજ્યની રાજ્યની રીતે. ગાંધીજી દિલ્હીમાં હતા ત્યારે તેમણે કહ્યું કે રાજ્યની રક્ષણની ફરજ છે; એટલે તેના હાથમાં હથિયાર શોભે. પણ, પ્રજના હાથમાં હથિયાર ન અપાય. જ્યારે ન્યાયની જળવણી થતી હોય ત્યારે લોકોએ રાજ્યના સાચા પગલાને રેકો આપવો જોઈએ. એટલે તેમણે કારભીરની રક્ષા માટે ભારતની સંસ્કૃત સૈનિક તૈયારીને રેકો આપ્યો હતો; કારણ કે એ ન્યાય હતો. કોઈને એમ થશે કે ગાંધીજી શું કામ ન ગયા અને કરકરે મોકલવું પડ્યું ? જ્યાં સુધી દેશની એકતા ન થાય ત્યાંસુધી પાકિસ્તાનમાં જવાનો કોઈ અર્થ ન હતો. સંસ્કૃત અંધાધુંધીનો સામનો એક બ્યક્ટિથી અમૃત મર્યાદામાં જ થઈ શકે, એ માટે ગાંધીજી નોઆખી ગયા હતા.

એટલે દાંડાધ અને શુંડાગીરીની સામે પણ લોકો અહિસક રીતે  
પાર થાય એ સ્થિતિ આપણે સર્જવી જોઈએ. સામુદ્દરિયિક  
અહિસાના પ્રયોગો આગળ વધે અને વિપરીત પ્રશ્નો આવે ત્યારે ધીરજ  
રાખી અતુથંધ વિચારખારાને ખરાખર સમજ થોડ્ય પગલાં લેવાં જોઈએ  
એ હમેશાં યાદ રહેવું જોઈએ. સામાજિક ન્યાય જળવવા અને સમાજને  
અહિસા તરફ લઈ જવા માટે સામુદ્દરિયિક અહિસાના પ્રયોગાની વાત  
કરવામાં આવે છે. એટલે એ એની સુખ્ય ભૂમિકા હોવી જોઈએ.



### ચર્ચા - વિચારણા

[ આ ચર્ચાના અંતમાં “ સાધુસંસ્થા ” અંગે પણ ચર્ચા થયેલી  
છે. તે ભાગ “સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા”માં પણ થાડે  
અંશો આવે છે. અહીં પણ તેનો સંદર્ભ હેઠળે સકારણ કરી રજૂ  
કરવામાં આવેલ છે. સં. ]

શ્રી. માટલિયાએ કહ્યું : “ સામુદ્દરિયિક સાધના જ્યારે થઈ જ  
ગઈ છે ત્યારે સમાજનાં જુદા જુદા ક્ષેત્રોમાં એ સાધનાને શ્રી રીતે  
લાગુ પાડવી ? કયાં હિસાની સંભાવના અવ્યક્ત છે ? કયાં પ્રગટ છે તે  
તપાસી સામુદ્દરિયિક કર્મથી હઠાવવી પડશે.

આજની દુનિયામાં ચાર મોટાં ક્ષેત્રો : - (૧) સામાજિક,  
(૨) આર્થિક, (૩) રાજકીય અને (૪) સાંકૃતિક; ગણ્યી શાકાય.  
એમાં અનિષ્ટા ન પેસે અને પેસેતાં હોય તો તે શ્રી રીતે ટળે ? એ  
પ્રથમ વિચારવું પડશે. શિક્ષણ અંગે સંતાનતું ભાવિ મા-ખાપને-શિક્ષકને  
ક્ષાળે સૌંપવું પડે છે. એમ આરોગ્ય અંગેતું ભાવિ ડોક્ટર-વૈધને સૌંપવું પડે  
છે. હવે જે કોઈ શિક્ષક શિષ્યાને ક્રસાવે કે કોઈ શિક્ષિકા કોઈ શિષ્યને  
ક્રસાવે; એવી જ રીતે ડોક્ટર કોઈ દર્દીને ક્રસાવે કે કોઈ દર્દી ડોક્ટરને  
ક્રસાવે; એટલે કે જાતીય સંબંધોમાં ક્રસાવે; ખોટા બ્યસનોમાં ક્રસાવે  
તો સમાજનો વિશ્વાસ ડગી જય. તેમાંથી ખીનતિ ક્રસાય તો પણીથી

તેને બાંગલી વરસુ જેમ તળ દેવાય છે-સમાજ પણ તેને તરછોડી મૂકે છે. પાલણુપુરનો શુદ્ધિ પ્રયોગ એ એવું પ્રતીક ગણ્ણી શકાય.

એવું જ ત્રોજું ક્ષેત્ર ધર છે. સસરા, જેઠ, મોવડી વગેરે પાસે બહેનોને રહેણું જ પડે છે. આમ સમાજમાં સસરા, જેઠ કે મોવડીને આધિન રહેણું પડે છે. કુદુંખની ડાઈ ખીજુ બહેન આમાં હાથો બની જતી હોય છે. જે તે સસરા-જેઠ કે મોવડીની ખાટી ઈચ્છાને વશ થાય તો તેમની વાસનાનો એણે લોગ થાણું પડે અને કુદુંખમાં દુરાઓર ફેલાય છે. જે વશ ન થાય તો સંધર્થું વધે અને પરિણામે કાંતો બાધને આપદ્ધાત કરવો પડે; કાં તેને મારી નંખાય. આમ નશેય ક્ષેત્રોમાં ખ્રીએની નિર્ભયતા નથી. આ મુંજાતી હિંસા છે. એમાં અનૈતિકતા છે એમ સહુ સ્વીકાર કરશે.

એટલે આ ક્ષેત્રે કાંતિ કરવા જતાં જરૂર સક્રિયા મળે. કારણું કે જેણે ભૂલ કરી છે તે ઉપરથી ગમે તેટલો બળવાન થવાનો પ્રયત્ન કરે પણ અંદરથી તેનું ‘મોરલ’ (Moral) (આત્મતત્ત્વ) તૂટી ગયું હોય છે. અહીં શુદ્ધિ પ્રયોગને સરળતા થાય છે.

એ જ રીતે આર્થિક ક્ષેત્રે પણ શોષણું સંગઠનો ઇપી સંવરથી રોકવું સહજ થાય છે. ન છુટકે ત્યાં પણ તપ અથવા નિર્જરાને માર્ગ જરૂં પડે તો તેથી મોટી હિંસા રોકી શકાય. દા. ત. નર્સ, લાંગી કે ઐડૂતોની ફરિયાદ ન સંભળાય અને તેઓ હડતાલ ઉપર ઉત્તરે તો મોટી હિંસા થાય. સમાજનો વહેવાર ચંલી જાય; અને જે હિંસા તોકાનને માર્ગ જાય તોથે હિંસા થાય. એટલે ત્યાં વિવેકપૂર્વક બંધારણીય રીતે ઉપવાસનું સાધન ચોગ્ય બને છે. પોતે પીડાય પણ બીજાને ન પીડે.

રાજકીય ક્ષેત્રે પણ સત્તા માટે નહીં; પણ કાનૂન લાંગ ન થાય અને અન્યાયનું નિવારણ કરવા માટે પ્રયોગ થાય; પાછો સુસંસ્થા સાથે અનુભંગ તૂટે નહીં, ઉર્કેરાટ વ્યાપે નહીં, આ રીતે કાળજીપૂર્વક ભાલ-નળાકાંડા પ્રયોગ દારા જુદા જુદા શુદ્ધિ પ્રયોગો થયા છે. જ્યાં સમાજ રીઢા બની ગયો હોય કે સત્તાવાળા પક્ષનું સીધી કે આડકટરી રીતે સમર્થન મળતું હોય ત્યાં અતિ તીવ્ર શુદ્ધિ પ્રયોગ કરવો પડે છે. દા. ત. સાખુંદમાં આવા સ્થળે તીવ્ર આંચડા આપી સમાજને ટેઢોળવો પડે છે.

એક વરતુ યાદ રાખવાની કે આવા પ્રયોગ કરનારનાં જીવનમાં પ્રતિઅધ્યક્તા તો હોવી જ જોઈએ. પછી તેણે શુદ્ધ માટે અખંડ મથ્યવું જોઈએ. પછી તે શુદ્ધપ્રયોગ સફળતાપૂર્વક કરી શકશે. સામુદ્દાયિક અહિસાની ડેળવણી જેમ જેમ વધતી જશે અને સંસ્થાગત નિર્ણયો લેવાતા જશે તેમ તેમ દરેક ક્ષેત્રમાં આવા પ્રયોગો વધારે વધારે થતા જશે અને લોકનિષ્ઠા વધતી જશે.”

**શ્રી. પૂંજલાલાધ :** “વાત સાચી છે. લોકનિષ્ઠા વધે પછી તેનું સુંદર પરિણામ આવે જ છે. લાલનળકાંડાના પ્રયોગોએ સુંદર પરિણામો આણ્યા છે. લોકો ધેર આવીને વધુ ભાવ આપે પણ ઘેરૂનો ન દે; સાતસો ગ્રામ્ય શાંતિ સૈનિકો ભયંકર ગાળ-અપમાન વચ્ચે પણ જરાયે મેંન ફરવે; તેમ જ પ્રલોબનો વખતે પણ નિલેંપતા—આ બધા શુદ્ધપ્રયોગાનાં અદ્ભુત પરિણામો છે.”

**શ્રી. અળવંતલાલાધ :** “સામુદ્દાયિક હિસા ડેવી રીતે ભડકે છે એ તો મેં જોયું છે. સાધુઓ આગળ આવીને તેને ઢારે એ જોવાની મારી તીવ્ર ધ્રંછા છે.”

**પૂ. દંડીસ્વામી :** “લાલનળકાંડા પ્રયોગોમાં સંતયાલજ અને પછી નેમિમુનિ આગળ આવ્યા તેમ કૈન સાધુઓએ સહૃથી પ્રથમ આ પ્રયોગોમાં પણ આગળ આવવું જોઈએ.

**પૂ. નેમિમુનિ :** “જરૂર આગળ આવશે. પણ તે કાંતિપ્રિય સાધુઓ સાથે સુસંસ્થાનું તેમ જ જનતાના સંગઠનનું બળ અને બધા ક્ષેત્રોની સુસંસ્થાનો અનુંધં હોવે. જોઈએ; નહીંતર એકલ હોમાર્દ જય અને કાંઈ પણ અર્થ ન સરે.”

**શ્રી. માટલિયા :** “પરદેશમાં પણ અનુંધં જોડાવાની શક્યતા જાળી થઈ છે. કેટલાક શાંતિવાહીઓએ અપીલ કરી છે. યુનેસ્કોની શક્તિ વધે અને વિશ્વવ્યાપી આંદોલન થાય તેવું લાગે છે. આંતરરાષ્ટ્રીય શાંતિસેના ધર્મા પ્રભાવ પાડી શકે. કાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ. આ દિશામાં પહેલ કરે તો તેઓ પોતાની ઉપરોગિતા ધર્મા સહિય રીતે સિદ્ધ કરી શકશે અને સામુદ્દાયિક અહિસાના પ્રયોગો વડે અહિસક સમાજનું નિર્માણ કરી શકશે.

(તા. ૧૮-૮-૬૧)

## સામુદ્દર્યિક અહિંસા - પ્રયોગના મુદ્દાઓ

ક્રોધપણ કાય કરતી વખતે તેની સંપૂર્ણ વિચારણા ન થાય; તેની ભૂમિકા અને તેના મુદ્દાઓ ન વિચારવામાં આવે તો તેમાં પાછા પડવાનું થાય. એટલે જ અહિંસાના પ્રયોગ અંગે અનુભંગ વિચારને અપનાવવાનું કહેવામાં આવે છે. રાજ્યસંસ્થા, લોકસંસ્થા, લોકસેવકસંસ્થા અને સાધુસંસ્થાનો વિચાર નહીં કરીએ તો પ્રયોગ એકાગ્રી અનશે અને તે કાયમની અમર નહીં ઉપાવે. ચારે બાજુ વ્યવસ્થિત કામ નહીં થાય તો ક્યાંક હિસા આગળ મયક મૂકવી પડશે કે આદર્શ-સિદ્ધાંતને પડતા મૂકીને કામ કરવું પડશે. ૧૯૫૬ માં શાંતિ-હુક્મનો ને પ્રયોગ અમદાવાદમાં સક્રાન્ત થયો હનો. તે જ પ્રયોગ ૧૯૫૮ માં અધૂરો રહ્યો તેના કારણે બધાને કેઠવું પણ્ણું. એવી જ રીતે કેંગ્રેસ જેવી બિનડાભી સંસ્થાને કેરલમાં મુસ્લિમલીગ સાથે હાથ મેળવવા પણા. આવી પરિસ્થિતિ ન જાલી થાય, તે અહિંસક પ્રયોગનો હેતુ હોવો જોઈએ. ધણ્યા લોકો માત્ર ટીકા કરવા લાગી જય છે. પણ અમૃક વ્યક્તિ કે સંસ્થા માટે એવી લાયારી આવવી કે સિદ્ધાંતને તિકાંજલિ આપવી પડે - તો તે બધાની શરમ ગણાવી જોઈએ.

આપણે સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગો સમસ્ત વિશ્વમાં કરવાના છે. એટલે તે દર્શિએ તેના મુદ્દાઓ નીચે મુજબ મુકું છું :—

(૧) રાજ્ય સિવાયની ને બેદ્ધામ ઉપદ્રવકારક શક્તિ છે તેને અટકાવવી જોઈએ. આવી શક્તિને ગામડામાં દાંડાઈ અને શહેરમાં ગુડાગીરી કહેવાય છે. તે ગામડામાં રંજા પેદા કરે છે અને શહેરોમાં હુલ્લડો - તોકાનો કરાવે છે. અને આખા દેશમાં ભાંભદોડ આલુ રખાવે છે. રાજ્યના નિયંત્રણ વરની ને કંઈ આ પ્રવૃત્તિઓ છે, તે દાંડાઈ છે. સાખ્યાદ, નાઝીવાદ હે કોમવાદ આવા પ્રકારના છે. પોલિસને કદાચ

એવી ગુંડગિરીને દ્યાવવાં માટે હિંસા વાપરવી પડતી હશે. પણ આ તર્ફે તો નિર્દેષ - લોકોના જન - માલને તુકશાન પહોંચાડે છે. મુંબઈ, મદાસ, અમદાવાદ વગેરે સ્થળે આ લોકોના, શાંતિ - સરધસના નામે જે જોહુકુમી ચાલે છે તે ભયાનક છે. એટલે જ વિનાભાજુને કહેવું પણું કે પ્રજાના પત્થરમારા કરતાં પોલિસની ગોળા અહિંસાની વધારે નજીક છે.

અહો એક બીજુ બાંજુ પણ વિચારવાની છે. આજાદીની લડત વખતે લોકોએ પાઠા ઉઘેડવા વગેરનાં કાર્યો કર્યાં - શું તે વ્યાજખી છે ? આ અંગે આપણે જોઈ ગયા છીએ કે ગુલાભી કરતાં તો એ ઉચિત છે પણ આવાં કાર્યો માટે દરેકને શોષણું ન પડે તે માટે મુખ્ય માણુસે એકરાર કરી તેની જે સંજ થાય તે બોગળી કેવી જોઈએ. જે આવા પ્રકારનાં તોઝનો અને હુલ્લડોને ગૃહેત રાખવામાં આવે તો તેમાંથી કાયમી અનથંની પરંપરા ચાલે છે. રાજ્યસત્તાની સામે થવું સમજાય છે પણ તે માટે દ્યો કરવો, જૂડાણાં કરવાં, તે બરાબર નથી. તોઝનોને વેગ ન મળવો જોઈએ. દાંડાધ લલેથોડા માણુસો કરતાં હોય છે પણ તેમની સાંકળ હોય છે. એટલે એમનાં જૂડાણાં અને તોઝનોને અટકાવવાં જોઈએ. અટકાવવાની પ્રક્રિયા શરૂ કરીએ એટલે અનુંબંધ વિચારનો જ્યાલ તરત આવે; સાથે જ ડાંગેસનો પણ વિચાર આવે.

અનિચ્છનીય પ્રવૃત્તિઓને ક્રયા ક્રયા પક્ષો ટેકો આપે છે તે ઊડાણુથી ચિચારતાં જણુાધ આવશે. રાજ્યા સ્વતંત્ર પક્ષનું ઉદ્ધારન કરે અને જ્યાપ્રકાશજીને જરૂરું પડે તેનું કારણ શું ? સ્વતંત્ર પક્ષને ભૂતપૂર્વ રાજ્યાનો ટેકો અને સમાજવાદી વિચારસરણી સાથે કર્યાં મેળ આય છે ? ભાષાના પ્રશ્ન અંગે પંજાખી સૂચા માટે ઉપવાસો થાય, પછી લોકો બેગા થાય, પોલિસ અટકાવે તો તોઝન કરે. ત્યાં અશોક મહેતા અને ગોરે જેવા જઈને ભલે તે શું સ્વચ્છવે

સંક્ષાંત વગરની પાર્ટીઓના આવા શાંકુમેળાથી અયોગ્ય અને દાંડ તરવેનો રસ્તો મોકળો થઈ જાય છે. એટલે જેમ આ દાંડાધ

કરતાં તત્ત્વો અને શસ્ત્રોને ભ્યાન કરવા પડશે, તેમ આવાં પદ્ધોને પણ ભ્યાન કરવાં પડશે. માત્ર સરકારની ટીકા કર્યા કરીએ અને આવા તત્ત્વોને છુટાં ફરવાં દઈએ તો હિંસાને વેગ ભળો જરો. એવા પદ્ધોથી દૂર રહેવું પડશે, જે આવા તોક્ષાની તત્ત્વોને હાથા અનાવીને ફરતા હોય. સરકાર ઉપર ગોળીખાર-લાડીમાર કરવાની ફરજ ન આવી પડે તે માટે આવાં પદ્ધોને પણ ભ્યાન કરવા પડશે.

આજે રાજકીય પક્ષોનો ટેકા પામી દાંડતત્ત્વો એટલું બધું જોર કરીને બેઠા છે કે ગામડામાં તમો નવો વિચાર કે કાર્યક્રમ ભૂકો તો તરત તેઓ આડા આવે છે. એ લોકો સામ્યવાદી ભાંગડોડ નીતિને જ આગળ લાવે છે. એટલે દાંડાઈ જેમ સામ્યવાદ પણ ન પાંગરે એ જોવું રહ્યું.

એવું જ કોમવાદું છે. ગાંધીજીની પ્રાર્થનામાં જવાના બહાને તેમને ગોળીખાર કરીને એના એક પ્રતિનિધિએ મારી નાખ્યા. આ માટે પણ એક સંરક્ષણ-શાંતિ-દળ જિલ્લા કરવું જોઈએ. દાંડાઈ, રંઝડ કે ઉપરવ કાઈપણું નામે નિયંત્રણુમાં રહેવાં જોઈએ. આવાં તત્ત્વો રાજ્ય શક્તિથી બળવાન થાય એમાં રાજ્ય સાથે પ્રજને પણ વધારે શોષવાનું રહે છે.

( ૨ ) ખીને મુદ્રો એ છે કે રાજ્યને શર્ખો કેમ ઓછાં વાપરવાં પડે. તેની લિસા ઓછી કેમ થાય તેવા પ્રયત્નો કરવા જાઈએ. એ માટે પ્રજને જાતે જ તૈયાર થવું જોઈએ. પોલિસ પહેંચે તે પહેલાં જો અહિસક દળ પહેંચી જાય તો દંડ અચુકી જાય. એ માટે લોકોએ હથિયાર પકડવાની જરૂર નથી પણ પોતાની નૈતિક શક્તિ જગ્માડવાની જરૂર છે.

અહિસાની દિલ્લામાં રાજ્ય ત્યારે આગળ વધી શકે જ્યારે પ્રજને એની અવેજીનું કામ ઉપાડી લે. એકવાર પાકિસ્તાનની સરહદમાંથી કચ્છની સરહદે ઢોરચોરી ખૂબ થતી. લશકરની ચોકી છતો આ કાર્ય ઘટતું નહીં. એટલે એક કાર્યક્રમ ખડીર-ખાખડીના વિસ્તારમાં ખેડૂત

મંડળ સ્થાપણું પરિસ્થિતિ એવી હતી કે અહીં રહેનાર અને પાકિસ્તાનમાં રહેનાર બધા સગાસંખંધીઓ હતા. અહીંના લોકોએ નક્કી કુશું કે અમે તમારાં ઢોર અહીં સંધરશું નહીં તે છતાં એક માણુસ કેટલાંક ઢોર ચોરી લાવ્યો. એટલે અહીંના લોકોએ પકડ્યો, તેનાં ઢોર બાંધી લીધાં. તેને સમજાવ્યો કે “ અહીંના ઢોર ત્યાં ચોરી જય કે ત્યાંના ઢોર અહીં આવે તે ધણું ખરાબ કહેવાય. અમારે તેને પોલિસમાં નથી આપવો પણું આ કામ અટકાવવું છે. ” પેદો માણુસ સમજુ ગયો.

લોકોનાં સંગઠનો કેટલાં વધારે બળવાન થઈને રાજ્ય પાસેથી શિક્ષણું, સંરક્ષણું, આરોગ્ય વ. પ્રશ્નો ઉપાડી લે તો સરકારનું ધણું કામ એાણું થઈ જય. એ વ્યવસ્થા સુચારુ ચાલે અને લોકમાનસ જગૃત હોય તો ધરાંગણેના પ્રશ્નો તેઓ જ પતાવે અને પોલિસને હિંસા કરવાનો એછો વખત આવે.

પણું, થોડા ધણું શાંત્વો કે સૈન્ય તો રાખવું જ પડે; કારણું કે જ્યારે આખા વિશ્વમાં જસુસી ચાલતી હોય ચીન, રશિયા, પાકિસ્તાન અમેરિકા વગેરે જસુસી કરે ત્યારે ભારત કહે કે અમારે કંઈ કરવું નથી તો રાજ્યને કહિ લારે હાનિ થવાનો સંભવ રહે છે.

( ૩ ) શાંત્વો એછાં રખાવવા માટે એક પ્રયત્ન ભીજે પણું થવે. ધરે. તે એક વિશ્વના દરેક દેશોને યુનોમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. કેમ ધર આંગણે અહિસાના પ્રચાર માટે કોંગ્રેસને સશક્ત બનાવવી જરૂરી છે તેમ વિશ્વના પ્રશ્નો અંગે ‘ યુનો ’ને સહીય બનાવવું જોઈએ, એટલે જ ચીનને યુનોમાં લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે તેથી કંઈક નિયંત્રણ તો રહેશે જ. ત્યાં કંઈને કંઈ જવાબ તો આપવો પડે ને? માણુસ એકલો ગમે તેમ બોલે પણું, પાંચ માણુસની રૂખરું બોલાવો તો તેને શેહશરમ આવશે. એટલે શાંત્વ-સંન્યાસ માટે વિશ્વવ્યાપી આંદોલન ભલું કરવું જોઈએ-તે માટે યુનોને તૈયાર કરવું જોઈએ. એ રીતે સમાજને અહિસાની દિશામાં આગળ વધારવો પડશે.

(૪) શાસ્ત્ર-સંન્યાસની સાથે અણુઅમ અને તેના પ્રયોગો ઉપર પ્રતિષ્ઠાંખ મૂકાવો જોઈએ. આજે રસ્તિયા અને અમેરિકા બનનેને એક ધીળ ઉપર વિશ્વાસ નથી અને વાત ગુંચવાય છે તેમજ છુપા પ્રયોગો ચાહ્યા કરે છે. આજે અદાર દેશો પાસે અણુઅમો છે-પછી એની વિનાશક શક્તિના પ્રયોગો કરતાં; લોકોની સજ્ઞનાત્મક શક્તિમાં તેનો ઉપયોગ થાય તો ડેટલું શોષણું અણુકી જાય અને જગત શાંતિથી રહી શકે.

એમ ન થાય તો જગતમાં તોકાનો, હુલ્લડો ન અટકે તો ભાર્યાંથી લેલા થાય, લશ્કરી રાજ્ય આવે અને અહિસાની વાત એકડારે રહી જાય. એ માટે વિશ્વનું પણ અહિસાની દિશામાં ઘડતર થાંનું જરૂરી છે. તે માટેનો પ્રારંભ તો વ્યક્તિગત અહિસામાં લોકો આગળ વધે તેમાં રહેલો છે.

આપણે આ સુદ્ધારોના સંદર્ભમાં થોડું વધારે વિચરિયાં. સર્વ પ્રથમ આપણે રાજ્યને અહિસાની ઘનાવાં છે તો જે જે વાહો કે રાજકીય પદ્ધો તોકાન મચાવે છે; કાનૂનાંગતી પ્રક્રિયા જિલ્લા કરે છે તેનો જીણુંનથી વિચાર કરવો પડશે અને એવા રાજ્યનીતિક પક્ષોને જ્યાન કરવાં પડશે.

એ માટે ધર્મિવાર થોડી હિંસા ક્ષમ્ય ગણુામ પણ એજ માર્ગ રૂપે તો ખલિદાન. શુદ્ધિપ્રયોગનો વધારેને વધારે પ્રચાર કરવો. પડશે. મનુષેનાની છેડતી ગુંડાએ કરી અને તેણે ચંપલ મારી; બાપુએ તેને કંણું કે ઢીક કંયું એ જ તારે માટે તે વખતે અહિસાની રસ્તો હતો. પણ ખલિદાનનો રસ્તો એથીયે એજ છે.

“ઘોળકામાં તોકાનીઓએ એક ભાઈની ટોપી ઉપાડી લાધી. તે ભાઈ રસ્તા વર્ચ્યે જ બેસી ગયા અને ઉપવાસ ઉપર જિતરીને પ્રાર્થના કરવા લાગ્યા. લોકોમાં ખળખળાટ થયો અને તરત તેમની ટોપી પાછી મળ્યા.

૧૯૫૮ માં અમદાવાદમાં તોઢાનો થયાં. ત્યારે કુરેશીભાઈએ આઠ ઉપવાસ કર્યા. લોકો આવ્યા-તોઢાનવાળા પણ આવ્યા અને મામદે શાંત થયો. આમ જે કરવામાં આવે તો અહિંસાની સામાજિક પ્રતિષ્ઠા વધતી જાય.

હમણું રહ્યા ડેલેજમાં ગયા હતા. ત્યાં વિદ્ધાર્થીએને લદકરની તાલીમ અપાતી હતી. તે એટલા માટે કે તોઢાનો વખતે ઉપયોગી થાય. આનો આડકતરો અર્થ સામુદ્દરિક હિંસાનું પ્રશિક્ષણ થયું। લોકોમાં આવા પ્રસંગો માટે સામુદ્દરિક અહિંસાની તાલીમ મળે તો જ શાંતિથી પતાવટ થાય.

કારણું કે, હિંસા હિંસાને અટકાવી શકતી નથી. એક જગ્યાએ ખૂન થયું. સામે બીજાનું ખૂન થયું. ખુનસ વધતું ચાલ્યું. એટલે ત્યાંના એક સાધુ-પુરુષે ઉપવાસ આદર્યા. જામવાળાએ પૂછ્યું કે બાપજી શું કામ! બાપજી કર્દી ન એલ્યા. પણ, જામવાળા સમજ જયા. દરમ્યાન આ પ્રશ્ન ઘેરૂત-મંડળ પાસે આવ્યો અને બન્ને પક્ષકારોને સમાધાન થઈ ગયું.

એક ભાણુસ તલવાર લઈને ફરતો હતો. તેની જમીન લીંબડી રાજ્યે ખાલસા કરી હતી અને એક ઘેરૂતને વહેંચી આપી હતી. હવે તે પેલા ઘેરૂત પાસે ગયો અને તેને કહ્યું કે “કાં’તો મને રોટલો આખ, કાં જમીન આપ; નહીંતર હું તારું ખૂન કરી નાખીશ !”

હવે શું કરવું. સરકાર કાયદેસર થાય તે કરી શકે. ત્યાંસુધી તો પેલો કંઈકનું કંઈક કરી બેસે. ઘેરૂતે લા. ન. પ્રયોગના એક કાર્યકરને વાત કરી. તેણે પેલાને સમજનીને કહ્યું કે પહેલા હથિયાર હેઠાં મૂક, પછી વાટાધાટ થાય. તેણે તલવાર હેઠી મૂકી અને બન્ને પક્ષને સમજવતાં હિંસા થતાં અટકી.

આમ વ્યક્તિ પાસે તો શસ્ત્ર ન રહે; પણ રાજ્યને એછાં વાપરવાં પડે તે માટે ધરતું કરવું જોઈએ. એ માટે સામાજિક

જ્ઞમિકા સાંકે કરવી જોઈએ અને શુદ્ધ ન્યાયની જળવણી કરવી જોઈએ. સમાજને રાજગારી મળે અને ન્યાયપૂર્વકની સલામતી મળે, એ ખાસ જોવું જોઈએ. બધી બાબતોમાં એક જતની સતત કાળજ રાખવી જોઈએ કે ટેંગાઈને ટેકા ન મળી જય. ટેંગાઈ કરનાર જાણે છે કે પોદળો પડશે તો ચખી ધૂળ લઈને આવશે જ. એટલે થાડું તો મળશે જ ! આ તત્ત્વ એટલું બધું વ્યાપેલું છે કે ગોરે, ડાંગે, જોશી, અસોાક મહેતા, જ્યગ્રકાશ વગેરે સારી નિષ્ઠાવાળા નેતાઓ; વ્યક્તિ તરીકે સારા હોવા જ્ઞાનાં-આવા અનિષ્ટાને ટેકા આપી હો છે. તેની પાછળ સતત લાલસા જ કારણુભૂત રહે છે. તો આ બધું દૂર કરવા માટે સામુદ્દરિક અહિસાના પ્રયોગો કરવાના છે.



## ચર્ચા - વિચારણા

શ્રી. માટલિયાએ ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : “ આર્થિક, સામાજિક, નૈતિક, જ્ઞાનિક અને રાજકીય-આ બધાંય ક્ષેત્રોમાંથી અનિષ્ટાને દૂર કરાવવાઃ સમાજ દારા આવા પ્રયોગો સંસ્થાકીય સંગठન ઇથે કરવા-કરાવવા પડશે. આધીજીએ એક ચીલો તો પાડયો જ છે. તેમણે અધિકારો સામે અહિસક પ્રતિકાર પણ કર્યો અને મદ્દ પણ કરી.

સર્વ પ્રયત્ન (૧) સમજવટનો માર્ગ છે; પણ તેમાં (૧) જનતાની ધીરજ ન ખૂટે તે જોવું જોઈશે. (૨) સમજવટ્યી ન સુધરે તાં જાહેરાત કરવી પડશે. આમાં સામાની નિદાનો ભાવ રહે છે પણ જગૃત રહીને તે કામ કરવું રહ્યું; નહીં તો એવી વ્યક્તિ કે સંસ્થા સમાજમાં અમ જિબો કરીને પ્રતિષ્ઠા જળવી રાખી અનર્થ વધારે છે. તેથી સારા ભાષ્યસોમાંથી સમાજની શક્કા ઉગવાનો પણ લય રહે છે. એટલે જેમ મિઠાઈ બનાવનાર ચાસણી તપાસે છે તેમ દરેક સમયે

સમાજની નાડ જેતાં જેતાં તપાસણી કરતા રહેવી પડશે; નહીં તો ચાસણી ચીવડ બની જતાં, સમાયેલું ધી પણ પાછું બહાર નીકળી જય, તેમ સમાજની અંદર પચેલાં સદગુણો પણ બહાર નીકળી જવાનો જય જિલ્લો થાય છે. તેમ ધણીવાર જહેરાત પછી વ્યક્તિ કે સંસ્થા નહોર બને. મોટા ભાગે રાષ્ટ્રીય સંસ્થા કે સંસ્થાના અગ્રગણ્ય ગણ્યાતાં માણુસો આવું કરવાના. ખિટિશ લોકો સામે સામાજિક દ્યાણ જહેરાતના કારણે આવવા માંઝું કે તંત્ર કહોર બનવા લાગ્યું. એવા સમયે ત્રીજું પગલું (૩) અસહૃકારનું આવીને ઉલ્લં રહેવું જોઈએ. જેમકે બાપુજી ખિટિશ હરખારી મેળાવડામાં ન ગયા. તેમને મળનારો ચાંદ પાછો મોકલાવ્યો. ટાગોરે પણ “માનપત્ર” પાછું મોકલ્યું. આથી પણ ન સરે તો ચોથું પગલું (૪) અહિંકારનું આવે છે. પરહેશી માલનો અહિંકાર આને લીધે આવી પડયો. જેના ઉપર ખિટન મુસ્તાક હતું તે પાયો વૃદ્ધી પડયો. આમ અનિષ્ટાનો પાયો તૂટી પડવો. જોઈએ. અઃ પછી (૫) પ્રતિકાર આવીને રહે છે. અહિંસક પ્રતિકારમાં પોતાની જત ઉપર કાયાકલેશથા મારીને સામુદ્દર્યિક તપ આવે છે. ગાંધીજીએ આ રીતે જાતથી મારીને સમુદ્દ્રય આખાને ઉપવાસ કરવાની હાકલ કરી હતી. તે છતાં પણ ન થાય તો (૬) આત્મસમર્પણું કરવું જોઈએ. બાપુએ જેકાસ્લોવેક્ઝાને કહ્યું હતું કે આકુમણુનો મુકાબલે હથિયારથી કરશો તો તેને હું અહિંસા લેખીશ. પણ જે જતને હોમશો તો અહિંસાનો ઉમદા પાઈ જગતને મળશે. જ્યાં તન ન પહોંચી શકે ત્યાં પ્રાણુપર્ણ તો પહોંચી જ શકે છે.

સન ૧૯૫૮ માં ડેટલાકે ટીકા કરી : “આ વખતે અમદાવાદ જઈ હોમાવાનું મૂકી માત્ર એક બાજુ ઉપવાસો કરવા તે કેવું ? ”

પણ, આપણે કલકત્તા ખાતે જેથું કે સુહરાવર્દીના પ્રયોગો સહજ ન થતા; બાપુએ જેમ ત્યાં આમરણ્યાંત ઉપવાસ કરેલા તેમ દિલ્હીમાં પણ કર્યા હતા. બાપુ વિશ્વવ્યાપી વ્યક્તિ હોઈને તેમનાં શરતી

અનજનો આખા જગતના પ્રાણુને જગૃત કરતાં, તે છતાં તેઓ સાથી અને કેંગ્રેસને સાથે લઈ લેતા. તે ઉપરાંત અહો ખૂબ જગૃતિની જરૂર છે.

આંધ્ર માટે રામુલુના ઉપવાસોએ અને તેના મરણે લોડામાં હિસા પ્રગટાવી હતી. તેમના ઉપવાસો શુદ્ધ છતાં ઉદેશ્ય સાંકડો હતો. તેના પરિણામો પ્રત્યાધાતો આજે જોવા મળે છે. માસ્તર તારાસિંગના ઉપવાસો, નાગાપ્રદેશના તોષનો આવી જગૃતિના અભાવનાં પરિણામો છે.

સહભાગ્યે ભા. ન. કાંડા વગેરે પ્રદેશમાં ગામડાનો (રચનાત્મક કાર્યકરોની સંસ્થા) પ્રાયોગિક સંધ તેમજ અહીંના શહેરમાં વિશાળ હેતુએ વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ રચાઈ ગયો છે. તેણે અત્યાર સુધી અનેક પ્રભોમાં પૂ. મહારાજશ્રીની દોરવણીથી, નાની ઉમર છતાં, માર્ગદર્શક ઠરાવો-પ્રયોગો અને કાર્યાથી માર્ગદર્શન મળ્યું છે.

ઉપરનાં (૧) સમજનવટ-વાટાધાર, (૨) જાહેરાત, (૩) અસહકાર, (૪) બદિષ્કાર, (૫) પ્રતિકાર અને (૬) આતમ સમર્પણ એ છુએ પગલાં ભરતી વખતે ખૂબજ સાવચેતી રાખવાની જરૂર છે.

**શ્રી. હેબળુભાઈ :** “કંઈ પ્રાયોગિક સંધતી નૈતિક દોરવણી તળે સામુદ્દરિક અદિસાના પ્રયોગ ભયાડ ખેડૂત મંડળે કર્યા છે. તેમાં પણ કરમરિયા ગામમાં સુમરા અને સામેના આગેવાનોની તાણુાતાણીમાં ગામને થતી હેરાનગતિમાંથા ગામને બચાવવું અને પક્ષોનું સમાધાન કરવું; એ તેની સફળતા ગણ્યી શકાય. તેથી સામાન્ય અને દ્યાયેલી પ્રણ પણ જગૃત થઈ. તાજ આમ પંચાયતની ચૂંણીમાં વિકાસ અધિકારી વગેરે અમલદારોએ તેથીજ ખેડૂત મંડળની સહાય માંગી હતી.”

**શ્રી. પૂંજાભાઈ :** “ગામડાંઓમાં વાડાઅંધી અને દાંડ જૂથનું જોર હોય છે. આમ પ્રજાની એકતા અને સહકાર માણસો આગળ ન

આવે તો તે જૂથે પોતે ટોપાપણું લઈ, ચોરીએ પોતેજ કરાવે છે. એટલે નીચલા થરેથી સાચા ન્યાયનું અને એકતાનું કામ વિશ્વાળ દર્શિથી શરીર થવું જોઈએ. તો શિક્ષક, અમલદાર, દાંડ અને ભૂડીવાઢી વગેરે બધા સીધા થશો.”

**શ્રી. ઘળવંતભાઈ :** “માટલિયાએ ગયા વખતે લાંચ અને દાંડ તરવે. સામે જે એ કાર્યક્રમો ભૂકેલા તેનાથી બણ્ણું કામ થઈ જાય. ડાંગેસનું સ્વેચ્છાએ ગામડાંએએ રાજકીય માતૃત્વ સ્વીકાર્યું છે; એટલે ડાંગેસી આવરણું લાંબો વખત આ કામમાં આંદું નહીં આવે.”

**પ્રો. સુનિશ્ચી સંતખાલાજી :** “આપણે સાત સ્પેતાહ વીતાવ્યાં. હજુ દરેક થશો. ત્યાં લગી કાર્યક્રમો નિશ્ચિત નહીં થાય. આપણે સમગ્ર જગતના પ્રશ્નોમાં કથા અગત્યના છે? આજે રાજકીય પક્ષો ઇપી અનિષ્ટાને દૂર શી રીતે કરવાં પડશે વગેરે પ્રથમ વિચારનું પડશે. સામેથી આવી પડેલ કોઈ પ્રશ્નને નહીં છોડાય; પણ સામેથી લેવાનો પ્રશ્ન હેઠળ તો લાંબું અને ઊંડું વિચારનું પડશે.

( તા. ૨૫-૮-૬૧ )



## વ्यक्तिगत અહિંસા અને સામુદ્દરિક અહિંસા

સામુદ્દરિક અહિંસાના પ્રયોગો અંગે લોકોમાં જોઈએ તેવો ઉત્સાહ ધર્ષીવાર દેખાતો નથી. અહિંસામાં સૌ માને છે. શાંતિની પણ વાતો કરે છે પણ તે અધું વ્યક્તિગત થઈ શકે, એવું બધા માને છે અને સામુદ્દરિક અહિંસા પાળી શકાતી નથી એમ કહીને એ પ્રશ્ન ઉપર મંદ્તા નાખવામાં આવે છે.

જો અહિંસા વ્યક્તિગત પાળવાની હોત તો સાધુસંસ્થાની જરૂર ન હતી. પણ વ્યક્તિગત અહિંસાનું આચરણ જો વ્યક્તિના જીવનને ઉન્નત કરી શકે તો સમૂહગત અહિંસા સમૂહને ઉન્નત કરી શકે! એ રીતે વ્યક્તિગત અહિંસાને વિચાર સમૂહગત થયો અને વ્યક્તિગત અહિંસાને સામુદ્દરિક ઇપ શી રીતે આપવું? વ્યક્તિગત અને સામુદ્દરિક અહિંસાનો તાળો મેળવવો શી રીતે! એમાંથી સાધુસંસ્થાની ઉપરોગિતા આવી ને ભાબી રહે છે.

આખો સંસાર કહિ સુધરવાનો નથી. સંસાર અનાદિ-અનંત છે. પણ એક વાત યાદ રાખવાની છે કે આખો સંસાર ભલે શુદ્ધ ન થાય પણ તેમાં પ્રતિષ્ઠા તો સદગુણોની જ હોવી જોઈએ. નહીંતર વ્યક્તિગત અહિંસા પણ, સામુદ્દરિક અહિંસા ઉપર આંખમીચામણું કરવાથી ઢીલી પડી જાય છે.

જેનો અહિંસામાં આગળ હોવાના કારણે તેમના ધાર્મિક પવં પર્યુંધર્ષનું ધર્ષું મહત્ત્વ છે. આજે જોવા જરૂરું તો જામડાથી લઈને જહેરમાં, આ દિવસોમાં ફંડ્ઝાળા થશે. તે વખતે વિચારાશે કે સામુદ્દરિક અહિંસાનું પહેલું પગલું થિયાં? તો ફસાઈખાનાં—ખાટકીવાડા કેમ બંધ થાય તે માટે ગતિ વિધિ થશે. ખીજુ વાત ઇપે આ શરીરને ઓછામાં ઓછું નાનું ગૌણું કેમ કરવું તેવી તાતીમ લેવી કે ઓછામાં ઓછી

વરતુથી કેમ ચલાવાય? ત્રોજે મધ્યમ માર્ગ એ છે કે ઓછી ચીજેથી ચલાવવું. આયંબિલ કરવાં, ઉચ્ચાદરી કરવી કે એવો ઘારાક લેવો જેમાં સ્થળ હિંસા ઓછોમાં ઓછી હોય. તે નિમિત્તે કંદમૂળ લીલોતરીને તાગ કરે. કેટલાક તો ધણી ઓછી ચીજે (પદાર્થો) વડે ચલાવે. આ બધું જે કે વ્યક્તિગત થાય છે તે છતાં સામુદ્દરિક અહિંસા સૌને ગમે છે. એટલેજ સહુ સામુદ્દરિયમાં ભેગા થાય છે. ત્યાં ફાળો એકત્ર કરે છે. અહિંસાનો વિચાર કરે છે.

જેવા જર્ખાએ તો આ પણ સામુદ્દરિક અહિંસાનો પ્રયોગ છે; પણ તે એક નાના સરખા વર્તુલનો બની જય છે. તેની ઈતિર સમાજ ઉપર જે છાપ પડવી જેઠાએ તે પડતી નથી. તેની પાછળ યોગ્ય અનુયંધ અન્ય સંસ્થાનો ન હોઈને તે સાંકડી પ્રવૃત્તિ ઇન્ફેજ રહી જવા પામે છે.

ધણીવાર એના કારણે લોકોમાં જીધે પ્રચાર પણ થાય છે. એક બાજુ જૈનો લીલોતરી તરે કે બીજી ધર્મના લોકો સમજે કે હવે શાક સસ્તું મળશે. તેચો બમણું ખરીદતા—આતા થાય છે. ગામડાંમાં પણ ધણું દિવસોમાં નહાવા—ધોવાનું જૈનો બંધ રાખે છે. ત્યારે ઈતિર પ્રગન ધરનો કચરો સાઝુ કરવા માટે બહાર કાઢે છે. વાધરી—કોળી વગેરે કેટલીક કામો ધેટાં—બકરાં લઈને જૈનાની પોળમાંથી નીછે. જૈનો પ્રષ્ઠે! “કુદાં જાવ છો!”

તો કહે કે “શું કરીએ? ખાવાનું નથી એટલે કસાઈને ત્યાં વેચવા જર્ખાએ છીએ!” જૈનો દ્વાય ખાઈને પૈસા આપી તેને છોડાવે છે. પણ, તેચો બીજુ પોળમાં જર્ખાને એજ કામ કરે છે. આમ એ પણ વ્યવસ્થિત ધંધો બની જય છે.

એટલે જે વ્યક્તિગત અને સામુદ્દરિક અહિંસાની સમતુલા ન જળવાય તો આમ જ બને. પછેડી નાની હોય તો એક બાજુ ઓઢો તો બીજે ઉધાડી થાય, એટલે કે માત્ર વ્યક્તિગત કામ કરે. તો સામાજિક છુંટું થાય. આજની આવી પરિસ્થિતિનું કારણું એક જ કે આપણે એકલપેટા થતા જર્ખ રહ્યા છીએ.

મને યાદ છે કે અમારી ગામડાંમાં પર્યાષણ આવે એટલે જૈન-અજૈન દરેકને આનંદ થાય, બધા ભેગા મળીને અનુભવે કે કેનોનાં પર્યાષણ આવે છે. બધા દિવસો અહિસા ન પાળી શકાય પણ આ દિવસે તો પાળવી જ જોઈએ. ખાટકીએ ચેતાનો ધંધો બધ કરે; માધીમારે માધી ન પકડે અને બધા માંસાહારથી દૂર રહે. તે વખતે મોટા લોકો વિચાર કરે કે ખાટકી, માધીમાર જેવા ધંધો બધ કરે ત્યારે તેને ચેટા ધંધો આપવો અથવા તેની આજુવિકાની ચિંતા કરવી એ આપણી પવિત્ર ઝરણ છે. તેએ એમને અનાજ વગેરે પહોંચતું કરે. આ બધો વિચાર ગામનું મહાજન કરે તેમાં માત્ર વાણિયા નથી, પણ અહિસા અંગે વિચાર કરનાર અખે જન સમૃદ્ધાય આવી જાય.

આજે સિથિત બુદ્ધી છે એક બાજુ અહિસાનો વિચાર થાય છે; ત્યારે ભીજુ બાજુ શેખણ રૂપે, વ્યાજ રૂપે અને અન્યાય-અનીતિ રૂપે થતી હિસાનો વિચાર તજ દેવાય છે. એટલે તાણો મળતો નથી, મારે જ્ઞાન બહુ વિચાર કરીને આગળ વધવાતું છે.

ઓરડીમાં એક ટાંગાવાળાનો બની ગયેલ પ્રસંગ છે. પર્યુર્ષણના દિવસો હતા. તેણે શેઠ પાસે બસો રૂપિયા વ્યાજ લીધા કે જેથા ટાંગો રીપેર કરાવીને ચલાવી શકાય. પણ ટાંગાની આવક કરતાં વ્યાજની જાવક વધી ગઈ, પરિણામ એ આવ્યું કે ટાંગાવાળાને વિચાર કરવો પડ્યો કે ધંધો ચાલતો નથી. ટાંગામાંથી વ્યાજ અને ખાવાનું પણ મળતું નથી. તેણે શેઠ પાસે જઈને વિનંતિ કરી કે ‘હું તમરા રૂપિયા આપવાનો છું પણ હમણું મારા પર દ્વારા રાખજો. પણ શેડ કહું લેવડટેવડમાં દ્વારા શેની? દ્વારા તો ધર્મસ્થાનકમાં થાય છે! જો રૂપિયા આ મહિનામાં નહિ આપ્યા તો તારું ધર લીલામ કરાવી દઈશ.’ ટાંગાવાળાએ શેઠને બહુ વિનબ્યા અને દ્વારા કરવાતું કહું પણ શેઠ એકના એ ન થયા. છેવટે તેણે એક ખાટકી સાથે લાગ રાખવાનો વિચાર કર્યો. તે શેઠ પાસે ગયો અને કહું। સો રૂપિયા આપો હું કસાઈના ધંધાની લાગીદારીમાં છામ કરીથ, ટાંગો પણ ચલાવીશ.

શેડ વિચાર કરે છે કે “ખાટકીખાના તો ચાલશે જ મારા એકલાથી બંધ થવાના નથી. કરશે તે ભરશે! એટલે કહે છે કે” લઘ જ! પણ રોજનો એક રિપિયો નવાં વ્યાજ તરીકે અને જૂતું વ્યાજ તો ચાલુ જ!

તેમની પત્નીએ આ વાત સાંભળીને કહ્યું : “આજે પર્યુષથુના દિવસો છે. હું રોજ ધર્મકરણી કરેં છું. જીવ માત્રની માઝી માગું છું અને તમે તો હિંસાને સિધો ટકા આપો રહ્યા છો !

શેડ કહ્યું ; “એ તો ધંધાની વાત છે.”

“પણ, તમારે જોડો વિચાર તો કરવો જોઈએ ને ? ” શેડાણીએ કહ્યું કે પેલા રિપિયા ન આપવા જોઈએ પણ શેડ માન્યા નહીં એટલે શેડાણીએ કહ્યું “તમે નહીં ભાનો તો હું મારા ઉપવાસો ચાલુ રાખીશ.

શેડમાં જૈન સંસ્કાર તો હતા જ તેણે કહ્યું : “તો શું કરું ? ”

શેડાણી કહે : “જૂતું વ્યાજ માઝ કરો, નવા સો રિપિયા આપો અને વ્યાજ ઓછું કરો સાથે કહો કે પેલો ખાટકીનો ધંધો ન કરો ! ”

પેલો ખુશ થઈ ગયો. તેણે કહ્યું : “મારે શા માટે હવે ખાટકીનો ધંધો કરવો પડે ? ” તે સારા કામે લાગી ગયો.

આમ જગતમાં અમૃતે જીણુવટથી વિચારવું પડશે. જગતમાં બલે હિંસા ચાલતી રહે આપણે વળી કયાં દૂચા દેવા જશું—આપણે તો આપણું સંભાળતું. આ દર્શિ ખોટી છે. સ્વાર્થ દર્શિ છે. જૈન આવક ખ્રાટે પંદર કર્માદાન કહીને તેવા ધંધા ન કરવાનું સ્વીચ્છયું છે. જો શેડ તે વખતે કદાચ ખસોનું દાન પુણ્ય કર્યું હોત તો સાસુદાયિક અહિંસાનો આચાર ન ફેલાત. બાઈના સંસ્કારે શેઠને થયું કે વધારે વ્યાજ લેવું; તેથી ટાંગાવાળાને થયું કે આવો હિંસક ધંધો મારે ન કરવો. જો આવો ખ્યાલ આવી જાય તો સાસુદાયિક અહિંસા ગર્તિમાન થઈ જાય.

પર્યુષથુના દિવસોમાં જેમ કસાઈખાનાં બંધ કરાવાયાં છે; તેમ જૈનોએ પોતે મીલો—ચક્કીએ—મોટરો વગેરે બંધ રાખવાં જોઈએ; કારણુ

કે પંદર કર્માદિનમાં “ યંત્ર ન ચલાવવાં ” એ પણ છે. પણ તેને કોઈ માન્ય નહીં રાખે – પરિણામે યંત્રના નામે ત્યાં શોષણું તો ચાલુ જ રહેશે. એટલે એ વાતની છાપ ભીજ ઉપર નહીં પડે. એટલે વ્યક્તિગત અહિસાતું એવું છે કે તેમાં અતિ દેખાય છે—કોઈ પગ ચાલે, કોઈ ધોડે ચાલે, કોઈ મોટરમાં એસે—પણ દરેક ગતિ તો કરવી જોઈએને—એવી જ રીતે વ્યક્તિગત અહિસા માત્ર પાળવાથી સામુદ્દરિક અહિસાની ગતિ ઘટકી જરૂરી.

યથા વખતે ચાર મુદ્દાઓ રજૂ કર્યા હતા :— ( ૧ ) રાજ્યની દંડશક્તિ મર્યાદિત કેમ રહે ? ( ૨ ) રાજ્ય અહિસાની દિશામાં આગળ કેમ વધે ? ( ૩ ) સમાજ અહિસાની દિશામાં આગળ કેમ વધે; અને ( ૪ ) વ્યક્તિગત લોકો અહિસામાં કેમ આગળ વધે. આ ચાર વાતો સમજાજ જાય તો સામુદ્દરિક અહિસાના ક્ષેત્રનો વિચાર આવી જાય.

એના અતુઅંધ માટે લોકસંસ્થા, લોકસેવક સંસ્થા, સાધુ સંસ્થા અને રાજ્યસંસ્થા – એમ ચારને લીધી. રાજ્યનું દ્વારા પણ હોય એટલે કે કાયદો ધરાય; અને ધર્મનું દ્વારા હોય — એટલે કે ધર્મ પ્રમાણે આદેશ હોય; તે છતાંથે જો વચ્ચેમાંનું લોકાનું—સમાજનું દ્વારા નહીં હોય તો પણ પ્રશ્ન ઉકેલાશે નહીં. કેટલાંક તત્ત્વો રાજ્યનું માનતા નથી તેમ ધર્મનું પણ માનતા નથી. તેવા માટે મધ્યમ માર્ગ કાઢયો—સમાજનું નૈતિક દ્વારા ઊભું કરવું. એક ડેકાશે આડો થાય છે તે માટે પાપ થાય છે. ભીજ તરફ વધારે ભરતીના કારણે પાપ થાય છે. ટાંગાવાળાને ખાટકીનો ધંધો કરવાની ધ્રમ્યા એટલા માટે થધ કે તે શેઠનું વ્યાજ ભરી શકતો ન હતો. અને જે દફાડે શેઠ ટાંચ લાવવાના હતા. શેઠ શા માટે તેને ઐસા ધીરવા તૈયાર થયા ? તો કલે કે વધારે વ્યાજ મળતું હતું. આમ વધારે ધન માટે આડા ધંધા કરવા પડે અને તેમાં હિસા શરૂ થઈ જાય છે.

કોઈ પણ પ્રક્રિયા શરૂ થાય છે તેનાં કારણો હોય છે. એવું હિસાતું પણ છે. કોઈ માખુસ ઝૂન કરે છે ? તેને ન્યાય મળતો નથી !

ખીજુ તરફ વક્તિલેના, કારણે ખૂની છુટી જય છે. એટલે ડંખ રહી જય છે અને પ્રતિ હિંસા-ખૂનનો બદલો ખૂનથીની પરંપરા ચાલે છે. મીલેમાં વધુ નહેં થાય છે. કામદારોને પુરતું મળતું નથી-પરિણામે હડતાળ પડે છે. તોશાન ઉચ્ચ થાય છે-પાંચ પચ્ચીશ ધવાય છે અને પ્રતિહિંસાની પરંપરા જન્માં લે છે. એક વ્યક્તિ પાસે પુષ્કળ ધન છે. તે વૈભવના પ્રદર્શન માટે કારો રાખે છે, બંગલા રાખે છે, જમણો કરાવે છે, ત્યારે ભીજે અનો જ લાઈ એની પૈસાની મોટાઈ નમે છે; તેને પણ એવા થવાની લાવના જન્મે છે. પરિણામે કાં તો તે સમાજનું શોષણ કરીને આગળ આવે છે; કાં તો પછી શેઠ જેવી વ્યક્તિઓ સાથે દૂષ વૃત્તિ જન્મે છે. આ હિંસાની ચિનગારી છે જે આગળ જતાં ભડકાતું રૂપ પડે છે.

ધર્મસ્થાનકમાં એમની લોકો એમ વિચારે છે કે આપણે પ્રશ્નની પ્રાર્થના કરીએ-દાન-તપ કરીએ-અહિંસા પાળાએ. પણ તેથી નાના ક્ષેત્રમાં અહિંસાનું પાલન થાય, પણ આટલા સમૃદ્ધાયની વ્યક્તિગત અહિંસાનો પ્રથાવ ભીજ ઉપર નથી પડતો. તેતું કારણ એ છે કે વ્યક્તિગત કાર્યોની સીધી કે ઊંધી અસરનો વિચાર કરવામાં આવતો નથી. ઐલા શેઠને હતું કે “મારે તો વ્યાજથી કામ. એ શું ધંધો કરે તેની સાથે મને શું પ્રયોજન!” તેથી સમાજ હિંસા તરફ વધે કે ફાદાગીરી ફેલાય એમ કોઈ વિચારતું નથી. રાજસ્થાન-કંચ્ચ અને અગાઉ સૌરાષ્ટ્રમાં ડેટલાક વાણિયા લોકો ડાકુ-ખફારવટિયાઓની લુંટના માલને (સોનાને) ગાળવાનો અને વેચવાનો ધંધો કરતા. તેમને થતું હશે કે અમારું કામ તો સોનું ગાળવું અને વેચવું છે. પણ જોતે તેની પાછળની ખફારવટિયાઓની ચોરી હિંસા અને રંઝડોની ઘ્યાલ ન કરે તો શું થાય? આ ડાકુ-ખફારવટિયાની પ્રવાતિને ઉતેજન મળી જય!

એટલે સમાજને અહિંસાની રીતે વાળના માટે કોઈ પ્રક્રિયા શરૂ થવી જોઈએ. તેમાંથી શુદ્ધિપ્રયોગની વાત આવી. આવા શુદ્ધિ પ્રયોગાનું ખરું મૂલ્યાંકન સમાજને થાય તેવું વાતાવરણ પેદા કરતું જરૂરી છે. આ શુદ્ધિપ્રયોગમાં એક કે અનેક વ્યક્તિઓ નિઃસ્વાર્થ પણ સહન કરે છે જ્યાં તેને

કેટલું ખંડું સાંભળતું પડે છે તેનો ખ્યાલ થોડી બાબતોથી આવી શકશે. મર્યાદાનું પ્રથમ જેની સામે થવાના હોય છે તે દાંડતત્ત્વેને એમ થશે કે આ લોકો સમાજની શક્તિ દ્વારા અમને ઉધાડા પાડશે. એટલે તેઓ શુદ્ધ પ્રયોગ કરનારને રંઝડરો. રાજ્યને એમ થશે કે આને આ લોકો આમની સામે જ કરે છે; કાલે અમારી સામે કરશે; એટલે તે વિરોધ કરશે. ધાર્મિક લોકો એમ કહેશે કે આ તો રાજકારણ થયું એમાં પડીને આત્માની લિંસા ચા માટે કરો છો? સાથી અને સેવકાને એમ થશે કે જેના માટે શુદ્ધપ્રયોગ કરવામાં આવે છે તે શક્તિ તો વેર-વિષેર પડી છે; વળી સાંધુઓ, વિરોધપક્ષ, રાજ્ય અધા વિરોધ કરે છે તો તેની અસરકારકતા ન થાય ત્યાં સુધી શક્તિ ચા માટે વેડિની? એટલે તેઓ પાસે આવશે નહીં. આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે સામુદ્દરિયક અહિસાનું કાર્ય કેટલું કૃપરું છે?

અમદાવાદમાં ખેડૂતોની ટૂકડીઓ ગઈ; તો લોકાએ કહ્યું કે, “ટૂકડીઓ આવી એટલે તોકાન થયું. ન આવી હોત તો શાંતિ રહેત છે।” પણ ખરી રીતે તો અહિસક માણુસો પ્રાણુપર્ણ કરવા તૈયાર થયા ત્યારે જ ત્યાં શાંતિ આવી; પેલિસો પણ શાંત થયા અને તોકાનીઓ પણ. નેમિમુનિ અને કુંગરશી મુનિ દ્વિલાખીના આંદોલન વખતે ડાંચેસ હાઉસમાં જતા હતા તો લોકાએ રોકવા કે ટોળાં ગુસ્સે થશે. કુરેશીભાઈ ગયા તો કહ્યું કે “તમે જરો નહીં; નહીં તો અપમાન થશે. છતાં જરું હોય તો ટોપી ઉતારીને જાઓ !”

તેમણે કહ્યું : “ટોપી ઉતારીને જાઉ તો ગાંધીજીનું અપમાન થશે !” એટલે ટોપી પહેરીને તેઓ ગયા. અટકી ગયા હોત તો તેમને વ્યક્તિગત રાહત રહેત. પણ પેલા લોકાની તોકાનીષ્ટતિને ટેકા મળી જત. આમ ધર્મી તક્કારી રાખવાની છે.

ધાર્યું પરિણામ ન આવે એટલે કે અસરકારકતા ન આવે ત્યાં સુધી ચૂપ બેઝવાનો અર્થ નથી. આગ લાગે ત્યારે પાણી નાખવું જોઈએ. એખું નાખતા આગ કાણુમાં નહીં આવે, એમ માની બંધ

ન રહેવાય; પણ, અચે તેઠલું બચાવાય. એટલે તોકાનો વર્ષતે કુકડીઓ ગઈ તેમાં કામ એહું થયું પણ તોકાનોનો અસુક અંશ તો કાણુમાં આવી જ ગયો હતો.

ધણુંને એમ થશે કે આ બધા પ્રયોગો કરવામાં આવ્યા તે ભાલ નળકાંડા જેવા નાના પ્રદેશમાં. હજુ આખું હિંદ બાકી છે અને વિશ્વની વાતો કરવાથી શું ફાયદો થાય? પ્રયોગશાળા હમેશાં મોટી ન હોય તેમજ તેનો વિસ્તાર આપા. વિશ્વમાં હોવા જોઈએ, એ જરૂરી નથી. પ્રયોગકારની નજર સામે આખું વિશ્વ હોવું જોઈએ. તેનું હદ્દ્ય તેના રાષ્ટ્રમાં હશે અને તેના પગ તેના કાર્યક્ષેત્રમાં રહેશે. પ્રયોગક્ષેત્ર નાનું હોય છે તેમાં તેના પરિણામો જોતાય છે; અને સફળ થતાં વિશ્વ સામે મૂકવામાં આવે છે. વિશ્વ તેને તપાસે છે અને તેની સહિતાને અપનાવે છે. એટલે અહિંસાના પ્રયોગો લદે ભાલ-નળકાંડા જેવા પ્રદેશમાં સંક્ષેપ રૂપે થયા; પણ તેમાં વિશ્વન્યાપી પરિણામો તો રહેલાં જ છે. ભગવાન મહાવીર અને ઝુદ્ધ ધર્મ-વિહારમાં જ ઉપરેશ આપેલો પણ તેમનો અહિંસાનો સંદેશ આજે જગત્તાં પણ ફેલાયો જ છે.

એનો દૂંડો સાર એ છે કે વ્યક્તિગત અહિંસા ગમે તેઠલી બ્યાપક અને શુદ્ધ હોવા છતાં સામુદ્દરિક બન્યા વગેર તે ઉહેણી બન્ય છે. ટાંગાવાળો અને શેડનો દાખલો એ અંગે નવો પ્રકાશ આપે છે. જે સામુદ્દરિક વિચાર નહીં હોય તો તમારું કુંડાળું ગમે તેઠલું મજબૂત હશે તેને પણ પણ તોડવું જ પડશે. ભાત્ર રાજ્યનો વિચાર નહીં આદે! વ્યક્તિ, સમાજ, રાજ્ય અને સંસ્થાનો વિચાર કરીને નૈતિક દ્વારા ઉભું કરવું પડશે. રાજ્ય હોવા છતાં સમાજનો પ્રયાલ પહેલો કરવો પડશે. નહીંતર રાજ્ય હોવા છતાં, સાધુઓને પાકિસ્તાનથી ભાગીને હિંદ આવવું પણું! દ્વાર્ધ-લામાને હિંદમાં આવવું પણું! એટલે વ્યક્તિગત અહિંસાને સામુદ્દરિક રૂપ આપવામાં એવો સમાજ જોબો કરવો એ વધારે મહત્વતું છે. આ બધું સામુદ્દરિક અહિંસામાં જ આવી જય છે.

## ચર્ચા - વિચારણા

**શ્રી. દેવલભાઈ** એ ચર્ચાનો પ્રારંભ 'કરતાં કહ્યું': “ વ્યક્તિગત અહિસાનો આધાર સામુદ્દર્યિક અહિસા ઉપર નિર્ભર છે. ચોમેર અનિષ્ટો હોય ત્યાં વ્યક્તિગત અહિસા શી રીતે આરાધી શકાય? આસપાસનું વાતાવરણ ઢીલું હોય ત્યાં ગમે તેઠોએ કંડક માણસ પણ ઢીલો થવાનોબજ. સાહુસાહીઓ પણ જે ગામ દાંડ લેડેતાં હોય ત્યાં જૂથના કારણે જરૂર શકે છે; અને ટકી શકે છેતેમજ દાંડતર્વોને સારા માર્ગ દૂરી શકે છે. સામુદ્રાય અને સામુદ્રાયિક કિયાનું મહત્વ આપણે ત્યાં છે જ. આજે તેનાં મૂલ્યો ખોવાયાં છે તો. દરેક સ્કેચે અહિસાના પ્રયોગો કરીને તેને સ્થાપવાં પડશે.

**શ્રી. બળવંતલભાઈ** : “ મારા નન્દ મતે અહિસાનું મૂળ વ્યાકૃતમાંથી શરૂ થાય છે. બાપુમાં જે મૂળ તરફ હતું તે સામુદ્રાયમાં ગયું. બાપુએ મારીનાં દેખાને પણ પાછું મૂકાવ્યું; જરૂર કરૂતાં વધુ પાછું કે મારીના કણું પણ વપરાય નહીં. ડેવી જીણી દર્શિણી ગુંદી આશ્રમમાં વસવાની શરૂઆત પહેલાં તો નવલભાઈ એ કરી. પછી તો અંશુમા વગરે પાયાના અનેક કાર્યકરો મુનિશ્રી સંતાપાલજીને ભળી આવ્યા. ગુંદીમાં જીલણ્ણા એકાદ્શરી વખતે જે બિભત્તસ પ્રવૃત્તિ થતી તેને દૂર કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો, ધીમે ધીમે દૂર થઈ ગઈ.

મારો પોતાનો પ્રસંગ કહું. એ મેળા માટે લોકો રિકીટ વગર એસી ગયા. રિકીટ તપાસનારને ઉચ્ચક દરશ રિપિયા આપી દીખા. મને એ જૂંચ્યું. મેં રિકીટ તપાસનારને ઠપકાર્યો. તેણે રિપિયા પાછા આપ્યા પણ રિકીટો ન લેવાણી તે અનિષ્ટ તો રહ્યુંજ. એટલે ગુંદી આવી મેં નવલભાઈને એ વાત કરી. છેવટે એ નાખુંનો સદૃપ્યોગ થયો.

**શ્રી. દેવલભાઈ** : “ કાંતિ. વ્યક્તિની પ્રેરણાથી શરૂ થાય છે અને સમૂહ તેને જીલે છે. એટલું ખરું હે તે વ્યક્તિગત હિમત અને નિબંધતા હોવાં જોઈએ, નહીંતર બધું બેળવાઈ જરો! ”

પ્રો. નેમિભુનિ : “ પણ એને જીલનાર સમુદ્ધાયમાં બળ નહીં હોય તો વ્યક્તિની નિબંધતા મોળી પડેશે. પાકિસ્તાનના ભાગલા પણ્ણા તે વખતે સાધુઓને વિમાનમાં બેસીને આવવું પડ્યું. તેમાં વ્યક્તિગત નથળાઈ ન પણ હોય; પણ જ્યાં એમને માનનારો સમૂહ નથળો પણો ત્યાં એંચાઈ જવું પડે. પૂંજીભાઈ ત્યાં વ્યક્તિગત હતા. નહીંતર જેમ ટિક્ટોટ તપાસનારે ભૂલ કણૂલ કરી એમ ટિક્ટોટ ન લેનારાઓ પણ ભૂલ કણૂલ કરી તેને સુધારી શકત.

આજે મત્સ્ય ઉઘોગ, વાંદરા નિકાસનો વિરોધ કાંતો અમૂક લોડા કરે છે. વ્યાપક વાત સમજ્યા વિના વિવેકયુક્ત વિરોધ થતો નથી. અથવા તો સ્વાર્થ ખાતર સરકારનો વિરોધ કરવામાં આવે છે કે વિરોધ કરનારના હાથા અનીને વિરોધ થાય છે.

એ દણિએ, સન ૧૯૫૬ ની આમ દુકદીઓનો ભાલ નલકાંઠાનો પ્રભાવ પણો હતો અને આજે પણ પડે છે. એટલેજ આજે નૈતિક સામાજિક દખાણુંપી અહિસાનું પગલું આચર્યાં વિના દ્શટકો નથી.”

**ગોસ્વામીલ :** “ દેવજીભાઈ કહે છે તેવી વીરતાતો જોઈ એજ ! ”

**શ્રી. દેવજીભાઈ :** “ સામાન્ય રીતે સંસ્થા હોય તો તેનાં બળે ડરપોંક પણ નીડર અની શકે છે.”

**ડૉ. મહિલભાઈ :** “ શું સામુદ્ધાયિક અહિસાના અયોજો એકલે માણુસ કરી શકે હે કેમ ? ”

**ડૉ. દેવજીભાઈ :** “ પણ, સામાજિક ધડતર સંસ્થા વિના ન થાય ! ”

**શ્રી. બધાવંતભાઈ :** “ કાંતિ ભલે વ્યક્તિથી થાય પણ સમાજ વ્યાપી કાંતિ તો સંસ્થા દારાજ શકે છે.

( તા. ૧-૬-૬૧ )



## સામુદ્દરિક અહિંસા અને શુદ્ધિપ્રયોગ

સામુદ્દરિક અહિંસા અને શુદ્ધિપ્રયોગ અંગે આ અગાઉ ઉલ્લેખ થઈ ચૂક્યો છે. આ શુદ્ધિપ્રયોગ શું છે તેની અત્રે વિચારણા કરસું. ઘણીવાર ધણુને આ શબ્દ નવો લાગરો પણ સમાજમાં ઇથ થતાં તે જાણીતું થઈ જશે. ગાંધીજીને સત્યાગ્રહને પ્રચલિત કર્યો. એટલે લોકને ઘ્યાલ આવે છે કે સત્યને ફક્ત રાખવું—આગ્રહ રાખવો, એ સત્યાગ્રહ છે. એવી જ રીતે શુદ્ધિપ્રયોગ શબ્દ લાલનળ કાંઠાના નિષાવાન કાયંકર નાનયંદભાઈએ પ્રચલિત કર્યો. આને ધણુા લોકાંએ તેને અપનાવી લીધો છે.

શુદ્ધિપ્રયોગ શબ્દમાં સત્યાગ્રહ તો આવેજ છે, સાથેજ અભિગ્રહ પણ હોય છે. એ ઉપરાંત તેમાં બ્યક્ટિન કે સમાજની શુદ્ધિતું કામ થતું હોય છે. એ ઉપરાંત બ્યક્ટિની શુદ્ધિ કે સમાજનિક શુદ્ધિના પ્રસંગો આવતા હોઈને દ્વારા પણ આવે છે. શુદ્ધિ આધ્યાત્મિક દ્વિજિતે એ દ્વારાથુમાં સ્ક્રદ્ધ હિસા લાગે છે પણ જેના ઉપર લાવવામાં આવે છે તેના હિતની બુધ્ધિ, એક ડેકટરની દર્દી પ્રતે કે એક ભાતાની બાળક પ્રતે હોય તેવી હોય છે. એટલે શુદ્ધિ અથોગમમાં સામુદ્દરિક અહિંસાનો વિચાર જુદી જુદી રીતે કરવાનો હોય છે.

હવે આ શુદ્ધિપ્રયોગ કયારે થઈ શકે તે વિચારીએ. જ્યારે સમાજમાં ડોધ અનિષ્ટ બાલતુ હોય ત્યારે સમાજને સુધ્યારતા સંરક્ષણ લેછસેપક્ષે જેને સમાજ શુદ્ધિકારક મંત્રિશ સાધુજ્ઞાએ તરત પહેલાં તો તે બ્યક્ટિને તેમ ન કરવા માટે ચેતવાએ. જોઈએ. ગુનેગારને ચેતાની ભૂલ અને સુધરવાની તક આપવી જોઈએ; તે છતાં પણ તે ન ભાને તો તેના ઉપર સામાન્યિક નેતૃઓ દ્વારા આખું જોઈએ; એમ છતાં પણ ન મળે તો અંતે શુદ્ધિ-પ્રયોગ કરવો જોઈએ. આ શુદ્ધિ

પ્રયોગમાં તે વ્યક્તિ કે વ્યક્તિઓ સ્વેચ્છાએ અનિષ્ટ ન ભૂકે ત્યાં સુધી પોતાના તરફથી ઉપવાસ કરવા અથવા પોતાની પ્રેરણાથી રચનાત્મક કાર્યકરોની સંસ્થાના સંચાલન દારા કરતા લોકસેવકો દારા ઉપવાસે કરવવા અને તપ-ત્યાગ અને બ્લિદ્ધાનના કાર્યક્રમોથી વાતાવરણ તૈયાર કરવું. અને પરિણામ ન આવે તો જીવન પણ હોડમાં મૂકવું; એ કાર્યક્રમ સમાયેલો છે.

ધણુંને એમ થશે કે સાધુએ તો આત્માનું દમન કરવું જોઈએ. ખુલું ખુલું તો સાધુએ ઉપદેશ આપવો જોઈએ; તેમણે આવી પંચાત્માં શા માટે પડવું જોઈએ? પણ સાધુની જવાબદારી અતાવતાં હાણુંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે:—

‘ચત્તારિ પુરિસજાયા પણત્તા :—

અપ્પણો ણામમેગે અલમત્થૂ ભવદ્દ નો પરસ્સ,  
પરસ્સ ણામમેગે અલમત્થૂ ભવદ્દ નો અપ્પણો,  
એગે અપ્પણો વિ અલમત્થૂ ભવદ્દ પરસ્સ વિ,  
એગે ણો અપ્પણો અલમત્થૂ ભવદ્દ ણો પરસ્સ;

આમાં ‘અલમસ્તુ’ શબ્દનો અર્થ ટીકાકાર કરે છે—

‘અલમસ્તુ, નિષેધો ભવતુ ય એવમાહ સોડલમસ્તિલ્લુચ્યતે. દુર્નયેષુ  
પ્રવર્તમાનર્ય નિષેધક: ઇત્યર્થ:’

—પોતે અગર તો સમાજ દુર્લિતિમાં પ્રવર્તાતો હોય તો તેને તેમ કરવાની કે ના પાડે છે; દુર્લિતિથી બચવા માટે ચેતવે છે, તે અલમસ્તુ કહેવાય છે, આ ચોલંગીમાં તીજા પ્રકારનો સાધક સર્વશ્રેષ્ઠ ગણ્યાય છે જે પોતાને અને ભીજાને બન્નેને અનિષ્ટ પ્રવૃત્તિ કરતાં બચાવે છે.

એટલે શુદ્ધિ પ્રયોગમાં સર્વપ્રધમ વ્યક્તિ કે સમાજને અનિષ્ટથી બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ જે તે દૂર ન થાય તો શુનેહગાર

૦૪કિતમાં જે અનિષ્ટ છે, તે ડેવી રીતે કેટલા હિસથી અને કેટલા પ્રમાણમાં પ્રવેશ્યું છે? આમ અનિષ્ટની શુણવતા પ્રમાણે શુદ્ધિપ્રયોગનો વિચાર કરવો જોઈએ કે સે તીવ્ર મંદ કે મધ્યમ શુદ્ધ પ્રયોગથી દુર થશે કે માત્ર સમજૂતીથી કે બ્યકિતગત એકાદ ઉપવાસથી દૂર થશે. આ પ્રમાણે શુદ્ધિપ્રયોગની મંદ-તીવ્રતાનું માપ કાઢી યોગ્ય પગલાં ભરવાં જોઈએ.

સમાજની શુદ્ધ માટે ઢાણુંગ સૂત્રમાં એક ચોલંગી અતાવવામાં આવી છે :—

ચત્તારિ પુરિસિજાયા પણતા, તંજહા

ગણસોહિ કરે ણો માણકરે, માણકરે ણો ગણસોહિકરે;

ગણસોહિ કરે વિ માણકરે વિ, નો ગણસોહિકરે માણકરે.

—આર પ્રકારના પુરુષો કલ્યા છે :— (૧) એક સમાજની શુદ્ધિ . કરે પણું સમાજનું માન (માપ) અરાખર કાઢતો નથી, (૨) બીજે સમાજનું માન કરે છે પણ શુદ્ધિ કરતો નથી, (૩) ત્રીજે સમાજનું માપ અરાખર કાઢે છે અને શુદ્ધ પણું કરે છે; (૪) ચોથેઓ સમાજનું માપેય કાઢતો નથી; શુદ્ધ પણું કરતો નથી. આમાં ત્રીજ પ્રકારનો પુરુષ શ્રેષ્ઠ કલ્યો છે.

શુદ્ધિપ્રયોગકારની યોગ્યતા માટે ઢાણુંગ સૂત્રમાં એક ચોલંગી વખ્ત ઉપર ફળી; પુરુષો ઉપર ધટાવી છે :—

ચત્તારિ વત્થા પણતા તંજહા :—

સુધ્વેણામં એગે સુધ્વે, સુધ્વે ણામ એગે અસુધ્વે;

અસુધ્વે ણામં એગે સુધ્વે, અસુધ્વે ણામં એગે અસુધ્વે.

—આ રીતની ચોલંગી અતાવીને પુરુષો ઉપર ધટાવતાં કહ્યું છે :—

ચત્તારિ પુરિસિજાયા પણતા તંજહા :—

સુધ્વે ણામં એગે સુદ્ધમળે; ચઉમંગો, ૪॥ એવં સુદ્ધસંકાપે સુદ્ધપણા, સુદ્ધદિદી, સુદ્ધસીલો, સુદ્ધાચારો સુદ્ધ-વવહારો વિ.

એનાજ સંહર્ષમાં આગળ પણ ધણું કહેવાયું છે. તેમાં વસ્તો ઉપરથી જોઈએ. કહેવાય છે કે જિની વસ્તુ ચોકખું હોય છે તેમ રેશમ પણ શુદ્ધ હોય છે. રેશમનો અર્થ મુગટા-કોરોટાએ મુક્તા કર્યું હોય તેવું વસ્તુ. પણ તેવું રેશમ કુમારાદાર નહીં હોય; પણ કુમાર માટે કોડાને મારીને તે બનાવવામાં આવે છે. એટલે તે ઉપરથી શુદ્ધ લાગે પણ ખરેખર અશુદ્ધ હોય. ખાદી લઈએ તો તે બને રીતે શુદ્ધ છે. તેનાથી લોકાને રોજ ભળે, મહા હિસા થાય નહીં એટલે શુદ્ધ. જાતે અમ કરેલું હોધને તે શુદ્ધ છે; ઐઝુત-મન્જુરને રોજ આપે તે રીતે શુદ્ધ અને શરીર રક્ષણુની રીતે પણ શુદ્ધ. એટલે એ એવા પ્રકારનું વસ્તુ છે જે બધી રીતે શુદ્ધ છે. પણ ખાદી મહેરીને કાળાખંજર કરે, જોડું બોલે, અનીતિ કરે તો કપડાં તરીકે શુદ્ધ પણ તેનો ઉપયોગ અશુદ્ધ.

એવી જ રીતે માણુસો અંગે કર્યું છે કે ડેટલાંક અંદરથી પવિત્ર અને બહારથી પવિત્ર; ડેટલાંક બહારથી ચોકખા પણ અંદરથી મેલાં; ડેટલાંક અંદરથી ચોકખા પણ ઉપરથી મેલાં; અને ડેટલાંક અંદર બહાર બને રીતે મેલા હોય છે. એટલે શુદ્ધિપ્રયોગ કરતી વખતે દ્વાણનો; પોતાના અંદર અને બહારની શુદ્ધિનો વિચાર કરવો જોઈએ. ત્યાર પછી સમાજશુદ્ધિનો વિચાર કરવો હિતાવહ થશે. સાથોસાથ ઉપકી ચોલાંગીની સાથે બીજી ચોલાંગીઓ પણ શુદ્ધસંકલ્પ, શુદ્ધમરણ, શુદ્ધદંષ્ટ, શુદ્ધશીલ, શુદ્ધઆચરણ અને શુદ્ધવ્યવહારની બતાવવામાં આવી છે. તે સ્વચ્છા જાય છે કે શુદ્ધ શુદ્ધિપ્રયોગ કરતાં પહેલાં શુદ્ધિપ્રયોગનું સંચાલન કરનાર સંસ્થા અને શુ.પ્ર.માં એસનાર નિદ્ધિપવાસી બ્યક્ટિમાં ફેની ચોભ્યતા અને તેવું જીવન કરું હોય જોઈએ. એટલા માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કર્યું છે :— “સોહી ઉજ્જ્વલભૂયસ્સ ધર્મો સુધ્ધસ્સ ચિઠૂર્ચ” જે સરળ હિલ અને સરળ બુદ્ધિવાળો હોય તેની શુદ્ધ થઈ શકે અને ધર્મ પણ એવા શુદ્ધ હૃદ્યવાળામાં ટકી શકે.

ભગવાન મહાવીરે બધું લાગ્યું; કુંભ-માલભિલક્ત બધું છોણ્યું;

શિક્ષા લેવા લાગ્યા પણ પરોક્ષમાં સમાજમાં અશુદ્ધિ હતી તે શુદ્ધ કરવાની હતી. એટલે સમાજને જગૃત કરીને તેની અશુદ્ધિ દૂર કરવા માટે અભિગ્રહ-શુદ્ધસંકલ્પ કર્યો. આ અભિગ્રહમાં તેમણે દાસદાસી પ્રથાના અનિષ્ટને દૂર કરવા અને ખીજતિને ઉંચુ સ્થાન આપવા સમાજનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તે છતાં સમાજને સુધારવો હોય તો સમાજમાં નવાં સંગઠનો બનાવવાં જોઈએ. એટલે તેમણે સંઘ રચ્યો. સંઘના જુદા જુદા વર્ગોના નિયમો બનાવ્યા. ભગવાન મહાવીરના જીવનમાં ત્રણું તત્ત્વોએ મુખ્ય કાર્ય કર્યું છે : - ( ૧ ) આત્મતત્ત્વની પ્રતીતિ માટે અભિગ્રહ અને ચંદ્રભાળાનો ઉદ્ધાર ( ૨ ) અનાર્ય ગ્રહેરોમાં વરસો સૂર્યી પરિબ્રમણ કરવું અને ત્યાં બિભસ્ત શ્રુંગાર રસોમાં પણ રસિકતા પડેલી છે તે બતાવવું; ( ૩ ) પ્રાણીમાત્રમાં સમાન આત્મ તત્ત્વ હોય તો કોણી અને ભયંકર સર્પને પક્ષ વાતસદ્ય ચખાડવું । એટલે જ લોકાએ ના કહી છતાં તેઓ ચંડકૌશિક સર્પ પાસે ગયા અને તેને વાતસદ્ય આપી પ્રતિશોધ્યો.

આમ દર્શન અને વહેવાર પવિત્ર કર્યા પછી; તેમણે સંધની રચના કરી. એટલે શુદ્ધ પ્રયોગમાં કમશઃ શુદ્ધ મન, શુદ્ધ સંકલ્પ, શુદ્ધપ્રરા (શુદ્ધ), શુદ્ધ દ્રષ્ટિ, શુદ્ધ શીલ, શુદ્ધ આચાર, શુદ્ધ વહેવાર અને પુરુષાર્થનો કમ રાખવો જોઈએ. તેની સાથે સાથે એ ડાળજ રાખવી પડશે કે પોતાની શુદ્ધિ કરવી અને આજુભાજુની શુદ્ધિની વાતને ટેકો આપવો અને બગાડ થતો હોય ત્યાં શુદ્ધપ્રયોગની હિમાયત કરવી.

અહિસક આજાદીની લડત સાથે સત્યાગ્રહ જાહેર આપણે ત્યાં વહુ પ્રયત્નિત છે. એટલે શુદ્ધપ્રયોગ અને સત્યાગ્રહ ને એકજ અર્થમાં અશુદ્ધવાની ધણ્યા લોકો ભૂલ કરે છે. ખરેખર બન્નેમાં મોટું અંતર છે તેમજ બન્નેની સામાજિક અનિવાર્યતા પણ અલગ અલગ તત્ત્વાથી ભરેલી છે.

ગાંધીજ આહિકામાં ગયા. વડીલાત ચાલુ કરીને આશ્રમ ખોલ્યો. બોડાં માખુસો રાખ્યાં; ધાર્થપિસ્ટ, પટાવાળા, કારકૂન વગેરે. એમાં એક

બહેન પણ હતી. એકવાર એમનો મહેતાજી પેલી એન સાથે ચેડાં કરતો હતો. ગાંધીજીને તે ઢીક ન લાગ્યું. બન્નેને સમજાવ્યાં છતાં ન ભાન્યાં. એટલે પેલા લાઈને રજ આપી. ચોતે જહેરાત વગર સાત ઉપવાસ કર્યાં. અહીં શુદ્ધિનો આયહ પોતાના તરફ છે. “એની ભૂલમાં મારી પણ ખામી છે; નહીંતર હું હોવા છતાં આમ ન ચાલે !” એટલે તેમાં વ્યક્તિ પોતાના ઉપર દ્યાણ લાવે છે. આ દ્યાણ એવું છે કે પસ થયું હોય ત્યારે દ્યાણ કરીએ તો સહેજ વધારે દુઃખે પણ પછી શાંતિ થાય; એના જેવું છે. આવું દ્યાણ કે સ્વક્ષમહિંસા વ્યક્તિ કે સમાજના હિત માટે હોઈને તે અહિસા છે.

અહીં ધણા એમ પણ કહેશે કે ગાંધીજીએ તેને રાખીને સુધાર્યો હોત તો ? તેને છૂટો કર્યો તો તેના પેટ ઉપર લાત તો પડી ને ? પણ, જે વ્યક્તિને ગાંધીજીના સાત ઉપવાસ અને સમજાવટથી પણ કંઈ અસર ન પડે તો શું કરવું ? સડેલું ચુમંડું ફેડવું જ પડે ! ધણા માણુસો ખોટાં કાર્યો કરી સારાં થઈને ફરતા હોય છે. એને સાચો અહિસક તો પ્રતિષ્ઠા નજ આપી શકે. આવા લોકાને સાથે રાખવાથી તેમની દોંગાઈને ટકો મળી જતો હોય છે.

ગાંધીજીના આશ્રમમાં લીલા નાગીનીનો હુદાફારનો કિરસો ઘન્યો. પહેલાં સમજાવવાનો પ્રયત્ન કર્યો; વાળ ઉત્તરાવી નાખવાનું કહ્યું, જીવન અમૃત રીતે જીવવાનું કહ્યું; પણ પરિણામ ન આવ્યું તો તેને છૂટી કરી. ધણાને એમ થરો કે ખરાખ માણુસ ત્યાં ન સુધરે તો પછી ક્યાં સુધરે ? પણ, ગાંધીજીએ માન્યું કે પ્રયત્ન કરવા છતાં પણ વ્યક્તિ ન સુધરે તો સમાજમાં ખોટા પ્રત્યાધાતો પડે; એટલે તેને છોડી દીધી.

ગાંધીજી ધણા પ્રસંગોભા, આશ્રમવાસીઓની ભૂલ થઈ હોય તો જતે પ્રાયશ્રિત કરી નાખતા. કોઈને કહેતા નહીં. એમ કરતાં લોકો જણી જય તો સંશોધન કરી નાખતા કે મારી ભૂલ તો નથી થઈને ?

એટલે શુદ્ધિ-પ્રકાયો એ પ્રકારે થાય. એકમાં ખીલને જણ ન

કરે. ખીજામાં જહેરાત કરે. કેટલીકવાર તેઓ શુદ્ધિ પ્રયોગ ન કરતા પણ સામાજિક દ્વાષુ લાવતા.

એકવાર કસ્તુરખાની ભૂલ થઈ. ઇંડના આવેલા પાંચ રૂપિયા ખીજ ખર્ચમાં વાપરી નાખ્યા. એટલે તેમણે નવજીવનમાં જહેરાત કરી કે કસ્તુરખાને ભૂલ કરી છે. તે વાત જાણુને તૈયાયજ હેઠળ વડોદરાથી દોડી આવ્યા અને કહ્યું: “આ તમે ભૂલ કરી. “એમની આપર ધૂળમાં મેળવી !”

ગાંધીજીએ કહ્યું: “એ લખતાં મને ખૂબ હુઃખ થયું છે. પણ મારે જહેર જીવનનો ચીલો પાડવાનો છે. સરથાએ વધશે, ઇંડા થશે અને એમાં જરાક બગાડો થશે તો લોકોની શ્રદ્ધા તૂટી જરો. એટલે મારે મારા પ્રત્યે કંડક રહેનું જોઈએ! તેથી ખીજને તે દાખલા રૂપે બનશો !”

આ બધી વાતો રજૂ કરવાનો આશય એ છે કે શુદ્ધિ પ્રયોગ અને સત્યાગહ માટે વમળ ઉડયાં છે ત્યારે આપણુને શંકા ન રહે! કયાં જુદ્ધી શુદ્ધિ પ્રયોગ કરવો. કેટલી હેઠળ જરું તે બધા વિચારો કરી શકાય?

હમણું ચેડા હિવસ પહેલાં એક ભાઈ આવ્યા. તેમણે કંદેવડાંયું કે મહારાજશ્રીને મળવું છે. વાત જાણ્યા પછી મેં મળવાની અનિન્દ્યા અતાવી. કોઈ સાધુનાં દર્શને આવે અને તેને ના પડાય તે કેવું? સાથાએને પણ આંચડો લાગ્યો. એક ભાઈ તો હીક હીક ગરમ થયા. પણ, આની પાછળ મારો આશય તો એ વ્યક્તિના લલાનો જ હતો, સમાજનાં મૂલ્યનો હતો. દર્શન કરવા આવે તે જુદી વાત છે પણ અંદરની દસ્તિ મેળી હોય તો કોઈને લાલ થતો નથી. તે ભાઈ એક અન્યાય સામેના શુદ્ધિ પ્રયોગ વખતે સામે પક્ષે હતા. તેમના મનમ એમ હતું કે શુદ્ધિ પ્રયોગ બલે થયો; હવે અમે સંતબાલ સાથે છીએ એમ દેખાડી સમાજમાં પ્રતિષ્ઠા મેળવી લેવાની તેમની વૃત્તિ હતી. આવાં માણુસા શુદ્ધિ પ્રયોગને નિચો પાડે છે.

ધણુા એવા હોય છે કે ચોતે શુદ્ધિ પ્રયોગ કરતા નથી, તેમ કોઈ

કરે તો ટેકા આપતા નથી; કેટલાક જાતે કરે છે, કેટલાક ટેકા આપે છે; કેટલાક તો વિરોધ જ કરે છે. આવા ચાર પ્રકારના લોકા હોય છે.

સાણુંદના શુદ્ધિ પ્રયોગની વાતની ધણુને ખબર નથી. ત્યાં એક સંસ્થાના નાણું, પોતે જિલ્લી કુરેલી નવી સંસ્થામાં ગુપ્ત રીતે લઈ જવાયા અને ખાંડા આખવાની ના પાડી તેમ જ હિસાબ પણ ન આપેલા તે માટે એ શુદ્ધિપ્રયોગ હતો. આવા પ્રકારના લોકાને સાથ આપનારા લોકા પાછા સમાજમાં સારા હેખાવા પ્રયત્ન કરે તો તેમને ભળવાથી રોલાલ? પાપીને ભળી શકાય છે કારણું કે તે ખુલ્લું પાપ કરે છે; પણ ને લોકા અંદરથી જુદું અને ઉપરથી જુદું થતાવે; છેડે ચોક અન્યાયને ટેકા આપે તેવા માણુસોને કષ રીતે પ્રતિષ્ઠા આપી શકાય! વ્યક્તિ તરીકે વાંધે ન પણ હોય; તે છતાંથે સમાજ ઉપર તેની જાધી અસર પડ્યા વગર રહેતી નથી. એનો ખ્યાલ ધણું હોયે પ્રસંગો બન્યા પછી આવે છે.

અહો જ સત્યાગહ અને શુદ્ધિ પ્રયોગમાં અંતર છે. એ જ કારણે ખાપુએ દેશને સત્યાગહને રસ્તે દોર્યાં બાદ આજે એમના મેતૃત્વમાં ચાલતી સંસ્થાઓમાં વિપરીત વ્યક્તિઓ આવી જતાં; તેમના કારણે સંસ્થાનું નામ ખરાબ થાય છે. ગાંધીજીએ કંઈ કાઈને આ રીતે ભળવાની મના કરી ન હતી; પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. એટલે શુદ્ધિ પ્રયોગમાં એ વસ્તુ કરવી પડશે. પહેલી વસ્તુ તો એ કે સત્યાગહ વખતે ને સવિનય કાનૂન લંગ આવતો હતો તે હવે નહીં થાય. કાનૂનરક્ષા થશે કે સંશોધન થશે; એટલું જ નહીં દુનિયામાં પણ લોકશાહીનું રક્ષણું કરવાનું રહેશે. જો લોકશાહી નહીં ટકે તો નિહિત-સ્વાર્થ-અનિષ્ટ તત્ત્વોનું જોર વધી જશે. એટલે જ લોકશાહીમાં માનતી અને કાર્ય કરતી દરેક સંસ્થાને ટેકા આપવો પડશે. યુનો પણ એવી જ એક સંસ્થા છે. એટલે વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધે; હમણું તેના મંત્રી દાગ હેમરશીદનું શાંકશીલ મૂલ્ય થતાં તે અંગે ઠરાવ ધડક્યો હતો। કૃયાં યુનો, કૃયાં આમ સંગઠનો અને કૃયાં પ્રાયોગિક સંધ! પ્રયોગ નાની જગ્યાઓ જ થાય છે પછી તેની વ્યાપકતા વધે છે.

એટલે બીજુ વાત ઇચે નવી સંસ્થાઓની જરૂર પડે ત્યાં જોબી કરવી તે શુદ્ધિ પ્રયોગમાં છે પણ તે સત્યાગ્રહમાં ન હતી. એ રીતે આમ સંઝડનો, પ્રાયે અભિક્ષ સંદેશો અને કાંતિપ્રિય સાધુસંસ્થાને તૈયાર કરવી પડશે. નેમની ભાવના સૂનેલી છે તેમને તક આપવી જોઈએ. સારી સંસ્થાઓએ સાથે અનુભૂતિ બાંધવો જોઈશે; તેમજ અનુભૂતિ વિચારખારા પ્રમાણે બધી સંસ્થાનો વિચાર કરવો પડશે. નિશ્ચાન અરાધર તાકયું હશે તો તૈયારી પણ જોઈશે. તેમ આંતરિક સફળતા માટે તૈયારી કરવી પડશે. તેમ બહારની રીતે પણ સફળતા માટે તૈયારી કરવી પડશે. જેથી શુદ્ધિપ્રયોગની ધારી સંપૂર્ણ અસર થાય.

સાણુંદના શુદ્ધિપ્રયોગ વખતે કે ભાઈઓ કામ કર્યે; તેને પદ્ધતાપ થયો કે નમાંના પાછાં અભ્યાસ જેવું તો ન થયું પણ એવું કામ કરનાર કે એની પડખે જિલ્લા રહેનારની પ્રતિષ્ઠા ધરી, તેમજ સમાજ નાગૃત થયો અને ફરીવાર કોઈ એવું કામ ન કરે તેવી ભૂમિકા જની થઈ. એટલે તેને એ રીતે સફળ મણી શકાય. ઘરણીવાર સફળતા બહારથી નથી દેખાતી પણ એની અસર એ બ્યક્ઝિયો. અને સમાજ ઉપર અભ્યક્ત રીતે જરૂર માય છે. તે કાયમી અનાવવા માટે બ્યાપક આંદોલન કરવું જોઈએ. વિરોધી લોકો આપણું પક્ષના છદ્દેવડાવવા માટે આગળ આવે એમાં પણ અભ્યક્ત બળની અસરજ રૂપી છે ને?

એવું નથી કે શુદ્ધિપ્રયોગ કર્યો અને તરત સફળતા મળશે. સાધુસંતો આડકતરો ટેકો આપે પણ સમજ સામે આપતા ડરે; કાંગ્રેસ, આમસંગઠનોને ટેકો આપતા ડરે. તેમજ બ્યક્ઝિતગત અને સામુદ્દરિક શુદ્ધિપ્રયોગમાં કુર્કા; વગેરે મુરક્કેલીઓનો વિચાર કરવાનો રહેશે. યુનો! અને કાંગ્રેસનું જોડાણું કુમ રહે! સાથે સંગઠનું જોડાણું કુમ રહે તે જોવાનું છે. સારું કામ છે એમ મળીને તે પ્રારંભ કરવાનું છે. કાંગ્રેસને જણ્ણાવતા રહેવાનું છે. તેના મત ઉપર રહીનેજ કાર્ય કરવાનું નથી. સારું કાર્ય છે તે જરૂર કરવાનું છે.

ગौतમ અને કેસી મુનિનો મેળાપ થવાનો હતો. કેસી મુનિ ચોતે ગૌતમને સામે લેવા જય છે. મોયા માને છે—પ્રણામ કરે છે. તેથી ગૌતમના મનમાં જીડી છાપ પડે છે. આમ શુદ્ધ ભાવે, શુલ હેતુસર શુદ્ધિપ્રયોગો કરવાના છે. તે માટે અલિમાન ન રાખવું પણ કાળજી તો રાખવીજ ! કાનૂનભાગ કર્યા સિવાય કાનૂન સંશોધન કરવું પડશે. અમૃક પ્રશ્નો અગે કાંગ્રેસની સામે લડવું પડશે તો બીજી બાજુ ટેકો આપવો પડશે. રચનાત્મક કાર્યકરોનો કયારેક વિરોધ કરવો; તો કયારેક તેમને ટેકો આપવો પડશે. એવું કાંતિપ્રિય સાધુસાધ્વીઓએ કરવું પડશે.

ગાંધીજીએ જ્યારે સવિનય કાનૂનભાગ, અસહકાર અને સત્યાગહ એ ત્રણેની વાતો એક સાથે મૂકી અને કાર્ય શરીર પણ કર્યું. પણ, દેશી રાજ્યોની લડતમાં ઓછું ધ્યાન આપેયું કારણ કે એ માનતા કે મુખ્ય કામ ખિટીશરોને કાઢવાનું છે. તે છતાં આંતરિક બાખોમાં એટલીજ જાગૃતિ રાખતા. દાઝના પીડે બહેનોને પિકેટીંગ માટે મૂકતા; હરિજનોના પ્રશ્નો ચર્ચાતા અને સાથેજ લીબડી રાજ્યને જાપાનથી ફેં વિષાં મંગાવવા એટલી આંતરિક પરિસ્થિતિને વળાંક આપી શકતા. એટલે કે જાગૃતિ રાખવીજ પડશે પણ તેથી કામ મૂકી દેવાશે નહીં. આપણે રાજ્યની શુદ્ધિ કરવી છે—લોકશાહીને ટકાવવી છે. એટલે વિરોધ પક્ષી બનવા કરતાં પ્રેરક-પૂરક બળોને ટેકો આપવો પડશે અને અનિષ્ટો સામે અહિંસક શુદ્ધિપ્રયોગો કરવા પડશે.



### ચર્ચા-વિચારણા

શ્રી. દેવલુભાઈએ ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : “ શુદ્ધિપ્રયોગમાં સમાજ જાગૃતિ અને નૈતિક દ્યાણ આવતાં ખોટી પ્રતિષ્ઠા મેળવનારાં તત્ત્વોને દૂર ભાગવું પડે છે; નહીંતર અપમાનિત થવું પડે છે અથવા સુખરવું પડે છે.

**શ્રી. પૂંજાલાઈ :** “અત્યાર સુધી તો કાં તો જેની લાડી તેની બેંસનો કાખહો હતો કે જેની પોઠણે માનવસમૂહ હોય તેની જીત થતી ! આવા નિરાશ સમયે શુદ્ધિપ્રયોગ માનવમાં નુંબું બળ ગ્રેરે છે. જેમ અગરથતી બળને સુગંધ ફેલાવે તેવું શુદ્ધિપ્રયોગોનું છે.

હું ભિંગલપુર શુદ્ધિપ્રયોગમાં ગયેલો. ત્યારે એ નામ મારા માટે નવું હતું. મને એમ થતું કે અદ્ધારી બલે આ લંઘણું કરું છું. પણ શું તેની અસર સરકાર ઉપર થશે ખરી ! પણ, જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ અધ્યા સતર્ક બની અને જનજાગૃતિનો પરચો જોતાં સરકારને અસર થઈ. તેમાં પણ ખાંલડામાં જે જોયું તે અદ્ભૂત હતું. અમે ઉપવાસ કરીએ અને ખુનસ પ્રકૃતિના લેડોના હાણાં ગગડે. એ વર્ષની પ્રજા જગૃતિ પછી તો ધણી હાલાકીઓ અટકી ગઈ છે. એટલે શુદ્ધિપ્રયોગથી જે નવું બળ મળે છે તે દરેકને અમે તેવી હાલાકીઓ વખતે ન્યાય મેળવવા સહી લેવાનું બળ ગ્રેરે છે.”

**શ્રી. બળવંતલાઈ :** “ગુજરાતમાં ભાલનળ કાંડા પ્રયોગની અસર છે; સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્યકર્તાઓની સમિતિના કારણે ન્યાયની આશા રહે છે પણ દેશના બીજા ભાગોમાં તેવું નથો ! તો જલદી જલદી શુદ્ધિ પ્રયોગ સમિતિઓ જિબી થવી જોઈએ.”

**પૂ. નેમિમુની :** “કેવળ શુદ્ધ પ્રયોગ સમિતિથી કામ નહી ચાલે અનુભૂત બળ પણ સાથે સાથે જોઈશો !”

**પૂ. દંડીસ્વામી :** “શુદ્ધિ પ્રયોગ પ્રત્યેની અધ્યા અને સ્થિતિ પ્રગતું માર્ગદર્શન કરી બની રહેશે.”

**શ્રી. બળવંતલાઈ :** “શુદ્ધિ પ્રયોગ શુદ્ધ સંસ્થા દારા થતો હોઈને એ બને વાતોનો ઉકેલ આવી જય છે. “જનજાગૃતિને ચરણે” પુસ્તક વાંચ્યા પછી મને આકષ્યંખ્ય થયું; પણ, ગુંદી અને નાનીઓઝિમાં

સક્રિય જતે ભાગ લીધેનું ત્યારે કે અનુભવ થયો, તે અદ્ભૂત થયો. અનુભવ સિવાય શુદ્ધ પ્રયોગની શક્તિ અને એના આનંદનો ખ્યાલ નહીં આવે.

પુ. નેમિભુની : “કેટલાક લોકો નૈતિક સામાજિક દવાણુમાં હિંસા જૂએ છે. ખરેખર તો એ અહિંસા છે. જૈનસૂત્રો નિશ્ચિય ચૂણ્યું અને વહેવાર સૂત્ર ભાષ્યમાં સાધુએને એ પ્રકારનાં પ્રાયશ્ચિત્તનું કર્યું છે. (૧) સ્વેચ્છાએ અનુગ્રહાત્મક અહિંસા, (૨) આચાર્ય દારા નિગ્રહાત્મક અહિંસા. સ્વેચ્છાએ દોષો ન સમજાય એટલે દોષો સમાજ બ્યાપી બને ત્યારે સમાજની હિંતચિંતક સંસ્થાઓ અગર તો આચાર્યો દોષ નિવારણ માટે દંડ આપે છે. તેમાં દંડ પામનાર અને સમાજ સૌંદર્ય હિત છે. જે કે શુદ્ધિક પ્રયોગમાં તથ તે સંસ્થા દારા આપ છે અને તેથી લોકનગૃતિને લીધે, દોષ ન કર્યું ત્યાં સુધી દોષિતની પ્રતિષ્ઠા ધરે જ છે.

( તા. ૨૨-૬-૬૧ )



“

## શુદ્ધિ પ્રયોગનાં મૂળભૂત તત્ત્વો

સામુદ્દરિક અહિસામાં શુદ્ધિપ્રયોગ અંગે આપણે વિચારી ગયા છીએ. અહીં શુદ્ધિપ્રયોગનાં મૂળભૂત તત્ત્વો ક્યાં છે, તે અંગે વિચાર કરવાનો છે. શુદ્ધિપ્રયોગોના કેન્દ્રમાં વ્યક્તિ નથી પણ સમાજ છે. સામાન્ય રીતે પોતાની આસપાસના સમાજને એ રીતે શુદ્ધ કરવો કે તે ખીંડ માટે આર્થિકે બને.

### સમાજને કેન્દ્રમાં રાખો :

વ્યક્તિ ગમે તેટલી મહાન હોય કે ખરાખ હોય પણ તેના ધડતરમાં સમાજનો કાળો છે; અને સમાજના ધડતરમાં એજ રીતે વ્યક્તિનો કાળો રહેલ છે. એટલે સમાજમાં કે હોષ આવ્યા તેમાં વ્યક્તિનો હોષ પણ એટલો જ છે. એવી જ રીતે વ્યક્તિના ગુના માટે સમાજ મુખ્ય જવાબદાર છે. વ્યક્તિ કેમ બગડી તેનો વિચાર કરવો જોઈએ; તેની ઉપર જે ચોકી રહેવી જોઈએ તે રહી નથી. વ્યક્તિના દ્વારો જોઈ ધર્થીવાર સમાજ આંખ મીંચામણું કરે છે. સ્વાર્થ, લોભ, લય કે શોહશરમને લઈને અસુક દેખેને સમાજ ચલાવી લેતો હોય છે. ધર્થી વાર એવી ગુનેગાર વ્યક્તિને ટકો પણ અપાય છે. એટલે એક વ્યક્તિનો હોષ સમાજ બ્યાપી બની જતો હોઈને, તે વ્યક્તિને કાઢો તોયે તે હોષ કાયમ માટે નીકળતો નથી. ધર્થીવાર એક વ્યક્તિના દ્વારો કાદણું; પણ દોષેણી પરંસરા તો આપશો, તે સુધીરણું કાયમી ટકરો નહીં. એટલે વ્યક્તિના હોષમાં સમાજનો હોષ ભાની સામાજિક દોષો દૂર કરવનો પ્રયત્ન કરવો જોઈએ. એવો ભાજે જ કોઈ પ્રસંગ હરો જેમાં વ્યક્તિના હોષમાં સમાજ જવાબદાર ન હોય!

પાલણપુરસો પ્રસંગ એનો નમુદ્દો છે. તે વિષે અમારું બોંદું કહેવાઈ મયું છે. એક યુવાન સતત વર્ષની કન્યાને તેની માંને ડેફરની

દીકરી સાથે મોકલી. તેનાં સગપણુ માટે ફોટોએ જોઈતા હતા. ડોકટરની દીકરીએ કહ્યું : “મારા ખાપુલ ફોટોઓથી જુણુ છે. ઐસા શા માટે ખર્ચો છો ? ”

તે યુવાન કન્યા તે ડોકટર પાસે ગઈ. ફોટો પડાવતાં અમુક ચેનચાળા થયા અને લટવાડ થઈ ગઈ. છોકરી ૧૮ વર્ષની થઈ ગયેલી. તેનું વેવિશાળ નક્કી થઈ ગયેલું. એટલે તે લગ્ન અટકાવવા માટે, છોકરી પાસે મા-ખાપ સામે નોટીસ કઢાવી. અઠાર વર્ષ થતાં છોકરી ઉમ્મર લાયક થઈ જાય છે અને તે મનનું ધાર્યું કરી શકે છે !

ઉંડાણુથી જોયું તો ડોકટરે આ એક જ ભૂલ નહોતી કરી; પણ અનેક આવી ભૂલો કરેલી. લોકો વાતો કરીને બેસી રહેતા. કેટલાક ડરતા. કેટલાકમાં ડોકટરને કહેવાની કે પડકારવાની નૈતિક હિંમત નહો; ત્યારે આવા પ્રશ્નો કોઈક તો લેવા જોઈએ ને ? એટલે સહેલે એ પ્રશ્ન આવ્યો । એટલે તે લાઘ્યા.

ડોકટરે કંઘલ કર્યું કે મારી ભૂલ થઈ છે. એટલે પંચે ગ્રાયશ્વિત આપ્યું. ડોકટરે એનો સ્વીકાર કર્યો. પણ ધરે ગયા પછી સમાજનાં કેટલાંક તત્વોએ એને અટકાવ્યો. ધણ્ણાં આર્થિક હિતથી તો ધણ્ણાં સત્તાના હિતથી સંકળાયેલાં હોય છે. કેટલાક ચોટે પાપ કરતા હોય છે; એટલે એકખીજની ભૂલો ઢાકે છે. સમાજનો ફેસલો અપાઈ ગયા ખાદ ડોકટર ફરી ગયો તેણે કહ્યું કે ગ્રાયશ્વિત નહોં લઇ થાય તે કરી લો ।

સમાજના બે ભાગ થઈ ગયા. સમાજના મોટા વર્ગ શુભ્યપ્રયોગને ટેકા આપ્યો. પણ એક વર્ગ વિરાધ કર્યો. તેમને લાગ્યું કે આ પ્રશ્નમાં જીત થાય તો આપણી નીચે પણ રહેલો આવશે. એટલે રાજકીય વિરાધપક્ષોવાળા એમની સાથે થયા; આર્થિક હિતવાળા તેમની સાથે થયા; સંપ્રદાયવાળા એમની સાથે થયા અને ભિત્રાચારીવાળા પણ સાથે થયા.

આમ જોઈએ તો વ્યક્તિ એક હતી પણું ભીજુ રીતે જોઈએ તો સમાજનો બહોળો ભાગ તેની સાથે હતો. કેટલાંક છાપાઓ પણ તેમની પડ્યે હતાં. કેટલીક પત્રિકાઓ પણ બહાર નીકળતી. આ બાજુએ જે કાઈ કિયા થાય તેનો સામી બાજુએ વિરોધ થતો! જે થવું જોઈએ તે હદ બહાર થયું! પણ, હોકેર પાસે નૈતિક આધાર ન હતો. એટલે અંતે તેને નમનું પડ્યું! તેણે સ્વેચ્છાએ એ માસ નગર-નિકાલ સ્વીકાર્યો, તે એનાજ હિતમાં સાંતું થયું, નહીંતર કન્યાનો માંબો તેને મારી નાખત!

આ પ્રયોગમાં મારી સાથે ત્યાંના સમાજનું બળ હતું અને બનાસકાંડા! એકૂત મંડળનું પણ પીડિયણ હતું. ભાલનળકાંડા પ્રયોગનો સહયોગ તો હતો જ એટલે તેની ધારી અસર થઈ. આવા પ્રસરોમાં શુદ્ધિપ્રયોગ જ અનિવાર્ય બને છે.

### શુદ્ધિપ્રયોગ માટે સંસ્થાના સંદર્ભ :

માણુસ ન્યાય માટે અમૃક હુદે જય છે. પણ તેને ટેકા મળતો નથી; એટલે અટકી જય છે. સરકારની મર્યાદા છે, કોર્ટની મર્યાદા છે; મહાજનો કે ડાલ્યા માણુસો પણ ટેકા આપતા નથી; એટલે માણુસ થાકી જય છે; પણ તે જનૂતી બની કાયદો હાથમાં લે છે. તેતું ધાર્યું પરિણામ આવતું નથી.

શુદ્ધિપ્રયોગકાર માટે આ તરફ જાણવું ધાણું જરૂરી છે. આવા પ્રશ્નોમાં વ્યક્તિ મદદ કરે તેના કરતાં સંસ્થા મદદ કરે તો તેની સમાજવ્યાપી અસર પડે છે. શુદ્ધિપ્રયોગ વડે જનજાગૃતિ અને ગતિશીલતા બને આવવા જોઈએ. વ્યક્તિત્વારા શુદ્ધિપ્રયોગ થતાં અંગત રાગદ્વેષ કે સફળતા મળતાં અહંકાર થવાની શ્વક્યતા છે. જ્યારે સંસ્થાના સંભંધો કરવાથી એનો પણ સંસ્થાને મળે અને રાગદ્વેષ ન રહે!

ભાવનગરમાં આત્મારામ લેટે શ્વાસદરચના હરિક્રિએ સામે શુદ્ધિપ્રયોગ

કર્મો. પરિણામે અમૃત હેઠ સુધી તો સંકળ થયા; પણ પછી અમૃત હેઠ જઈને તે વાત અટકી પડી, જે તેની પાછળ સંસ્થા હોત તો એ વરસુ કાયમી ટક્કત.

એવો જ ભીજે પ્રયોગ એમણે ગઈ સાલ કર્મો. એ એક રૂપે શુદ્ધિપ્રયોગ જ હતો. પણ નામ તેમણે જુહું જ આપ્યું હતું. અમૃત જગ્યાએ અમૃત સમય સુધી જીબા રહેવું અને મૌન સત્યાગહ કરવો. ત્યાંના વેપારીએ ખાંડના કાળા બજારમાં ભજ્યા હતા. એક વર્ષ સુધી એ પ્રયોગ ચાલ્યો; ધણા પ્રયત્નો થયા પણ પરિણામ ન આવ્યું એટલે આમરણાંત ઉપવાસનું નક્કી કર્યું. છેવટે લવાને કામ સોંપાયું. આ પ્રશ્ન પણ વ્યક્તિએ લીધેલો. એટલે અમૃત હેઠ જઈને અટકી અધો.

સત્યાગહ અને શુદ્ધિપ્રયોગ એ એવાં બળો. છે જે સમાજને ગતિ આપે છે પણ એ બન્ને પ્રયોગોમાં જે ભૂળભૂત અંતર છે તે જરૂર સમજવું જોઈએ. એટલે શુદ્ધિપ્રયોગ દ્વારા ખાસ કરીને સમાજને કેન્દ્રમાં રાખીને સંસ્થા દ્વારા પ્રયોગ કરીએ તો ગતિશીલતા વધે; વરસુ અટકી ન જાય !

હમણું જાણુના મળ્યું છે કે, સાળંગપુરમાં એક ભીજે શુદ્ધિપ્રયોગ થયો. ત્યાં સ્વામી નારાયણ સંપ્રેદ્ધયના હનુમાન મંદિરની જોયર જગ્યા મંદિરના સ્વાથી તત્વેએ ઘેડાવી નાખી. ઘેડુતોના ગાય બળદ માટે એ જગ્યાનો મનસ્વી ઉપયોગ ન થાય માટે મંદિરની સામે શુદ્ધિપ્રયોગ થયો. તેમણે ભૂલ કણૂલી અને બન્ને પક્ષે સુંદર પરિણામ આવ્યું. પણ જે એ પ્રયોગ વ્યક્તિ મારકૃત થયો હોત જીત મળ્યા પછી ઘેડુતો ટક્કત નહીં. સંસ્થા હતી એટલે કાયમી બળ મળ્યા કર્યું. હમણું ત્યાંની જગ્યામાં કોઈ હનુમાનની મૂર્તિ સ્થાપી ગયું. એને કોણું ઉઠાવે ? ઘેડુત મંડળના ભાધાએ ગયા. તેમણે મૂર્તિનું ભીજે પ્રતિષ્ઠાપન કર્યું. આની પાછળ સંસ્થાનું બળ ન હોત તો આ ધર્મની વાત હતી એટલે ધર્મામાં ધર્મ-જૂન વ્યાપત અને વ્યક્તિ ટકી ન શકત ! પણ અહીં

સંસ્થા હોઠને બધાને પાછા હઠવું પડે ! સંસ્થા બધી જતની કાળજી રાખી શકે ? એટલે સંસ્થા દારા જ યુધ્ઘિપ્રયોગ થવો જોઈએ અને તે પણ સમાજને લક્ષમાં રાખીને થવો જોઈએ.

### અનિષ્ટોતું મૂળ ક્યાં છે ?

તોને મુદ્દો એ છે કે અનિષ્ટોતું મૂળ ક્યાં છે, તે પણ જોવું જોઈએ. ધર્મિવાર વ્યક્તિમાં અનિષ્ટો હોય છે તેમ રાજ્ય પણ અનિષ્ટોને થાયડતું હોય છે ! અથવા અનિષ્ટોતું ઉત્પાદન કરનાર બને છે.

વિનોભાળએ જગન્નાથપુરીના સમેલન વખતે એક પ્રવચનમાં કહ્યું હતું કે “કાંગ્રેસ પણ કદાચ એવી સ્થિતિએ આવતી રહી છે કે તે અહિસાની દિશામાં ખડકની જેમ આડે આવીને ભાલી રહે !”

હું કાંગ્રેસના એ ભાગ પાડું છું. એક સ્વરાજ્ય પહેલાંની કાંગ્રેસ અને ભીજી સ્વરાજ્ય પદ્ધીની કાંગ્રેસ ! જે પહેલાંની હતી તે તપ-ત્યાગ વાળી હતી. હવેની સત્તા અને ધન લાલસા વાળી છે. હવે તેમાં સંશોધન કરી જે સારાં તત્ત્વો છે તેને પ્રતિષ્ઠા આપો અને તેમાં હતાશા ન આવે તે રીતે ધીરે ધીરે પૂરક અને પ્રેરક તત્ત્વો ઉમેરી દો ! તપ અને ત્યાગનું બળ તો આ દેશમાં છેજ. પણ ગામડાં અને શહેરોના પ્રશ્નો આવે છે ત્યારે શહેરોના બુદ્ધિશાળી વર્ગ એ વિકસતાં ગામડાંને પાછાં પાડી દે છે.

ભીજ દેશોની કાંતિને આપણે જોઈએ તો ત્યાં જે લોકશાહી આવી છે તે લગભગ મૂડીવાદી ટાઈપિની લોકશાહી છે. બિટન, ઇંસ, વગેરોના ઘરિયાસ તપાસતાં એ જણ્ણુાઈ આવશે કે ત્યાં લાગવગિયા અને મૂડીવાદીઓન આગળ આવી ગયા છે. ભારતમાં એવું ન થાય તે ખાસ જોવાતું છે. તેમાં પણ શહેરો ગામડાંને કચડી ન નાખે એ પણ ધ્યાન રાખવાતું છે.

લોક-લક્ષી લોકશાહી એટલે લોકને—જે ભારતમાં મોટા ભાગે ગામડાંમાં ફેલાયેલ છે—લક્ષમાં રાખીને વિકસતી લોકશાહી. આવી

લોકલક્ષી લોકશાહી સ્થાપવી હશે તો હમણુંની કાંગ્રેસનું રૂપાંતર કરવું પડશે. તેની શુદ્ધ કરવી પડશે. બંને કામો સાથે લેવાં પડશે. તેની સાથેજ લોક-લક્ષી લોકશાહી કાયમ રહે તે માટે કાંગ્રેસને આગળ ધપાવવી પડશે અને લશકરી ટાઈપની લોકશાહીને સુધારવી પડશે. આમ કરતાં એ પ્રકારની કાળજ રાખવી પડશે. એક તો એ કે લોકશાહીનું રક્ષણ કરવું. અને બીજું સંશોધન કરવું। આ કામ કઠણું છે. કાનૂન લગ હવે પોતાની લોકશાહી માટે ખતરનાક છે, ત્યારે કાનૂન સંશોધન જરૂરી છે ત્યાં કરવાનું છે પણ તેને સાચવીને!

ગણોત્પારાના સુધારા માટે શુદ્ધિપ્રયોગ થયો. તે સરકારની સામે થયો. તે વખતે ચૂંટણી પણ ચાલતી હતી. એક તરફ શુદ્ધિપ્રયોગા માટે ઉપવાસ નિયમ, કાર્યક્રમ, પ્રાર્થના વ. ચાલતા હતા, ત્યારે બીજી તરફ ઘેરૂનોએ કાંગ્રેસને પૂરો ટેકા આપ્યો. એટલુંજ નહીં પ્રયાર માટે પણ તેમણે મહેનત કરી. અહીં એક તરફ કાંગ્રેસ અને તેના વડે લોકશાહીને ટકાવવાની વાત પણ થઈ અને બીજી તરફ કાનૂન સુધારવા માટે અહિંસક આંદોલન પણ ચાલુ રાખ્યું. લોકશાહી પણ ટકે અને તેની કૃતિઓ પણ દૂર ચાય; એજ સાચું કામ છે.

ગણોત્પારા શુદ્ધિપ્રયોગ શરૂ કરતાં પહેલાં પ્રાયોગિક સંધની ભિન્નગમાં ચર્ચા ચાલી! સંધમાં એ સક્ષેપ્તા એવા હતા કે જેમણે કાનૂનની રક્ષા કરવામાં અને કાનૂન ધરવામાં ટેકા આપેલો. તેએ ધારાસક્ષેપ્તા હતા. જે કે કાયદો આવ્યો ત્યારે ધારાસલામાં પક્ષની એઠકમાં તેમણે વિરોધ કરેલો, પણ કાયદો થયા પછી, તેમની પાઈની શિસ્ત પ્રમાણે કાયદાને માન આપવું જોઈએ. આમાં એક પ્રાયોગિક સંધના પ્રમુખ હતા. ગડમથલ ચાલી કે શું કરવું? ચર્ચાને અંતે એવું નક્કી કર્યું કે “તેમણે ધારાસલામાં ટેકા આપ્યો છે એટલે અહીં વિરોધ ન થઈ શકે. તેમજ તેમણે રાન્યને વક્ષાદાર રહેવું જોઈએ. માટે શુદ્ધિપ્રયોગનો ફરાવ ચાય ત્યારે તેમણે મત ન આપવો!”

આ ભાષતો ડાડાણુથી વિચારવી જોઈએ. જેખમી લાગ ઉપર આપરેશન કરતી વખતે ડોકટરને કેટલું બધું ચિંતન કરવું પડે છે?

તેવીજ રીતે કેને ટેકો આપીએ તેની સામે જ વિરોધ કરીએ તે ન્યાય સંગત નથી; પણ લોકશાહીની નિરુદ્ધજ સંસ્થા જતી હોય તો તેની સુધારણા કરવી; વિરોધ કરવો અને ધ્યાન બેંચવું, એ એતો માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ નથી, પણ એતું ધડતર કરવા માટે છે. આ બહુજ વિચારવાની વાત છે!

એવોજ પ્રશ્ન હડતાલનો છે. કાનૂન ભંગ ન થાય તે ખરદ; પણ અનિષ્ટો થતાં હોય. અન્યાય ચાલતો હોય તો હડતાલ પાડવી કે નહીં?

એમ કરવામાં જહેર અદ્દાલન કરવું પડે પછી અમે તેટલી શાંતિની વાતો થાય; પણ એ આદ્દાલન શાંત ન થઈ શકે! દ્વિલાખી રાખ્ય વખતે શાંકરરાવ દેવે સુંઅર્ધમાં સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિવતી વિરોધ કર્યો. શાંત આદ્દાલન માટે ઉપવાસ કર્યા; પણ પછી તો લોકો ઉત્ત્ર થયા! હડતાળ પડી, સરખસો નીકલ્યાં અને તોકાનેતાની જે શરૂઆત થઈ તેમાં નિર્દ્દિષ્ટ પ્રગતિ જે કનુંગત થઈ તે અતિ દુઃખદ છે.

એટલે જ શુદ્ધ પ્રયોગમાં હડતાળ નહીં પાડવાનું કહેવામાં આવે છે. ભંગી હડતાળ પાડે તો લોકાની સુખાકારી બગડે, વેપારી હડતાળ પાડે તો લોકાને જરૂરની વસ્તુ ન મળે, આની અવેજુમાં શુદ્ધ પ્રયોગ થાય તો લોકાની સહાનુભૂતિ સહેને “સહન કરનાર વર્મ” તરફ વળે અને અન્યાય ફરનારને સંશોધન કરવાની ફરજ પડે.

એટલે જ શુદ્ધ પ્રયોગમાં (૧) હડતાળ નહીં, (૨) ઉર્કેરાટ નહીં (૩) બ્યકિતગત ભાંડવાનું નહીં—એ બાબતો અચૂક હોવી જોઈએ. સાથે પ્રાર્થના-ઉપવાસ અને બલિદાન આપવાની તૈયારી હોવી જોઈએ.

જહેર અદ્દાલન એ રીતે ખરાય પ્રક્રિયા ઊભી કરે છે:- (૧) એક તો તે ઉર્કેરાટ તોકાન ભચાવે છે; અને (૨) તે વખતે ધણ્યાં ઘોટાં રાખકીય બળો પક્ષો ભળો જાય છે. ક્ષારેક સમાજ વિરોધી તત્વો તેનો લાલ ઉઠાવે છે. તેના ફરતો ફાનુસ-સંશોધન થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ.

શ્રી રામુલ્લુ પવિત્ર પુરુષ હતા. પણ તેમણે જે કારણે આમરણાંત ઉપવાસ કરી બલિદાન આપેયું તે કારણું બરાબર ન હતું. જો કે તેથુણું ભાષી લોકોને આંદ્ર ભળી ગયું; પણ તેણે લોકોમાં ભાષાના નામે સંકુચિત પ્રાંતવાદ ધૂસેરી દીઘો. તેના કારણોસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ અધ્યોગ્ય આંદોલન થયાં—અને પ્રાંતો જુદા થયા. હવે પંજાબી લોકોના પંજાબી સુભાની વાત આગળ આવે છે. આવા પ્રસંગે ધણ્ણા વિરોધી પક્ષો એક થઈ જાય છે—તેમનો ટેકો મેળવવામાં આવે છે. પરિણામે આંદ્ર, મુંબઈ અને ગુજરાતની લડત વખતે સામ્યવાદીઓ તક જોઈને એ આંદોલનમાં ભળી ગયા અને તેમણે પોતાનું સ્થાન જમાવી કીધું. એટલે જ શુદ્ધિપ્રયોગમાં આ હડતાળને સ્થાન નથી; પણ કાનુન—સંશોધન થાય તેવી પ્રક્રિયા જાલી કરવી જોઈએ.

આમ શુદ્ધિપ્રયોગમાં ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે :—  
 (૧) સમાજને કેંદ્રમાં રાખવો, (૨) સંસ્થા દારા પ્રયોગ કરવો;  
 તેમજ (૩) અનિષ્ટનાં મૂળને શોધી તેને ટેકો ન આપવો. તેમજ  
 કાનુન ભાગ નહીં પણ કાનુન સંશોધનની દર્જા રાખીને શુદ્ધિપ્રયોગો  
 થવા જોઈએ.

### ત્રિવિધ જાગૃતિ :

ધર્માધીરાર કોઈ સંસ્થા પાછળ ફરો અને વ્યક્તિ આગળ ફરો એવા શુદ્ધિપ્રયોગો પણ કરવા પડશે. સાથું હમાં શુદ્ધિપ્રયોગ વખતે સંસ્થા હતી પણ વ્યક્તિને મુખ્ય બનાવી હતી. આવે વખતે ત્રિવિધ જાગૃતિ રાખવી જોઈએ.

(૧) પ્રયોગમાં, ગુનેગાર પ્રતિ અંગત રાગ્રોષ્પવાળા ન ભણે;

(૨) ભાષામાં જરાયે ડિસા ન આવે.

(૩) ગુનેગાર કે તેના પક્ષકારને આર્થિક કે શારીરિક સળ ન થાય.

સાથું હમાં શુદ્ધિપ્રયોગ થયો ત્યારે ત્યાં કેટલાક બળા;  
 જેમની સામે પ્રયોગ થયો તેની વિરોધનાં હતાં. કેટલાક

કાંગ્રેસ-વિરોધી પણ હતા. આ બધાને ટાળવા પડ્યા. એક માથુસ શુ.પ્ર.ની પત્રિકા લેવા આવ્યો અને કહે કે મારે તે લોકાનો વિરોધ કરવો છે. કાર્યકરને ખખર પડી ગઈ એટલે કહ્યું કે પત્રિકા નહીં આપું. આઠવી બધી કાળજી રાખવા છતાં ક્યારેક દાંડાઈને ટેકા ભળે તેવું વતાં અગણે ડેટલાક લોકા તરફથી થઈ જાય છે.

તે વખતે પ્રાયોગિક સંઘવાળાઓની સભા હતી. અન્યાયપક્ષી લોકાને રદીયો અપાઈ રહ્યો હતો; તે વખતે મહિનેન પક્ષવાળાઓ વિરોધ કરવા લાગ્યા. એટલે સભાજનો પૈકી ડેટલાક ઉસકેરાઈને તેમને બેરી વજ્યા. બેંચાબેંચ શરૂ થઈ. પ્રાયોગિક સંઘના કાર્યકરો ત્યા પહેંચી ગયા અને તેમને છોડાવ્યા. તે છતાં તેમણે બહાર જાઈને જાધ્યા. પ્રચાર કર્યો કે પ્રાયોગિક સંઘવાળાઓએ અમારા ઉપર હુમલો કરાવ્યો. તેવા પ્રસંગે પણ વિરોધિપે ભાષાની હિંસા ન થાય તે ધ્યાન રાખવું રહ્યું.

સાણંગપુર શુદ્ધિપ્રયોગ વખતે પણ આવું બનેલું. મંહિરવાળાઓ ઉપર જાસાચિદ્દી આવી એટલે તેમણે પ્રચાર કર્યો કે ઐદૂત મંડળવાળાનું એ કામ છે. સરકારે તપાસ કરાવી પણ ખાંડું નીકળ્યાં. જ્યાં પવિત્ર ધરો થતાં હોય ત્યાં સ્વાર્થી હિતવાળા કેરિધનસંતોષીએ અડયણો. નાખવાનાજ. એ વખતે વિચાર કરી ઉર્ચા વગર કાળજીથી કામ લેવું જોઈએ.

**અનુભંગ હોવો જોઈએ :**

પાંચમું તત્ત્વ ધાર્યું અમત્યનું છે. તે છે શુદ્ધિપ્રયોગમાં અનુભંગની કાળજી રાખવાનું. અનુભંગ એટલે, શુદ્ધિપ્રયોગ કરતાં, રચનાત્મક કાર્યકરાનો ટેકા ન હોય, કાંગ્રેસનો ટેકા ન હોય, લોકસંગઠનોનો ટેકા ન હોય; તો જે સંસ્થાની પ્રયોગ થાય પણ તેમાં પૂછું સહિળતા ભળશો નહીં! કૃદાય ભળે તો તેની અસરકારકતા નહીં રહે.

સાણુંધના પ્રયોગમાં આવું જ થયેલું. ત્યાં પ્રિય નેમિમુનિ એક કાંતિપ્રિય સાધુ તરીકે જયા; પ્રાયોગિકસંધ જેવી ૨૦ કાર્યકરાની સંસ્થા

સાથે અનુભંગ હતો જ, પણ સર્વોદ્યના કેટલાક લોક્સેવકો (૨૦ કાર્યકરો) ઉદ્ઘાસ હતા. કાંગ્રેસનાં કેટલાક લોકો ગુનેગારના પક્ષમાં હોઈ સંસ્થાકીય રીતે ટેકો આપવા માગતા ન હતા. એને એ ચાર જેવી સાવ ૨૫૪૮ વસ્તુ હેવા છતાં કોઈ ગુનેગરને કે ગુનેગારની પીઠ ચાખડતાં તત્ત્વોને સાચું સમબંધવવા આગળ નહેંતું આવ્યું. ત્યાં માર્ટલિયાજુએ નિવેદન અહાર પાડી ખરી વાત કહી. એટલે શુદ્ધિપ્રયોગની જે અસરકારકતા થવી જેધું એ તે ન થઈ. પ્રયોગ સક્ષળ થયો—લોકો જગ્યા—તેઓ પૈસા આપવા તૈયાર થયા; નવી સમાંતર સંસ્થા જીભી કરનારને રાજીનામું આપવું પહુંચું અને લોકોએ તેમનાં કૃત્યને વખોડી નાખ્યું। પણ, પૈસા ગુનેગાર તરફથી પાછા ન મળ્યા! જે તે વખતે ઉપરનાં બળોનો સાંગોપાંગ અનુભંગ હોત તો પૈસા પણ તરત મળત ! તેની અસરકારકતા હંમેશ માટે રહેત.

આજે ત્યાં કાંગ્રેસ બાળમંદિર બરાબર ચાલે છે; લોકો જગ્યાત થયા છે અને વસ્તુને ઓળખી ગયા છે ! તેઓ એ પણ જણે છે કે ત્યાં કાંગ્રેસ અને રચનાતમક કાર્યકરોએ લીધેલ વલણું બરાબર નથી. તે છતાં પણ અનુભંગવાળી સંસ્થા તરીકે પ્રાયોગિક સંધે અને આમસંગઠને ચૂંણણી વખતે કાંગ્રેસને જ ટેકો આપ્યો ! જે કે આજે ત્યાં કામ બરાબર ચાલે છે પણ અનુભંગ વિચારધારા પ્રમાણે કાંગ્રેસ અને સર્વોદ્યા લોક્સેવકોને ગળે તે વખતે વાત ન ઉત્તરતાં તેની અસરકારકતા જીભી નથી થઈ !

આમ આ શુદ્ધિપ્રયોગોમાં કયાં સક્ષળતા મળી, કયાં નિષ્ણળતા મળી તેનું પૃથક્કરણું કરવું પડશે અને ઉપરના શુદ્ધિપ્રયોગનાં મૂળભૂત પાચ તત્ત્વોના આધારે કાર્ય આગળ ધ્વાવવું પડશે.



## ચર્ચા - વિચારણા

**શ્રી. દેવજુલભાઈએ ચર્ચાનિઃ પ્રારંભ કરતાં કહ્યું:** આમે આંબ નૈતિક લોક-સંગઠનો અને શહેર શહેરમાં પણ જનસંગઠનો નથી થયાં ત્યાં લગી કેંગ્રેસનો સંક્રિય સહયોગ મેળવવામાં તેમજ કેંગ્રેસને પણ શુદ્ધ ખનાવવામાં તકલીફ રહેવાની. દુર્લાઘ્યે સર્વોધ્યના લોક્સેવકોની સંસ્થાનું વ્યવસ્થિત સંગઠન નથી તે કાર્યકરો આવા પ્રશ્નો પ્રત્યે આંખમીચામણું કરીને ચાલે છે. થોડુંક માર્ગદર્શન જે કાંતિપ્રિય સાધુઓ આપે તો આમણાંમાંથી હજુ લોક્સેવક-સંગઠન જાલું થઈ શકે. ચારેય સંસ્થાનો અનુભંગ એ શુદ્ધપ્રયોગમાં મુખ્ય હોવો જોઈએ.”

**શ્રી. પૂંજાલાઈ :** “શુદ્ધપ્રયોગ આપણી પાસે અમયસર આવ્યો છે. ધરમાં કોઈ ખાય નહીં તો કાચય મોટા પણ ન ખાય, અથવા ગામમાં કોઈ પૈસા ન આપે તે વાણિયો દાંતણું-પાણી લઈને ધરણું ધરે. આ વાતો શુદ્ધ પ્રયોગમાં ન આવે. ત્યાં બદલો લેવાનો છે ત્યારે શુદ્ધપ્રયોગમાં એવું નથી. શુદ્ધપ્રયોગમાં સામી વ્યક્તિને સમાજનાં મૂળ્યો વચે માટે સહેવાનું તપોભય આંદોલન હોય છે. ત્યાં પ્રાર્થના-ઉપવાસ, શાંતિભય ચર્ચા બધું થાય પણ બદલો કે દૂપની ભાવના ન હોય! આજે બદલો લેનાર કે ગુના કરવામાં રીઢા થયેલાને આ વાતો ગણે ન જિતરે પણ ગરીઝને ન્યાય આપવા માટે આ અસરકારક સાધન છે. આ યુગ વ્યક્તિનો નથી પણ સંસ્થાનો છે. એટલે સંસ્થાનત જે શુદ્ધપ્રયોગ કરીને સમાજના શુદ્ધ અને સક્ષાઈ કરવામાં આવે તો તેની ધારી અસર ઉપજે તેમ છે.”

**શ્રી. બળવંતલાઈ :** “ધણાને એમ થતું હશે કે સાખુંદમાં જે વ્યક્તિઓએ છુટેચોએ અનર્થ કર્યો હતો તેમનું હદ્દ્ય પરિવર્તન શુદ્ધ પ્રયોગથી ન થયું; પણ લોક જગ્યાતિ તો આવી છે. સમય પસાર થાય છે તેમ અમાઉ ટેકો આપતા તેવા કેંગ્રેસીનોનો પણ તેમનાથી દૂર થતા જઈ રહ્યા છે; તેમજ દ્વાખું આવતાં નરમાય વધતી જાય છે.

ચોમેર નૈતિક સંગઠનો હોય અને સંસ્થાનો અનુભંગ હોય તો અસરકારકતા તરત દેખાય નહીં તો મોડું થાય. બાકી શુદ્ધિપ્રયોગ સંપૂર્ણપણે સફળ હથિયાર છે. વેર-ડંબ કે ટોળાંશાહી સિવાય તે દરેક પ્રકારનાં અનિષ્ટાને ગ્રેમથી કાઢી શકે છે. લાગવગશાહી કે મૂડીવાદના પ્રભુત્વમાં રાયતો માણસ ન્યાય મેળવી શકતો નથી. ત્યારે શુદ્ધિપ્રયોગથી ગરીબને સાચો ન્યાય મળવાની શક્યતા મોટી છે.”

**શ્રી. દેવલુભાઈ :** “લચાઉમાં કણુંભી જાતિ અને એસવાળ જાતિના લોકોએ ચા મૂડી. ત્યાં શ્વે. મૂર્તિ સાધુઓનું ચોમાસું હતું તેમને એ ન ગમ્યું. થોડાંક માણુસો વિરોધમાં પણ્યા. એકે તો હઠ પકડી. અંતે શુદ્ધિપ્રયોગ થયો. એ જણના તણું ઉપવાસ અને એ જણના એ ઉપવાસ થતાં સૌને સમજ પડી ગઈ. અંતે સત્ય બહાર આવ્યું. લોકો સત્યને જલદી પકડી લે છે-પછી અસત્યને ટકવું મુશ્કેલ બને છે. એટલે શુદ્ધિપ્રયોગ સમાજમાં જગૃતિ લાવે છે અને સત્યનું લાન કરાવે છે. તેથી અસત્યના પાયા ઉગમગી જાડે છે !”

[ આ પછીની ચર્ચાના ભાગ હવે પછીના પ્રવચનોને અનુરૂપ હોય ત્યાં લેવામાં આવેલ છે. સં. ]

( તા. ૨૪-૯-૬૧ )



## શુદ્ધિ પ્રયોગ અને લવાદી તત્ત્વ

માણુસના જીવનમાં એ ભૂખ છે—રોટલાની અને ન્યાયની ભૂખમાંથી લવાદનો પ્રશ્ન આવે છે અને રોટલાની ભૂખમાંથી ન્યાયોચિત આજીવિકાનો પ્રશ્ન આવે છે. આ એ બાધ્યતામાં જ્ઞારે કોઈક વિધન આવે છે, ત્યારે સામાન્યિક અશાંતિ જિલ્લી થાય છે. આ અશાંતિને દૂર કરવા માટે સમજૂતી, સમાધાન, લવાદ અને સૂચના-પત્ર તેમજ પછી કુમશ્શ: શુદ્ધિપ્રયોગ આવે છે. આ અહિસા સુધી પહોંચવાની રીત છે. હિસ્ક રીતમાં લડાઈ, મારામારી, ઝૂન, લુંટ વગેરે આવે છે. પણ, હિસ્ક સાધનો વડે હમેશાં હિસા વધે છે. એટલે અહિસક સાધનોનો વિચાર કરવામાં આવે છે.

### લવાદ માટે ભૂમિકા :

હવે પ્રશ્ન એ છે કે શુદ્ધિપ્રયોગમાં લવાદને સ્થાન છે? છે તો કઈ ભૂમિકાએ? ન્યાય મેળવવા માટે શુદ્ધિપ્રયોગ થાય છે. પણ તે પહેલાં જેને અન્યાય થયો હોય તેના મનમાં ડંખ ન રહેવો જોઈએ. તેને સમાધાન મળનું જોઈએ. તે માટે સમજૂતી થાય તો વધારે સારું છે. ત્યારબાદ લવાદ નીમો કે પંચ ફિસલા દારા ન્યાય કરો. તે યોગ્ય થશે. જો ડંખ રહેશો તો અન્યાય હર્તા અને અન્યાય પીડિત વચ્ચે મહોષ્યત પેઢા કરવી છે, તે થશે નહીં.

જૈન પરિભાષામાં સહધર્મી વાતસ્ય શર્પદ આવે છે. તેનો એકરૂધ અર્થ એ પણ છે કે બધા સાથે બેસે અને જમે. શુક્રવારની નમાજ દરેક ભુસલસાન સાથે ભલ્લે; રવિવારની પ્રાર્થનામાં દરેક ઘસાઈએ સાથે લલે. એનો અર્થ એ છે કે શોભિત કે શોષક બન્ને સાથે બેસે એ ભૂમિકા આવવી જોઈએ. તે માટે ડંખ કાઢવો જોઈએ. તેમ ન થાય તો નિમિત્ત મળતાં શોભિત સ્પ્રોંની માર્ક ઉછુળે છે.

ધરમાં જોશું તો ત્યાં પણ આવું જ બને છે. છોકરાને દ્વારાણુથી ચૂપ કરો તો તે વખતે ચૂપ થઈ જય પણ પાછો બિછળે. તે રીંગો થાય અને મહેમાનો આવે ત્યારે ધરણું વખતે સાપ કાઢે તેમ કંઈક પણ કાઢે. જેમ ધરમાં સ્થિતિ છે તેમ સમાજમાં સ્થિતિ છે. બીજી વાત વાત એ છે કે જે ડિક્ટિન્યુન હે સમાજ સાથે સંબર્ધ હોય તેનું સમાધાન તો થઈ જય પણ સમાજમાં અન્યાય પ્રતિષ્ઠિત થઈ જય તેનું શું? લોકાને એમ કહેવાનું મન થાય કે જોયું ને! વહેવારમાં તો અન્યાય જીતી ગયોને? એમ ન થવું જોઈએ.

“અંતે તો ન્યાય જીતે છે.” તેની ખાત્રી લોકાને થવી જોઈએ. મતલખ કે ત્રણ બાબતો થવી જોઈએ :—(૧) પીડિત અને પીડક બને વચ્ચે મહેષભાત રહેવી જોઈએ. (૨) અન્યાયની પ્રતિષ્ઠા ન થવી જોઈએ; (૩) અંતે ન્યાય જીતે છે, તેની સહૃદૈ ખાત્રી થવી જોઈએ. આ બાબતો ધ્યાનમાં રાખીને વિચાર કરશું તો લવાદ નીમવો કે નહીં? તેને ઘ્યાલ આવી જશે. જે કે બધા પ્રયત્નો થયા છતાં ન્યાય ન મળે, તો શુદ્ધિ પ્રયોગ તો છેવટે કરવો જ જોઈએ.

### લવાદ ક્યારે?

એટલે શુદ્ધિપ્રયોગ આ બધી ભૂમિકાઓ વટાવ્યા બાદ શરૂ કરવામાં આવે છે. તે અગાઉ ડંખ ન રહે, સમાધાન થઈ શકે તો લવાદ નીમવો જોડું નથી; પણ બધું વિચારીને શુદ્ધિપ્રયોગ શરૂ કર્યાં બાદ લવાદને ન નીમવો જોઈએ; ન માન્ય કરવો જોઈએ. શુદ્ધિપ્રયોગ પૂર્ણ થયા બાદ કોઈ આર્થિક બાબતોના ફેસલા માટે બન્ને પક્ષ સ્વીકારે તો તે માટે લવાદ નીમી શકાય છે.

સાળંગપુરના શુદ્ધિપ્રયોગમાં (પૂર્ણાંકિત થયા બાદ) વળતર કેલું આપવું તે માટે અંતે લવાદ નીમવાનું નક્કી થયું. ખરી રીતે સરકારના નિયમ પ્રમાણે ( $\frac{2}{3}$ ) છુટો ભાગ ઘેડૂતોએ આપવો જોઈએ, પણ સમાધાન થતાં થાડા ફેરફારો થયા. ત્યાં લડત મૂળ જમીન ઘેડવા માટેની

હતી. જે લાગ ઉપર જેર હેવામાં આવે તો મૂળ ભુદો માર્યો જાય. અંતે લવાદ શોંકું વધારે નક્કી કર્યું. તે ગણેતિયાઓને મંહિરે આપવું પડ્યું.

શુદ્ધિપ્રયોગ એટલા માટે થાય છે કે અન્યાયની પ્રતિષ્ઠા ન થવી જોઈએ અને સમાજ લાગાર ન બની જાય! પણ જ્યાં સમાજ વ્યવસ્થિત ન હોય ત્યાં પ્રશ્ન ગુંચવાય છે એટલે સિદ્ધાંતને વાંધો ન આવે ત્યાં લવાદ થઈ શકે છે. પણ જ્યાં મૂળભૂત વાંધો હોય, સમાજ ઉપર ખાટી અસર બિની થતી હોય તો લવાદનો સાઝ ઈન્કાર કરવો જોઈએ! પૈસા અંગે બને વર્ચ્યે ન્યાયપૂર્ણ અને સમજુતી યુક્ત નિકાલ, માટે લવાદ નીમી શકાય છે.

અમદાવાદમાં મજૂરો ને અન્યાય થતો હતો ત્યારે ગાંધીજીએ પ્રશ્ન ઉપાયો. તેમણે મજૂરોને કલ્યું કે તમને ન્યાય મળે તેવી ભૂમિકા બિની થશે; પણ તમારે સંગઠન કરવું પડશે. પછી સભા થઈ. મીલો બંધ પડી. મીલમાલિકોનું સંગઠન હતું પણ મીલમજૂરો વેર-વિભેર હતા. તેમાંથી કેટલાક લાલચમાં પઢ્યા; કેટલાક અહાર રહ્યા અને હડતાલ તૂટવાનો ડર આવીને બિનો રહ્યો. તે વખતે મજૂરોની અંતઃશુદ્ધિ નિમિત્ત ગાંધીજીએ ઉપવાસ કર્યા. ગાંધીજ માટે મીલમાલિકો તરફથી અંભાલાલ સારાભાઈ વગેરેને માન હતું. ધણ્યા મીલમાલિકોના મનમાં કંદી હતી કે ગાંધીજ તટસ્ય હોવા છતાં મજૂરોનો પક્ષ દેશે! અનશન કર કર્યું ત્યારે અંભાલાલભાઈ જેવાને પણ લાગી આવ્યું કે બાપુ મજૂરોનું બેચ્યે છે! મજૂરોમાંથી પણ ધણ્યા ખરી જવા માગતા હતા, ગાંધીજના આ પ્રયાસોથી તે નારાજ થયા! અહીં ગાંધીજની વિચિત્ર પરિસ્થિતિ હતી. બને પક્ષો તેમને એકખીલના પક્ષકાર માનતા હતા. અંતે અંભાલાલભાઈ, અનસુયાબેન, શાંક્રલાલ એકર જેવાના પ્રયત્નોથી બને પક્ષ માટે ગાંધીજએ આનંદશંકર બાપુભાઈ ધ્રુવને લવાદ નીભ્યા. તેમનો ઇંસલો બને પક્ષે માન્ય રાખ્યો.

આ એક વિચિત્ર સંયોગજ હતો! ત્યારે પ્રસંગ વશ લવાદની

નીમણુંક ચલાવી શકાય છે. મજૂર મહાજન અને મીલમાલિક મંડળ વચ્ચે લવાદ નહોતું. પણ વળતર કેટલું આપવું; હડતાલતું વળતર આપવું કે ન આપવું; તેમજ મજૂરોની ભૂલો વગેરે વિચારનારું મધ્યરથ-પંચ જેવું હતું.

પૈસાની આવી બાઅતો હોય; બને પક્ષો તરફથી પૈસા ખવાઈ ગયાં કે ચવાઈ ગયાં; એવી વાતો આવતી હોય તો તેના સમાધાન માટે લવાદને નીમો. આવી લવાદીમાં પણ શારીરિક સજથી દૂર રહેવાય તે ઝેંસલો વધારે ઉત્તમ છે. અન્યાય પીડિતને ડંખ ના રહે અને સંતોષ થાય તો પણ શારીરિક સજ ન. યું જે ગયું છે જે ક્ષતિ ( તુકસાની ) ચર્ચા છે, તેનું વળતર મળવું જોઈએ. તે ન મળે તો ડંખ જાય નહીં. અંતે તો ડંખ કઢાવી, શુનેગાર સામાજિક જીવન જીવતો બને તેવી રિચ્યતિ સર્જવી જોઈએ. અન્યાયીનું હૃદય પણ નીચું પડે છે. તેની શુદ્ધ થાય તો સૌનું ભલું થાય છે!

### લવાદ શુદ્ધ હોવો જોઈએ :

લવાદ માટે અંગેજમાં “ આરથ્યોટ્રેર ” શાખદ વપરાય છે તેનો અર્થ મધ્યરથ કે બીચબિચાવ કરનાર એવો થાય છે. તે બને પક્ષને માન્ય હોય કે નહીં તે અંગે કેટલીક વખત ધ્યાન અપાતું નથી. તેમજ તેના ઝેંસલામાં કોને કેટલું હુઃખ થાય છે; ડંખ રહે છે તેનો ઘ્યાલ એછો રખાય છે. એ લગભગ આજની ન્યાય પક્ષતિ ઉપર ચાલે છે. ત્યારે લવાદ બને પક્ષને માન્ય હોવો જોઈએ તેજ શુદ્ધ હોય છે. લવાદની શુદ્ધ ગાંધીજીએ આનંદશંકરભાઈ દ્રુવની નિમણુંકથી કરી બતાવી. આ લવાદ કોઈને અન્યાય થયે છે કે નહીં; તે તપાસી શકે. જેમકે પંનથી સૂચાના પ્રશ્નમાં શીજોને અન્યાય થયો છે કે નહીં; પણ ચીને છેઠેચોક આકુમણું કર્યું હોય ત્યાં લવાદની વાત કરીએ તો મૂળભૂત તરવેજ મરી જશે. એક દાંડ માણુસ કોઈના નાણું પચાવી એઠો હોય પછી કહે કે લવાદ નીમો, હું ઝેંસલો માન્ય કરીશ; તેના જેવીજ આ વાત છે. ધણીવાર ઉપરતી સૂક્ષ્મિયાણી વાતોથી

દોંબાઈ ને ટેકો મળી જય છે. કાસમીરના પ્રશ્નમાં આકુમણુ બંધ કર્યા પછીજ લવાદની વાત પાહિસ્તાન કરી શકે!

### લવાદ એટલે પંચ :

લવાદ એટલે પંચ. મધ્યરથ અને તઠસ્થપણું! અગાઉ આપણે ત્યાં ‘પંચ બોલે તે પરમેશ્વર’ એમ મનાતું. અગાઉ આવા પંચ તરીકે રાજ ગણ્યાતો. અને મને લાગે છે કે તે કાળે રાજના જે પાંચ કર્તાઓ હતા તે ઉપરથી જ પંચ શખ્ષ આવ્યો છે. રાજનું કર્તાઓ હતું :—

દુષ્ટસ્ય દંડ: સુજનનસ્ય પૂજા, ન્યાયેન કોષસ્ય ચ સંપ્રવૃદ્ધિ.

અપક્ષપાતો, નિઝરાપ્ત ચિંતા, પંચાપિ ધર્મ નૃપ પુંગવાનામ્.

એટલે કે દુષ્ટને દંડ મળે કેથી પોડિતને ડંખ ન રહે, અન્યાયની પ્રતિષ્ઠા ન થાય, ન્યાય જીતે છે તેની સમાજને ખાત્રી થાય, ન્યાયથી કોશાશ્વાધિધ થાય; સંજનતાની પ્રતિષ્ઠા થાય, આર્થિક વિ. ભાય્યાતો અંગે અપક્ષપાત રહે તેમજ રાજ્યહિત ચિંતન થાય, કેથી અનિષ્ટો દૂર કરી શકાય. એ પાંચ રાજના ધર્મ છે.

રાવણુ સીતાજીને હરી ગયો. તેમને પજવ્યાં છતાં સીતાને ડંખ ન રહ્યો કારણ કે તેમના પતિ રામ હતા. વળી રાજ્ય રાવણુના જ ભાઈ વિભીષણુને આપૈયું હતું. પણ દુર્યોધને જે કાર્યવાહી કરી દુઃશાસન દારા ચોટલો પકડીને દ્રૌપદીને લાવવામાં આવી; તેનું દુઃખ દ્રૌપદીને હતું, તેનો પડ્યો પાંડવોમાં પણ્ણો હતો. આ ડંખ કઢાવવા માટે મહાભારતનું યુધ્ય થયું! આ ડંખ કેવળ એક નારીનેના ન હતો. પણ આખા સમાજની નારીઓનો હતો! જે તે ન નીકળત તો સ્વીઓની શી દસ્તા થાત? તે માટે કુંતીએ કહ્યું :—

“યદ્ર્યં ક્ષત્રિયઃ સૂતે સોઢ્યં કાલઃ સમાગતઃ:”

એવો કાળ આવ્યો છે કે જેને માટે ક્ષત્રિય માતા આવા પુત્રોનો પ્રસવ કરે છે. આ ડંખને વળાંક આપવા માટે શ્રીકૃષ્ણ ખુદ લવાદી

કરવા ગયા હતા. બન્નેનો મેળ ભણે તો સારું. અંતે પાંચ ગામ આપવા કહ્યું; પણ દુર્યોધન ન માન્યો, એટલે યુદ્ધ થયું !

ભારતમાં ‘પંચ’ કે લવાદ તરીકે અગાઉ રાજ હતા. પછી ઝડપિયો, ખાલિશો. અને ન્યાયમંત્રીઓ આવ્યા. આજે આપણે ત્યાં જે ન્યાય-પ્રથા છે તે પદ્ધતિમાંથા આવેલી છે. તેના ઉપર ઈસાઈઓ તેમજ મુસ્લિમ શાસકો બન્નેનો પ્રલાવ છે.

### ન્યાયનો વિકાસ :

પદ્ધતિમાં ન્યાય આપવાનો વિકાસ થયો. ત્યાં રાજ્ય સિવાય બીજુ કાઈ સંસ્થા ન હતી. એટલે ન્યાયનું કામ રાજ્યને સોધાયું !

ઘરસ્થામાં ખલીફાના રાજ્યમાં કાજ ન્યાય કરતા, ખલીફાનો દિકરો ભૂલ કરે તો તેને પણ સરળ થતી એટલે કહેવાયું કે “કાજ દુધલે કર્યોં ?” તો કહે “સારે શહરકો દિકર !”

તારે પ્રિસ્તી ધર્મમાં રાજ્ય સરોંપરિ હતું એટલે તે ન્યાય આપતું પણ ધીમે-ધીમે તંત્ર બહલાયું. ન્યાયનું તંત્ર ઊભું થયું. ન્યાય કાણ્ય કરે ? તો કહે કે તઠસ્થ માણુસોને સોંપવો એમને ન્યાયાધીશ કહ્યા. ત્યારથાદ વધુ વિકાસ થયો. ન્યાયાલયો થયાં-કરિયાદી અને આરોપી પક્ષની વકીલાત માટે વકીલો થયા ! આ છતાં પણ ન્યાયની અંતિમ સત્તા-દયા આપવી; એ રાજ્યના હાથમાં રહી.

પણ આ બધામાં જે ડંખ જવો જોઈએ તે જતો નથી. પરિણામે ન્યાયાલયો ધર્માધ્યાન બુદ્ધિપૂર્વક દલીલોની જતનું સ્થાન બને છે અને લોકો સમજે છે કે ન્યાય એમને મળતો નથી.

ડંખ કાઢવા માટે ભારતની સંસ્કૃતિમાં ધર્ષાં ઉજાજવળ પ્રસંગો છે ! જહાંગિર ધોખણુના દિવમાંથી ડંખ કાઢવા તેના હાથમાં બંદૂક આપીને પોતાને મારવાનું કહ્યું ! તેની ધારી અસર થઈ. અને ધોખણુના દિવમાંથી ડંખ જતો રહ્યો !

આજે એવું કયાં થાય છે ?

જો કે ન્યાયમાં હમણાં જેટલાં શોષિત-પીડિત છે તેમને જ મહત્વ અપાય છે. મકાન માલિક ભાડૂત પાસે મકાન આવી કરાવી શકતો નથી; જમીનદારોને ગણેણાતિયાને નેમનો હજુ આપવો પડે છે; સ્વી અને પુરુષોમાં સ્વીઓને પહેલી પસંદગી આપવામા આવે છે, મજૂર-માલિકના પ્રશ્નમાં મજૂરને પહેલું મહત્વ અપાય છે, પણ આ બધું ઉપરખલું થતું હોય તેવું લાગુછે. લોકોને થયેલા અન્યાયો દૂર ન થાય ત્યાં સૂધી એ પ્રશ્ન અધૂરો જ રહેશે ! તે માટે પરિસ્થિતિ સર્જવી પડશે. રાજકારણનું ધડતર થતું જાય તેમ ન્યાય તંત્ર બધાય છે. જ્યાં લાંચ-દિશવત કે સત્તા-સ્વાર્થ જ રાજકારણનાં અંગો બન્યાં હોય ત્યાં ખરો ન્યાય ક્યાંથી મળે ? એટલે આજનાં જીલાં કરેલાં પંચો શેહ-શરમમાં તણાઈ જાય છે. એવી પરિસ્થિતિમાં લવદ નીમો તો ખોટાં મૂદ્યોને પ્રતિષ્ઠા મળી જાય છે. એટલે સાચી અસરકારકતા પેઢા કરવા માટે ચારે સંસ્થાનો અતુઅંધ થાય તો જ કંઈક થઈ શકે ! એ માટે આમરણાંત ઉપવાસ કરવા પડે તો તે પણ કરીને એ અસર જલ્દી કરવી પડશે !

કેટલાક પ્રશ્નો ! હું એકવાર ચાતુર્માસિમાં કોઠ ગામમાં હતો. ત્યાં એક મુદ્દો આવ્યો. એક પટેલે એક કુંભારના ધરની સામે માતાની દહેરી નાખી. કુંભાર એટલે વસવાયા. એમનું શું ગન્યું ? તેની સ્વી મારી પાસે આવી. ધખા પ્રયત્નોના અંતે પ્રશ્ન લવાદને સેંપાયો. આ દહેરીનું ઉત્થાપન થવું જોઈએ, તે નક્કી થયું; પણ તે કામ કોણું કરે ? કોઈ માથે લેવા તૈયાર ન થાય; દેવતનું ઉત્થાપન થાય અને દેવ કોણે તો ? પટેલને દેવીએ એવું સરખનમાં કહ્યું કે “ મારે બીજાની જમીનમાં એસવું છે ! ” ત્યારે તેણે સ્વખામાં દેવીને સમજાવવાં જોઈએ કે “ માઝ ! મારા હજની જમીનમાં એસો ! ” આવા પ્રસંગોમાં પંચ તટરથ ન હોય તો ન્યાયનું મૂદ્ય રહેતું નથી. પણ થોડા પૈસા અપાવી હે છે પણ ન્યાયની જીત થતી નથી ! ત્યાં ચાઅડભાણું થાય છે. એટલે સમાજમાં નિરાશા થાય છે અને ન્યાયની પ્રતિષ્ઠા સમાજમાં થતી નથી.



ભાવનો એક પ્રસંગ છે. એક દરજી પોતાની સિલાઈના પૈસા લેવા એક પટેલને ત્યાં ગયો; તો પટેલે પૈસા આપવાનાં તો દૂર રહ્યા પણ તેને બારણું ખંધ કરીને માર્યો. હું ત્યાં હતો. મારી પાસે એ પ્રશ્ન આવ્યો. મેં ગામ લોકોને બોલાવીને ન્યાય કરવાનું કહ્યું. લોકો પટેલની શહેરમાં તણુાઈ ગયા અને કહેવા લાગ્યા કે “એને ધી-ગોળ અપાવો એઠલે શરીર તાજું માતું થઈ જશે.”

મેં કહ્યું : “એ બરાબર નથી. આ ગરીબ માણુસ છે. એના ઢોકાણું તમે કોઈ હોત તો ? કોઈ ગામનો મોટો માણુસ હોત તો ? સાચો ન્યાય તો એ છે કે એનો વાંક ન હતો; પટેલ દેણુદાર હતો. છતાંયે માર્યો। તો કાલે તમે લેણું માગવાં જરૂરો. તો તમને પણ મારશે અને ખાડો દાખલો એસશે. માટે જે સંજ એણે દરજીને કરી તે સંજ દરજી એને કરે !”

લોકોને ગળે વાત ઉત્તરી. પટેલ પણ ઝુશીથી તૈયાર થયા. પણ દરજીના મનમાંથી ડંખ જતો રહેલો એઠલે તેણે ક્ષમા આપી. બન્ને પક્ષે ડંખ નિકળી ગયો. અન્યાયી જ્યારે જતે એવી જ સંજ લેવા તૈયાર થાય છે ત્યારે બન્ને પક્ષે મનનું ખરું સમાધાન થઈ જય છે. વેર ન લેવું; ડંખ ન રાખવો, ન્યાયની જીત અને અન્યાયની પ્રતિષ્ઠા આ ચારે વાતો લવાદ વડે ઉપજવી જોઈએ.

લવાદનું તરત્વ એ છે કે ન્યાયમાં પક્ષપાત ન થાય; ન્યાયના મૂલ્યો ન ખોવાય ! શુદ્ધિપ્રયોગ કરતાં પહેલાં તેતી શક્યતા હોય તો તેનો વિચાર કરવો જોઈએ પણ શુદ્ધિપ્રયોગ શરીર થયા બાદ લવાદ કરવાથી અન્યાયને ટેકો મળો જવાનો સંભવ રહે છે. આર્થિક કે ભેજસેળવાળા પ્રશ્નોમાં બન્ને પક્ષની સંમતિથી લવાદ કરી શકાય પણ સામાજિક કે અન્યાયના પ્રશ્નોમાં બાંધછોડ કરવા જતાં; મૂળભૂત તરત્વ જ ખોવાઈ જય છે; અહીં લવાદ ન જોઈએ.



## ચર્ચા - વિચારણા

[ ગયા અડવાડીએ ચર્ચાના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોમાં લવાદ અગેની વાતો હતી. તે આજના વિષયના સંદર્ભમાં હોઠને અહીં રજૂ થાય છે.-સ. ]

**કેટલાક પ્રશ્નો !**

**પુ. મુનિશ્રી નેમિચંદ્રાલુ :** શુદ્ધિપ્રયોગ માટે આ ચાર વાતો વિચારવા જેવી છે :— ( ૧ ) લવાહી હોઠ શકે નહીં ? ( ૨ ) કાનૂનને આજરો લેવો કે નહીં ? ( ૩ ) નજીવા પ્રશ્નો માટે આતું મહાન સાધન શા માટે લેનું જોઈએ ? ( ૪ ) જેના ઉપર અન્યાય થયો છે તે પોતે શુદ્ધિપ્રયોગમાં એસે કે નહીં ?

આ પ્રશ્નોની વિચારણામાં લવાદ અગેની વાત લેવાઈ અને ચર્ચાની સાર આ પ્રમાણે નીકળ્યો :—

“ ભાલનળકાંડા પ્રયોગમાંનો શુદ્ધિપ્રયોગ સમજવટ, અસહકાર, બહિજીવાર વગેરે બધા ઉપાયો પછી આવે છે. જે રાજ્ય ન્યાય માટે સંસદ ઉપર લવાદ હોતો નથી; સર્વોચ્ચ અધારત ઉપર લવાદ હોતો નથી; તો લોકો અને લોકો ઉપરની નૈતિક સંસ્થા પ્રાયોગિક સંધનો શુદ્ધિપ્રયોગ થાય. ત્યાં લવાદ કેમ હોય ! હોય શકે જ નહીં. ”

સાણુંદનો પ્રશ્ન ચોક્કેએ અને ચટ હતો છતાં લવાદની વાત લાવતા હતા; તે ભરમાવવા આતર કે લોકો લવાદનું તત્ત્વજ્ઞાન જાણતા નથી અને ન્યાયને બદલે સમાધાનમાં માને છે તે ન્યાયને નામે બદલે ભરમાય; પણ લવાદ એટલે ભાંજમડ નહીં, પણ શુદ્ધ ન્યાયશોધક તત્ત્વ લઈએ તો શુદ્ધિપ્રયોગમાં જનતા શુદ્ધ થઈને ખુદ લવાદ જેવી ખની જાય છે. સાણુંદની જનતા અને માટલિયા જેવા રચનાત્મક કાર્યકરોનાં નિવેદનો, એ લવાદની સિદ્ધિ છે. આથી રનિયંકર મહારાજે પણ તેમને વખાણુંતો પત્ર ત્યારે લખ્યો હતો.

[ અહીં હવે આજ દિનાડની ચર્ચા વિચારણા આપવામાં આવે છે. સ. ]

## કેટલાક અનુભવો :

આજની ચર્ચાનો પ્રારંભ કરતા શ્રી. માર્ગલિયાએ દરખાસ્ત મૂડી કે શ્રી. અંબુલાઈ આજના મુદ્દા ઉપર સપ્તિરોષ કહે. વર્ગમાં તે દરખાસ્ત મંજૂર થતાં શ્રી. અંબુલાઈ બોલ્યા. તેમની તઠસ્થ દર્શિ, તર્કોથી સલર સર્વાંગી દર્શિએ છણુવટ અને પ્રતિપાદક શૈલી આકર્ષક હતી. તેમણે કહ્યું, તેનો નીચોડ આ પ્રમાણે છે :—

**શ્રી. અંબુલાઈ :** “ લવાદી અંગે સવારે મહારાજશ્રી સંતખાલજાએ જે સિદ્ધાંતો મૂક્યા છે તે રીતે જેતાં, આજની લવાદી, વહેવારમાં સાચાં ન્યાયો મૂલ્યોને અફલે લાંજગડેજે પરિણમે છે. ખરી રીતે, (૧) ન્યાયનાં નવાં મૂલ્યો સમાજને આપવાં, (૨) નવાં મૂલ્યોનાં ન્યાયવાળો ચૂકાદો આપવો અને (૩) ન્યાયનું (નવાં મૂલ્યોનું) પાલન કરાવવનું—આ તરણે બાધતો લઈતે આપણે શુદ્ધિપ્રેરોગને ચકાસવો જેધાએ.

જેમ, આજે રાજ્ય કાયદા ધરે છે; પણ ચૂકાદો ન્યાયાધીશ આપે છે અને પોલિસ દ્વારા એ ચૂકાદાઓનું પાલન કરાવે છે; તેમ હવે ધર્મભ્ય સમાજરચનામાં માનતારી સંસ્થાઓએ માત્ર નવા ન્યાયનું કામ જ નહીં; પણ એવા ચૂકાદા અને ચૂકાદાઓનું પાલન થાય તે આખી પરિસ્થિતિ પલટાવવાનું કામ કરવાનું છે.

સાણુંદના શુદ્ધિપ્રેરોગની વાત રૂપણ હતી. પ્રાયોગિક સંધના હાથ તળેની સંસ્થાનાં નાણું, બીજી સંસ્થા જીભી કરીને લઈ જવાયાં. આ સત્યમાં ડોઈનો ભતભેદ ન હતો. છતાં લવાદીની વાત લાવવામાં આવી; અને એ બ્રમણુંમાં સારા એવા કાર્યકરે પણ ભરમાઈ ગયા. સારું થયું કે લાઈ માર્ગલિયાએ તળથી શોધન કરીને, એક રચનાત્મક કાર્યકરણે જગત આગળ સમયસર સત્ય જાહેર કરી દીધું.

સાળંગપુરની ઐડૂતોની જમીન પહાણીપત્રકમાં ઐડૂતોના નામ ઉપર ન હતો; તે સમાજને મંજૂર હતું; ઐડૂતોને મંજૂર હતું. સાળંગપુર મંહિરને મંજૂર હતું. છસો સાતસો વીધાં જમીનનો પ્રશ્ન હતો. આમ પ્રશ્ન સાવ રૂપણ છતાં લવાદીની વાત થઈ. સહુને જે વાત

મંજુર હોય તેમાં કઈ રીતે લવાદી હોઈ શકે? આપરે સત્ય-ન્યાય માટેના ચાર માસના શુદ્ધિપ્રયોગ પછી મંહિરે પણ એકરાર કર્યો. પછી વધુ ભાગ લીધો હતો તે પરત કરવામાં કાયદેસરની મુસીબત હતી. (જમા થઈ ગયા પછી રકમ પાછી આપવા અંગે) ત્યાં લવાદી જરૂર હોઈ શકે.

એજ રીતે સાણુંદના પૈસા ખીને લઈ જવાયા—એ ભૂલનો એકરાર થયા બાદ, કાંઈક વપરાયા હોત તો તેનું શું કરવું એ લવાદીનો મુદ્દો થઈ શકત. પણ મૂળભૂત સર્વમાન્ય ભૂલના એકરારની વાતમાં લવાદીની વાત હોઈ શકે નહીં.

સ્વરાજ્યની લડત વખતે બ્ધીશ સરકાર કહે કે “સ્વરાજ્ય આપવું કે નહીં તે અંગે વાત લવાદી ઉપર છોડીએ!” એ એક વાહિયાત વાત ગણ્યાય. તેવીજ રીતં સાણુંદ શુદ્ધિપ્રયોગ વખતે આવેલી લવાદીની વાત વાહિયાત હતી. હમણાં પંનાભી સુઝો આપવો કે નહીં એ વાત લવાદ ઉપર છોડવાની વાહિયાત માગણી થઈ. બિન ડોમવાદી સરકાર અને ડોમવાદી માગણી કરનાર જૂથ વર્ચે લવાદ હોઈજ શકે નહીં. મતભેદનો મુદ્દો હોય; પણ સિદ્ધાંત એક હોય ત્યાં લવાદ હોય શકે અથવા ચૂકાદાની બાબતમાં સિદ્ધાંત સચ્યવાતાં, વિગતમાં ફેરફાર કરવામાં લવાદ થઈ શકે. સાણુંદના ઋષિ બાલ મંહિરના સાખનોનો મુદ્દો મતભેદનો હતો, ત્યાં લવાદનું સ્થાન હોઈ શકે.

આને રાજ્યની દંડશક્તિ પાછળ કરોડો ઇંધિયા બરાબાદ થાય છે, જ્તાં ન્યાયની બાબતમાં તેની ધણીવાર લાચારી હોય છે. દા. ત. સાળંગ-પુરના પણણીપત્રકમાં નામ ન હતાં; તે સાળંગપુરના ઐડૂરોની વાત સરકારના જવાબદાર અમલદારો જાણુતા હતા; પણ શું કરે? સાક્ષી પુરાવા આપનારજ ન મળે, ત્યાં શું કરવું? શરીર હોય તો તેને ટકાવી રાખવા માટે ચોડી હિંસા થાય; (હવા, પાણી, અન્ન વગેરે લેવામાં) પણ તે કારણે આપધાત ન થાય. સંતખાલજ એમ માને છે કે અહિસંહ દિશામાં નેતિક સામાજિક દ્યાખુમાં ચોડી હિંસા છે; પણ તે દંડ

શક્તિની અપેક્ષાએ અહિંસા છે. એવીજ રીતે આધ્યાત્મિક દ્યાણુની હિંસા, નૈતિક સામાજિક દ્યાણુની અપેક્ષાએ અહિંસા છે. તે દર્શિએ એ ક્ષમ્ય પણું છે. એ શક્તિને લઈને દંડશક્તિ પણું અહિંસા તરફ વળશે અને આધ્યાત્મિક દ્યાણ તથા અહિંસા તરફ લોકોની શક્તા વધશે.

અમે તો જ્યાં જ્યાં શુદ્ધિપ્રયોગ કર્યા, ત્યાં એકપણું અપવાદ સિવાય સો ટકા સફળતા મેળવી છે. આપણે આગળ વધશું તો રાજ્ય પાછળ આવશેજ. સાળંગપુરમાં રાજ્ય ભણોર મારવા પાછળ આવ્યુંજ હતું. શુદ્ધિપ્રયોગની ખૂબી એ છે કે તેથી થતો નવો ન્યાય ગરીબમાં ગરીબ માણુસ માટે જીબો થાય છે; જૂનાં ખોટાં મૂલ્યો ખરે છે. તેમજ જનજગૃતિ આવતાં રાજ્ય અને દંડશક્તિનું બળ ધટે છે. સમાજ શુદ્ધ થાય છે. શુદ્ધિપ્રયોગો જ્યાં જ્યાં થયા છે ત્યાં ત્યાં તે પહેલાં સમજવટ, દ્યાણ વગેરે બધા પગલાં લેવાછ ચૂકાયાં હતાં.

અહીં એક ખીજે ખુલાસો કરો. કેટલીક વાર કહેવાય છે કે સુનિશ્ચ સંતાપાલજ રાજકારણમાં શું જાણે? બંધ બાંધવામાં ડર્જનેર, શિક્ષણમાં શિક્ષક, આરોગ્યમાં વૈધ, તેમ રાજકારણમાં ધર્મ હેવી રીતે પ્રવેશાવવો તે જો ધર્મસંસ્થાના, આચાર ઘડતર પામેલ સાધુપુરુષો નહીં જાણે, તો ખીજું કોણ જાણુશે?

અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિશ્રદ્ધ એ જો બ્યાપક ધર્મ હોય તો તે સાધુ પુરુષો કે જેઓ બ્યાપક દર્શિ અને વિશ્વવાત્સલ્યમાં માને છે, તેઓ નક્કી નહીં કરે તો ખીજું કોણ નક્કી કરી આપશે?

હા, એ વાત સાચી છે કે આજની ધરેડમાં કે તણ્ણાઈ રહ્યા છે, એવા સાધુઓ પહેલાં અથવા એ ધરેડમાંથી સાચી દિશામાં માયું ઉંચકતા ઉરશે; તેઓ આ નક્કી નહીં કરી શકે. તેટલા માટે તો ‘કાંતિપ્રિય’ વિશેષજ્ઞ લગાડાય છે. મારા નન્દ મતે, આ સાધુસાધ્વી શિદ્ધિરમાં એ દર્શિ હતી અને છે. જેથી નવી સંસ્થા કે સંપ્રદાય જીબો ન કરવો પડે અને ચોતાને સ્થાને રહીને; સાધુસાધ્વીઓ આ અતુભૂત વિચારધારાને આગળ ધર્પાવી શકે! ”

ત्यारभाव प्रश्नोत्तरी नीचे मुજऱ्य थમ.

શ્રી. દેવજીભાઈ : “ દાંડ માટે શો ઉપાય ? ”

શ્રી. અંબુલાઈ : “ દાંડ માણુસો ચોરી કરે, છેડતી કરે અથવા અન્ય ખોટાં કામ કરે અને સમાજ મૂળે રહીને જેયા કરે એમ હેખાય છે, પણ ખરી રીતે તો આંખ આડા કાન કરીને સમાજ એને આડકતિં પ્રોત્સાહન આપી રહ્યો હોય છે. જે એ સંગઠિત અને જાગૃત રહીને પડકારે કરે તો દાંડાઈ ટકી શકે જ નહીં ! દાંડાઈને ટકવા માટે સમાજની ધરતી જોઈએ તે મળે ત્યાં લગી જ દાંડાઈ ટકે છે.

શ્રી. દેવજીભાઈ : “ એવાં તત્ત્વાને દૂર કરવા માટે રાજ્યની દંડશક્તિની મદ્દ લેવી કે નહીં ? ”

શ્રી. અંબુલાઈ : “ પ્રથમ પગલું આધ્યાત્મિક દાયારાનું છે. ખીજું પગલું નૈતિક સામાજિક દાયારાનું છે. ત્રીજું પગલું પ્રજા-માન્ય સરકારનું છે. આ ત્રણે પગલાં લેવામાં હરકત ન હોઈ શકે. સવાલ માત્ર એટલો છે કે આપણો જોક મુખ્યત્વે આધ્યાત્મિક કે નૈતિક સામાજિક દાયારાનો હોવે. જોઈએ કે રાજ્ય તરફનો ? મારા નામ મટે આપણો જોક આધ્યાત્મિક પુરષેની શુભેચ્છા સાથે નૈતિક-સામાજિક દાયારું તરફે રહે છે. બાકી આપણાં પગલાંથી સરકારની દંડશક્તિ જગીને આપોઆપ કામે લાગે તો તેને આપણે રોકશું નહીં. એ પણ જેવાયું છે કે સરકારની દંડશક્તિ કામે લાગે જ છે અને તે પણ અહિસાને માર્ગ વળે છે. ૧૯૫૬ ના મહાગુજરાતના અમદાવાદ ખાતેના તોકાનોમાં આમટુકડીએ ઉપર હુમલા થયા ત્યારે પોલિસ પોતાની દંડશક્તિના બદલે ક્ષમારીલતા વધારી શકી હતી.

તેનાથી જિલ્લાં એક રથે જેયું. એક પોલિસ અધિકારીએ આવી શરૂ થવમાં છુકું ગોઠવી એક દાંડ આગેવાનું ખૂન કરાવ્યું. થોડો સમય શાંતિ લાગી, પણ, સમય જતાં હેખાયું કે એક ચૂંઢો ગયો પણ, ખીજ પાછા ઊભા થયા જ. એટલે જ્યાં લગી બન્ને બાજુંનું કામ ન થાય; એટલે કે મુખ્યપણે લોક જગૃતિનું કામ ન થાય ત્યાં લગી

ગુંડાગીરી. દાદાગીરી કે દાંડાઈ અટકે જ નહીં. જોલટું જે માણુસ ગુંડાને મારે તેજ આગળ જતાં યુંડો ન બની જય તેનાથે ખાતરી નથી. આ અધું જોતાં આજના યુગે સંસ્થા દારા શુદ્ધિપ્રયોગ અનેડ ધૂલાજ લાગે છે.’

**શ્રી. ભાઈલિયા :** “કાયરતા કરતાં સામનો લલે સશ્વત્ત્ર હોય તો તે સારો! તે પણ અઃમરક્ષકદ્વલ દારા થાય તો તે ક્ષમ્ય છે; કારણું કે તે પ્રણમાન્ય અને સરકાર માન્ય છે. કોઈ પ્રસંગ એવો આવી જય છે કે અગુંતપણે રાજ્યને અને સમાજને ચેતવીને દાંડ સામે સશ્વત્ત્ર પ્રતિકાર કરી શકાય! પણ હંમેશા માટે તેનું વિધાન ન કરી શકાય !

અમારે ત્યાં એક લરવાડ અનેક બહેનોની છેડતી કરે. કોઈઠું માનેજ નહીં. રાજ્યને તો કાયદા વગેરેની ધર્શી મર્યાદા છે. તેવામાં એક આલણે સંકલ્પ કર્યો: ‘નો એ માઝી જહેરમાં માગી, પોતાના જીવનને સુધ્યારવાની ખાતરી નહીં આપે તો હું ઉપવાસ ઉપર જિતરીશ !’

ખીજે જ હિવસે તે ગુંડો નભી ગયો. અલખત આવાએની દાંડાઈ દૂર કરવા માટે અંખુલાઈ કહે છે તેમ સંસ્થાકીય નૈતિકભણ મદદમાં હોય તેજ તે અસરકારકપણું કાયમી રકે. ”

**શ્રી. ઓઝી :** “ધર્શીવાર કોઈ માતખર સંસ્થા પણ દાંડાઈને સીધો કે આડકતરો રેકા આપે તો શું કરવું ?”

**શ્રી. અંખુલાઈ :** “નમતા, સૌભ્યતા, ભૂલ સુધ્યારવાની તૈયારી વગેરે સત્યાગ્નીની શાંતો છે. કેટલીકવાર આપણે દાંડાઈ માની લીધેલી હોય છે; તેમાં આપણો નિર્ણય ઉપલભ્યો કે ઉતાવળો હોય છે. કયારેક પૂર્વયધવાળો હોય છે. વળી વ્યક્તિગત રીતે લોકશ્રદ્ધ પણ જીતી લીધી હોતી નથી. આથી સંસ્થાના અંચાલનની નીચે આવા પ્રસંગો મૂકવા એ સલામત રસ્તો છે, જેથી ગફ્ફલત થતી હોય તે ચણાઈ જય. વળી ઘેડૂત મંડળ, એટલે કે નૈતિક ગ્રામ સંગડન પ્રથમ અદાલત; તેના ઉપર પ્રાચીગિક સંધની અદાલત અને ઉપર વિશ્વતસલ-સંધની કલ્પના છે. અત્યારે તો મોટા ભાગે આ બધી અદાલતો ખૂબ છણ્યા બાદ ન્યાય થતા હોય છે—એવી સહજ રિચિત્ત હોય છે. ( ૬-૧૦-૬૧ )



## શુદ્ધિપ્રયોગ અને રાજ્યાશ્રય

સામુદ્દર્યિક અહિસાના પ્રયોગોમાં; શુદ્ધિપ્રયોગ એક એવું સાધન છે, જેમાં સામુદ્દર્યિક અહિસા આગળ વધી શકે. વ્યક્તિના અનિષ્ટની સામે વ્યક્તિગત દિલાણું તો લાવી શકાય પણ તેની અસરકારકતા સ્થાયી નથી રહેતી, એટલે આપણે સામુદ્દર્યિક દિલાણું લાવવું છે. એ દિલાણું શુદ્ધિપ્રયોગથી લાવી શકાય છે. અગાઉ આપણે શુદ્ધિપ્રયોગમાં લવાઈ ક્યાં અને કયારે એ અંગે વિચાર કર્યો છે. આજે શુદ્ધિપ્રયોગમાં રાજ્યાશ્રય લેવો કે નહીં એ અંગે વિચારવાનું છે. જો કે અનુભંધ વિચાર ધારાનો મેળ શુદ્ધિપ્રયોગ ભાગે હોવો જોઈએ પણ અહીં રાજ્ય શું અને એનાં અગો ક્યાં, એ અંગે વિચારિયું.

રાજ્યના મુખ્ય ત્રણ અંગો છે :— ( ૧ ) ધારાસભા—જે પ્રજાનું ચૂંટાયેલું માંડળ કાયદા ધકે. ( ૨ ) ન્યાયખાતું—તે કાયદા પ્રમાણે ન્યાય અંગે ફેંબલો કરે; ( ૩ ) વહીવટી તંત્ર—રાજ્યને ધડાયેલ કાયદાના ન્યાય પ્રમાણે ચલાવે! ધારાસભાનું મુખ્ય કામ દેશહિતને ધ્યાનમાં રાખીને કાયદાઓ પસાર કરવાનું છે. ન્યાયખાતું એ કાયદા પળાવવાનું કામ કરે છે. તે એક તરફ અમલદારોને વ્યવસ્થિત રાખે અને ખીલું તરફ સરકાર સામે ફરિયાદ કરવી હોય તો તે પણ કરી શકે. કોઈ માણસ ભૂલ કરે તો કોઈ તેને જણ કરે. જણનો અમલ કરવા માટે ચોલિસ તંત્ર હોય છે. તે જ રીતે દેશનો વહીવટ ચલાવવા માટે તલાટીથી માંડીને ડલેકટર સુધી, પછી પ્રાંતીય સરકારો અને અંતે મધ્યરથ્ય રાજ્ય આવે છે. આ છે રાજ્યનો સામાન્ય ઘ્યાલ!

**રાજ્ય પણ સંસ્થા જ છે ને?**

શુદ્ધિપ્રયોગ સંસ્થા દ્વારા થવો જોઈએ, એમ આપણે વિચારી ગયા છીએ. તો કોઈ કહેશે કે રાજ્ય પણ એક સંસ્થા છે. તે પણ

પ્રગણએ ચૂટેલી સંસ્થા છે. તેનું બંધારણું છે.. તે ન્યાયનું કામ કરે છે—  
વહીવટનું કામ કરે છે—ખંડું કરે છે. તો પછી રાજ્યાશ્રયનો ધનકાર શા  
માટે? એનો જવાબ એ છે કે શુદ્ધિપ્રયોગ સરકારનો ધનકાર નથી કરતો  
પણ તેનો આશ્રય લેવા જવામાં માનતો નથી. પણ જે સામેથી મદ્દદરૂપ  
થવા આવે તો તેને ના નહીં પાડે.

આ માટે સાળાંગપુરના શુદ્ધિપ્રયોગનો દાખલો જોઈ એ. શ્રી. કુરે  
શીલાઈએ જેયું કે આ મંદિરવાળા લોકોને ખૂબ રંનાડે છે, સભાએ  
કરે છે અને સરધસ કાઢે છે. શુદ્ધિપ્રયોગમાં ભગેલા માણુસો નીકળે  
તેમનો હુસ્તિયો. ઓલાવવો કે મશકરી કરવી; એવું મેલું વાતાવરણ તેમણે  
સરળ્યું હતું. બહારગામથી ઘેરૂતોની હુકીડીએ આવે તેમનું અપમાન  
કરે, છાંજિયા લે, ધાંખલ કરે, હોયાળા કરે। કુરેશીલાઈએ આ ગજરે  
જેયું, કેટલંક સાંભળ્યું! તેઓ પ્રાયોગિક સંધના પ્રમુખ હતા; બીજુ  
ખાજુ ધંધુકા તાલુકાના સભ્ય હતા. તેમને થયું કે, ધારાસભ્ય તરીકે  
મારી ફરજ છે કે આ જાતનું તોઝાન થાય, અપમાન થાય અને તે  
પણ જે લોકો ન્યાયની મદ્દદ આવ્યા છે તેમનું; એટલે મારે પોલિસ  
તંત્રને અને મામલતદારને ખ્યાલ આપવો. જોઈ એ. આમ વિચારી  
તેઓ શુદ્ધિપ્રયોગની છાવણીમાં આવ્યા. છાવણીના સંચાલક શ્રી. નાન-  
અંદાઈ હતા. એટલે કાગળ લખીને તેમને પોસ્ટ કરવા આપ્યો.

નાનયાંદાઈએ ખહુ જ નભ્રતાપૂર્વક કહ્યું : “આપ પ્રાયોગિક  
સંધના પ્રમુખ છો. અહીં ધારાસભ્ય તરીકે સરકારનું ધ્યાન દેરા છો;  
પણ પ્રયોગ ચાલતો હોછને સામેથી ચાલીને મદ્દ લેવામાં અમે  
માનતા નથી. એટલે હું આ કાગળો નાખવા નહીં જઈ શકું. આપ  
બીજુ વ્યવસ્થા કરો !”

કુરેશીભાઈને નવાઈ લાગી કે આ કેવી જાતની કાર્યવાહી! એની  
ખૂબ ચર્ચા ચાલી, પછી સમન્યું કે શુદ્ધિપ્રયોગની છાવણીમાં એસીને  
સરકારનો આશ્રય ન લેવાય! બહાર જઈને ગમે તે કરો! પણ, જે  
સરકાર સામે ચાલીને મદ્દ આવશે તો ખુશીથી લેશો!

## શુદ્ધપ્રેયોગમાં રાજ્યાશ્રયનું સ્થાન :

આ પ્રશ્ન અણો અને ગંભીર છે. તેની ઊડી વિચારણા જરૂરી છે. રાજ્યનો આશ્રય માગીને ન લેવો, પણ, દેવા આવે તો ધનકાર ન કરવો! એનો આશ્રય એ છે કે શુદ્ધપ્રેયોગ એ લોકજનગૃતિ અને સાચા ન્યાય માટેની કાંતિનો પ્રયોગ છે. એટલે રાજ્ય પોતે કહિ કાંતિ ન કરી શકે. એ દખિએ તે રાજ્યથી અલગ જ થવો જોઈએ. અહીં સામાજિક-નૈતિક દ્યાણ વડે કેવળ એક વ્યક્તિ કે સંસ્થા સામે સાચા ન્યાયને સ્થાપવાનો કે અન્યાયેને ઉલેચવાનો જ પ્રયોગ થતો નથી; પણ લોકજનગૃતિ એ રીતે આખુવામાં આવે છે કે બવિષ્ય માટે પણ તે એક આધારશીલા બનીને રહે છે. તે એક એવું સ્વેચ્છાપૂર્વકનું નૈતિક વાતાવરણ ધડે છે કે જ્યાં ક્રીને એ અનિષ્ટને ફૂલવું-ફૂલવું ક્રપકું થઈ પડે છે. ત્યારે રાજ્યને તો કાયદો તોડે તે પ્રમાણે :સર્જાજ કરવાની હોય છે. શુદ્ધપ્રેયોગમાં આ સ્થળ સનાને સ્થાન નથી. પણ ઉંઘ નીકળી જાય તેવા પ્રકારના હૃદ્ય-પરિવર્તનને સ્થાન છે. એટલે એ હૃદ્ય-પરિવર્તન કરવાના પ્રયોગમાં રાજ્ય મદદરૂપે આવે તો ના ન પડાય; પણ સામે ચાલીને રાજ્યનો આશ્રય લઈને ગુનેગારને સર્જ ન કરાવી શકાય! રાજ્ય એકવાર ગુનેગારને પકડીને, સર્જ કર્યા વગર ન છોડી શકે! ત્યારે શારીરિક સર્જ એ શુદ્ધપ્રેયોગનું ધ્યેય નથી. કુચારેક દાંડ, બળનાખોર કે હિંસાવાદી તર્ફો ફાઠી નીકળે અને રાજ્ય પોતાની કામગીરી બળવે તો તેને મનાઈ ન કરી શકાય કારણ કે તે રાજ્યની ફરજ અને અધિકાર છે, એનો અધિકાર છીનવી ન શકાય! તેમાં ઉખલ પણ ન કરી શકાય!

આપુનું ખૂન થયું-ખૂની પકડાયો. એનો કેસ ચાલ્યો! રચનાત્મક ઝાર્યકરોમાં ચર્ચા ચાલી કે બાપુ અહિસાને વરેલા હતા; તેમની દખિએ આ ખૂનીને સર્જ થાય તે ધર્મચુનીય છે?

ત્યારે, કિશોરભાઈએ રહિયો આપ્યો કે બાપુ હ્યાત હોત તો થું કરત, એ જુદો સવાલ છે. પણ આજે તો રાજ્ય પાસે એ પ્રશ્ન

ગયો છે અને રાજ્યની જે ચાલુ વ્યવસ્થા છે તેમાં ઉખલ કરીને કે ધક્કો પહેંચાડીને આપણે કંઈ પણ નહીં કરી શક્યો !

ધણુંને એમ થશે કે સંજને ટેકો આપતાં હિસા નહીં થાય ! અહીં વિચારવાનું એ છે કે કોઈ ચોભય રચનાત્મક કાર્યકર કે ધર્મગુરુ વ્યક્તિગત રીતે ગોડસેનો પરિચય સાધી, તેનું હૃદય પરિવર્તન કરે અને ચોભય લાગે તો રાજ્યપિતાને અરજી કરીને પોતાનો અભિપ્રાય જણાવી શકે ! પણ, રાજ્યપિતાના ખૂનને શહીદીમાં ન ખપાવી શકાય—તેમજ જેનો હૃદય—પલટો થયો નથી તેવા માણુસને બચાવી અન્યાયને ટેકો આપવો તે હિસા જ કહેવાય ને !

ઓને દાખલો કાળું પટેલના ખૂનનો છે. તેના ખૂનીએ પકડાયા. મારી, રનિશંકર મહારાજની તેમજ ગામના પંચની ઝિંડા ગૂતો કખૂલ કર્યો. પણ, એટલું કહ્યું કે ‘અમે દ્શૂઠીએ તેમ કરજે’ ત્યારે અમે રૂપી કહ્યું : “તમારે ચુનાનો એકરાર કરવો જોઈએ, કાર્ટમાં સાચું એલાવું જોઈએ અને પરિણામે જે સંજ થાય તે બોગવવા તૈયાર રહેવું જોઈએ. સત્યનો સહાયક ઈશ્વર છે. પણ વ્યક્તિગત રીતે તમારા કલ્યાણનો પ્રયત્ન કરશું !” તેમને સંતોષ થયો હતો. કાર્ટમાં ગયા બાદ કાયદાની ખાંચખૂંચના કારણે તેઓ નિર્દોષ દ્શૂઠી ગયા હતા.

તોઝે પ્રસંગ ભાલના એક ગામમાં નાની બાળા ઉપર બળાત્કાર થયો તેનો છે. સરકારે કેસ કર્યો પણ ચુનેગારે સમાજ પાસે માફી માણી. હવે શું કરવું ? પ્રા. સંખ પાસે આ પ્રશ્ન આવ્યો ! સંધે કહ્યું કે અમે શારીરિક સંજમાં માનતા નથી, તેમ કાર્ટનો ધનકાર પણ કરતા નથી. એટલે તમારે તો કાર્ટ ને સંજ કરે તે બોગવવા તૈયાર રહેવું જોઈએ ! બીજુ બાજુ ચુનેગારે ભૂલ કખૂલ કરી પશ્ચાતાપ જાહેર કર્યો છે એટલે કાર્યકર અને ફરિયાદ પક્ષ સાક્ષી પૂરાવામાં તટસ્થ રહે, એમ કરવા સમજાયું. તેથી જું પણ ન એલાય અને એમ કહે કે હું જાણું છું પણ કંઈ કહેવા માંગતો નથી. એના પરિણામે કાર્ટના નિયમનો ભંગ પણ નહીં થાય ! ત્યારબાદ જે કંઈ સંજ થાય તે તેણે બોગવી

લેવી. આના પરિણામે ગુનેગારને સુંદર અસર થાય; ન્યાયમાં સંરોધન થાય અને લોકો જાગૃત થાય! આમ કરતાં સત્ય પણ જળવાય અને ન્યાયકોર્ટની મહત્વાની પણ જળવાય!

### શુદ્ધિપ્રયોગ અને ચાલુ ન્યાયમાં અંતર :

આજની ન્યાય-અદાલતો કાયદા દારા ચાલે છે એટલે તેમની ડેટલીક મર્યાદા આવી જાય છે. ગુનો પુરવાર કરવો એ ઇરિયાદીનું કામ છે. ડેટલાક પ્રશ્નોમાં સરકાર ઇરિયાદી અને છે. તેનો બચાવ સરકારી વકીલ કરે છે. ઇરિયાદી ને પણ તે મદ્દ કરે છે. આજના ન્યાયનો કાયદા એ છે કે બલે સો ગુનેગાર દ્શ્યા જાય પણ એક નિર્દેષ ન માર્યો જાય! પરિણામે સમાજમાં ગુનેગારા વધી ગયા છે. તેમાંથી ધણ્ણા તો ઉધાડા ગુનેગારા હોય છે. સમાજ તેમને પ્રતિષ્ઠા આપે છે. ધોળા ચોરી કરે તેને કોઈ પકડતું નથી; પણ, ગરીબ માણ્સ રોટલા માટે ચોરી કરે તો તેને સરળ થાય છે. એટલે ન્યાયકોર્ટની આ અપૂર્ણતા માટે જ શુદ્ધિપ્રયોગની જરૂર છે.

આપણી કદમ્બના એવી છે કે સરળ થવી જોઈએ પણ તે અહિસાની દિશામાં આગળ વધવી જોઈએ. ન્યાય તંત્રનાં અંગો—ન્યાયાલય, ન્યાયધીશ તેમજ વકીલની શુદ્ધિ થવી જોઈએ. કાયદા છે કે નવાખૂં ગુનેગાર બલે દ્શ્યા જાય પણ એક ખીન ગુનેગાર ન માર્યો જવો જોઈએ! આ જતની કાયદાથી નવાખૂં દ્શ્યા જાય છે અને એક જ પકડાય છે. ન્યાયધીશને કાયદાના ચોકડામાં રહીને ન્યાય આપવો પડે છે; તે અંતરાત્માને આધીન ન્યાય આપી શકતો નથી. ગુનેગાર નિર્દેષ દ્રુટ્યા પછી બહાર ફૂલહાર થાય છે; તેની પ્રતિષ્ઠા થાય છે. પરિણામે લોકોની ન્યાય ઉપરની શક્ષા તૂટે છે. પછી તેઓ કાયદા હાથમાં લે છે.

સરોજભાગા ખૂન કેસમાં ન્યાયધીશે ટીકા કરી કે એ કેસમાં બહારનું દ્શાણ લાવવામાં આવ્યું છે. સાંભળવા પ્રમાણે સરોજભાગાનું જીવન એવું હતું કે તેને લાજ બચાવવી, શીલ બચાવવું મુરકેલ બન્યું

અને તેણે આત્મહત્યા કરી કે તેને બાળવામાં આવી. પણ બાધ બળી ગઈ તે વાત સાચી હતી. હવે આ વાતનું સંશોધન સમાજ નહીં કરે તો બીજું કોણું કરશે? રાજ્યની મર્યાદા છે. કાયદાની પણ મર્યાદા છે. રાજ્યસંસ્થાની પણ મર્યાદા છે! પણ સરોળે આપધાત કર્યો તો તેનાં કારણોની તપામ તો થવી જોઈએ કે નહીં?

મેં આ અંગે એક લેખ લખ્યો. ત્યારે એક વકીલ તે અંગે ચર્ચા કરતા હતા. મેં કહ્યું કે “મારે લોકોની અદ્ધા ન્યાય તંત્ર ઉપરથી વરી ન્યાય, તેવું કરવું નથી. પણ ગુનેગારની શોધ આજે રાજ્ય કરતું નથી એટલે અનિષ્ટને અપ્રતિષ્ઠિત કરવાનું કામ કોણું કરશે.” સરોદ્યુહ કાર્યકરણે કુરસદ નથી. ડેટલાક ધારાસભામાં ગયા, તો હવે પ્રાયોગિક સંધ જેવી સંસ્થાની જરૂર છે. તેમજ આવા પ્રશ્નોમાં સમાજને જગૃત કરવા માટે શુદ્ધિપ્રયોગની જરૂર છે. એ રાજ્ય સાહેં કે જ્યાં સજી ઓછી હોય, ફરસીની સજી ન હોય—કાયદા ઓછી હોય અને પોલિસની ઓછામાં ઓછી જરૂર હોય. આ સ્થિતિમાં રાજ્યને દોરવું જોઈએ!

એક કાળ એવો હતો કે રાજ્ય ગુનેગારની શોધ જતે કરતું. જહાંગીરનો દાખલો છે. જ્યાં સુધી ગુનેગાર ન મળ્યો ત્યાં સુધી તેને ખાવાનું ન લાવ્યું. એક વખત તે જમવા એડો હતો. એગમ પંખાથી પવન નાખતી હતી; પણ બાદશાહ ઉદાસ હતો.

એગમે કારણ પૂછ્યું તો કહ્યું: “ધોખીને કોઈએ માર્યો છે પણ તેના ગુનેગાર જડેતો નથી!”

ગુનેગારને શોધવાની જવાબદારી ચોતાની! આજે તો શોધનાર જુદા, ન્યાય આપનાર જુદા, સ્થળ જુદા, ગુનો થાય ગામમાં, ન્યાય—તોળાય શહેરમાં. ધનવાળો હોય તે જુતે કે ખુદ્ધિવાળો હોય તે જુતે!

ત્યારે, શુદ્ધિપ્રયોગમાં સ્થળ ઉપર તપાસ થાય છે—ત્યાંજ પ્રયોગ થાય છે. ગુંડી આશ્રમમાં ચોરી થઈ. ચોર મળતો ન હતો એટલે

ખાંડી મુદ્દતનો શુદ્ધિપ્રયોગ થયો. લોકોનું ધ્યાન ખેંચાય કે આશ્રમ એ તેમની મિલકત છે. ગુનેગારને શોખવાનું કામ પણ તેમનું છે.

રાજ્યનો આશ્રય નહીં, પણ મદ્દ કરવા આવે તો લેવી! આ મદ્દમાં પણ પહેલો નંબર ખર્મસંસ્થાનો, બીજો નંબર લોક્સેપક સંસ્થા અને લોક્સસંસ્થાનો અને ત્રીજો નંબર રાજ્ય સંસ્થાનો! આ રીતે સાળંગપુરમાં કુરેશીભાઈનો આશ્રય ન લીધો! શુદ્ધિપ્રયોગ છાવણીમાં સરકારી મદ્દ કરનારને આવવાનો પણ અધિકાર નહીં.

અમદાવાદનાં તોકાનો વખતે ગ્રામ ટુકડીઓ ગઈ. પોલિસ તેમનું રક્ષણું કરવા તૈયાર થઈ. એટલે ટુકડીઓનોએ કલી દીધું કે “અમને તમારી જરૂર નથી. તમારી ઝરણ બજાવવી હોય તો જરૂર બજાવો! પણ, અમારા ઉપર હુંમલો કરનારને આપ પડકશો નહીં. આપ સહુ દખિયાર વગર સાદા વેશમાં આવો તો વધારે મારું!”

એ લોકોએ માન્યું. પરિણામ એ આવ્યું કે તોકાનીઓએ ઐદૂતોને હેરાન કરવામાં મણ્ણા ન રાખી. નાગા કર્યા, માર માર્યો, ગાળોનો વરસાદ વરસાવ્યો પણ શાંત! પોલિસ પણ શાંત. તે એટલે હદ સુધી કે એક મોટા અમલદારતી આંખમાં એક જણે ધૂળ નાખી છતાં તે શાંત રહ્યા. તેઓ ધારત તો મારી શકત! આ અસર આમટુકડીની હતી. ધીમે ધીમે તોકાનીઓને બખાએ વખોડ્યા અને વતાવરણ શાંત થયું. પરિણામે પ્રણ મોટા તુકશાનમાંથી ઉગરી ગઈ. ટુંકમાં શુદ્ધ પ્રયોગ રાજ્યની મદ્દ કેવા નહીં જય; આવરો તો પોતાના સિધ્ધાંતોની અંદર રહીને મદ્દ કરવા માટે ધન્કાર નહીં કરે.

સાળંગપુરમાં અમલદારો આજ્યા. ઐદૂતોને પૂછવા લાગ્યા. ઐદૂતોએ શુદ્ધ પ્રયોગવાળાને પૂછ્યું કે અમારે એમને જવાબ આપવો કે નહીં! શુદ્ધપ્રયોગ સમિતિએ તેમને છૂટ આપી કે તમારે જે સાચું હોય તે કહેવું જોઈ એ! આમ કાયદો મદ્દે આવ્યો તો પોતાની મર્યાદામાં તેની સહાયને નકારી નહીં. એ સાથે હિસાને ટેકા ન મળે તે પણ જેયું.

**શુદ્ધપ્રયોગ-અનુભંગ વિચાર ધારા વગેરેતું અંતિમ ધ્યેય તો એ છે**

કે સમગ્ર જીવન ઉપર રાજ્યની જે અસર છે તે એહી થાય; તેમજ રાજ્ય એછામાં એછી હિંસાથી ચાલે એવી સ્થિતિ સર્જાય! આ કાર્ય પ્રજાએ કરવાનું છે. તે માટે તેણે જગૃત થતું જોઈએ. પ્રજાતંત્રમાં પ્રજામાં નૈતિક-સામાજિક જગૃતિ હોવી જ જોઈએ. એવી જગૃતિ માટે શુદ્ધપ્રયોગ એક અહિસક સાધન છે; જે સામુદ્દર્યિક અહિસાના પ્રચારમાં અસરકારક છે.



### ચર્ચા - વિચારણા

શ્રી. માટલિયાએ આજની ચર્ચા શરૂ કરતાં કહ્યું :—આજનું પોલિસ તંત્ર પ્રજાલક્ષી બન્યું નથી ત્યાં લગી નગરો અને ગામડાનું રક્ષણ લોકાવલંખી બનાવવા માટે પોલિસતંત્ર અને શુદ્ધ પ્રયોગ બને વર્ચ્યેનું એક દળ જોઈશે! સરકારે જે કે ગૃહરક્ષકદળ અને આમરક્ષક દળ જીભાં કર્યાં છે, તેમને હથિયારો પણ આયાં છે પણ તે ખીજુ દર્ખિએ; કે દાંડ તર્તો સામે તે દળ ઉપયોગી થશે. આવાં દળો એકતરફ સરકાર સામે વધુ જેનારાં અને ખીજુ બાજુ દાંડ તર્તો સાથે પણ સખાધિત રહેવાનાં. એનાં કારણે આજની આમ-પંચાયતોમાં જેમ માથાભારે લોકો સરપંચ બની જાય છે તેમ આમાં થવાનું. પણ જે ઠેર ઠેર નૈતિક આમ સંગઠનો, માતૃસમાજો, મજૂર સંગઠનોનું નૈતિક પ્રતિનિધિત્વ જીલ્લાં થશે અને જિલ્લાવાર, તાલુકાવાર કે નાના વિભાગવાર શુદ્ધપ્રયોગનું તત્ત્વ આવશે તો તેવો માણુસ પ્રમાણમાં દાંડ નહીં રહી શકે. અને ધીર-ધીર અહિસાનો અંકુશ પણ હિસા ઉપર આવશે.

આનાં પરિણામે આપણે સેતે સ્વાવલંખનના કાર્યક્રમોમાં જે સ્વાવલંખી રક્ષા છચ્છીએ છીએ, તે આવવાની અને પોતાના ગામ કે નગરની બહેનોની બજજત રહે-શિયળ રક્ષાય તથા ગામ કે નગરની શાન વધે તેવું જ આમરક્ષકદળ કે નગર રક્ષકદળનાં માણુસો કરશે. એજ રીતે તેને શુદ્ધપ્રયોગની લાગણી થશે. તેમજ આપણી દર્ખિએ લવાદનો કાર્યક્રમ ચાલશે. આજે તો આમપંચાયતમાં લવાદને પણ વગમાં તણ્ણાવું

પડે છે. તારે લોકસંગઠનોના લવાહો વધુ શક્તિશાળી રહેવાના; કારણું કે તેમની પછવાડે સિદ્ધાંત—નિષ્ઠા અને નૈતિક બળોની તાકાત રહેવાની.”

**શ્રી. હેવળુભાઈ:** “એવાં દળોની દર્શિ પ્રજાલક્ષી હોય અને પ્રેરકથળ અહિસાતું હોય તથા ઉપર છેવટનું જગૃત માર્ગદર્શન કાંતિપ્રિય સાધુ સાધીઓનું હોય તો વાંધો નથી. બાકી પ્રેરકથળ રાજ્ય કે તેની દંડશક્તિ હશે તો તે પ્રયોગ જોખમી નીવડશે.”

**શ્રી. ઘળવંતભાઈ:** “આજની આમ પંચાયતો કે નગરનાં કે પેરેશનોના મોટા ભાગે; દાંડ તત્ત્વ, રાજકીયપક્ષો અને મૂડીવાદી પરિયોગનાં પ્રેરિત હોવાથી વધુ જગૃતિ રાખવી પડશે !”

**શ્રી. માટલિયા:** પોલિસ કરનાં એવાં આમ્રકષ્ટ દળોને ક્ષમ્ય ગણ્યવા પડશે. નજીકનાં તેમનાં સગાંસંબંધીઓના કારણે કંઈક પણ નૈતિક અંકુશ રહેશે અને રક્ષાની બાયતમાં પરાધીન બનેલી પ્રજા સ્વાવલંખી બનશે !”

**શ્રી. પુંજાભાઈ:** “પુ. ગુરુહેવ સંતખાલજીનું ચોમાસુ સાવરકુંડલામાં હતું તે વખતે હું ત્યાં આવેલો. તારે ગામડામાં એક બંદૂકના લાયસન્સવાળા સામે ફરિયાદ હતી પણ માથા ભારે તરવો સામે થવાની હિંમત ન હતી. એટલે ઘણ્ણીવાર ગૂંડાની સામે થનાર એકલો પડી જાય છે ! જે કે ગૂંડામાં નૈતિકથળ હેતું નથી, એટલે નૈતિકશક્તિ જગૃત થતાં તેઓ દયાધર જવાના. તે માટે સંગઠિત થતું જરૂરી છે ! જરૂર પડે સહન કરવું પણ જરૂરી છે. હમણ્ણાં ગરખા મંડળીમાં કેટલાક ગૂંડાઓએ ચેનચાળા કર્યાં; અને મંત્રીએ ટોક્યા. ત્યાં તેઓ ચઠી આવ્યા અને લોડો બધા જ નાસી ગયા. એટલે સંગઠન અને અહિસા બન્ને જરૂરી છે.

**શ્રી. ઘળવંતભાઈ:** કેટલાક માથાભારે તરવો બન્નેને લડાવી, પોતે નિલેંપ જેવા રહી, પછી સમાધાન કરાવી પોતાની પ્રતિષ્ઠા જમાવે છે. એવાથી બચવું પણ જરૂરી છે.

**શ્રી. દેવજીભાઈ :** આમ સંગઠનની વિઝ્ઞ થયેલાં તરવો, આમ સંગઠનની અભાવી વ્યક્તિઓ ઉપર ખરપરિયાપણાંનો આક્ષેપ કરે છે!”

**શ્રી. ખરાવંતભાઈ :** “તમે સંગઠન સાથે છો. પણ એકલાને કેટલું બધું સહેલું પડે છે તેનો એક દાખલો આપું. એક માથાભારે વિધવાખણે એક ગરીબના ધર આગળ ઉકરડો કરવો શરૂ કર્યો. બધા થરથરે કે ભૂંડી ગાળો ભાડે. અંતે આમ પંચાયતના ન્યાયપંચને અરજી કરતાં એ ઉકરડો અમયજાથી દૂર કરાવ્યો.”

**શ્રી. માટેજ પરિયહ,** પ્રાણુ અને પ્રતિષ્ઠા હોમવાની વાત થાય છે! શુદ્ધ સામે અશુદ્ધ થાય તેમાં નવાધ નથી!”

**શ્રી. પૂંજીભાઈ :** “મને એક પ્રસંગ યાદ છે. એક પાતીદારે ભરવાડો બેઠા હતા તેમની ઉપર જ્યાં થલાવી. બધા લાગી ગયા. એક પરી ગયો. તેના ઉપર એ વાર કાર ફેરવી ધોળે દઢાડે તેનું ખૂન કરીને તે ચાલ્યો ગયો. યછી ભરવાડની બાધને એક હજાર આપ્યા. એક સાક્ષી થાય તેવા ભરવાડે હજાર આપ્યા. પોલિસને તેણે સાધી લીધી અને ડેસની માંડવાળા કરાવી નાખી. આમ ધોળે દઢાડે ખૂન થાય છતાં કંધ પણ ન થઈ શકે.

**શ્રી. ઓર્ડેન :** એટલે જ અનુસંધ સાથેના શુદ્ધિપ્રેરોગની વાત કરીએ છીએ.

**શ્રી. માટેજ પરિયહ :** કૃષ્ણુ ગોવર્ધન ઉપાખ્યો, ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપ્યો. બન્નેની શક્તિ, વ્યક્તિ અને સંધની ખરી; તે ઉપરાંત ત્રીજી કુદરતની શક્તિ પણ કામ કરતી હોય છે. આ યુગે ગાંધીજી, રાષ્ટ્રીય મહાસભા તેમજ એવી જ્ઞાત-અજ્ઞાત ખણી શક્તિઓએ ભારતને મદદ કરી હતી. સામુદ્ધારિક અહિંસાનો શુદ્ધ પ્રેરોગ રાજ્યાશ્રય નહીં દે પણ રાજ્યને પ્રજાશક્તિ શુદ્ધ સંગઠિત કરી સાચી દિશામાં હારીને રાજ્યને પ્રજાનું આશ્રિત બનાવી મૂકશે.

( ૧૩-૧૦-૬૧ )



## શુદ્ધપ્રયોગમાં અનુભંધનું સ્થાન

સામુદ્દાયિક અહિસાના પ્રયોગના અનુસંધાનમાં શુદ્ધપ્રયોગ અંગે વિચારણા ચાલી રહી છે. આ આખા પ્રયોગની આધારશીલા અનુભંધ તત્ત્વ જ છે. યોગ્ય સ્થાને દરેક એસે અને પછી સંકળાઈને રહે એ અનુભંધ વિચારનું મુખ્ય લક્ષ્ય છે.

શુદ્ધપ્રયોગ અંગે વિનેચન શરૂ થયું ત્યારથી એક વાત કહેવાઈ છે કે તેમાં અનુભંધ હોવો જોઈએ ! જો તે નહીં હોય તો કેટલીકવાર કચાશ જેવું લાગશે. આપણું મનમાં એમ ન થવું જોઈએ કે શુદ્ધપ્રયોગ જોઈએ તેણેલો સફળ થયો નથી. તે માટે ચારેય સંસ્થાનો અનુભંધ તેની સાથે કેવી રીતે રહે તે વિચારવું જોઈએ.

શુદ્ધપ્રયોગ એ પ્રકારના થાય છે :- એક પરિણામલક્ષી, અને બીજે ધડતર લક્ષી. ધડતરવાળામાં પરિણામ ન આવે છતાં આપણુંને એમાંથી ધણ્ણું શીખવાનું મળે છે. બન્નેમાં એવું જ વાતાવરણ તૈયાર કરવાનું હોય છે. શુદ્ધપ્રયોગનું મુખ્ય તત્ત્વ એ છે કે જે પ્રક્રિયા માટે પ્રયોગ લીધો હોય તેના વિષે જનતાને એકાય કરવી અને પ્રશ્નનું ભરાયર નિરીક્ષણ કરવું. કેટલાકને આ સાચું લાગે, કેટલાકને બીજું સાચું લાગે. એટલે દર્દીનું વલોલાણું કરીએ અને ફેફેફેદા જુદા કરી નાખીએ, તેમ એ પ્રશ્નનો સર્વ દર્શિએ જીણુવટલર્યો અભ્યાસ કરવે. -સાચી વાતની શોધ કરવી પછી પ્રયોગ શરૂ કરવો. પ્રારંભમાં જનતા મીઠી થઈ હોય એમ લાગશે. આપણે શું ? મરશે ! કરશે તે બોગવશે ! એમ નિંબર ઢોરની જેમ સમાજ એસી રહેશે. પણ શુદ્ધપ્રયોગની જુદી-જુદી પ્રક્રિયાઓ જ્યારે ચાલે છે, અને ચોમેર એની હવા ફેલાય છે, ત્યારે સમાજ જાગે છે, પછી તેને સાચી વાતની શોધ કરવા પ્રેરે છે. તે વિષેનો અલિપ્રાય જાહેર કરાવે છે અને પ્રશ્નનો નીવેડો લાવવા માટે ગુનેગાર ઉપર નૈતિક-સામાજિક દ્યાણ લાવે છે.

શુદ્ધિપ્રયોગના એ પાસા કલાં :-એક તો પરિણામ લાવવાનું અને બીજું લોકાનું ધડતર કરવાનું. ધડતર થાય છે ત્થારે તે સંસ્કૃતિ બને છે. એ માટે ધડાયેલી વ્યક્તિએ કામ કરવું જોઈએ-તેમજ તેનું ધ્યેય ધડતર હોવું જોઈએ. ધડતર માટે ઉપવાસ, પાર્થના વિ. હોવાં જોઈએ. પણ જે તેનું લક્ષ્ય ધડતર નહીં હોય તો તે શુદ્ધિપ્રયોગ નહીં કહેવાય.

અમદાવાદમાં કોઈ સાધુ કે સાધી લાંખા ઉપવાસ કરે છે તેને શુદ્ધિપ્રયોગ નહીં કહીએ. લોકાને થાય છે કે એ તો સાધુજ કરી શકે આપણાથી ન થાય. ધણું તેમની દેખાડેખ્યા ઉપવાસ શરૂ કરે છે પણ તેથી કંઈ કાયદો થતો નથી. ગાડી પાટા ઉપર નહિ ચાલતી હોય; તો તેને ખરે રસ્તે વાળવી જોઈએ; પણ પાટોજ ઉખાડી નાઓ તો તેનો કોઈ અર્થ નથી. ગાડી સાથે આપણે પણ પડ્યું. તેમજ હેતુ વગરના ઉપવાસનો કોઈ અર્થ નથી. સમાજની ગાડીને હેતુ વગરના લાંખા ઉપવાસો કરીને આજે મોટે લાગે અંધશ્રદ્ધ કે ચમત્કારને માર્ગ દ્વારવામાં આવે છે.

એટલે શુદ્ધિપ્રયોગનો રૂપ્ય અર્થ અનુભંગ દારા સંસ્થાઓમાં, અને સમાજમાં ગતિશીલતા શી રીતે આવે, તેવી શુખ્ય પ્રક્રિયા છે. તેથી અલિદાનની લાવના એકાય થાય છે. કોઈ ચિત્રકાર જ્યારે પ્રારંભમાં પીંછી પટલ ઉપર ફેરવે તો રંગના લીટા જ દેખાય; પણ ચિત્રકારના મનમાં તો એનું સમય ચિત્ર હોય છે. એવી જ રિથ્યિ સર્વાંગી કાંતિકારના મગજમાં હોવી જોઈએ. અગવાન મહાવીરે અલિયણ કર્યો ત્યારે તેમના મગજમાં દાસીપ્રથા અને નારીજનિની અવનતિ નાખ્યદ કરવાનો રૂપ્ય સંકલ્પ હતો। એવી જ રીતે કાંતિકારાએ રૂપ્ય પરિણામલક્ષી પ્રયોગો કરવા જોઈએ. તે સિવાય જનતાનું ધડતર પણ તેથી થવું જોઈએ. આજે બધા ઉપવાસો કરે છે, તે શા માટે? પરંપરાથી ચાલ્યું આવે છે તે માટે! પણ આટલા બધા ઉપવાસો છતાં જૈન સમાજ ધડાતો નથી. તો તેનો શું અર્થ?

એટલે શુદ્ધિપ્રયોગમાં અનુભંધ પહેલાં રહેવો જોઈએ. હવે જ્યાં જ્યાં અનુભંધ નથી ત્યાં કેટલીકવાર પાછળ પડવું પડે છે તે જોઈએ.

ગાંધીજી સ્વરાજ્ય મળ્યા બાદ એકલા પડી ગયા હતા. તેઓ બોલ્યા કે હવે માર્ઝિં કોઈ માનતું નથી. તેમણે કંગ્રેસ સાથે અનુભંધ રાખ્યો હતો પણ સત્તા કંગ્રેસના હાથમાં આવતાં; સાધુપુરુષો નથળા પણ હતા. એટલે તેમને કંટાળાલયું બોલવું પડ્યું. અહીં અનુભંધ હોત તો પરિણ્યામ જુદું આવત.

રાજકોટના વીરાવાળાના પ્રસંગમાં ગાંધીજીએ આમરણુંત ઉપવાસ કર્યા. કારણું કે વચન આપ્યા પછી લંગ થતો હોધને તે સંસ્કૃતિનો પ્રશ્ન હતો; એટલે સાધુસંતોષે તેને ઉપાડવો જોઈતો હતો. તેમનો અનુભંધ જોઈતો હતો; પણ તેમ ન બન્યું. મોટો વિરોધ થયો પણ મોરીસ અવાયરના ચૂકાદાથી ગાંધીજીની જીત થઈ. જે તેની સાથે ધર્મનો અનુભંધ હોત તો ધર્મા કુરક પડત.

કંગ્રેસ સાથે અનુભંધ હતો એટલે ભાવનગરના મહારાજાએ ફેદિલી જઈને ગાંધીજીના ચરણોમાં પોતાનું રાજ્ય ધરી દીધું. એટલે રાજકોટમાં કે ન બન્યું તે અહીં બની ગયું. ઔંધના રાજ, વડોદરના રાજ, એમ બધા રાજ્યો દેશમાં ભળી ગયા. આપો દેશ એક થયો. બધાં રાજ્યો ભળી ગયાં; તેનો યશ આપણે સરદારને આપીએ હીએ; પણ તેની પાછળ કંગ્રેસ, ગાંધીજી તેમજ લોકસંગઠનોનું બળ હતું એ ન ભૂલવું જોઈએ. નહીંતર પરિણ્યામ કંઈક જુદું આવત. '

હવે આપણા શુદ્ધિપ્રયોગમાં અનુભંધે કેટલો ભાગ બજવ્યો તે જોઈએ :—

સાચુંદ્નો શુદ્ધિપ્રયોગ પરિણ્યામલક્ષી અને ધડતરલક્ષી બન્ને રીતે હતો. પરિણ્યામ એ આંધું કે પાવતી ફ્રાન્સીલી તેનું તત્ત્વ આવી જવું જોઈએ. પ્રાયોગિક સંધના એ નાચુંં છે. તે તેને મળવાં જોઈએ; તે: મળ્યાં. સાચુંદ્ના નાગરિકાએ અને બહારનાઓએ ભેગા ભળી આપી

દીખાં. ધણુા લોકોએ સહી કરીને પેલા લોકોના કૃત્યને વખોડી કાઢ્યું. નવા સ્થાપેલા ભાલમંહિરના પ્રમુખે રાજુનાસું આપી દીધું. સંધને થયું કે આ નાણું સાણુંના કોઈ સારા કામમાં વપરાય તો સારં! એટલે સંધે તેજ સલામાં નાગરિકોને એ રકમ પરત કરી. આ પ્રયોગમાં કેંચ્યેસ તઠસ્થ રહી; તેનો અનુભંધ પૂરો ન હતો. એટલે તેની ખામી ખરી! એટલે રવિશંકર મહારાજે કહ્યું તેમ ગામ લોકા સાથે સમાધાન કર્યું. શુદ્ધપ્રયોગ સક્ષળ થયો. પણ કેંચ્યેસ તઠસ્થ રહેતાં ધણુને બોલવાનું થયું.

સાળંગપુરના પ્રયોગમાં જોયું કે ત્યાં અનુભંધ રહેતાં સુંદર કામ થયું હતું. સરકાર કુરેશીભાઈ મારક્ષત મદ્દે આવી. તાલુકા કેંચ્યેસ સમિતિએ પહેલા વિરોધ કર્યો પણ પછી તેમને કહેવું પણ્યું કે એડૂતો સાચા છે. અંતે મામલતદાર અને જિલ્લાધિકારીએ તપાસ કરી અને એડૂતોને ન્યાય અપાવ્યો. આમાં કેંચ્યેસનો વિરોધ હોત તો પરિણામ સારં ન આવત! સાળંગપુરમાં ધડતર અને પરિણામ બન્ને આવ્યાં. લોકજાગૃતિ પણ થઈ.

પાલણપુરના પ્રસંગમાં વેપારી કામ, કેંચ્યેસ, લોકસંગઠન વગેરે એ જારો ભાગ ભજ્યો હતો. ગુનેગારે ગુનાનો એકરાર કરવોઝ જોઈએ; ભૂલ ન માને તે ખાટું છે. આમ લોક લાગણી થઈ. ગણેલાલધારા શુદ્ધપ્રયોગમાં પણ જનજાગૃતિ ખૂબ આવી ગઈ. દશહજાર ઉપવાસ એક રાણું થયાં. હેઅરભાઈ અને લાલાકાંને તે વખતે વાત ગણે જાતરી ન હતી, છતાં સરકાર ઉપર દાખણ લાવવામાં મદ્દ કરી છે. આમ અનુભંધ હોઈને ત્યાં પણ સક્ષળતા મળી છે.

હવે પ્રાયોગિક સંધ સિવાય પણ હમણું આવો પ્રયોગ થયો હોય અને તેમાં સક્ષળતા મળી હોય તેનો એક દાખલો લઈએ. ગુજરાત પ્રાંતીક સમિતિએ એક જહેર સલા ચોજ. તેમાં મોરારજીભાઈ પ્રવચન કરવાના હતા. પણ તોઝાનીએ એ “જનતા કરક્યુ”ના નામે લોકોને સભામાં જતાં રોક્યા. પોલિસ આર્મ શું કરી શકે?

મેરારળભાઈને ખૂબ લાગી આવ્યું. તેમણે નિર્ણય કર્યો કે જે લોકોને સાલણવું છે તેમને સભામાં આવતાં રોકાય ત્યાં સુધી હું જોજીન લેવાતું છોડું છું. તેમને સાતેક દિવસ ઉપવાસ કરવા પડ્યા. પરિણામ સુંદર આવ્યું. તોકાનીઓની સામે જોઈને પત્થરમારાની વચ્ચમાં સભામાં લોકોએ હજારોની સંખ્યામાં હાજરી આપી. બહેનો પણ હીમતથી આવી. એ જોઈ તેમને આનંદ થયો. બધું સમાવાન થયું. આ મેરારળભાઈના ઉપવાસ આમ તો સમજ માટે હતા. સમજને માટે ઉપવાસ કરતા હોય તો, સમજ એમાં ભાગ લે તો રાજ થતું જોઈએ। પણ એ ન સમજય ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ. હવે આ પ્રયોગને શુદ્ધિપ્રયોગ કહેવાય કે નહીં? તેમનું કહેવું છે કે “આ તો અચાનક પ્રસંગ આવી પડેલો તેથી મેં આવું કર્યું.” એટલે હું તેને શુદ્ધિપ્રયોગ માનતો નથી. ”આ એંગે તેમનો સુંદર પત્ર આવ્યો હતો. તેમાં જણાવ્યું હતું.: “મારા જીવનમાં વ્યાક્ત તરીકે અંતરમાં લાગ્યું કે આ પ્રશ્ન લેવા જેવો છે તો લીધો !” પણ સમૃદ્ધાય માટે ન લેવો એમ માને છે!

પણ પ્રશ્ન એ છે કે તેમણે કેના માટે કર્યું? ગુજરાત માટેને! એ લોકો માટેને કે જેમની ગતિશીલતા સમજ વિરોધી તત્વોએ દાંડાધથી રોકી હતી! તેથી સમજની ગતિશીલતા માટે ઉપવાસ-શુદ્ધિપ્રયોગ થવા જોઈએ એ વાત આવીને ઊભી રહે છે. પણ, મેરારળભાઈ, દાદા વગેરેને ગળે એ વાત ઉત્તરતી નથી, તેનું કારણ ઇદ્દિયુસ્તતા છે.

શુદ્ધિપ્રયોગમાં, પ્રયોગકાર પાસે ર૪૪૮ ચિત્ર હોવું જોઈએ તે વખતે સમજને મળે એ વાત જિતરે કે ન ઉત્તરે, પણ પોતાને લાગે કે ઉપવાસ કરવા જોઈએ તો સંસ્થાના આશ્ર્યે થાય તેમાં વધારે અસરકારક પરિણામ આવે છે. છોડુભાઈ એ રીતે સાણું થ. -પ્ર. વખતે શ્રી આમરણ અનશન કરવા તૈયાર થયા હતા. મેરારળભાઈ પણ એજ રીતે પ્રાણું આપવા તૈયાર થયા હતા. તેમની પાછળ કેંગ્રેસ હતી, સરકાર હતી અને લોકો પણ હતા. આમ અનુભંધના તત્વો જોડાયેલા હોય

તો સુંદર અંસર થાય છે. આ વાતની ધરેડ એસી જરો તો એ ક્ષાયકા  
થરો. ધણીવાર નિરાશા થાય છે કે આપણી પાછળ કોઈ નથી. પોંધી  
કેરવનારને એમ પ્રારંભમાં લાગે છે કે કંઈ હેખતું નથી; પણ સંપૂર્ણ  
ચિત્ર ઘને છે ત્યારે ખ્યાલ આવે છે. એમ લોકામાં જે સત્ય પણું છે  
તેને જો નિમિત્ત મળે તો એ સત્ય જગૃત થઈ જય છે અને નિરાશા  
ભાગી જય છે. એટલે નિરાશા દુર થાય છે અને સત્ય પ્રકાશે છે. તે  
માટે અનુભંધ જરૂરી છે! વાત સાચી છે, તો પુરુષાર્થ કરો, અનુભંધ  
જોડો, બલિદાન આપવા તૈયાર થાવ-તેમાં સક્ષળતા વરસેજ; એની  
આત્મી રાખવાની છે.



## ચર્ચા - વિચારણા

શ્રી હેવળભાઈએ ચર્ચા કરતાં કહ્યું: “ પુ. મહારાજશ્રીએ  
સવારે કહ્યું તેમ અનેક પુરુષો સંધરપી નૌકામાં એસીને તરી ગયા છે;  
તેમ શુદ્ધિપ્રયોગમાં પણ લોક સંગઠન, લોક-સેવક-સંગઠન, રાજ્યસંગઠન  
અને સાધુજનો ઇપી ચાર સંસ્થાના-સંધીના અનુભંધ વડે વિશ્વમાં  
વ્યાપક બલિદાનની, શુદ્ધિપ્રયોગની અને શાંતિ સેનાની વાત ખરાખર  
જૈન તત્ત્વજ્ઞાનને અનુરૂપ જ છે. ચારે બાજુના અંધકારમાં આ રીતે  
સાધુસાધી શિખિત નવો પ્રકાશ લાવશે. જૈન સાધુ-સાધીઓ દૂરથી  
જોડો રસ લઈ રહ્યા છે. તેઓ પ્રત્યક્ષ આપણી ચર્ચા અને વિચારણામાં  
સામેલ હોત તો બધાને ડટલો વિશેષ આનંદ મળત અને કાર્ય તરત  
સહિયું લેત ? પણ બી રોપાઈ ચૂક્યાં છે. નહીં આવેલા પસ્તાઈને  
પણ આની કાર્યવાહી વાંચી દુર રહીને સાચે પંચે લાગી જરો.

પુ. નેમિમુનિએ શુદ્ધિપ્રયોગ ઉપર પ્રકાશ નાખતાં કહ્યું: “ જો  
અનુભંધ હશે તો એકલો સાધક કે સાધુ ગમે ત્યા શુદ્ધિપ્રયોગ કરશે  
તોણે આલશે; કારણ કે શુદ્ધિપ્રયોગની સંસ્થાઓ સાથેનું તેનું અનુસંધાન

કુદરતી હશે. સાણુંદના શુદ્ધિપ્રયોગમાં ડોઓસનો સંસ્થા તરીકે તો અનુભંધ હતો જ પણ કેટલીક વ્યક્તિઓની કૂઠનીતિ અથવા આડકતરી દાંડાધ-પોષક નીતિને કારણે જ પરિણામ બાહ્યદિષ્ટએ તાત્કાલિક ન હેખાયું, તે હવે હેખાય રહ્યું છે; અને વધુ હેખાશે. પ્રાચીણિક સંધની દિષ્ટિએ તો તે પ્રયોગ સંપૂર્ણ સફળ થયો જ હતો; હવે સર્વાંગી રીતે સફળતા હેખાશે. તાટકા તેમજ ખર-હૂપણું ન હોય તો રામની અભિનવરીક્ષા કોણું કરે? જેમ પૂર્ણ મહારાજશ્રી સંતભાલજીએ રાજકોટના વીરાવાળા પ્રસંગની વાત કરી હતી કે તે વખતે લલે ગાંધીજીની અસર સ્પષ્ટ ન હેખાણી, પણ હિંદુ સ્વતંત્ર થતાં ભાવનગરના રાજએ બાપુને ચરણે રાજ્ય સોંપી દીધું! એ શું સુચવે છે? સરદારની સફળતામાં, બાપુના રાજકોટ પ્રકરણના અનશનનો ક્ષાળો છે જ ”

**શ્રી. ખળવંતભાઈ :** કિલ્લેઅંધી ચોમેરની હોઈ આમસંગહન અને અનુભંધનું કાર્ય લલે મુશ્કેલ હોય પણ આખરે તે સર્વાંગી-સંપૂર્ણ સફળતાને પામશે, એ ચોક્કસ થતું જાય છે.

( ૨૦-૧૦-૬૧ )



## શુદ્ધિપ્રયોગનો ક્રમ અને વિધિ

આજે આપણે શુદ્ધિપ્રયોગનો થું ક્રમ છે અને વિધિ છે તે અંગે વિચારણા કરશું. સામાન્ય રીતે શુદ્ધિપ્રયોગમાં ચાર અંગો આવે છે. લવાદી, સાચો ન્યાય, અસહકાર અને બહિષ્કાર! અન્યાયના પ્રતિકાર માટે જે ડોર્ઝ પ્રશ્ન આવે અને શુદ્ધિપ્રયોગ કરવો પડે તે પહેલાં જો તે અંગે સમજુંતી થાય તો તે જોઈ લેવું; પછી સામાન્ય દધાણ લાવવું! તે છતાં પ્રશ્ન ન ખેતે અને લવાદીને અવકાશ હોય તો તે કરી જોવું. લવાદીમાં પણ ન્યાયનું તત્ત્વ જળવાય છે કે ક્રેમ તે જોવું જોઈએ. પછી સામાજિક દધાણ આવે, પછી અસહકારની વાત આવે. તે ન થતાં બહિષ્કાર અને વિનન્દ્ર સ્વ્યાનાઓ. આ બધા યોગ્ય ઉપાયો અજમાવી લેવા જોઈએ. આ બધી ભૂમિકાઓ પસાર કર્યા પછી જ પ્રાર્થનામય ઉપવાસથી શુદ્ધિપ્રયોગ શરૂ કરવો જોઈએ! તે શરૂ થયા પછી ધર્ણી બાયતોનું ધ્યાન રાખવું પડે છે. લવાદી મૂળભૂત સિદ્ધાંતોના લોગે નહીં, પણ આર્થિક બાયતોના નિરાકરણ માટે અંતે સ્વીકારી શકાય. તેમજ રાજ્યાશ્રમ પણ સામે ચાલીને ન માગવો; પણ આવે તો ઘર્ન્તકાર ન કરવો.

### શુદ્ધિપ્રયોગ સામેની પ્રતિક્રિયાઓ :

શુદ્ધિપ્રયોગ શરૂ થાય એટલે સામે પક્ષેથી પણ પ્રતિક્રિયાઓ શરૂ થાય છે. તેમાં નીચેની ચાર-પાંચ પ્રતિક્રિયાઓ થતી સહેલે જોવામાં આવે છે :—

( ૧ ) કુતુહલ અને હૃસ્ય : પ્રથમ કુપહલ જાગે કે આ ઉપવાસ વળી શા માટે કરે છે? પછી ઠુઠા મર્યાદા ચાલે કે આ તે રેના ઉપવાસ કરે? રાતના કટેલાં દૂધ પીએ છે.

( ૨ ) વગોવધ્ની : શુદ્ધિપ્રયોગમાં બેઠેલા લાઈએ. બહાર નીકળે એટલે તેમના ઉપનામો પાડીને ચીડવે. ગામમાં તેના અંગે ખોટી-ખોટી વાતો ફેલાવે. તેમને ખીજવે; ચીડવે અને ગામમાં ધૂણાવતી ફેલાવે.

( ૩ ) જૂઠા આક્ષેપો : શુદ્ધિપ્રયોગ ચાલતો હોય ત્યારે પ્રયોગકરો। ઉપર જતના ખોટા આક્ષેપો કરવામાં આવે.

( ૪ ) જસા ચિહ્નોએ : તેમના નામે જસા ચિહ્નોએ મોઝલવામાં આવે કે બધું મૂળીને ચાલતો થા. નહીંતર તારી ઘેર નથી ! વગેરે.

( ૫ ) ત્રાસદ્યાયક પગલાં : આ છતાં પણ શુદ્ધિપ્રયોગમાં એડેલા ભાઈએ મજબૂત હોય તો જુથનાં જુથ લેગાં થઈ તેનો વિરોધ કરે। તેમની પ્રભાતકેરી નીકળે-તેમની સામે વિરોધીએ સેંકડોની સંખ્યામાં ઢોલ-નગારાં સાથે નીકળે - કોકીયારીએ. પાડે - ઉપવાસીએને અશાંતિ થાય, એવી રીતનો શોરગુલ-નગારાં વાદન બધુંથે કરે! તેમની પ્રાર્થના-ધૂન ન થવા હે. આ બધું વિરોધ પક્ષ કરે! શુ.પ્રયોગની છાવણી માટે મકાન કે સ્થાન ન આપે. અન્યાયપીડિતોને ધમકીએ ખતાવે. સાળ-ગપુરમાં વિરોધનો વિચિત્ર તાલ જોયો હતો ! અમદાવાદમાં તો તોદ્દાનીએઓ કપડા ફાડીને માર પણ માર્યો હતો.

### અંતે ભૂલ સ્વીકાર અને પશ્ચાત્તાપ :

આ બધી પ્રતિક્રિયાએ થયા પછી પણ શુદ્ધિપ્રયોગકાર ન ઉગે ત્યારે ગામમાં-લોકોમાં જાગૃતિ આવે અને પોતાની ભૂલનો સ્વીકાર વિરોધીપક્ષે છેવટે કરવો પડે. આઠલી બધી પ્રતિક્રિયાએ વિરોધી બળાએ કરી હોય એટલે મનમાં ડંખ રહે તે સ્વાભાવિક છે. એટલે શુદ્ધિપ્રયોગમાં જે હારે તેની સાથે બધા મળે અને ડંખ કે રોષ ન રહે તેવું મિલન ગોઠેને। ત્યાં સહુનાં ગળ્યાં મોઢાં થાય અને સૌ આનંદથી છૂટા થાય ! ભૂલનો સ્વીકાર ન થયો હોય ત્યાંસુધી તેની સામે અસહકાર હોય પણ ભૂલનો સ્વીકાર થયો કે મિલન ચાલુ થઈ જાય.

આમ શુદ્ધિપ્રયોગમાં ભીજની શુદ્ધિ સાથે પોતાની પણ શુદ્ધ રહેલી છે.

### શુદ્ધિપ્રયોગ સંસ્થાના અતુસંધાને શા માટે?

શુદ્ધિપ્રયોગ સંસ્થા દારા શા માટે? એવો પ્રશ્ન થાય છે. તો તેનો જવાબ એ છે કે બ્યક્ટિલ એક જ છે. તેની સાથે એ વાતો જોડા-

ચેલી છે. રાગદ્રોષ ! એટલે ઇતેહ મળે તો અભિમાન થાય અને નિષ્ઠળતા મળે તો નિરાશા થાય. હાર થાય તો લોકો ટોણું-મેણું મારે. એટલે સંસ્થા દ્વારા થશે તો અભિમાન નહીં વધે અને રાગદ્રોષ કાઢવામાં સરળતા રહેશે. સાથે મોટો લાલ એ થશે કે તે પ્રયોગ વ્યાપક અનશે.

પણ તે સંસ્થા એવી હોવી જોઈએ, જેતું અનુસંધાન અન્ય સુસંસ્થાઓ સાથે હોય; તે વ્યાપક હોય, તે ધડાયેલી હોય, તેતું ગેરક તરફ નૈતિક હોવું જોઈએ. નહીંતર, કંઈક જુદું જ ઘડાઈ જશે. એટલે ધડાયેલી સંસ્થાના સંચાલન તળે શુદ્ધિપ્રયોગ થવો જોઈએ. જ્યાં આવી સંસ્થા ન હોય ત્યાં પ્રતિકાર તો કરવો જ રહ્યો. પણ જે એવી કોઈ સંસ્થા હોય તો તેતું સંધાન રાખવું સાહેં છે.

ગાંધીજીના વ્યક્તિ તરીકેના પ્રયોગ સફળ ગયા. તેતું કારણ તેમની પાછળ સંસ્થા હતી. જે પાછળ સંસ્થા ન હોય તો કોઈ કામ ન થઈ શકે.

### શુદ્ધિપ્રયોગમાં ઐસનારનાં ગુણો :

હવે શુદ્ધિપ્રયોગમાં ભાગ લેનારમાં શું ગુણો હોવા જોઈએ તે અંગે પાકી કસોટી થવી જોઈએ. તે માટે તેમાં નીચેના ગુણો હોવા જોઈએ :—

( ૧ ) તેનામાં અંગત રાગદ્રોષ ન હોવો જોઈએ. આ પ્રશ્ન પૂરતો તેનામાં સ્વાર્થ ન હોવો જોઈએ કે પૂર્વઅંહ ન હોવો જોઈએ.

( ૨ ) વ્યક્તિ તરીકે ડેવળ નહીં પણ સંસ્થા તરીકે પણ તેનામાં અંગત રાગદ્રોષ ન હોવો જોઈએ.

( ૩ ) શુદ્ધિપ્રયોગમાં ઐસનાર વ્યક્તિ તટસ્થ હોવી જોઈએ. જેને અન્યાય થયો હોય તે એમાં ભાગ ન લઈ શકે.

( ૪ ) આ પ્રયોગ સાથે દેશ અને દુનિયાનું સંધાન ( અનુભંગ ) હોવું જોઈએ. દેશ તરીકે કોચેસ સંસ્થાને તેમજ વિશ્વ તરીકે ‘ધૂનો’ને આપણે સાથે રાખીએ છીએ. ચીની-સાખ્યવાદ સાથે જેમ ન લગ્યા

થકાય તેમ ડોમવાદ સાથે પણ વાંધો છે. કાંગ્રેસ સાથે અતુસંધાન ન હોવાના કારણે ન તો સામ્યવાદને લઈ જઈએ કે ન સમાજવાદને! ન જનસંધપક્ષને કે ન સતતંત્રપક્ષને.

આજના મોટાભાગના પ્રશ્નો માત્ર એ જ વાદમાં સમાઈ જય છે. એક મૂડીવાદ ( અમેરિકા ) અને ભીજું સામ્યવાદ ( ચીન-ઝસ વિ. )માં. એટલે એનો લગવાડ કોઈ સ્વરપે હોવાનો. તેથી શુદ્ધિપ્રયોગમાં એસનાર કોઈ કાંગ્રેસી હશે કે કોઈ બિન-પક્ષી હશે તો ચાલશે.

શાંતિ સેના અંગે આ વાતો વિનોભાળના ગણે જિતરી ન હતી. રાજ્યસ્થાનમાં ગયા પછી તેમને અનુભવ થયો કે એમાં કેટલાંક સ્વાર્થી તત્ત્વો પ્રવેશી ચૂક્યાં છે. કાંગ્રેસી લોકોએ કહ્યું : “ શાંતિ સેનામાં દાખલ થઈયું પણ કાંગ્રેસ સાથે સંબંધો નહીં છોડીએ. ” તો તેમને ચલાવી લેવું પડ્યું.

આ બધી વાતો લાંબા ગાળાના અનુભવે આવી છે. અત્યારે તો લગવાડ જેવું કંઈ પણ નહીં લાગે; પણ ભવિષ્યમાં ભીજે લગવાડ નીકળવાનો. કાંગ્રેસ સિવાયના પક્ષોનો લગવાડ મૂડીવાદ કે સામ્યવાદ સાથે આજે નહીં તો ચુંઠ્યી વખતે પણ હેખાશે જ! સંયુક્ત-મહારાષ્ટ્રની લડત વખતે, મહાગુજરાતના આંહાલન વખતે આ બધું બહુ રૂપી રીતે સામે આવ્યું. તમે કહેશો કે કાંગ્રેસે પણ આવું કર્યું છે તો શું કરવું?

સર્વનારો સમૃદ્ધ્યન્ને, અર્ધત્યજતિ પંડિત:

—કોમવાદી કે ભીજા પરિયનો સાથે સંબંધમાં આવે છે ત્યાં નહીં માના કરતાં કાશો માગો. સારો એ ન્યાયે આપણે ચાલીએ છીએ. પણ, તે એક ભૂલ છે. એનો ઉંખ પણ રહે છે. એટલે એવી ભૂલોનો સ્વીકાર કરવો પડે છે.

( ૫ ) એટલે કે અમે તે સંસ્થાના માખુસોને પ્રયોગમાં લેવાના નથી. તે કાં તો કાંગ્રેસ-વિરોધી ન હોય; કાંગ્રેસી હોય અથવા તટસ્ય નિલેખં વ્યક્તિ હોવી જોઈએ.

સાણું શુદ્ધિપ્રયોગ આખતમાં એક ભાઈએ કહ્યું : “તમે ડૉચેસ વિરોધીઓની ડેમ મદ્દ લીધો ? ” ખરેખર તો એમ બન્યું જ નથી; જીલું એ લોકો મદ્દ આપવા તૈયાર થયા ત્યારે કાર્યકરોએ કહ્યું : “નાગરિક તરીકે મદ્દ કરવા છુંછો તો છાવણીમાં આવો. અમે તમારી પાસે નહીં આવીએ । ”

(૬) તેમાં એસનાર વ્યક્તિ વ્યસની ન હોવો જોઈએ. દારી, ખીડી કે ખીજ તેનામાં લત ન હોવી જોઈએ, જેથી તેનામાં લોકો વિશ્વાસ કરી શકે.

(૭) લોકો ગમે તેટલા આક્ષેપો કરે; તો પણ તે સાંભળી શકે; ભૂલ હોય તો સ્વીકારવા તૈયાર થાય; તેમજ નિર્મળ ચરિત્ર વાળો હોનો જોઈએ.

### શુદ્ધિપ્રયોગનો વિધિ અને કાર્યક્રમ :

**પ્રાર્થના :** શુદ્ધિપ્રયોગનો પ્રારંભ પ્રાર્થનાથી થનો જોઈએ. શુદ્ધિપ્રયોગ પોતેજ પ્રાર્થનાનું તત્ત્વ છે. એમાં વ્યક્તિ સમાજ સમાજિ જોડાયેલાં છે. એકનો દોષ થવામાં ખીજની ભૂલ છે. એ રીતે કે તમે આંખ આડા કાન કર્યા હશે, કાં પ્રતિકાર નહીં કર્યો હોયા. એટલે દોષ વહ્યા. તે દોષ નિવારણ માટે પ્રાર્થના કરવી જોઈએ. પણ પ્રાર્થના માટે એકાથતા જોઈએ તે પેટમાં પહુંચ હોય ત્યાં સુધી ન આવે.

**ઉપવાસ :** એટલે ઉપવાસની વાત આવી. અલઘત એટલા બધા ઉપવાસો ન થવા જોઈએ કે શરીર સાવ નકાસું થઈ જય ! એટલે પહેલાં ત્રણુ ઉપવાસ રાખતા, હવે એ ઉપવાસ રાખે છે. તેના કારણે ગોપાલકો, ઘેડૂતો પણ આ પ્રયોગમાં ભળી શકે છે. ત્રણુ ઉપવાસથી વધારે નહીં રાખવાનું કારણુ એટલુંજ કે શરીર અનુમય કોષ્ઠી બનેલું છે, એટલે અનુ પડે તો શાંતિ રહે અને મનમાં વિચારવાનું કંઈક કિરણુ પ્રગટે.

**ઉપવાસ માટે કેટલાક કિસ્સામાં અપવાદ હોય છે.** સાણંગપુરમાં

નવલભ દ્વારા પાંચ ઉપવાસથી શરીરાત કરી હતી. કુરેશીભાઈએ હરિજન આશ્રમમાં સાત ઉપવાસ કર્યા હતા. ખાસ કિસસામાં કોઈ આમરણુંત ઉપવાસની તૈયારી બતાવે તો તે સંસ્થાની મંજૂરીથી થઈ શકે. જે સંસ્થા કહે કે વચ્ચે તમારે છોડી દેવું તો તે માટે તૈયાર રહેવું જોઈએ. મતલભ કે શરતી અનશન હોવું જોઈએ.

**કાંતણુ રેઠિયો :** ગરીબોની સાથે અનુસંધાન રહે તેના શ્રમના પ્રતીક તરીકે રેઠિયો હોય છે અને તેનું કાંતણુ એકાગ્રતા લાવે છે; તે પણ હોવું જોઈએ.

**સર્કાઈ :** શુદ્ધિપ્રયોગ કરનારને છાવણી અને આસપાસની સફાઈ જાતે કરવાની હોય છે. તેથી તે સ્વાવલંબનો પાડ લોકોને શીખવી શકે.

**પ્રભાતક્રેરી :** સવારમાં પ્રભાતક્રેરી નીકળે-ધૂત ભજન બોલાય! સારાં સૂત્રોચ્ચારણ થાય! જેમ યોગસાધના અને ક્ષેત્ર વિશુદ્ધ માટે યોગ ઉપયોગી છે તેમ આ પ્રયોગને અનુકૂળ એવાં સૂત્રો તૈયાર કરવાં અને બોલવાં જોઈએ. તે બોલાય એટલે લોકા પૂછે કે આ શું? સેવા શું અને સત્તા શું? તે વખતે 'શાંત પ્રાર્થના દારા એવા પ્રશ્નોને ઉકેલ આપવામાં આવવો જોઈએ.

એક વખત શુદ્ધિપ્રયોગમાં આવેલા ભાઈઓને પોલિસે પૂછ્યું: “શુદ્ધિપ્રયોગમાં આવેલ ભાઈ ઓ સાચું જ કહેશો ને!” તેમણે ગામમાં બનેલા એક પ્રસંગ સાચી રીતે જણ્યાયે. કોઈ ભૂલ ન થાય તે માટેજ ઉપવાસ અને પ્રાર્થનાને મહત્વ આપવામાં આવે છે.

**સાંધ્ય-ક્રેરી :** સાંધ્યાકળે ચારથી છ વાગ્યાની વચ્ચે સંધ્યાક્રેરી નીકળે. તેમાં વિદ્યાર્થીઓ અનેખારથી આવેલા બેદૂતો લગે છે. તે વખતે ચક્કલે ચક્કલે પત્રિકાનું વાંચન થાય. જહેર સ્થળોએ ચોંટાડવામાં આવે. તેમાં સૂત્રો હોય છે. તેમજ ગાંધીજીના આધારા-સંસ્થાના અનુભવો વગેરે બધું હોય છે. લોકા પ્રશ્નો પૂછે તેના ખુલાસા કરવાના હોય છે.

આ ખંડા કાર્યક્રમો પાછળ એક જ હેતુ હોય છે કે ને અવાજ દ્વારા વેલો છે તેને જગૃત કરવાનો છે. દાંડતત્ત્વોને ઉધારાં કરવાનાં હોય છે. તેમ જ જનજગૃતિ લાવવાની હોય છે.

**રાત્રિનો કાર્યક્રમ :** દિવસના કાર્યક્રમ પછી રાત્રે, ગ્રાથીનાસભા, વાંચન વગેરે થાય છે.

### શુદ્ધિપ્રયોગમાં સહાયકો :

તે ઉપરાંત ખલારગામની ટુકડીઓ શુદ્ધિપ્રયોગમાં સહાનુભૂતિ તરીકે આવે છે. એ લોકો તે ગામનું આતા નથી પણ ડેવળ પાણી પીએ છે. સરધસમાં સૂત્રો ઉચ્ચારે છે અને પછી પોતપોતાને ધેર જય છે. ત્યાં પ્રચાર કરાવે છે. સહાયક ઉપવાસો કરાવે છે. આમ આંદોલનનું સ્વરૂપ ચોમેર ધારણું થાય છે; અને જનજગૃતિ આવે છે.

### સહાયક ઉપવાસો :

હવે ઉપવાસો અંગે થોડીક ચોખવટ કરી લઈએ. ઉપવાસનું હથિયાર ગમે તે વાપરે તો તે ભારે તુકદાન કરે છે. ધણ્ણા લોકોનું કહેવું છે કે ગાંધીજી પછી ધડાયેલા કાર્યકરો ઉપવાસ કરે તે સમજાય છે; પણ ગમે ત્યાંથી આવેલા કે બોલાવેલા માણસો, ઐઠુતો—ગોપાલકો ઉપવાસ કરવા એસી જય, તેમની હાજરી નોંધાય તો તે યોગ્ય છે?

એમને એઠ્યો જ ખુલાસો કરવાનો કે સંવત્સરીનો ઉપવાસ ખંડા કરી શકે, રોજ સહુ કરી શકે કે એકાદશીનો ઉપવાસ ખંડા કરી શકે તો એજ રીતે ત્રાગાં માટે નહીં, દ્વાણ માટે નહીં, પણ પોતાના દોષોની શુદ્ધિ કરી, સમાજશુદ્ધિ કરવા માટે, સંરથા ઉપરની શ્રેધાના કારણે ઉપવાસમાં એસે તો તેમાં કાર્ધ જતનો દોષ નથી.

વિનોદાજી ગુંદી આશ્રમમાં આવતા હતા, ત્યારે શુદ્ધિપ્રયોગના વિરાધી એક ભાઈએ પૂછ્યું: “ ને તે માણસ ઉપવાસ કરવા એસી જય તે યોગ્ય ગણ્યાય ! ”

વિનોભાળએ કહ્યું : “ ના ! ”

ત્યારે તેમની બાજુમાં ચાલતાં શ્રી. ફૂલજાઅધારે ખુલાસો કર્યો : “ બાયા ! નૈતિક તત્ત્વવાળી કોઈ સંસ્થાના સંચાલન નીચે કોઈ ઉપવાસ કરે તો વાંધો ખરો ! ”

વિનોભાળએ ત્યારે કહ્યું : “ ના ! ત્યારે કાંઈ વાંધો નથી. ”

એવીજ રીતે શુદ્ધિપ્રયોગ સિવાયના આસપાસના ગામનાં જે સહાયક ઉપવાસો થાય તે પણ યોગ્ય જ ગણ્ય !

## બહારની ટૂકડીઓ

એવો જ પ્રશ્ન બહાર ગામની ટૂકડીઓ માટેનો છે. તે પણ યોગ્ય જ છે. ગાંધીજીની પ્રેરણથી સ્વરાજ્યની લડત વખતે કેંગ્રેસ કમિટીઓ સત્યાગ્રહ કરવા દૂર-દૂરથી ટૂકડીઓ મોકલેલા માણુસો યોગ્ય હોયજ ! એજ રીતે નૈતિક બળ પ્રેરતી સંસ્થાના સંચાલન તળે બહારની ટૂકડીઓ આવે તેમાં વાંધો નથી.

સત્યાગ્રહીઓમાં તે વખતે ધર્ષાયે નિષ્ઠળ નીવડતા; ધર્ષા માઝી માગી ધર કેગા થતા; છતાં ગાંધીજ બહારના માણુસોને લેતા, તો સંસ્થા જેના અંગે ખુલાસો કરીને મંજૂરી આપતી હોય તેવા માટે વાંધો ન લેવો જોઈએ. માણુસ ખરાય હશે તો તે ટક્કી નહીં શકે પણ તેને તક જ ન આપીએ; કંઈ કરીએ જ નહીં; તો કામ કેમ ચાલે ? કેંગ્રેસની માન્યતાવાળા અને પરિચિતોને લઈએ એટલે ચિંતા ઓછી રહે છે.

## અતિ ઉચ્ચ શુદ્ધિપ્રયોગ

ક્યારેક શુદ્ધિપ્રયોગમાં સરળતાથી કે હુંકી મુદ્દતમાં સફળતા નથી મળતી. તે વખતે પોતાની સંસ્થાને બધી વિગતો જણાવી; તેનાં માર્ગદર્શન તળે અતિ ઉચ્ચ શુદ્ધિપ્રયોગ પણ કરવામાં આવે છે. ત્યારે ચોમેરથી એવું વાતાવરણ ઘડવામાં આવે છે કે અન્યાયોને ક્યાંથ નીકળવું સુરકેલ

થઈ જય છે અને અંતે તે શરણે આવે છે. શુદ્ધિપ્રયોગ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ કરવો, એનો નિર્ણય વ્યક્તિ નહિ લઈ શકે, સંસ્થા જ લઈ શકશે.

### અંતની માહાશ

આમ હૃદયપૂર્વક અન્યાયી પોતાની ભૂલનો એકરાર કરે છે; ત્યારે અંતે શુદ્ધિપ્રયોગકારો સાથે તેનું મિલન થાય છે. તે વખતે ગોળ ધાણું પરસ્પરને અવડાવીને મો મોઠાં કરાય છે; અન્યાયની કંડવાશ જતાં; ન્યાયની મીહાશ આવે છે. આ વખતે ખાસ કરીને શુદ્ધિપ્રયોગકાર માટે વિરોધ તથકો આવે છે. તેણે જેના થકી સહન કર્યું છે તે વિરોધી માટે પણ તેના દિલમાં ડંખ રહેવો ન જોઈએ.

શુદ્ધિપ્રયોગ એક એવા પ્રકારની જગૃતિ પેદા કરે છે કે અનિષ્ટ તેનાથી દુર ભાગે છે. સાથે જ એમાં ડાઈપણ પ્રકારની હિસા ન હોએને તે સામુદ્દર્યિક અહિસાનો પ્રચાર કરવામાં મદદર્ય હોઈ તેને સુખ્ય સાધન તરીકે લેવામાં આવેલ છે.



### ચર્ચા-વિચારણા

શ્રી. પૂંજાભાઈએ ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : “લોકો તાત્કાલિક પરિણામ તરફ જુઓ છે. તેના લીધે કામ કાચું રહી જાય છે. એક બાજુ ચોરીના ગુનેગારને શારીરિક સળ થાય અને માલ પાછો મળે તેનું પલ્લું જુઓ અને બીજું બાજુ ચોરીનો ગુનેગાર સમાજ અ.ગળ એકરાર કરે અને સુધરે તેમજ માલ પાછો મળે અને ન પણ મળે; છતાં ચોરીના ગુન્હાઓ બીજે રસ્તે જ ધર્યવાના. હૃદય-પલટાના પ્રસંગો ભલે એઓછા જોવા મળે; પણ સામાજિક અનિષ્ટો આગળ વધતાં અટકે છે. શુદ્ધિપ્રયોગ જે પાત્ર કે જૂથ સામે થયો હોય તે કદાચ તરેત ન કર્યુને તો એ તેનું હૈયું ડંખે છે એટલે તેની પ્રતિષ્ઠા પણ તૂટે છે; અને તે સુધરે છે. આજે એક તરફ ધર્મદ્વિયા કરે અને બીજું તરફ લોકોને

છેતરવાની વૃત્તિ ચાલે છે. આ બધું અનિષ્ટ શુદ્ધિપ્રોગ વ્યાપક થતાં અડકશે અને પરિણામે દાંડતત્વોમાંથી પણ જેસલ્લ-તોરલ જેવાં આગળ વધશે.

શુદ્ધિપ્રોગ કાં તો વ્યક્તિને નિર્મળ બનાવે છે; કાં તો એવું વાતાવરણ ઊભું કરે છે કેથી તેણે સુધરવું પડે છે. નહીંતર તે કાયમ માટે પ્રજાના હૃદયમાંથી પોતાનું સ્થાન ગુમાવે છે. મને જત અનુભવ છે કે ઉપવાસમાં બેસનાર જતે પણ શુદ્ધ થાય છે અને આખા સમાજમાં શુદ્ધિમય વાતાવરણ વ્યાપી જય છે. અનુઅંધ, જગૃતિ અને સુસરસ્થાના સંચાલન દ્વારા આ પ્રયોગ થાય તો આ વિજ્ઞાનયુગમાં કંઈ ન થયેલી સિદ્ધિ થતી જણ્ણાશે.”

**શ્રી. દેવજીભાઈ :** “સામુદ્દરિક યજ્ઞથી, સામુદ્દરિક તપ સૂધી પહોંચેલી આ પ્રક્રિયા ગાંધીયુગના સત્યાગ્રહનો વિકાસ છે. છતાં આમાં સંસ્થાતત્ત્વ અને અદ્ધાતત્ત્વની મહત્ત્વા છે. એટલે થોડોક નવો પ્રયોગ હોધિને, જરા ધીરજ રાખવી પડશે. આકી ડંખ, લય, વેર, બદલો ભિવાયતનું; ભૂલ કરનારના હૈયાને ઊડું સળવળાવનારું આ સાધન અજોડ છે; એમાં ન રાઈ નથી.

આજના વ્યક્તિગત કે સમાજગત ગુનામાં આડકતરી રીતે સૌ જવાઅદાર છે. એવી જગૃતિ અને તેને દૂર કરવા માટેની ભાવના શુદ્ધિપ્રોગમાં છે. તેથી શરૂઆતમાં કદાચ અદ્ધા ન એસે; પણ અનુભવ થતાં, એકવાર જીમેલી અદ્ધા પાછી નહીં ઉખડે.

એકવાર એ ગૂંડા જેવા માણુસોએ એક ખેડૂતને માર માર્યો હતો. પણ જ્યાં હજારો ખેડૂતો એક સાથે સંગઠિત થઈ શુદ્ધિપ્રોગનો નિચાર કરવા લાગ્યા કે ત્યાંજ બન્ને નભી ગયા. શુદ્ધ તરત્વનું સંગઠન થાય તો અશુદ્ધ તરત્વો આપોઆપ લાગી જય !

**મૃ. દંડીસ્વામી :** “આજે અનેક વિધ શુદ્ધિઓ કરવાની છે. શુદ્ધિપ્રોગ તે માટે અસરકારક અહિંસક લથિયાર છે. અદારપુરી પારો કે હજારપુરી અભરખની ઉપમા અને નાતી પડશે. તે ચૈતન્યને સપ્કષ્ટાતી બૌદ્ધ ધર્મની નિષ્ઠા અને ગાંધીજીની સમાજની અતિથીલતા આપનારી

વાસ્તવિક ચીજ છે. આ કામ સાધુ-સાધ્વી-સંન્યાસી પૈકી ને કાંતિપ્રિય હશે તે વડે શરૂ થયું છે અને આગળ વધતું જશે-તેમાં સૌ ખેંચવાતાજ મારા નાનું મતે આધ્યાત્મિક કાતિનું આ પાયાનું બળ છે. જાની થયા ખાદ હિમાલય વાસ કે એકાંત સેવવાની વાતો ભામક છે.

**શ્રી. ઘળવંતલાઈ:** “ન્યાયની ને દેવી ન્યાયમંહિરમાં છે તેનાં કરતાં વક્તાલોને કારણું જુદું જ દેખાય છે. કાયદાની ઇદી તથા કેંદ્રિત ન્યાય વગેરે અનેક દોષો છે. શુદ્ધિપ્રયોગ અદાલતને પણ યોગ્ય માર્ગ ચીંધનાર છે; જનનજગૃતિ લાવનાર છે અને અનિષ્ટોને જનતા વડે જ અપ્રતિષ્ઠિત કરાવનાર છે. મારા મનમાં તે છતા એક પ્રશ્ન ઉઠે છે કે જ્યા ફાડ તરત્વોનું જોર હોય, વિરોધી રાજકીય પક્ષોનું જનતામાં વર્ચસ્વ હોય ત્યાં શુદ્ધિપ્રયોગ અસરકારક બનશે ખરો? જો કે એમ તો લાગેન છે કે જે અલે તત્કાળ સુક્ષમ અને રથૂળ બન્ને રીતે તે સૌને પરિણામદાયક ન લાગે, છતાં સ્થાનિક જનતા અને સંસ્થાને સફળતા આપનાર બને તો અંતે બન્ને રીતે સૌને સંપૂર્ણ સફળતાદાયક બનેજ છે! સાખુંદ્દો દાખલો તાજે છે! કદાચ તાત્કાલિક સૌને એની ધડન બેસે ત્યાં ધીરજ રાખવી એજ ઉત્તમ છે.”

**શ્રી. વનિતાણેન :** “જેમ આસ્તિકોને શુદ્ધિપ્રયોગની અસર વહેલી કે મોડી થાય છે તેમ નાસ્તિકોને થાય છે ખરી?”

આ પ્રશ્ન ઉપર ચર્ચા ઢીક એવી થઈ-તેનો સાર આ પ્રમાણે હતો:—

“નૈતિક સામાજિક દ્વારા આગળ નાસ્તિકને પણ નમનું પડે છે. કારણું કે નાસ્તિકની ધરતી તો સમાજ જ છે. કુશેવને પણ હવે ર્ધ્યારનું નામ ચોતાના ધમંડની આગળ એ રીતે મૂકવું પડે છે કે ઈશ્વરની છંચા હશે તો હું આમ કરીશ. આથી વિશેષ પ્રમાણું આ યુગમાં ખીજું કર્યું હોઈ શકે! અલપત્ત નાસ્તિક વ્યક્તિ ને સમાજની ધરતીથી અલગ હશે તેને અસર નહીં થાય, એમ કદાચ બને, પણ તેવી વ્યક્તિથી ખાસ હાની થતી નથી.

( ૨૭-૧૦-૬૧ )



## શાંતિસેનાનો પાયો અને ચોખ્યતા

સામુદ્રાયિક અહિસાના પ્રયોગોમાં આજે શાંતિ સેનાનો મુદ્રો વિચારવાનો છે. એક સેના એવી હોય છે જે ને યુધ્ધ કરે છે ત્યારે શાંતિ સેના વિશ્વમાં તોક્ષાનો થાય તાં શાંતિ રાખવાનું કામ કરે છે અને કરશે. એટલે જ તેને અહિસાના સામુદ્રાયિક પ્રયોગો માટે એક ઉત્તમ સાધન માન્યું છે.

શાંતિ અને સેના એ એ શબ્દો ભળીને શાંતિ-સેના થાય છે. પણ અને શબ્દનો મેળ એસે છે કે કેમ એ એક પ્રશ્ન છે. ગાંધીજીની સામે કોઈ એ આ પ્રશ્ન મૂક્યો હતો. ત્યારે ગાંધીજીએ એ મતલબનો જવાય આપ્યો હતો કે “આપણે પ્રતિકારનો સ્વીકાર કર્યો છે તો હિંસક પ્રતિકારની કેમ અહિસક પ્રતિકારમાં પણ એવો જ શબ્દ જોઈ એ જે અસર કરી શકે!”

શબ્દોની પોતાની અસર છે. ધણુા જોશ પ્રેરે, ધણુા હતોત્સાહ કરે. તેથી જ મંત્રોમાં શબ્દો ઉપર લાર મૂકવામાં આવ્યો છે. જે વાતાવરણમાં અસર પેદા કરે છે. “સેના” શબ્દ સાથે લશકરી માણુસેનું માનસ-રીતમાત વગેરે આવે છે એટલે સહેલે ધૃણા થાય છે. ત્યારે તેની સાથે શાંતિ શબ્દ જોડાતાં તે વિશ્લેષ આકર્ષણું જમાવી; તેનો વિશ્લેષ અર્થ લોકમાન્ય થઈ જવામાં વાર નહીં લાગે. એ અંગે એના કાર્યક્રમો યોજવા જોઈએ.

## શાંતિસેનાનો પાયો

હવે શાંતિસેનાનો પાયો શું છે તે તપાસીએ. આ દેશમાં અમૂક લોહખણો એવાં છે કે જે તે હિંસાથી અહિસા તરફ વળશે તો દેશને તુકશાન થશે. આવાં બળોમાં, શીખ, મુસલમાન, અને પછાતવર્ગો મુખ્યત્વે હોય છે. એટલે ગાંધીજીએ શીખોને હિંસાના પ્રતીક તરીકે કટારને નહીં, પણ અહિસાના પ્રતીક તરીકે કોઈપણ વસ્તુ રાખવા

જણાંયું હતું. પછાત વર્ગને હરિજન નામ આપ્યું. તેમને અહિસક અને સંસ્કારી જનત્વયા. મુસલમાનો પ્રત્યે હિંદુઓને ઉદાર રહેવાનું જણાંયું અને મુસલમાનોને ન્યાય મળે તેની જતે કાળજી સેવતા.

ગાંધીજીએ શાંતિસેનાના પાયા માટે, મૂળભૂત હિંસા કર્યાં છે તે તૃપાસી લીધું અને તેને દૂર કરવા પ્રયત્ન કર્યો હતો. જે શીખોને કોઈ અલ્પસંઘ્યક કહીને દ્યાવે તો તે તરત હુમલો કરવા તૈથાર થઈ જાય. એવી જ રીતે મુસલમાનોને નાની તક મળે તો તેઓ હુલ્લડ કરી મૂકે છે. પછાતવર્ગના લોકો પણ દાઝે-ઘળોને બદલો લેવા તૈથાર થાય; આ બધું સ્વાભાવિક છે.

આવાં બળોને શાંતિસેના વડે અહિસા તરફ વાળાએ તો કેટલું મૈનું કામ થઈ શકે? નહીંતર સંધર્ષ વધુ થાય અને તેવા સંધર્ષને ઉતેજન આપવા કોમવાદી કે સામ્યવાદી પદ્ધો તો પહેલ કરતાં જ હોય છે. સામ્યવાદીઓ તો એ લર્ધને ઐઠા છે કે મજૂરોએ અને અમિકોમાં અસરોાય જાઓ કરી તેને મૂડીવાદી પરિયોગ સાથે લડાઈ કરાવવી તેમજ પોતે દૂર રહીને તમારો જેયા કરવો. આવી હિંસાના મૂળિયાં ઉપેડવામાં ન આવે ત્યાં સુધી શાંતિસેનાનો પાયો મંડાય કર્ય રીતે?

કદાચ એકવખત લાગશે કે ઉપરથી શાંતિ થઈ ગઈ છે; પણ હિંસાના મૂળિયાંનો નાશ કર્યા વગર; તેની અસર સ્થાયી રહી શકશે નહીં. ગાંધીજીએ હિંદુ-મુસિલમોનો સમન્વય કર્યો હતો. સર્વ ધર્મ સમન્વયની દર્શિએ તો ખરું જ, પણ તેમણે બન્ને લાખાની-હિંદી-ઉર્દૂ ભાષાની એકતાની દર્શિએ હિંદુસ્તાનીનો પ્રયોગ પણ કર્યો હતો. તે વખતે અન્ય ધર્મશરૂએ ચેત્યા નહીં.

હવે એ કામ શાંતિસેનામાં માનનારા આપણા જેવા લોકોએ કરવાનું છે; પક્ષમુક્તતાની વાતો કરીને ખોટા પક્ષોને પણ આડકતરી રીતે ટેકો ન મળો જાય એ ખાસ જેવાનું છે. જે પક્ષો હિંસામાં માને છે; એવા લોકો શાંતિસેનામાં આવે તો તેઓ દારા થતી હિંસા વખતે

અહિસક પ્રતિકાર શક્તિ કામ નહીં આવે. હુલ્લડ અને તોઝાની તરવોને વખોડના જોઈએ; નહીંતર શાંતિ-સેના પાયા વમરની થણે.

પછાતરગેર્ણને પણ એ દણિએ સારા માર્ગ વાળવાની જરૂર છે. કેવળ વિચારો આપવાથી એ કામ નહીં થાય; પણ સાથે ધડતર જરૂરી છે, નહીંતર એ લોકો તોઝાની, હિંસાવાદી, સાભ્યવાદી, કે કોમલવાદી તત્વોન્ય હાથમાં રમી જશે. શાંતિની વાતોથી શાંતિ આવતી નથી, પણ તે માટે સર્વપ્રથમ અહિસા વડે જાત ધડતર અને પછી લોકધડતર કરવાથી જ થશે. તેથી જ સર્વ સામાન્ય લોકોમાં હિંસાન્ય બદલે અહિસા પ્રત્યે શ્રદ્ધા બેસરો અને આમ જનતા તેમાં રસ લેતી થશે.

### શાંતિ સૈનિકની યોગ્યતા :

આપલો વિચાર કર્યા પછી હવે શાંતિસૈનિકની યોગ્યતા વિષે વિચારીએ ‘શાંતિસેના’ શબ્દમાં સૈનિક-સંગઠન આવી જ જાય છે. શિસ્તઅદ્ધ અને સંસ્થાઅદ્ધ એ શાંતિસૈનિક હોવો જોઈએ. તેનો સુસંસ્થાઓ સાથે અનુભંધ હોવો જોઈએ. તે ધડાયેલી સંસ્થામાં ધડતર પામાને આવેલો હોવો જોઈએ !

વગર ધડાયેલા ગમે તે પક્ષના લોકોને શાંતિસેનામાં દાખલ કરવાથી અને પાછળથી ધડતર થઈ જશે, એમ વાત કરવાથી, યોગ્ય સેના નહીં અને. કરાય એવો સૈનિક ક્રવાયત કરશે, શિસ્ત પાળશે, પણ મોડો આવતાં ડેટલો ટકી શકશે તે એક શાંકા છે. તેના બદલે આમસંગઠન, લવાદી પ્રયોગ, શુદ્ધિપ્રયોગ વગેરેમાં એ ધડાતો ધડાતો આવશે તો, આવા ધડાયેલા શાંતસૈનિકો લલે સંખ્યામાં ઓછાં હશે પણ ટકી શકશે તેમજ અહિસામાં માનનારા ધણ્ણા ભીજનું ધડતર કરી શકશે.

### શાંતિના પ્રયોગો :

દેશ અને દુનિયાના પ્રવાહો જોતાં મને લાગે છે કે શાંતિ માટે ત્યાગ-અલિદાન કરનારા લોકો કેવળ ભારતમાં જ નહીં, પણ અન્ય

હેશોમાંયે પાકયા છે. પણ, આ ખંડા પ્રયોગો વ્યક્તિગત થયા છે હવે તેને સંગઠિત બળ રૂપે કરવાની જરૂર છે.

વેર વિઘેર જે બજો આ દિશામાં પડ્યાં છે; તેનું સર્વપ્રથમ સંકલન કર્છ રીતે થાય તે અંગે હવે પણી ( આવતે અઠવાડીયે ) વિચારશું. પણી એ સંગઠિત બળનો પ્રવાહ આગળ ધરાવશું તો અદ્ભૂત કાર્ય થઈ શકશે. શાંતિસેનાના સંદર્ભમાં જે વ્યક્તિગત પ્રયોગો દેશવિદેશમાં થયા છે, તે અંગે થોડું જોઈ જરૂર છે; જેથી ખરા શાંતિ-સૈનિકનો ખ્યાલ આવી જાય.

### યુકેંગનું અસરકારક બલિદાન :

આજનું જે રાષ્ટ્રવાદી ચીન છે, તેને આધીન ફર્મેસા દીપ હતું. ચીનના શાહંશાહે ત્યાનું રાજ્ય ચલાવવા માટે ત્યાંના એક આદ્વિસી ‘યુકેંગ’ની નીમણૂંક કરી હતી. યુકેંગે ત્યાંના આદ્વિસીઓના કલ્યાણ અને શુભનિષ્ઠા દારા તેમનું હૃદ્ય જીતી લીધું હતું. તેણે આદ્વિસી પ્રજાને જે હિંસક અને કુર હતી, સંમાર્ગે અને સંસ્કૃતિને માર્ગ વાળવા માટે માથાવુટ પ્રયત્નો કર્યા. આ આદ્વિસીઓમાં એક જંગલી અને કુર પ્રથા હતી, જીવિત માણુસોનો શિકાર કરીને તેમના માથાં ટેવતા-ઓને બલિ ચઢાવવામાં આવતાં. યુકેંગે આદ્વિસીઓને સમજજીને આ કુપ્રથા ખંડ કરાવવા ધરણા પ્રયત્નો કર્યા, પણ તેમાં તે સફળ ન થયો.

એક વખત આ આદ્વિસીઓએ એકો સાથે ૪૦ જીવિત માણુસોનો શિકાર કરી નાખ્યો. આ જોઈને યુકેંગનું હૈયું પ્રુજ જિધ્યું. એણે તરત આદ્વિસીઓને ઓલાવીને નમ્ર સ્વરે કહ્યું—“જે તમે દર વરસે એક માયું ટેવીને ચઢાવશો તો એટલા ખંડાં માથાં તમારે માટે ૪૦ વરસ સુધી ચાલશો. ત્યાં સુધી તમારે એક્ય માણુસનો નવો શિકાર નહિ કરવો. યુકેંગ પ્રત્યે આદ્વિસીઓએ જાહર અને પ્રેમથી, પ્રેરાઈને તેની વાત કબૂલી. યુકેંગે વિચાર્યું ૪૦ વરસ જેટલા લાંબા માળામાં આ સોકો આ ખંડું હિસા કરવાનું ભૂલી જશે. પણ થયું એનાથી ઉલ્લંઘન નથી.”

ચાલીસ વરસના અંતે પણ તે લોકો દેવીને એક માણુસનું માયું ચઢાવવા માટે યુકેંગ પાસે સલાહ દેવા આવ્યા; ત્યારે યુકેંગે તેમને ધણું સમજાવ્યું કે હવે આ કુપ્રથાને બંધ કરો, કાઢી નાઓ. પણ યુકેંગની વાત તે લોકોએ નહિ માની. બહુ વિચારને અંતે તેણે એક રસ્તો કાઢ્યો કે ‘જે તમારે માણુસનું માયું જ ચઢાવવું હોય તો અમૃત ડેકાણે લાલ કપડાં પહેરેલા માણુસને જુઓ તેનું જ માયું કાપનો, ખીજનું કાપતા નહિ’ તેમણે કણૂદ્યું,

યુકેંગ હવે સમજ ગયો કે માત્ર ઉપરેશાથી એ લોકો માનવાના નથી, બલિદાન આપવું જ પડશે. તે પોતે લાલ કપડાં પહેરીને આદ્વિવાસીઓને બતાવેલ ડેકાણે ભિભો રહ્યો. તેણે પોતાનો ચેહરો બદલી નાખ્યો, એટલે ઓળખતો ન હતો. આદ્વિવાસીઓએ તેનું માયું કાપી નાખ્યું. દેવીને ચઢાવ્યું તે વખતે તેમનો ચેહરો ઓળખીતો લાગ્યો. હવે શું થાય ! અરર ! આતો યુકેંગ ! ! ગજબ થઈ ગયો.

યુકેંગના બલિદાનની ધારી અસર થઈ. ત્યાર પછી આ આદ્વિવાસી-ઓએ નરબ્યલિ પ્રથા બંધ કરી દીધી.

### સ્વીટ્યુરલેન્ડનો જોન બુદ્રોજ :

ખિસ્તી ધર્મના અનુયાયીઓમાં પણ અહિસક શાંતિવાદીઓના ધાર્યા દાખલા મળે છે. સ્વીટ્યુરલેન્ડના જન બુદ્રોજનો દાખલો બહુ જ પ્રેરણ્યાદ્યાયક છે. તેત્યાં લરકરી તાલીમ આપનાર એક હેઠેદ્ધર હતો. તે લરકરને તાલીમ આપતો. તેના દાથે તાલીમ પામેલાને પહેલું સ્થાન મળતું.

તેના ખિસ્તામાં એક નાની બાયખલની ચોપડી હમેશા રહેતી. જ્યારે તે પ્રાર્થના કરતો. ત્યારે બાયખલ ઉધાડી ને થોડું વાંચતો. એકવાર બાયખલ વાંચતાં-વાચતાં તે મંથનમાં પડી ગયો કે “તારા ડાયા ગાલ ઉપર તમારો મારે તો જમણો ધરકે” જિસસના આ વાક્ય સાથે યુક્તની તાલીમનો મેળ પડતો નથી. ખિસ્તી ધર્મ સાથે પણ માનવસંહારનો મેળ આતો નથી. તો શું મારે હવે આ લડાઈની તાલીમ આપવાની નોકરી છાડી દેવી નોઈએ.

આમ મન સાથે નોકરી છોડવાનું નહીં કરી તે એક દ્વિસની રજી લઈને પોતાને ધેર જય છે. પોતાની પતની આગળ આ વાત કરે છે. તે પણ જોનના વિચાર સાથે સહમત રહ્ય અને આ વિચાર ને કાર્યાન્વિત કરવાનું ગ્રોત્સાહન આપ્યું, જોને નક્કી કરી લીધું કે આ નોકરી છોડતાં કે અંધ્ર આફ્તો કે કણ્ણે આવશે તે ખુશીથી સહીશ.

તે ધરથી સીધે॥ પોતાના કમાંડિંગ ઓફિસર પાસે છાયાથીમાં આવ્યો અને પોતાનો ફોલ પોશાંક અને રાઇફલ તેમની આગળ મુક્કીને વિનંતિ કરી. “સાહેબ, હવે મારાથી આ નોકરી નહિ થાય. મેં જિસસનો અવાજ સાંભળ્યો છે. અત્યાર સુધી તો મેં લડાઈની તાલીમ આપી, હવે હું ધ્યાનના પ્રેમ અને અહિસાની તાલીમ આપવા માસું છું.”

તેના ઓફિસરે તેને ધણ્ય સમજાવ્યું અને કહ્યું કે “જે તું અધ્યવચ્ચેથી નોકરી છોડીશ તો તને હમણું જ પકડીને જેલખાનામાં લઈ જવામાં આવશે અને તારા ઉપર ડાયફેસર કેસ ચાલશે અને તને સજ થશે. એટલે આ ગાંડગણું છોડી હે. ધરડે ધડપણ કોણું તને પાળશો.” તેના ઓફિસરે વિચાર્યું કે હમણું લડાઈનો કોઈ પ્રસંગ નથી, છતાં આઠલો મોટા હોઢો છોડીને જય છે, તેથા એતું મગજ ચસકી ગયું લાગે છે. તેણે જોનને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. પણ ત્યાં જોન જેવા બાહેશને કોણું રાખે! છેવટે તેના ઉપર કેસ ચાલ્યો. મેજર ઓર્નાન્ડ સેરીસોલ નામના સરકારી વકીલે તેના ગુના પ્રમાણે થોડાક માસની સજ આપી. જોન બુદ્ધોજ પોતાના વિચારોમાં ખૂબજ મક્કેમ રહ્યો. તેણે ગુનો પણું કણ્ણુંથો અને લોકો આગળ પોતાની અનતિર્યથા કહી સંભળાવી. હવે તો એક પણી એક ફોલ તાલીમવાળા જોન બુદ્ધોજનું અતુકરણું કરવા લાગ્યા. લોકો ઉપર તેના ત્યાગની જરૂર અસર થઈ. તેના આંતરરાષ્ટ્રીય શાન્તિદાનમાં ધણું લોકો બળી ગયા.

### ક્રિનલેન્ડની મટિલારીડ :

એવીજ અહિસાની સાધિકા ક્રિનલેન્ડની મટિલારીડ નામની ખાઈ રહ્ય. તે ત્યાંના ગવર્નરની પુત્રી હતી, બહુ જ રૂપાળી અને ડોમણ

સ્વભાવની, નાનપણુથી જ તેની નિર્દિશી કૂર ડેઢીઓમાં વીતી હતી. તે વખતે કિનલેન્ડમાં જેલોની હાલત બહુ વિચિત્ર હતી. ફહેરેગીરો પણ કૂર અને અત્યાયારી હતા કેને પરિણામે ડેઢીઓ પણ કૂર બની જતા. તેઓ આપસમાં લડતા, એકખીજાને ભારતા અને લાગ મળનાં ફહેરેગીરો ઉપર પણ જુલમ કરતા. એથી શાંતિ સ્થાપવી સુરકેલ થઈ જતી.

એ બાઈને ગ્રેરણા થઈ કે હું મહું જીવન આવા કૂર ઝુનેહગાર લેડોની વચ્ચે આગું અને એમના સુતેલા લગવાનને જમાડું। પહેલાં તો તેને રાજ્યાધકારીઓએ તથા માવતરેણે ધનજાત ન આપે. પણ જ્યારે તેમણે જેણું હું આ બાઈ બહુ ગ્રેમાળ છે અને પોતાના વાતસલ્યથી આ લોકાને સુધરી શકે છે. લોકાએ પહેલાં તો તેને ગાંડી કહી. પણ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. શરૂઆતમાં તો ડેઢીઓ પણ તેની મળક કરતા, પણ તે બહુ જ કાળજીથી, નિર્ભાત થઈને પૂરી સહાતુભૂતિથી બયંકરમાં બયંકર ડેઢીની વીતક કથા સાંભળતી; તેના ગુનહાના કારણો ઉપર વિચારતી, જેલના એાફિસરો અન્યાય-અત્યાયાર કરતા તો તેમને પણ ગ્રેમથી સમજાવતી. આજ તેણીએ બધાનાં હૃદ્ય જીતી લીધાં. અને ડેઢીઓ તથા એાફિસરો પણ એની વાત માનતા. ડેઢીઓ સુધર્યાં, જેલો સુધરી. મહિલડારીડે અહિસાનો ચમત્કાર પ્રત્યક્ષ બતાવી આપ્યો કે જેલથી સુકુત થયા પછી પણ મહિલડાની સાથે ધણું ડેઢીઓ સેવાના કાર્યમાં શાંત અને અહિસક બનીને લાગી ગયા. ડેટલાક નાગરિક જીવન વિતાવવા લાગ્યા. મહિલડાએ ‘આંતરરાષ્ટ્રીય મૈત્રી વર્દ્ધક સંધ’ સ્થાપ્યો; તેમાં ધણું લોકો શાંતિ સ્થાપવા અને સેવા આપવા તૈયાર થયા.

### ઇંસાંડની ઇલોરેંસ નાઈટિગેલ :

એવી જ રીતે ‘હાથ બતી સાથેની દેવી’ નામે મશ્વર થયેલી ઇંસાંડની ઇલોરેંસ નાઈટિગેલનો દાખલો પણ શાંતિ માટે અદ્ભૂત છે. તેણે માંદા-ધાયક વગેરેની સેવાસુશ્રૂષા માટે જીવન આપી દીધું અને

આજના Red-Crossના કાર્યનો પાયો નામ્યો. લડાઈ સૈનિકોના જીવનમાં જે કોરતા આણે છે તેને આ સેવા-ચાકરી વડે વિનભ્રતામાં ફેરવી નાંખો, તેને અનુસરીને ધથ્થી સારા ધરની સ્વીએ એ સેવા-સંધમાં દાખલ થવા લાગી.

## બૌદ્ધ સાધ્વી ઝકમાવતી

વ્યક્તિગત પ્રયત્નોમાં બૌદ્ધ સાધ્વી ઝકમાવતીનો દાખલો ઘેરેક છે. તે વખતે એક મોટો ફુકળ પણ્ણો. લોકો પાસે કાઈ ખાવાનું ન રહ્યું. તેમાં એક બાઈની રિથ્તિ એઠલી કુપરી આવી ગઈ કે તે પોતાના આળકને મારીને ખાવાની તૈયારી કરતી હતી. ત્યાંથી સાધ્વી ઝકમાવતીને પસાર થવાનું થયું. તેણે બાઈને સમજનીવી હતી. પણ બાઈ ન માની એટલે તેણે એ બાળક લઈ લીધું અને પેલી બાઈને પોતાનું સ્તન કાપીને આપી દીધું.

આવા નમૂના દરેક ધર્મમાં છે. માત્ર તેનું સંકલન થવું જરૂરી છે.

## રાણુપ્રતાપનો પુરોહિત :

રાણુપ્રતાપ અને શક્તિસિંહ બન્ને ભાઈઓ જ્યારે વાહે ચઢી ગયા હતા અને તલવાર કાઢીને એક ભીજાનું માયું ઊડાતવાની તૈયારીમાં હતા, ત્યારે તેમનો પુરોહિત વચ્ચે આવી ને સમજાવે છે. જ્યારે તેઓ સમજતા નથી-ત્યારે પુરોહિત પોતાના હાથે જ બન્નેની વચ્ચે છરી પોતાના પેટમાં હુલાવીને પોતાનું બલિદાન આપી દે છે. આની બન્ને ઉપર તરત અસર થઈ. અને બન્ને ભાઈઓ લડવાનું ભૂલી પસ્તાવો કરવા લાગ્યા. અને ગ્રેમથી રહેવા લાગ્યા.

## ગુરુ ગોવિંદના એ પુત્રો :

ગુરુ ગોવિંદસિંહ પાસે એ વાત મૂકવામાં આવી કે “ કાંતો આખી શીખ કોમ ઉપર અત્યાચાર થશે-નહીંતર તમારા એ દીકરાને સોંપો એ અમે તેમને અંમારા બનાવશું ! ”

ગુરુ ગેવિદસિહે આખી કોમના રક્ષણ માટે એ છોકરાઓ સોંપ્યા. બાદથાહે તેમને મુસલમાન થવાનું કહ્યું પણ તેઓ ન માન્યા એટલે બન્નેને જીવતા દ્વિવાલમાં ચણી દેવાનો આદેશ આપ્યો. નાનોભાઈ પહેલો ચણ્યાયો. એટલે મોટાભાઈની આંખમાં આંસુ આવ્યા. તેની પાલક માંચે કહ્યું “ એઠા ! બલિદાનમાં રડવું શું ? ”

**મોટાએ કહ્યું :** “ ભરવામાં નાનોભાઈ પહેલો થઈ ગયો તેનું મને રડવું આવે છે. ”

બન્ને ભાળકોની બલિદાનની ભાવનાનો જીવંત નમૂનો જોઈ ને ત્યારથાદ કોઈ બાદથાહે શીખ્યો. ઉપર જુલમ ગુજરવાની હિંમત ન કરી અને શાંતિ સ્થપાઈ. આમ શાંતિ માટે પ્રાણ્યાંકનિ આપવી પડે તો હસતે મોટે આપવી પડે છે.

### બટ્રોંડ રસેલ અને શાંતિની વાતો :

આમ દેશ-વિદેશોમાં ધણ્યાં વ્યક્તિગત આંદોલનો થયાં છે. બટ્રોંડ રસેલ નેવાએ તાજેતરમાં “ અણુભોન બંધ કરવાની ” શાંતિવાદી ઝૂંપેશ્વર ઉપાડી હતી પણ એમાં સંસ્થાનો અનુભંધ નથી. વ્યક્તિએ ધણ્યી ભળો છે; ધણ્યી સહીએ થઈ છે પણ વ્યક્તિએના સરવાળાથી કંઈ સહ્ય થતું નથી; ધડતર પામેલી વ્યક્તિએ તૈયાર થાય તો જ શાંતિનું આંદોલન જગાડી શકે, વર ધડાયેલા લોકો કે તેમની શાંતિસેના તૈયાર કરવાથી કોઈ પણ કાર્ય સરતું નથી.

### જનતા સાથે શાંતિ-સેનાનું સંક્લન :

આના સંદર્ભમાં મને એક વાત યાદ આવે છે. મારું ચોમાસું ઘોળકા હતું અને સન ૧૯૫૬ માં મહાગુજરાતવાદીઓના તોષાન વખતે મોરારજીભાઈ ઉપવાસ કરી રહ્યા હતા. ત્યારે મને થયું કે સર્વપ્રથમ મારી ઉપવાસ કરવાની ફરજ છે! તે છતાં પણ ગુજરાત પ્રાંતિક ડેંગ્રેસ સમિતિની ડેંગ વ્યક્તિએ ઉપવાસ કરવાની ફરજ હતી! તેના બદલે એક ડેંગ્રેસી અને સરકારી હોદેદાર ( મુંબઈના મુખ્ય પ્રધાન ) ઇપે

મોરારજુલાઈ ઉપવાસ કરે તે જરૂર અંથન જગાડનારું હતું. પ્રશ્ન એ હતો કે તેના બદલે ખીજુ કોઈ વ્યક્તિ ઉપવાસ કરત તો અસર થાત ખરી !

મારું માનવું છે કે ન થાત. કોઈપણ વ્યક્તિનો અનુભંધ પ્રાણું, પ્રતિષ્ઠા, પરિશ્રહ હોમવાવાળા લોકો સાથે હોવો જોઈએ. મોરારજુલાઈનો એ રીતે કોંગ્રેસ, ગુજરાત અને હિંદ સાથે સંબંધ હતો એટલે તે પ્રશ્નનો નીકાલ આણવા બધા અયણીએ. પ્રથતન કરવા લાગ્યા અને પ્રશ્ન જલદી ઉકેલાઈ ગયો.

એટલે શાંતિસેના માટે એ પ્રશ્ન જિલ્લો થાય છે કે આમ જનતાની સાથે તેનું સંકલન કઈ રીતે કરવામાં આવે ?

એ માટે બધા પાસે બધી રીતે અપેક્ષા કરવામાં આવે પણ તે અપેક્ષા ત્યારે જ ક્રોન જ્યારે પહેલ પોતાનાથી થાય. સર્વ પ્રથમ તો શાંતિસૈનિકોમાં એ વાતો હોવી ધણી જરૂરી છે :—

( ૧ ) વિશ્વપ્રેમ ચુંબકત્વ

( ૨ ) સર્વતોમુખી પ્રતિભા !

—આ એ ગુણો તપ-ત્યાગ અને બહિરાનથી જ આવી શકે અને એ ગુણો જ અનુભંધ રખાવે. ધણ્યા લોકોની પ્રાણું પ્રતિષ્ઠા-પરિશ્રહ છોડવાની તો તૈયારી હોય પણ આક્ષેપ કે અપમાન તેમનાથી સહન થતાં નથી. તેમના માટે મીરાંબાઈનું આ પદ પ્રેરણાદાયક થશે :—

મેં તો જેર પીધાં છે જાણી જાણી

રાખ્યાલું, મેં તો જેર પીધાં છે જાણી... !

તારા હિંરલાં માણેકને રાખા ! શું રે કરું !

શું રે કરું ! વિષ પીધે ના રે મરું !

મેં તો જેર પીધાં છે, જાણી જાણી. રાખ્યાલું... !

—ચારે ખાજુ ઝૂલતો વરસે; પણ જ્યારે આક્ષેપો થાય, અપમાનો થાય ત્યારે એ તો કાર્યક્રર ઉપર થવાનું જ છે એમ જાણુને તેને હસીહસીને વધાવી લેતાં આવડવું જોઈએ. ચારેખાજુ અંધકાર છવાયો

હોય ત્યાં અવ્યક્તાત્મળ ઉપર અધ્યા રાખવાથી જ આશાનું કિરણ ફૂટે  
છે. કોઈને કોઈ સ્કુલથ્યા દારા સાક્ષાત્કાર થાય જ છે।

આને કુશેવે, ૫૦ મેગાટનોના બોમ બનાવીને અખતરો કરાવ્યો  
છે। તે લોકને ઉરાવવા માટે કે હિસ્ક શક્તિમાં અમે કેટલા આગળ  
છીએ? પણ, આ પ્રકારનો ગર્વ શું કામનો? જોડસેએ ગાંધીજીને  
મારીને ગર્વ અનુભવ્યો તેથી શું થયું? ગાંધીજી તો અણુનમ રહ્યા!  
એક ગાંધીજી ગયા તો શું થયું તેઓ અહિસાનો વારસો આખા જગતને  
આપી ગયા. પરિણામે શર્વો દૂખાડવાથી લઈને મહારાષ્ટ્રોની શિખર  
મંત્રથ્યા, અને અણુવિકસિત રાષ્ટ્રોના વિકાસથી લઈને રાષ્ટ્રોના  
શાંતિમય સહઅરિતત્વની વાતો કરતું જગત થઈ ગયું છે.

### આમજનતાની શાંતિ સેનામાં સહાયતા!

આ અંગે અમાઉ ચર્ચા થઈ ચૂકી છે કે જનસંગઠનોનું ધડતર  
એ દિશામાં થશે તો તેમાંથી શાંતિ સહાયકો મળ્યા વગર નહીં રહે!  
અમદાવાદમાં ૧૯૫૬ માં મહાગુજરાતવાદીઓનું તોક્ષાન ચાલતું હતું  
ત્યારે પરિસ્થિતિ એવી વિકટ હતી કે કોઈ સાંદુ, લોકસેવક કે કુંગેસી  
ખદાર નીકળી આ તોક્ષાનીઓને કહી શકતું નહીં. મોરારજીભાઈએ તો  
ઉપવાસ કરી પોતાની કુરજ ઘનવી હતી. પણ લોકોમાં નિર્ભયતાનો  
સંચાર કોઈ કરવા તૈયાર ન હતું. તે વખતે ભાલનળકાંઠામાંથી ઐદૂતો  
અને ગોપાલકોની દુકડીઓએ આરીને નિર્ભયતાનો સંચાર કર્યો. લોકોમાં  
નેતિક જગૃતિ આણી અને તોક્ષાનીઓને શાંતિનો ખાઠ શીખ્યો.

હવે પ્રશ્ન એ છે કે શું એ દુકડીઓને ધડતર. મજું હતું? ના,  
તેમને માત્ર ભાલનળકાંઠા પ્રાયોગિક સંબંધ અને ઐદૂત-ગોપાલક મંડળ  
પ્રતિ અદ્દા હતી. પેસા આપવના હોય તો લોકો સહેલાઈથી આપી શકે;  
પણ અહીં પ્રાણુ-પ્રતિષ્ઠા આપવના હતા. ઐદૂત મંડળ જેટલું ગોપાલક  
મંડળનું ધડતર પણ થયું ન હતું. તે છતાં ગોપાલકો અને ઐદૂતો  
સહી ન શકાય તેવી ગાળો, આક્ષેપો અને પત્રરમારા વચ્ચે શાંત રહ્યા  
એ આશ્ર્યેજનક હતું.

એક ગોપાલકભાઈને તો નગર કરીને પોળમાં તોદ્વાનીઓ લઈ ગયા. ત્યાં કહેવા લાગ્યા કે “ અમને લખી આપ કે અમને ઐસા આપને ભાડેથી લાવવામાં આવ્યા છે ! ”

આ ગોપાલક ભાઈ તુંકારો પણ ન સહેતારા હતા; છતાં બધું સહ્યું અને કહ્યું : “ આમ એટું શી રીતે લખી આપું ! અમે તો ભાડેથી નથી આવ્યા ! દ્વિલથી આવ્યા છીએ.”

તેમની હેરાનગતિ વધી તે વખતે પોળના એક ભાઈનામાં રામ જાગ્યા. તેમણે આવીને કહ્યું : “ શું કામ નિર્દોષને હેરાન કરે છો ! ”

અ સાંભળતાં તોદ્વાનીઓ ભાગી ગયા. ત્યારાદ મને યાદ છે ત્યાં સુધી ૩૦ મીએ ૧૨-૧૩ શાંતિસૈનિકોની ધડાયેલી ઠુકડી ગયેલી ! પણ તેની અગાઉના લોકો ધડાયેલા ન હતા છતાં શાંત કષ રીતે રહી શક્યા ? તેની પાછળ કયું બળ કામ કરી રહ્યું હતું ? જેથી નિર્ભયતાથી તેઓ સૂત્રોચ્ચાર કરીને જર્ખ શક્યા. એ પ્રસંગનું મહત્વ તો ભવિષ્યના ધૃતિહાસમાં અંકારો. આવું ધડતર માત્ર ભાષાથી થતું નથી; વસ્તુથી પણ થતું નથી; પણ પ્રસંગો હોમવાના આવે ત્યારે ઝુદ્ધિથી સ્ફૂરતું જોઈએ. માઠાની લડત વખતે જ્યારે ગાંધીજીએ હાકલ પારી ત્યારે ગ્રામીણું લોકોમાં અપૂર્વ જુસ્સો આવી ગયો હતો ! આવે પ્રસંગો જે લોકો નીકળી પડે છે તેઓ શાંતિસેનાને સહાયક થઈ શકે છે.

૧૯૪૬ માં અમદાવાદમાં જગન્નાથ મંહિર તરફથી સવારી નીકળી. તેમાં વ્યાયામ પડુ હતા. પણ સુસલમાનોએ હુલ્લડ કહ્યું છે તે સાંભળતાં બધા ભાગી ગયા. તે છતાં ધૂદુષેન નિર્ભય થઈને મુસ્લિમોની દરગાહ પાસે ભાષણું કરતાં હતાં ! એ અજ્ય જેવી વાત હતી ! ત્યાં ન જવું છતાં વસંતરાવ વગેરે ઢાડી ગયા. તે વખતે દૂધાભાઈ હરિજનનાં ટોળાં ઉપર લોકો ઘટવાના હતા. આ લોકો વચ્ચમાં સુધ ગયા. અનુની ટોળાએ તેમને કરખીણ રીતે ભારી નાખ્યા.

લાધ વસંતરાવ, રજુખઅલી કે ગણેશશક્તર વિદ્યાર્થીના આવાં બલિદાનો પાછળ સંકલના હોય; અને પ્રસંગ પડે શાંતિ લડત ચાલે તો ધથ્યા લોકો તૈપાર થઈને આવતા જય. સવાલ માત્ર અનુભંધનો છે. અનુભંધ નહીં તો એકલી વ્યક્તિનું બલિદાન ત્યાંજ અટકી જશે।

જે એમ કરવા જરૂરે કે જેમને હેમાધ જવાની છંચા છે તે અગાઉથી નામ લખાવે અમર અમૃત પ્રકારના લોકોમાંથી લેવાની ગણુની હોય તો એ પ્રયોગ આમ જનતાનો નહીં બને. અમદાવાદનો પ્રસંગ એ સૂચવે છે કે પ્રસંગ આવે સામાન્ય લોકોમાં જગૃતિ આવ્યા વિના રહેતી નથી.

પાલણુપુરમાં પંચના ફેસલાને ડોક્ટર માનીને પણ ફરી ગયો તે નિમિત્તે મારે તો પ્રાયશ્રિત કરતુંજ જોઈએ. લોકોમાં જગૃતિ થઈ. એક ઘેરૂને તો ત્યાં સુધી કહ્યું: “શાકભાજ મારે તો અમારી પાસે આવશો ને? અમે મહારાજને આમ મરવા નહીં દઈએ!”

એટલે કે બલિદાનોની પ્રક્રિયા ચાલે ત્યારે તેની અસર જનતા ઉપર પડે! તેમાંથી જનૂન અને જુવાળ (હિસામય) ને બાદ કરવામાં આવે તો ઉત્સાહી જનતા વડે મોઢું કામ થાય. આવી આમ જનતાને આવી ચોઅ દોરવણી મળે તો સામાનિક ન્યાયો સચ્ચવાર્ધને રહે.

આ આરે અનુભંધની કંડી સંખાર્છ જય તો ગામડાં અને શહેરોમાં દાડતત્ત્વે ઉપર દ્વારાણના અને લાંચરંશવત અટકાવવા માટેના અહિસક પ્રયોગો સફળ થઈ શક્યો. આ શાંતિસેના ધરાંગણે તોકાનો, અન્યાયો રોકવામાં સફળ થશે અને વિશ્વમાં શોષણ, યુદ્ધ અને સંહારને રોકવામાં સક્રિય થઈ શક્યો.

તે મારે વિશ્વના અહિસક અળોનું સંકલન કરતું પડશે. તે કેવી રીતે? તે અંગે હવે પણ વિચાર કરશું.



## ચર્ચા - વિચારણા

**શ્રી. ચંચળભેન :** આજની ચર્ચાના પ્રારંભ કરતાં કહ્યું : “ગાંધીજીના હિંદુ-મુસ્લિમ—એકતાના પ્રયાસો પાયાના હતા. તેથી સ્વરાજ્ય બાદ તેમને નોઓખલી સાંભળ્યું. તેઓ હિસાના ઓળામાં અભયને અતાવી આપતા.

સવારે પુ. મહારાજશ્રીએ કહ્યું તેમ સન ૧૯૪૬ માં દિદુમતીભેને હિસક હથિયારોવાળાં ટોળાં વચ્ચે જઈને ભાષણ આપ્યું હતું. જે શૌર્ય છે તેને હિસાના બદ્લે અહિસાને માર્ગ વાપરવામાં આવે તો કેટલું બધું કામ થાય! સુભાષ એ. જ. રાજપૂત કોમ વગેરે વ્યક્તિ અને સમૂહ કેટલું ભવ્ય કામ કરી શકે! પુ. ગુરુદેવ ખલિફાની વાતો ગાંધીજીના અનુસંધાનમાં કહી રહ્યા છે, તેથી આપણે સૌ ધડાઈ રહ્યાં છીએ. એટલે આ શિબિરનું પરિણામ ધથું સુંદર આવશે તેમાં શાંકા નથી.”

**શ્રી. દેવજીભાઈ :** “શાંતિસેનાની વિદ્વતાભરી વાતોથી શાંતિસેના નહીં આવે. એનો પાયો અને યોગ્યતા કાર્યક્રમોમાંથી અને તેથે આમ જનતામાંથી આવશે. આમદુકડીએ. તેમજ મહિલા દુકડીએ. ઉપર અમદાવાદમાં જે બન્યું તેમાં એ બધાં ટકી રહ્યાં તેની પાછળ પુ. મહારાજશ્રી પ્રત્યેની અને લાલ નળકાંડા પ્રયોગની સંસ્થાએ. પ્રત્યેની અધ્યા સિવાય મુખ્યયુણ બીજું શું હતું? એ પ્રસગો લભ્ય બની ગયા. જે કયાંથે નથી મળતું તે અનુઅધમાંથી મળે છે. ગાંધીજીને જે મુખ્યયુણ મળ્યું હતું તે તો મુંગી જનતાની સમજસૂઝાલરી અધ્યાથી જ મળ્યું હતું.”

**શ્રી. પૂંજાભાઈ :** શાંતિસૈનિક મોટે લાગે સાધુવર્ગમાંથી જ આવવા જોઈએ, હારણ કે, પાછળની એને ચિંતા ન હોય। જે કે સાધુ જાતે જ શાંતિસૈનિક જ છે. પણ તેઓ આજે તેવા રહ્યા નથી. હવે તેમને બદ્લાવું પડશે.

ગામડાંએભાંથી તેમને અનુસરનારા ધણુા મળો રહેશે; કરણું કે ત્યાં જત હોમિને પણ આગ ઓલવનારા ઓલવે છે. પણ તેની સાથે ઈચ્છનીય છે સતત-શાંતિ! આવી શાંતિ ગાનપૂર્વ હોમનારામાં જ આવશે! વ્યક્તિગત ઘલિદાનો રજ્યાચ્યાલી કે વસ્તંતરાવ જેવાનાં થયાં છે, પણ સંસ્થાનો અનુભંગ નહીં હોવાથી તેની ધારી અસર પડતી નથી. પણ સાંધુ ઉપર લોકેની શ્રદ્ધા હોઈને તે પ્રતિષ્ઠા હોમિને પણ અસરકારક પ્રભાવ પેદા કરી શકે છે. તે એક તરફ નિસર્ગાંનાં અભ્યક્તિખળ ઉપર આધાર રાખશે અને ભીજી તરફ સમાજ ઉપર.”

**શ્રી. ખળવંતભાઈ:** “હું ધડાયેલો નથી પણ મને અહિસામાં વિશ્વાસ છે અને સમગ્રતું હિત થાય ત્યાં ઘલિદાન આપવા પણ તૈયાર છું. જેમ લાલનળકાંઠા અને ગુજરાતમાં શાંતિસેનાનો પ્રયોગ કરવા માટે કાંતિપ્રિય સાધુઓ જોડાયા તેમ આખા દેશમાં અનુભંગાન થઈ જય તો ધણું સારું કામ થઈ શકે! આજે આટલા બધા જૈન સાધુઓ છે—વૈદિક સાધુઓ છે. શું મહાત્માજી જેવા ગૃહસ્થાશ્રમી સંત કરતાં તેમની જવાબહારી ચોણી છે? આજે તો હું “વડો”ની સાક્ષાત્મકામાં દુનિયામાં મજબૂત મડાગાંઠ જીબી થઈ છે. તલવાર સામે ઢાલ જેટલી મજબૂત જોઈએ તેમ ચોમેરની હિંસા સામે અહિસા પણ એટલી જ મજબૂત જોઈએ; તોન વિશ્વભરમાં શાંતિ થાય. અત્યારે અહિસા માટે પુષ્કળ તક છે.

**શ્રી. સુદ્રલાલ:** “કેમ સૈનિકોને સેનાપતિ ઉપર વિશ્વાસ હેઠય છે તેમ આપણું પણ જોઈએ! શાંતિસેનાના સેનાપતિ પાસે પ્રેમતું જ મુખ્ય બળ હો જેટલે કશી હરકત નહીં આવે! હું એવો શાંતિ સૈનિક બનવા છુંચું છું.”

**શ્રી. દુલેરાય માટલિયા:** સેનામાં સાત વસ્તુઓ હોય તો તે હેચ્ય બને છે.— (૧) સેનાની (૨) શિસ્ત (૩) તાલીમ (૪) સંગ્રહ (૫) સંખ્યા (૬) જુસ્સો અને (૭) વ્યૂઠ. શાંતિ-સેના માટે

પણ આ બાબતો એટલી જ જરૂરી છે. શાંતિસૈનિકની યોગ્યતા જતને હોમનાની તૈયારી એટલે જ આપણે ગણેશશંકર વિદ્યાર્થી, વસંતરાવ. રજ્ય વગેરેને યાદ કરીએ છીએ. બાપુ એટલા માટે જ ખડા સૈનિકોનું લિસ્ટ રાખતા. એ લોડાએ આદેશ મળતાં ચાલી નીકળવાનું હોય. અલખત પ્રાંતવાર, વિસ્તારવાર, સેનાપતિએ પણ નીમતા !

શ્રી રીચર્ડ ગ્રેગ કહ્યું છે તેમ અહિસક સૈનિકે તાલીમ લિધી હોવી જોઈએ. જે પ્રતયેક હુશે તેજ ગમે ત્યા અનિષ્ટાનો પ્રતિકાર કર્યા કરશે. ચર્ચિલે ધડિયાળનાં કાંઠા બદલાવ્યા અને “V” for victory એટલે કે “અમે વિજય માટે છીએ”—તેવાં સૂત્રો ચોમેર લખાવ્યાં. તે પ્રમાણે જુસ્સો ટકાવી રાખવા માટે કંઈક થવું જોઈએ. પોતાના ચોક્કસ વિસ્તાર સાથેના સંગઠન સાથે જોડાઈને કામ કરતા બધાના આશ્રયરૂપ થવાય; નોધારાનો આધાર, સ્વીએ માટે અલયરથાન.

મારો અનુભવ છે કે આપણે જેમની ચિંતા કરીએ છીએ તેઓ આપણી વધારે ચિંતા કરતા હોય છે, મને માલપરાના લોડા એકલા ન જવા હેતા. “જે છે સૌંઠું, તેનાં સૌ છે.” લાલનક્કાનો આદેશ થયો તો મારી ચિત્તણની થોડી સંપર્કની સ્થિતિ પણ મદ્દે આવી !

એટલે વિનોભાળએ સંગઠન ન કર્યું તો જુસ્સો લાંખો ન ટકચો. અમૃક સમયે શાંતિ-સૈનિકોની પરેડ કરાવીએ તે ન ચાલે. રોકની કુવાયત જોઈએ. એજ રીતે સૈનિકો નીચેથી ઘડાયેલા હોવા જોઈએ. કેટલીકવાર શુદ્ધિપ્રયોગની જેમ નાના ઉપવાસની પ્રથમ કરીએ લઈ, છેવટ આમરણુંત ઉપવાસની કરીએ. સુધી જવું પણ પડે. કેટલીકવાર પૂરમાં ન હોમાતાં બાજુ ઉપર બેસીનેથે હોમાવાનું આવે-આ બધો વિવેક રાખવા જોઈએ ! ”

**શ્રી. ખળવંતલાઈ :** “અમ અને હોમાવું” એ સિક્ષાંતને લઈને ચાલતી સન् ૧૯૨૦ પછી જિલ્હી થયેલી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેના નેતા બિપ્રેસેરે સોલ છે. આપણે જ્યારે વિશ્વશાંતિ લગી અહિંસા દારા પહેંચવું છે તો આવી સંસ્થાઓ તેમજ વિશ્વનાં શાંતિનાં પરિણો સાથે આપણો અનુભંગ જોડવો જોઈએ ! ”

**પૂ. નેમિસુનિ :** “શાંતિસેના સાથે શાંતિ સહાયક સેના પણ જોઈએ. શાંતિસૈનિકો કરતાં, સહાયક સૈનિકોની ચોઝતા ઓછી હોય તો ચાલે ! એવી જ રીતે શાંતિરક્ષક દળનો પણ વિચાર જોડાય તો આખ્યાય, નીચેથા ઉપર લગીના ધડતરનો તાળો મળો રહે ! ”

**પૂ. સંતખાલાલજી :** “શુદ્ધપ્રયોગમાંથી જેમ શાંતિ સહાયક સહેને તૈયાર થાય છે તેમ નૈતિક જનસંગઠનો એ શાંતિરક્ષક દળની ગરજ સારે છે. અમદાવાદની આમ દુકાનો, શુદ્ધપ્રયોગો. અને ચૂંણુંનાં તોડાનો વચ્ચે તેજ રીતે કાર્ય થયું હતું.

( ૩-૧૧-૬૧ )



## વિશ્વમાં અહિંસાનાં પરિખળોનું અનુસંધાન

સામુદ્રાયિક અહિંસાના પ્રયોગમાં શુદ્ધિપ્રયોગ, શાંતિ સેના અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. પણ આ પ્રયોગોની અસર સમસ્ત વિશ્વસુધી પહોંચતી ન કરવામાં આવે તો તેની અસર અમૃક ક્ષેત્ર-પ્રાંત કે પ્રદેશ સુધી રહી જશે અને કાળાંતરે તેનું ભૂળતત્ત્વ પણ માર્યું જશે. જગતમાં હિંસા અને અહિંસા વચ્ચેનું સંધર્ષ યુગ્યુગથી ચાલતું આવ્યું છે. અંતે તેને શાંતિ અને અહિંસાને ચરણે આવવું પડ્યું છે ! પણ તેમ કરવામાં અનેક યુદ્ધ-પ્રતિહિસા વગેરેમાંથી જગતને યાતનાસહિત પસાર થવું રહ્યું. એટલે જ વિશ્વનાં અહિંસાના પરિખળો શાધીને તેનું અનુસંધાન કેવી રીતે કરી શકાય તે અંગે વિચારવાતું છે.

અહિંસા સાથે ખાન-પાનને ધણો સંબંધ છે. વિચાર સાથે તો છે પણ આચારમાં તેને ધણો એાછા ઉતારે છે. એટલે અહિંસક ખાન-પાન કોનાં-કોનાં છે તેનો સર્વપ્રથમ વિચાર કરીએ :—

### જૈનો અને અહિંસા :

અહિંસા સાથેનો ખોરાકનો વિચાર જૈન અને વૈષ્ણવ ધર્મમાં કરવામાં આવ્યો છે. જૈનધર્મમાં આહારશુદ્ધ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તે અંગે અહિંસાનો ઝીણુવટથી વિચાર કરવામાં આવ્યો છે. એમાં પણ પહેલાં મહારંલ અને મહાપરિયહેને પાપકારક અને નરકગતિમાં લઈ જનારા બતાવ્યા. પછી બીજી એ તત્ત્વો ઉમેરાયાં— “કુણિમાહારેણું, પંચેંદ્રિયવહેણું” માંસાહાર અને પચેંદ્રિયવધ. એક બાજુ તાં વિશ્વ વિશાળ લુલ અહિંસાને સાચવવાની ભૂમિકા છે અને એક તરફ જૈન શાખક રાજ ન્યાય માટે ખૂનખાર જંગ લડે તેમાં ૧ કરોડ ૮૦ લાખ માણુસો મરે. તે છતાં તેને સ્વર્ગામી બતાવ્યો. ત્યારે માંસાહાર કરનારને નરકગામી બતાવ્યો. આ વાતને ઊડાણુથી સમજવા જેવી છે ! એ તત્ત્વ ન સમજવાને કારણે આજે જૈનોમાં પણ

અહિંસા-પાલનનો જીવો પ્રત્યાહ ચાલ્યો છે. જેટલો વિચાર આજે કૈનોમાં, માંસાહાર, ભધ, કંદા-બ્યાટા, ભક્ષયાલક્ષ્ય, પાંચ પર્વી તિથિએ લીલેતરી ન ખાવી વગેરે ખાખતો તરફ છે તેટલો વિચાર, માનવનું શોપણ, અનીતિ અને અન્યાયની કમાણી તેમજ પૈસા માટે બધુંયે પાપ કરી છુટ્યા સુધીની મનોવૃત્તિ; આ અંગે કરતા નથી. એટલે જ સંત વિનોભાજું કૈનોને મીહી ટકોર કરતાં કહ્યું :—“ કૈનોએ અહિંસા ઉપર જેટલી ઝીણુવટથી વિચાર કર્યો છે-તેટદો સત્તાચરણ—આજવિકા શુદ્ધ ઉપર કર્યો નથી ! ”

એ વાત ધંદે અંશે ખરી છે. અહિંસાના પ્રયોગો દુનિયામાં કૃયાં-કૃયાં ચાલે છે. એમાં કૃચાં સંગઈનો ક પરિયોગ કામ કરી રહ્યાં છે એનો વિચાર સુદ્ધાં જૈન-સાધુ-વર્ગ લાગ્યે જ કરી શકતો હશે, જેટલો માંસાહારનો નિષેધાત્મક ભાત્ર વિચાર થાય છે; જીવદ્યામાં મનુષ્ય સિવાયના જીવોનો જેટલો વિચાર કરે છે-તેટલો માનવોના જીવનના દરેક પ્રક્રોમાં, જીવનના દરેક ક્ષેત્રોમાં, અહિંસાના સામુદ્દરિક પ્રયોગ શી રીતે થઈ શકે એનો વિચાર અતિ નજીવો થાય છે. એટલે કૈનોની ઊડાણુ-પૂર્વીની અહિંસા ડેવળ કૈનસમાજ સુધી જ સીમિત થઈને—અને તે પણ કદંગી હાલતમાં પડી છે, તે છતાં અહિંસાનું આ એક પરિયળ છે ખરું ! વૈદિકો અને અહિંસા :

ખીજું પરિયળ છે વૈદિક ધર્મનું અને તેમાં પણ વૈષ્ણવ લોકોનું, વૈષ્ણવોમાં ધર્માં કંદમૂળ, લસણ-દુંગળી જેવાં પણ ખાતાં નથી. તેમનો પણ અહિંસાનો ખ્યાલ વ્યક્તિગત અને ખાનપાન સુધીનો છે. વેપાર વગેરેમાં નદ્ધાખોરી, શોપણ વગેરે તેઓમાં પણ ચાલે છે. તે છતાં તેમની અહિંસાની મોટામાં મોટી મર્યાદા ગો—સંવર્ધનમાં આવી જાય છે. ગો-વધ-પ્રતિવંધ એમની પ્રયળ ભાવના છે. પણ પછી ગૌથાગાઓમાં ગોપાલન સારી પેઢ થાય કે જીવહિંસા કુમ ધટે તે તરફ પ્રયત્ન બહુ ઓછો થાય છે.

એક ભાઈ મારી પાસે આવે ત્યારે ફરિયાદ કર્યા કરે : “ આ

ગોવધ પ્રતિબંધ થવો જોઈએ ! ” એ થછ જય તો વૈષણવો રાજ થઈ જય. પણ આ પ્રતિબંધ કરસો ડોણું ? સરકાર કે લોકો ? રાજ્ય એકલું કરી શકશે ? તેની એક મર્યાદા છે. જ્યાં સુધી લોકોને ગળે આ વાત ન ભિતરે અને ગોરક્ષાતું વાતાવરણ પેદા ન થાય ત્યાં સુધી રાજ્ય એકલું કાનૂન દારા પણ આ કામ નહીં કરી શકે ! ધણીવાર તો આવા વૈષણવો ગોવધ પ્રતિબંધના નામે વિરોધી રાજકીય પક્ષોના ખોટા હાથા ઘની જય છે. દા. ત. કરપાત્રીજ એક રાજકીય પક્ષના આગેવાન ઘની લોકોને ભડકાવી રહ્યાં છે. આવાં ડોમવાદી પરિષણાથી અંજાઈ આમ લોકો તેમના ચક્કમાં ફૂસાઈ જય છે. જેમ મહાગુજરાત જનતા પરિષદ્ધના વિષયકમાં ફૂસાઈ ગઈ હતી, જેની પાછળ સામ્યવાદી અને તોશાની તત્ત્વો હતાં.

આર્ય સમાજ જેવો રાષ્ટ્રીય સ્વતંત્રતાને માનનારો અને બિનકોભી સમાજ, ક્યારેક હિંદુમહાસભા કે ક્યારેક જનસંઘને ટેકો આપી ડોમવાદી લાગણીને પંપાળ્યા કરે છે. એટલું જ નહીં, હિંદુ-મુસ્લિમ હુલ્લડ વખતે મુસલમાનોને ખતમ કરવા માટે હિસ્ક શર્ખો દેવામાં આવા લોકો બાધ નહીં માને. વૈદ્ધિક સંન્યાસીઓમાં અહિસાની લાગણી ગોવધ-નિષેધ માટે જેટલી છે તેટલી લાગણી અન્યાયના અહિસક-પ્રતિકાર માટે ધર્મ-ડોમ સમત્વયની આવનાની નથી. પણ તે છતાં આ એક અહિસાતું પરિષળ છે ખરં !

**બૌદ્ધો અને અહિસા :**

હવે બૌદ્ધ ધર્મ ઉપર આવીએ. બૌદ્ધ ધર્મનો ઇલાવો ખાસ કરીને હિંદુસ્તાનની અહાર વધારે થયો છે. ત્યાં મોટા ભાગે માંસાહારને બૌદ્ધ લોકોએ ક્ષમ્ય ગણ્યો છે; પણ હિંમાં હમણાં જે રીતે બૌદ્ધ ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે તે જોઈને અહોભિક્ષાચરીમાં નિર્માંસાહાર આવશે એમ લાગે છે. એટલે તે પણ અહિસાતું એક પરિષળ ઘની શકશે.

**શાકાહાર અને અહિસા :**

અહિસાના પ્રચાર માટે, જીવદ્યા માટે કે ગોવધ નિષેધ માટે

ને વરતુ અત્યંત જરૂરી છે તે છે શાકાહારનો પ્રચાર। તેથી આપણે ખોરાકનો વિચાર સૌથી પહેલો કરવાનો છે. હું નિર્માંસાહારી ધરની બિક્ષાચરી કરતો હોઉં છું. એમાં ધણી મુશ્કેલી પડે છે. મુસ્લિમ, ખિસ્તી અને કેટલાક વૈદિક લોકોનો ઊડાખુથી સંપર્ક થતો નથી. મહારાષ્ટ્રમાં તો ધણે સ્થળે મુશ્કેલી પડી. પ્રવચનોમાં ઉપર ચોટિયો પરિચય થાય છે. બિક્ષાચરીમાં ધેર ધેર જતાં ઊડાખુથી સંપર્ક થાય છે ત્યારે જ તેમની ભાવનાનો ઘ્યાલ આવી શકે છે? પણ તે મુશ્કેલ હોવા છતાં જરૂરી છે.

### જીવનયામંડળો અને અહિસા :

એ દાખિએ નિર્માંસાહારનો પ્રચાર કરવા અને અહિસાને સમાપ્તિ સૂધી પહોંચાડવા માટે જરૂરી છે કે વિશ્વની ને શાકાહારી પરિષ્હો છે; તેની સાથે અનુસંધાન કરવું જોઈએ. અહીં ધણુંને એમ થશે કે આવી પરિષ્હોના સમ્યો મોટા ભાગે પશ્ચિમના દેશોમાં હોય છે ત્યાં તેમનાં અંગત જીવનમાં ચારિયનાં મૂલ્યો જુદી જ રીતે ધડાયેલાં છે? તો તેને ચ્યાલાવવા કે કેમ? જ્યારે એ મુદ્દાઓને એકો સાથે લેવામાં આવે તો એક સાંઝે-અહિસક પરિણા હોય—બીજું ન પણ હોય! પણ દરેક વાતનો વ્યક્તિગત વિચાર ન કરતાં સંસ્થાગત કરવો પડશે

કેટલાક જૈન વૈષ્ણવ અહિસક ધર્મ સંસ્થાના સમ્ય હશે; બીજું બાજુ વ્યક્તિગત જીવનમાં શોષણું કરતા હશે. કદાચ શોષણુને સાંઝે ન પણ માનતા હોય! અહીં એ વિચારવાતું છે કે માણસ શોષણું સંસ્થાગત તો કરતો નથીને; અગર તો શોષણું કરનાર સંસ્થા સાથે જોડાયેલો તો નથીને, કે શોષણુને સાંઝે માનતો તો નથીને? આ ત્રણેય વિકલ્પોન હોય તો એ અહિસક સંસ્થા સાથે જોડાયેલ માણસને લેવામાં બાધ નથી. અહીં શોષણુનો મુદ્દો અલગ રીતે લેવાનો છે.

ઉપરોક્ત બાબતમાં આપણી કસોટી પ્રમાણે ને રાજકીય વિરોધી પણ્ણો ગોવધ-નિપેધ અંગે કામ કરે છે; તેવા ખાંડો કોમવાદી હેઠળ તો

તેની સાથે અનુસંધાન નહીં થઈ શકે ! તેનાં અનિષ્ટ પરિણામો આગળ જતાં આવે છે.

હવે એની સાથે વિશ્વમાં કે અહિસાના પરિણામા વ્યક્તિગત કે સંસ્થાગત કામ કરી રહ્યા છે તેનો વિચાર કરીએ. આમાં માર્શલ ટીટો, નાસર અને પાર્ટિત નેહર લોકશાહીનાં પરિણામા છે. કે શાંતિમાં માનનારાં છે. એવી જ રીતે પંચશીલના સિદ્ધાંતો ઉપર સહી કરનારાં રાહ્યો છે. તે પણ એક રીતે અહિસાના પ્રસાર માટે મદ્દહિપ છે. તે ઉપરાંત એવાં પરિણામા કેને સામ્યવાદ, કોમ્પ્યુટર કે મૂડીવાદ સાથે લગવાડ નથી, તેને ટેકો આપી શકાય ! કારણું કે આ પક્ષો સત્તા દ્વારા કાંતિમાં માનનારા છે અને તેઓ તે માટે અહિસાનો કે સાધનશુદ્ધિનો આથડ રાખતા નથી; એટલે તેઓ અહિસાના પ્રચાર ને વખત આવે આજુએ રાખી શકે છે. તેથી જ્યાં સર્વોદ્યવાળાનો આ બન્ને પક્ષો સાથે લગવાડ હોય ત્યાં તેનો વિરોધ આપણે કરીએ છીએ.

એ દણિએ વિશ્વ શાકાહારો પનિષદ તઠસ્થ છે. તેનો રાજકીય પક્ષો સાથે લગવાડ નથી. તેવીજ રીતે જીવદ્યા મંડળા, હિંસા વિરોધક સંઘ કે પ્રાણી પ્રત્યે કૂરતા અટકાવતો સંધ; પણ સંસ્થાગત રીતે તઠસ્થ છે. તેમની સાથે અનુસંધાન કરવામાં વાંધા આવતો નથી. વ્યક્તિગત રીતે જે સભ્યોનો એવા પક્ષો સાથે લગવાડ હોય છે, તેને દૂર કરવો જોઈએ

આ વધી સંસ્થાઓએ નિર્માંસાહારનો જોરશોરથી પ્રચાર કરવો જોઈએ; ચોતે માંસ ન ખાય, ખીલમાં તેનો પ્રચાર રોકે. અને શાકાહારની શક્યતા ભલી કરી શકે ! આ સંસ્થાઓ પ્રિસ્તી, ઈસ્લામ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં વધારે પ્રભાવશાળી થઈ શકશે. એકવાર જે એ ધર્મના વડાઓને એમ થાય કે ઊડાણુથી જોતાં કાઈસ્ટે કે મહિમદે પરિસ્થિતિ બદલાય તો પણ માસાહાર કરવાનું એકાંત વિધાન નથી કર્યું; તો આ દિશામાં ધાર્ષણ ઉપયોગી હાર્ય થાય.

## ખ્રિસ્તી ધર્મના ગ્રેમ અને અહિંસા :

શું ખ્રિસ્તીધર્મ સતત હિંસા કે માંસાહારમાં માને છે? કે એને અહિંસા તરફ વળી ન શકાય? આના જવાબમાં હું એ વાત રજૂ કરીશ. એક તો એ કે વનરપતિ અહાર સંધનો જન્મ જેવા જર્દ એ તો પરદેશમાંથી જ થયો છે. તે ઉપરાંત વિજ્ઞાન પણ એવા સિદ્ધાંત ઉપર આવી રહ્યું છે કે માંસાહાર કરતાં વનરપતિ આહાર માનવ શરીરને વધારે અનુકૂળ છે. તે ઉપરાંત “ગ્રાષ્ટુઓ પ્રતિ કૂરતા અટકાવો” એમાં માનવનારો સંધ પણ સર્વપ્રથમ ત્યાંથી થયો છે. એ ઉપરથી આશા કરી શકાય કે ખ્રિસ્તીધર્મ જરૂર શાકાહાર તરફ વળી શકશે.

જિસ્સુ કાઈસ્ટે તે જમાનામાં ગ્રેમની વાત કરી; “તારા ડાખા ગાલ ઉપર તમાચો મારે તો જમણો ગાલ ધરજો!” એજ સંપ્રદાયમાં ધર્મસંસ્થા દારા યુક્તની વાત કરવામાં આવી. તને વિરોધ કેટલાક ઘર્સાઈ સંતોષે કર્યો. પણ તેમણે જે કર્યું તે લોકસંસ્થાના અનુભૂતિ વગર એટલે તેમનો અવાજ વ્યાપક ન બન્યો. ધર્માધ ધર્મમાં કેવેકર્સ સંપ્રદાય નીકળ્યો. કે જેણે ગમે તેવા કણ્ઠો કે આઝિતો સહીને લડાઈમાં દાખલ થવનો વિરોધ કર્યો. એમાં પહેલાં કેટલાક સેનાપતિ હતા. તેમના મનમાં એ નિયાર રક્ખ્યો કે “આપણે આ માનવહિંમાના કાર્યમાં પડવું નથી!” તેમણે પદ-પ્રતિષ્ઠાનો ત્યાગ કર્યો. આવા ધર્ણા ખ્રિસ્તીધર્મના માણુસો મળી શકે છે. સંપ્રદાય જીવન શુદ્ધ ઉપર ભાર મૂકે છે તેમજ તને કાધપણું પ્રકારનો રાજકીય પક્ષનો લગવાડ નથી. એટલે તેના સાથે અનુભૂતિ જોડવો જોઈએ.

ગાંધીજીને ખ્રિસ્તીધર્મ પ્રત્યે એ કારણોથી આકર્ષણું થયું હતું. એક તો રક્તપિતીયાની સેવા દારા એકાત્મ ભાવ કેળવવાની વાત; ધીજું, મારનાર પ્રત્યે ગ્રેમ અને ક્ષમા. એમાંથી એમને ગ્રેમ, સેવા ને સત્યાગહ એ ત્રણ સિદ્ધાંતો લાખ્યા હતા.

ખિસ્તી સંપર્દાયમાં એવા લોકો પાકચા છે કે જેમણે પવિત્રતા સાધી છે; અગર તો વિશ્વમાં લડાઈઓ બંધ થાય કે, જધડાઓ સમજૂતી-શાંતિથી પતે એમાં વિશ્વાસ રાખનારા છે. એક બાળુ માનવા વિષે આટલા ઊડાણુથી વિચારનાર ધર્મે પશુ-હિંસા-નિવારણ માટે ન વિચાર્યું હોય એમ માનવામાં આવતું નથી.

### Thou shalt not kill

—‘તારે કોઈને મારવું નહીં’ એ નિષેધાત્મક વાક્ય અને દ્વેરેકની સાથે ગેમ રાખવો એ વિધેયાત્મક વાક્ય બન્ને ખિસ્તી ધર્મની અહિંસા સૂચવે છે. ધણા માંસાહારીઓ માંસાહારની તરફેણુમાં કોઈક જૂના કાળતું એક વાક્ય રજૂ કરે છે :—Cow has no soul “ગાયમાં આત્મા નથી.” પણ ત્યાર પછી ધણું સંશોધનો થયાં છે અને આજે જીવશાસ્કીઓ પશુ-પંખી નહીં, વનરપતિ અને પાણી તેમજ વાતાવરણમાં જવ અને જીવકણેને માતે છે. એટલે ખિસ્તી ધર્મના અહિંસામાં માનવારા નિર્માંસાહારી પરિણા સાથે પણ અતુસંદ્ધાન કરવું પડશે !

### ધર્મલાભ અને અહિંસા :

આમ તો ધર્મલાભ શાંતિવાદી છે. પણ શરૂઆતથી જે વાતાવરણમાં તેનું ધડતર થયું ત્યારે પશુવધ-માંસાહારના ત્યાગની ભૂમિકા બહુ ઓછી ભલી થઈ છે. તે છતાં પણ થોડોક ઊડો વિચાર કરતાં નીચેની ખાઅતો ઉપરથી તેનું વલણ અહિંસા-વનરપતિ-આહાર તરફ થઈ શકે છે, તે જણી શકાશે :—

એક ડેકાણે વિધાન છે કે “તારા ચેઠને પશુ-પંખીની કાયર ન બનાવીશ !” આનો અર્થ ૨૫૭૮ જ છે.

ખીને સ્થળે વિધાન છે કે “ગર્ભિણી ધીરીને કહિ મારને નહીં” “એક જીવની જરૂર હોય તો ઐતી નાહક હત્યા ન કરવી” એ વાત આમાં ૨૫૭૮ તરી આવે છે.

૬૦૪—(તीર्थयात्रा) વખતે યાત્રાસ્થળે (મહકા અને કાંચામાં) કોઈપણ પશુનો વધ ન કરવાની વાત કરી છે. તેમજ રમાનના દિવસોમાં રોજ વખતે સંયમ અને પવિત્રતાની સાથે પશુવધ ન કરવાનું ફરમાન છે.

માંસાહાર-ત્યાગ કે પશુવધ નિષેધ ઉપર જેટલું ધ્યાન ખ્રિસ્તી ધર્મામાં અપાયું છે તેટલું ધરલામમાં નથી અપાયું. તેથી જ શાકાહારી પરિષદ્, ક્રેકર્સ સંઘ વગેરે ધસાઈ સંપ્રદાયમાંથી મળ્યા પણ ધરલામમાં એવી ભાગ્યે જ કોઈ સંસ્થા છે. તે છતાં ગાંધીવાદની અસર નીચે આવેલા ગુલામરસૂલ કુરેશીભાઈ, તૈયાંઅલી જેવાં રહ્નો વ્યક્તિત્વાત રીતે મળી આવી શકે છે. એવાં પરિષળોના બળને વધારવા માટે પ્રયત્ન થાય, તો ધણ્ય કામ થાય.

### કાંગ્રેસ : નહેં અને અહિંસા

અહિંસાના પરિષળો તરીકે કાંગ્રેસનો પણ સમાવેશ કરી શકાય છે. તેનો પાયો, પ્રેરકબળ અને ધડતર એ દિશામાં થયેલાં છે. કાંગ્રેસનું ધડતર ગાંધીજીએ અહિંસાની દિશામાં કંયું હતું. તેમણે એ અંગે કદિ પણ હિસ્ક તત્ત્વોના હાથમાં ન રમી જવાની તકેદારી રાખી હતી.

એટલે જ બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે સંસ્થાનવાદની નીતિને ગૌણું ગણુંને ભિત્રરાજ્યને ટેકો આપવાની વાત કરી હતી. સાથે જ તેમણે કંયું કે જેની સામે અહિંસક લડત છે, તેવા દુઃમનના દુઃમનને ટેકો આપવો એ હીન નીતિ છે. તે વખતે જર્મની અને જપાન દુઃમન રાખ્યો હતાં. જો તેમને ટેકો આપવા કર્યાયે તો નારીશાહી કે સર-મુખ્યત્વારથાહિને ટેકો આપવા જેવું હતું.

સુભાસ એઝે કહ્યું : “અત્યારે સારી તક છે. જો ખિટિશનું નાક બંધ કરીયું તો મોઢું ચોલશે.”

પણ, ગાંધીજીએ સ્વપ્ન ‘ના’ કહી !

ગાંધીજી બાદ કેંચેસનું સુકાન અને દેશનું સંચાલન પં. નહેણના હસ્તક છે. તેમનો પણ અહિસાની દિશામાં આગ્રહ દેખાય છે. પંડિતજી અને કેંચેસ એકખીળ થકી આ બાબતમાં મક્કમ છે. જ્યારે જ્યારે તક મળે છે ત્યારે ત્યારે નમ્ર ભાષામાં તેઓ અહિસાની વાત કરે છે. એમણે એલ્યુડ પરિષદ્ભાં હિંસાવાદી કે મજુર સરમુખ્યત્વાર શાહીવાદી રાષ્ટ્રોને તેમજ સંસ્થાનવાદી જૂથોને સાંક્રાન્તિક કલી દીધું હતું કે વિશ્વશાંતિ જોઈતી હોય તો તમારા રાષ્ટ્રો તટસ્થ બળ તરીકે રહેવું જોઈએ.

એટલે અહિસાના પરિયલો માટે કેંચેસનું અનુસંધાન રાખવું પડશે તેમજ તેને ટેકા આપવો પડશે. એની સાથે એ વાતની તકદીરી રાખવી પડશે કે સીધી કે આડકતરી રીતે સામ્યવાદી, સમાજવાદી કે કેંચવાદી અથવા હિંસા ને માનનારાં બળાને ટેકા ન મળે, તેમજ એમને અપ્રતિષ્ઠિત કરવાં જોઈએ.

### ‘ધૂનો’ અને અહિસાઃ

દેશની જેમ વિશ્વની સપાઠીએ અહિસાના પરિયળ માટે ‘ધૂનો’ ને ટેકા આપવો જોઈએ. કારણું કે તે એક તટસ્થ બળ છે અને જગતમાં શાંતિના પ્રચાર માટે કાર્ય કરી રહ્યું છે. એટલું ખરું કે આ સંયુક્ત રાષ્ટ્ર સંધની શક્તિ ખૂબજ અસરકારક બનાવવી જોઈએ. જેથી તે રાષ્ટ્રો-રાષ્ટ્રો વચ્ચે સુસંખ્યે સ્થાપી શકે.

‘ધૂનો’ના હસ્તક ચાલતું “ધૂનેરકો” પણ વિશ્વશાંતિ માટેનું મોઢું બળ છે. તે જગતમાં જ્ઞાન-વિજ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર સાથે અણુવિકસિત રાષ્ટ્રો માટે ધર્યી કલ્યાણકારી યોજનાઓને સાકાર કરી રહ્યું છે. એટલે એ પરિયળનું અનુસંધાન પણ જરૂરી છે.

### તટસ્થ રાષ્ટ્રો અને અહિસાઃ

ત્રીજું બળ છે સહિય તટસ્થ રાષ્ટ્રો. તેમને પણ લોક્ષાહીની દર્ખિએ ટેકા આપવો જોઈએ. પહેલાં તો પંચશીલ ઉપર ચીન-ઝપાન

વગेરे રાજ્યોએ સહી કરી હતી પણ પાછળથી એના ઉપર ટકી ન શક્યા. કોલાંખોમાં હમણું એવા રાજ્યોની બેઠક મળી હતી. તેમાં કામ ચૂંદર થયું પણ સંસ્થાવાદ, કોરિયા અને હંગેરીના ઉકળતા પ્રશ્નો આવ્યા તારે કોઈ સીટો, તો કોઈ નાટો, તો કોઈ સામ્યવાદ, તો કોઈ સંસ્થાનવાહની તરફેખુમાં થઈ ગયા. તેથી તટસ્થ રાજ્યોવાહના પ્રશ્નમાં નિરાશા આવી. હવે એને ખણ્ડું જડપથી આગળ વધારવાની તક આવી લાગી છે. નિરાશ થવાની જરૂર નથી. શાંતિની વાતો કરનારાં બળો જે પ્રજાની કક્ષાએ વાત કરતા થાય તો નિઃશબ્દીકરણ અણુંખોમ પ્રતિબંધ કે સેન્ય ધારાઓનો પ્રશ્ન ખણ્ડું જડપથી પતે. પણ મોટાં મોટાં રાજ્યો પ્રજાનો અવાજ ગુંગળાવી હેવાનો પ્રયત્ન કરતાં હોય છે.

**હમણું-હમણું** એ આશાપ્રદ વાત અની છે કે કેનેરી એને કુશ્ચેવ બનેની પત્તીઓએ શાંતિ ભાટે સાંક્રાંતિકા—સાંક્રાંતિક વાતો કરી છે. જે સ્વી સંસ્થાઓ મારક્ષત આ કામ થાય તો વિશ્વમાં શાંતિનો માર્ગ સાંક્રાંતિક જાય. માતુ સમાજે આગળ પણ આ વાત હું મૂકવા ઈચ્છાં છું. વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધને પણ આ ખુશી સમાચાર જણાવ્યા છે. છેવટે તો જનતાનાં સંગઠનો વડોદરા વિશ્વમાં અસરકારક સામુદ્દર્યિક અહિસાનો પ્રયોગ કરી શક્યું.

### વ્યક્તિગત શાંતિનાં પરિષ્ણો :

હવે આપણે વ્યક્તિગત રીતે વિશ્વમાં શાંતિનાં જે પરિષ્ણો છે, તે વિષે વિચારીએ. મને જ્યાંસુધી થાદ છે; સાયપ્રસ નામના ટાપુ ઉપર “સ્કીલ” નામનો એક યુવાન કિસાન રહેતો હતો. ઈંગ્લાંડ એને જર્મનીના અધડા વખતે ઈંગ્લાંડની ફોન જર્મની બાજુ ઉપરી તારે એ યુદ્ધનો વિરોધ કરવા ભાટે એ લોકોની દુકાની ઉપરી અને એક છાપણીમાં એલે ૨૧ ઉપવાસ કર્યાં. એની સહાતુભૂતિમાં ભીજા સહાયક ઉપવાસીએ પણ ધણું હતા.

એવીજ રીતે ખર્દોડ રસેલે અણુભોંગ પ્રયોગ ઉપર પ્રતિબંધ મૂકવા માટે બિઠીશ કચેરીઓ ઉપર પ્રદર્શનો કર્યાં. હિંદુસ્તાનમાં મુંઘલમાં પણ આ રીતે વિદેશી કચેરીઓ ઉપર પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. લાખો વિજાહિઓ ( pamphlets ) વહેંચી. પછી કાંઈક કાનૂનભંગ કર્યાં હશે એટલે રસેલને બિઠીશ સરકારે જેલમાં પૂર્યા છે !

એવીજ રીતે આંતરરાષ્ટ્રીય અમ શિબિર નામની એક સંસ્થા ભાતૃભાવ વધારવાનું કામ કરે છે. પણ, એ બધા નાના મોટા પ્રયોગો છેવટે વ્યક્તિવાદી પ્રયોગમાં માનનારા છે. એ બધાં શાંતિવાદી બળાનું અનુમંદાન કરવા માટે સર્વસેવા સંધ તરફથી થાડોક પ્રયત્ન ચાલે છે.

એવીજ રીતે વિશ્વના ધર્મોવાળાને લેગા ભળાને વિચાર કરવા માટેની ભૂમિકા મુનિશ્રી સુશીલકુમારજીએ વિશ્વધર્મ સંમેલન વગેરે દારા બિલી કરી છે તેમજ અહિંસાના વિકાસ માટે અહિંસા શાધ્યપીઠ અને અને અહિંસા પુરસ્તકાલય પણ ચલાવવાની ચોજના છે.

હિંસા વિરોધક સંધ, જીવદ્યા મંડળી તેમજ જુદી જુદી ગૌશાળાઓના પ્રયત્નો પણ ચાલે છે. પણ એ બધાનું સંકલન થાય અને બધા લેગા ભળાને કામ કરી શકે તોજ અહિંસા વિજયી બની શકે. નહીંતર હિંસાના પ્રવાહો એટલી અડપથી વહી રહ્યા છે કે એને ખાળવાનું કામ અધરું બની જશે.

### હિંસક શાસ્ત્ર-અણુભોંગ ઉપર પ્રતિબંધ :

હવે તો અણુભોંગ ઉપર પ્રતિબંધ મૂકવાની અપીલ લાલચીન અને સામ્યવાદી રસ્તિયા તરફથી પણ ખાર પડી છે. હવે રાષ્ટ્રો એ દિવ્યાર્મા કૂચ કરી રહ્યા છે. અણુભોંગ ઉપર પ્રતિબંધની માંગ દિવસે દિવસે વધતી જાય છે. પણ લોકોને ચીન કે રસ્તિયા ઉપર વિશાસ ઐસતો નથી.

કારણ કે રસ્તિયા અણુભોંગ-પ્રતિબંધની વાત એક તરફ કરે છે ત્યારે ભીજી તરફ ૫૦ મેગાટન બોંના પ્રયોગો કરે છે. આ બન્નેનો મેળ ભાતો નથી.

તે ઉપરાંત સામ્યવાદી નીતિ સંધર્થની છે. તે પણ હિંસાનો ફેલાવો કરે છે. એટલે પાંડિત જવાહરલાલ નેહરુએ ચીનને 'ધૂતો' માં ફાખલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેની પાછળનો આશય એટલે જ કે સામ્યવાદી નિરંકુશ લાગવગ ઉપર મર્યાદા આંવી જય! તે માટે ચીન સાચે ધર્ષી બાંધ-છોડ કરી પણ ચીનનું રૂપોષ્ટ: આકભણુકારી રવિષ્ય આગળ આવી રહ્યું છે!

આ બધા પ્રશ્નોમાં આપણે શું કરી શકીએ? આપણી શક્તિની મર્યાદા છે. જે પ્રયોગ આપણો ચાલે છે (પ્રાયોગિક સંધ) એનું કાર્યો સાચવીને આંતરાણ્ય અહિસક પરિણામનું અનુસધાન કેવી રીતે કરી શકશું એ સવાલ છે.

તો પછી શું ડેંગેસ-રાજ્ય સંસ્થા એ કાર્યો કરી શકશે? એની એક મર્યાદા છે એટલે રાજ્ય કરતાં પ્રજા પાસે વધારે આશા રાખવી પડશે. કોમવાદ ભારતને એછો પજ્વતો નથી; તે છતાં પ્રજાના ઘડતર વગર એ અગેના પ્રતિધિંધના ફરાતને પડતો મૂકી હોવો પણો. એવું જ સામ્યવાદનું છે અને ચીનના આકભણું સમયે તો એ બહુ જ રૂપોષ્ટ રીતે આગળ આવ્યું. તે છતાં એ અંગે કહી શકતું નથી.

એ માટે લોક સંભળનોને ઘડવાનું છે. તે કાર્યો રચનાત્મક કાર્યો કરેણું છે અને તેમને જગાડવા કે માગંદર્થન આપવાનું કાર્યો કાંતિગ્રામ સાંસુદ્ધ-સાધ્યીએનું છે. તેમણે જ્યાં જ્યાં રચનાત્મક કાર્યો કરેની ક્ષતિ થઈ છે તે સારુ કરીને આગળ વધવાનું છે. દા. ત સર્વોધયના ગ્રેરકોએ સર્વપક્ષ સમન્વયની વાત કરી. મેલવ્યાલ ખાતે કાયેદી આમદાન પરિષદમાં બધા પણોનો ટેકા મળશે એવી આશા રખાઈ હતી. એ વખતે શ્રી નંદુદ્રિપાદ (કભુનીસ્ટ પાર્ટીના મંત્રી-કેરલના તે વખતના મુખ્ય મંત્રી) નો ટેકા રખો-પણ એ પછી શાંતિસેના કે આમદાન માટે સામ્યવાદી પાર્ટીનો સક્રિય ટેકા મળ્યો હોય, એમ લાગતું નથી. સમાજવાદી લોકો જુદા કુદા ઇંદ્રાજિત અનું છે. સુમાજુવાદી હે જાણ્યનાંકી પણ અતા દાખ કાંતિમા

માને છે. તાં તેમનો સર્વોદ્યની રાજ્યમુક્તિ કે રાજ્ય નિરપેક્ષતાની વાત સાથે ક્યાંથી મેળ બેસી શકે ? વ્યક્તિગત રીતે સારા ભાષ્યમો હેઠળ શકે પણ સમગ્ર પક્ષ કે સરંથાની સાથે અતુસંખાનની વાત વ્યક્તિના આધ્યમથી થતી હોય તારે તેમાં કાળજ રાખવી જોઈએ !

સામુદ્દર્યિક અહિંસાના પરિણામો સામે સર્વોદ્યમિ કાર્યકરો અથડાતા હોય એવો ધર્માનીવાર આભાસ થાય છે એટલે સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગો કરવામાં જે કાળજ રાખવાની છે તે રાખ્યા વગર તો બધું જ કાર્ય જાદું વળી જવાની લિતિ છે.

### સામુદ્દર્યિક અહિંસાના પ્રયોગના વિશ્વ માટેના કાર્યક્રમો ?

આ અંગે વિચાર કરીએ તો નીચેના કાર્યક્રમો ઉપાડવા જોઈએ, એમ લાગશે :—

( ૧ ) વિશ્વસરકારનો વિચાર સર્વપ્રથમ કરવો પડશે. આજે વિશ્વની કક્ષાએ જ્યારે એ વસ્તુનો વિચાર કરીએ છીએ તારે 'યુનો'નેજ દેખું પડશે. તેને સક્રિય, તટરથ, નિષ્પક્ષ, અહિંસાની દ્વિશામાં પ્રગતિશીલ અને બળવાન બનાવવી પડશે.

( ૨ ) વિશ્વઅહિસા સંપર્ક સમિતિ રચવી પડશે. જે વિશ્વના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સૌધારી ઉપર કામ કરતાં અહિંસાનાં પરિણામો સતત સાથે સંપર્ક સાખરશે.

અત્યારે તો 'વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ' અને ભાલ નજીકાંડા (આમ્ય) પ્રાયોગિક સંધ બન્ને આ વિષે પ્રયત્નશીલ છે. બીજી પરિણામે સંપર્કમાં રાખવા વિરોધ પ્રયત્નો કરવા પડશે.

( ૩ ) અષ્ટુંઘાંમ પ્રયોગ પ્રતિઅંધ ભૂક્ષવાની વાત જડપથી વિશ્વના રાષ્ટ્રોના કાને પહોંચાડવી પડશે.

( ૪ ) સક્રિય તઠસ્થ બળ : એક એવું સક્રિય તઠસ્થ બળ જિસું કરવું જેનો અવાજ વિશ્વમાં પહોંચી શકે. આપણે પણ એક સક્રિય તઠસ્થ બળ તરીકે કામ કરી રહ્યા છીએ એનો ધાર્યા એણને ખ્યાલ હશે. ડાંગ્રેસને ટેકા આપવાનું કારણું એટલું જ કે વિશ્વમાં આપણો સાદ પહોંચાડવા માટે આપણું દેશમાં એનાથી વધુ સખળ ભીજું ડોઈ માધ્યમ નથી. તેથી ધણીવાર આક્ષેપો આવે છે તે વહેરાને પણ અહિસાની દ્વિશામાં આગળ વધવું જોઈએ ! લોકો આપણુંને હ્યાગ્રહી કહેશે પણ તેથી કંટાળાને સત્યનો આગ્રહ છોડી હોવાનો નથી. ધાર્યા કાર્યકરાને લાગે છે કે આપણું સિધ્ધાંતો પ્રતિ અતિ આગ્રહો છે તેથી તેમના મનમાં એક અંધી બંધાતી જાય છે. તેમનું કહેવું છે કે ડાંગ્રેસમાં અનિષ્ટ તરનો દ્વિસે દ્વિસે ધસી રહ્યાં છે, છતાં તેને ટેકા આપવો એ યુક્તિ સંગત નથી ! અતુઅંધ વિચારધારા પ્રમાણે આપણી દૃષ્ટિ ડાંગ્રેસથી કંટાળાને ભાગવાની નથી; પણ પ્રેરક અને પૂરક બળા દારા એક બાજુથી શુદ્ધ અને ભીજુથી બાજુથી સિધ્ધાંતોને લીધે ડાંગ્રેસની પુષ્ટિ કરવાની છે; તેથી તે વધારે મજબૂત બની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સક્રિય કામ કરી શકે. ડાંગ્રેસને તરછોડવાથી તો મૂડીવાદી, ડોમવાદી, સામ્યવાદી, દાંડતત્ત્વો કે તોષાની બળાને જ ટેકા મળશે અને તે રચનાત્મક કાર્યકરાને ભારે પડશે.

મને તો ખાતરી છે કે જ્યારે વિશ્વસરકાર માટેની જગતમાં ભૂમિકા થઈ જશે; તે વખતે ડાંગ્રેસે માનવું પડશે કે લોક સંગઠનો અને લેઝસેવક સંગઠનો, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ક્ષેત્રે ખરાં પૂરક પ્રેરક બળો છે; તેમજ લોકસંગઠનો માટે રાજકીય ક્ષેત્રે તરનો માતૃત્વ સંબંધ હોઈ ડાંગ્રેસના પૂરકબળ તરીકે એ રહેશે. એવી જ

રીતે પ્રાચીણિક સંધ તેના માટે પ્રેરક બળ રહેશે. ધણાને આ વાતમાં જરા ગર્વ જેવું લાગશે; પણ ગાંધીજીને જેમ કેંચેસના સરમુખ્ત્યાર, હિંદુઓના પક્ષપાતી કહેતા, તેમ આ બધા આસ્કેપો સહીને જ આપણે આગળ વધવાનું રહ્યું.

(૫) દેશમાં અહિસક બળોનો સંપર્ક : એજ રીતે આ દેશમાં જ્યા જ્યા અહિસક બળો છે તેમની સાથે સપર્ક સાધી, જે સાધુઓ, બહેનો, રચનાત્મક કાર્યકરો છે, તેમના ગળે આ વાત ઉત્તારવી પડશે; આમે અને શહેરોમાં ચાલતા અનિષ્ટો અને હિસક પરિબળોને દૂર કરવા પડશે. આ કાર્ય ચાલુ થશે એટલે અહિસક પરિબળો પણ ભળી રહેવાના એવી મારી અધ્યા છે.



## ચર્ચા - વિચારણા

શ્રી. પૂંજાલાઈએ આજની ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું : ‘સવારે પુ. મહારાજશ્રીએ આ અંગે ધણી સુંદર રીતે કહ્યું છે. મારા નામ મને તો કાર્યકરો આપણા જેમ-જેમ આગળ વધતા જરો તેમ-તેમ તે પરિબળોનું અનુસંધાન આપોઆપ થશે. જેમકે વૈષ્ણવો અને જૈનો નિરામિપાહારના કાર્યકરમમાં આપોઆપ અનુસંધાન પામશે. કારણ એ કાર્યકરમમાં તે બન્ને નજીક જ છે. પછાત કોમમાં પણ ધણા શાકાહારી નીકળશે.

રામાયણમાં હનુમાને લંકા જઈ આવ્યા પછી સારુ કહ્યું : “ મુદ્દ અનિવાર્ય છે. ” તેમ આજે લારતીય સંસ્કૃતિનું અપહરણ થયું છે. તેને જે પુનઃ વિશ્વ પ્રતિષ્ઠિત કરવી હોય તો ગાંધીયુગ પછી અનુભંગ વિચાર

ખારા પ્રમાણે યુગની કાંતિના કાર્યક્રમો નેમ લાલનળકાંડા અને ગુજરાતમાં અપાયા છે, તેમ હવે આ જીબિર પણી દેશ-દેશાંતરમાં આપવાના રહેશે. આપણે જમતના ચોગાનમાં સામુદ્રાયિક અહિસાના પ્રયોગોવાળી વાત સીધી રીતે મૂક્ષ દેવી જોઈએ. વિશ્વના અનુસંધાનમાં નિરામિથા-હારને લલે વાર લાગે પણ યુદ્ધકલાની હિસા તો જરે જ. તેમ જ કાર્યક્રમો આવતાં જગતમાંના બધાં અહિસંક બજોતું અનુસંધાન થઈ જ જવાનું.”

**શ્રી. સુદ્રલાલ:** ભારા નમ્ર મત પ્રમાણે નિરામિથાહારની વાત પણ જગતની માનવજાતમાં જેરથી ફેલાશે! પણ-પંખીને થતું દુઃખ જે જતે જુએ તો આજનો માનવી એ છોડશે જ!

**શ્રી. માધલિયા :** “સવારે પ્રવચનમાં ઘટ્રાંડ રસેલની વાત આવી હતી. આ અગે થોડી ચોખવટ કરી લઇ. અત્યાર સુધી રસેલની જવન દિલ્લીની ભોગવાદી-સ્વચ્છાંહ્તાની હોય તેવી તેમના સાહિત્ય પરથી છાપ ઉતે છે. તેઓ અહિસાને સિદ્ધાંત તરીકે નહીં, પણ ઉપરોગિતાની દર્શિએ માનતા જણ્યાય છે. છતાં ખરેખર એમને અસેર સાચી થઈ હોય તો જુદી વાત છે. નહીં તો આપણે એમની સાથે અનુસંધાન કરીએ છતાં બ્યાપક પ્રતિષ્ઠા નહીં આપી શકીએ.

આપણી અનુભંગ વિચારધારા સાથે વધુ સુસંગત તો કેવેકસં સંપ્રદાયના શાંતિવાદીએ છે. તેઓ એતી, ડૉક્ટર કે શિક્ષકનો ધંધો પસંદ કરે છે કારણું કે થુદ્ધ આજીવિકાનો તેમનો આગ્રહ હોય છે. એમનામાં ચાર બાબતો મુખ્ય છે :-( ૧ ) નિશ્ચિત સમયે કુયાંયે પણ હોઈએ ( મૌન ) પ્રાર્થના, ( ૨ ) યુદ્ધનિષેષ ( યાતના સહીને પણ ), ( ૩ ) થુદ્ધ આજીવિકાનો આગ્રહ, ( ૪ ) બાળકો પૈકી એકાદને આપવું. આપણે ચર્ચામાં કટુતા લાવતા નથી. છતાં ઉત્તા કોઈવાર આવે છે ત્યારે આપણા નેતાનું કહેવું “ માનીએ કે ન આતીએ ” એવી પરિસ્થિતિ

આવે છે. ત્યારે તેઓ તો ઉચ્ચ ચર્ચા થાય ત્યાં શાંતિનો ધંટ પડતાં ખધા અનુસરે છે. શ્રી રસેલને પં. નહેરાએ હજુ સ૫૪ રીતે ટેકો આપ્યો નથી. બાકી પૂર્ણ ગુરુદેવે કલ્યાં તેમ પંડિતજી અને ડેંગ્રેસ એકલાં ન પડે તે તો આપણે જેવું જોઈએ.

આપણે નીચેના કાર્યક્રમો આપી શકીએ ;-( ૧ ) નિર્માંસાહાર, ( ૨ ) સંયમલક્ષ્મી જીવન, ( ૩ ) આજીવિકા શુદ્ધિ, ( ૪ ) સંતાનો ચૈક્રી એકાદ આ કામમાં આવે તેવી સમાજ પાસે માંગણી, અને ( ૫ ) હરિજનો, આદ્વિાસીએ કે પણતોને સ્વમાનભર્યું સ્થાન મળે તે માટે ધેર-ધેર જર્દને સંકદ્પો કરાવવા.

આવા આવા કાર્યક્રમો આપવાથી વિશ્વમાં અહિંસાના પરિણામનું અનુસંધાન જરૂર થઈ જશે.

( ૧૭-૧૧-૬૧ )

## નવાંમાનવી

માનવ હૃદયમાં બઢતી ના  
અભિલાષાએ, નવી આકંક્ષાએ  
નવા વિચારેને વાર્તા, પ્રસંગચિત્રે  
નિખંધો, નાટકોઇપે રજૂ કરે  
માસિક.

વાર્ષિક લખાજમ : રુ. 3-00



: કાર્યાલય :  
દીનાંધની વાડી,  
અમદાવાદ-૨